

કંપની ધારા કલમ ૧૪૩ (૬) (બી) અન્યથે, ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ, ગાંધીનગરનાં તારીખ ૩૧/૩/૨૦૨૧ ના રોજ પુરા થતાં વાર્ષિક અહેવાલની કામગીરી અંગેનો સરકારનો અહેવાલ

ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ નો વર્ષ ૨૦૨૦ -૨૦૨૧ ના વર્ષનો ૩૧મો વાર્ષિક અહેવાલ રાજ્ય સરકારને તા. ૨/૩/૨૦૨૨ ના રોજ મળેલ છે. અહેવાલનાં વર્ષ દરમ્યાન નિગમે નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરેલ છે. ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ વર્ષ ૨૦૨૦ -૨૦૨૧ દરમ્યાન ઉર્જા પરિયોજના-આયોજન અને તેના અમલીકરણના તબક્કાઓની વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ રહ્યું હતું. નિગમે ગત વર્ષ ૨૦૧૯-૨૦૨૦ માં ₹ ૨૭૪.૭૨ કરોડ ની આવક સામે, વર્ષ ૨૦૨૦ -૨૦૨૧ દરમ્યાન ₹ ૩૨૨.૩૧ કરોડ ની આવક મેળવી છે તથા નિગમે વર્ષ ૨૦૧૯-૨૦૨૦ માં થયેલ ₹ ૭૮.૮૫ કરોડના નફોની સામે વર્ષ ૨૦૨૦ -૨૦૨૧ દરમ્યાન ₹ ૫૭.૬૯ કરોડ નો નફો કરેલ છે.

આગામી પ્રોજેક્ટ્સની ફંડની જરૂરિયાતોનો વિચાર કરીને, ચાલુ વર્ષે નફો જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. તેથી અહેવાલનાં વર્ષ દરમ્યાન કોઈ ડિવિડન્ડ ભલામણ કરતા નથી. રાજ્ય સરકારનું આ નિગમમાં ૫૧ ટકાથી વધુ રોકાણ હોવાથી, કંપની ધારા, ૧૯૫૬ ની કલમ-૬૧૭ હેઠળ ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ સરકારી કંપની છે. તા. ૩૧/૩/૨૦૨૧ ના રોજ કંપનીની અધિકૃત શેરમૂડી ₹ ૬૦૦ કરોડની સામે, ભરપાઈ થયેલ શેરમૂડી ₹ ૫૧૩.૨૨ કરોડની છે.

કંપની રાજ્યમાં ઉર્જાક્ષેત્રે વિકાસકારી ઉદ્દીપક તરીકેની ભૂમિકા બજાવી રહેલ છે. વિવિધ બળતણ પર આધારિત ઉર્જા પરિયોજનાઓ નિયત કરે છે. આવી ઉર્જા પરિયોજનાઓ માટે તાંત્રિક-આર્થિક શક્યતા અહેવાલ તૈયાર કરે છે. યોગ્ય ખાનગી/સંયુક્ત ક્ષેત્રના પક્ષકારો નિયત કરે છે અને પસંદ કરેલા પક્ષકારો સાથે પરિયોજનાઓનો સંયુક્ત રીતે અમલ કરે છે. ઉર્જા પરિયોજનાઓ નિયત કર્યા પછી તેના અમલ માટે જળ અને હવા પ્રદુષણ મંજૂરી, પર્યાવરણીય અને વન મંજૂરી, નાગરિક ઉદ્વચન મંજૂરી જેવી વૈધાનિક અને વહીવટી મંજૂરીઓ મેળવવાની કામગીરી આ નિગમ દ્વારા હાથ ધરવામાં આવે છે. જમીન સંપાદન અધિનિયમ હેઠળ જમીન સંપાદન સંબંધી ઔપચારિકતાઓ આગળ ધપાવે છે અને ઉર્જા પરિયોજનાઓ માટે બળતણ સંયોજન જોડે છે. કેટલાક કિસ્સાઓમાં જાહેર સાહસો સાથે સમજૂતી કરારથી પરિયોજનાઓ અમલી બનાવવામાં આવે છે.

વર્ષ ૨૦૨૦-૨૦૨૧ દરમ્યાન નીચેના પ્રોજેક્ટ્સ કાર્યરત અથવા અમલીકરણ હેઠળ હતા.

(૧) શુપીસીએલની વીજળી પરિયોજના (વિન્ડ મિલ/ સૌર કાર્યરત છે)

- (ક) ૬ મે.વો. વિન્ડ મિલની વીજ પરિયોજના, મનાબા અને પેથાપુર ગામો, તાલુકા રાપર, જી. કચ્છ
- (ખ) ૧૦.૫ મે.વો. વિન્ડ મિલની વીજ પરિયોજના, જમનવાડા, જી. કચ્છ
- (ગ) ૪.૨ મે.વો. વિન્ડ મિલની વીજ પરિયોજના, હાઈબ્રીડાઈઝેશનની સંકલ્પના હેઠળ ચારણકા સોલર પાર્ક, જી. પાટણ
- (ઘ) ૫ મે.વો. સોલર વીજ પરિયોજના, પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગુજરાત સોલરપાર્ક ગામ ચારણકા ખાતે
- (ચ) ૧૦ મે.વો. સોલર વીજ પરિયોજના, પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગુજરાત સોલરપાર્ક ગામ ચારણકા ખાતે
- (છ) ૧ મે.વો.નો છત આધારિત સોલર વીજ પ્રોજેક્ટ

(૨) ગુજરાત સોલાર પાર્ક (કાર્યરત છે)

ગુજરાત સોલાર પાર્ક પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચારણકા ગામમાં ઊભો કરવામાં આવ્યો છે. આ સંકલિત “સોલાર પાર્ક” વરસાદી પાણીનો સંગ્રહ કરવાની અને ઘરઆંગણે વીજળી મેળવવાની જોગવાઈ સાથે અતિ આધુનિક આધારમાળખું ધરાવે છે. ૩૬ ડેવલપર્સ સાથે ૭૩૦ મે.વો.ના સોલાર પ્રોજેક્ટની ક્ષમતા સ્થાપિત કરવામાં આવી છે.

(૩) ૭૦૦ મે.વો. ગેસ આધારીત પીપાવાવ વીજળી પરિયોજના જી. અમરેલી

ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને ગુજરાત પાવર કોર્પો. લિમિટેડ વચ્ચેના સંયુક્ત સાહસ જી.એસ.પી.સી. પીપાવાવ પાવર કંપની લિ. મારફતે ૭૦૦ મે.વો. ગેસ આધારીત પરિયોજના વ્યાવસાયિક કામગીરી હેઠળ છે.

(૪) ૭૦૦ + મેગાવોટ રાધાનેસડા અલ્ટ્રા મેગા સોલાર પાવર પાર્ક


ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે ગામ: રાધાનેસડા, તાલુકો: વાવ, જિલ્લો: બનાસકાંઠા ખાતેની આશરે ૧૩૯૨ હેક્ટર વિસ્તાર ધરાવતી પડતર/બિનઉપજાઉ જમીન પર ૭૦૦ મેગાવોટ અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટ (UMSPP) સ્થાપવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલ છે. રાધાનેસડા અલ્ટ્રા મેગા સોલાર પાર્ક અમદાવાદથી ઉત્તર-પશ્ચિમ દિશાએ આશરે ૨૭૧ કિ.મી. દૂર આવેલ છે.

ભારત સરકાર અને ગુજરાત સરકારે જી.પી.સી.એલ.ને અમલકર્તા એજન્સી જાહેર કરી છે. વિગતવાર અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. જમીનનું આગોતરૂં સંપાદન કરવામાં આવ્યું છે. હાલમાં, આ પ્રોજેક્ટના વિવિધ આંતર માળખાકીય કામો જેમ કે, રોડ, પાણી પુરવઠો, સંદેશાવ્યવહાર, પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિગેરે પૂર્ણ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત ૭૦૦ મેગાવોટ માટે પ્રોજેક્ટ ડેવલપરની પસંદગી કરી લેવામાં આવી છે.

હાલમાં, કુલ ૪૦૦ મેગાવોટનો સોલાર પાવર પ્રોજેક્ટ ઓગસ્ટ-૨૦૨૧ સુધીમાં કાર્યાન્વિત કરી દેવામાં આવશે. ૨૦૦ મેગાવોટ ક્ષમતા જૂન-૨૦૨૨ સુધીમાં કાર્યાન્વિત કરી દેવામાં આવશે. જ્યારે, ૧૦૦ મેગાવોટ સોલાર પ્રોજેક્ટ સ્થાપવાની કામગીરી પ્રગતિમાં છે.

(૫) ખાણકામ પરિયોજનાઓ:

- ભાવનગર લિગનાઈટ ખાણકામ પરિયોજનાઓ (કાર્યરત છે)



મમતા પર્મા

અગ્રસચિવ


ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ



Address : Block No. 8, Sixth Floor,
Udhyog Bhavan, Sector 11,
Gandhinagar - 382 011
Phone : 079 - 23251255-60
Fax : 91-79-23251254
www.gpcl.gujarat.gov.in
CIN:U40100GJ1990SGC013961



ગુજરાત
પાવર
કોર્પોરેશન
લિમિટેડ



ગુજરાત
પાવર
કોર્પોરેશન
લિમિટેડ

વાર્ષિક અહેવાલ
૨૦૨૦-૨૦૨૧

મૂળ અંગ્રેજી અહેવાલનું આ ગુજરાતી ભાષાંતર છે.
કોઈ સંદિગ્ધતા જણાય તો મૂળ અંગ્રેજી અહેવાલ આખરી ગણાશે.

31મો વાર્ષિક અહેવાલ- 2020-21

ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ - ગાંધીનગર
 (સીઆઈએન: યુ80100જે 1440 એસજીસી 013449;
 રજિસ્ટર્ડ ઓફિસ: દેવો માળ, બ્લોક નં. ૬ અને ૮, ઉદ્યોગ ભવન, સેક્ટર-૧૧, ગાંધીનગર -૩૮૨૦૧૧
 ઈમેઈલ-cosecgpcl@yahoo.co.in; વેબસાઈટ - www.gpcl.gujarat.gov.in
 (ટેલિફોન નં. ૦૭૯-૨૩૨૫૧૨૫૫-૬૦; ફેક્સ-૦૭૯-૨૩૨૫૧૨૫૪)

નિયામક મંડળ

શ્રીમતી સુનયના તોમર, આઈએએસ	:	ચેરમેન (૧૦/૦૧/૨૦૨૦થી ૧૫/૦૬/૨૦૨૧)
શ્રીમતી મમતા વર્મા, આઈએએસ	:	ચેરમેન (૦૯/૦૭/૨૦૨૧થી)
શ્રી એસ.બી.ખયાલિયા	:	મેનેજિંગ ડિરેક્ટર (૦૧/૧૦/૨૦૨૧ સુધી)
શ્રી વિકલ્પ ભારદ્વાજ	:	મેનેજિંગ ડિરેક્ટર (૧૧/૧૧/૨૦૨૧થી)
શ્રીમતી અંજુ શર્મા, આઈ.એ.એસ	:	મહિલા નિયામક (૨૮/૦૭/૨૦૨૧ સુધી)
શ્રી પ્રફુલ એચ.રાણા	:	નિયામક
શ્રી આર.જી.દેસાઈ	:	નિયામક (નાણાં વિભાગ, ગુજરાત સરકારના નામનિયુક્ત) ૦૭/૦૮/૨૦૨૦ સુધી
સુશ્રી દિપલ હડિયલ	:	નિયામક (નાણાં વિભાગ, ગુજરાત સરકારના નામનિયુક્ત) ૨૩/૧૨/૨૦૨૦થી

સ્વતંત્ર નિયામકો

શ્રી પી.કે.તનેજા, આઈ.એ.એસ. (નિવૃત્ત) : સ્વતંત્ર નિયામક (૨૬/૧૧/૨૦૨૦થી)

મુખ્ય વ્યવસ્થાપકીય કર્મચારી વર્ગ

શ્રી મેહુલ જે. ડનાયક	:	ચીફ ફાઈનાન્સીયલ ઓફિસર
સુશ્રી કૃપા એન. જોશી	:	કંપની સેક્રેટરી

ઓડિટરો

વૈધાનિક ઓડિટરો	મે. અનિલ એન.શાહ એન્ડ કું. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, અમદાવાદ
સેક્રેટરિયલ ઓડિટર્સ	મે. ધારા પટેલ, કંપની સેક્રેટરીઝ, પ્રેક્ટીસીંગ કંપની સેક્રેટરી, અમદાવાદ
કોસ્ટ ઓડિટર્સ	મે. પી. એચ. દેસાઈ એન્ડ કું. કોસ્ટ એકાઉન્ટન્ટ્સ, અમદાવાદ
બેંકર્સ	એક્સીસ બેંક લિમિટેડ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એચ.ડી. એફ. સી બેંક લિમિટેડ

અનુક્રમણિકા

અ.નં.	વિગત	પાના નંબર
૧.	નિયામકનો અહેવાલ	૦૧
૨.	કંપની ધારો ૨૦૧૩ની કલમ-૧૪૩(દ)(ખ) મુજબ કોમ્પ્રોલર અને ઓડિટર જનરલ, ભારત સરકાર તરફથી ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ, ગાંધીનગરના તા. ૩૧મી માર્ચ, ૨૦૨૧ના હિસાબો ઉપર કરવામાં આવેલાં ટીકા ટિપ્પણી	૧૯
૩.	ઓડિટરનો અહેવાલ	૨૦
૪.	પાકું સરવૈયું	૩૧
૫.	નફા-નુકસાન ખાતું	૩૨
૬.	કેશફલો સ્ટેટમેન્ટ	૩૩
૭.	નાણાકીય પત્રકો અંગેની નોંધો ૧ થી ૩૦	૩૭

નિયામકોનો અહેવાલ

પ્રતિ,
સભાસદો
ગુજરાત પાવર કોર્પોરેશન લિ. (જી.પી.સી.એલ.)
ગાંધીનગર

તા.૩૧-૩-૨૦૨૧ના રોજ પૂરા થયેલા વર્ષ માટે કંપનીનો ૩૧મો વાર્ષિક અહેવાલ અને હિસાબોનું ઓડિટ કરેલું પત્રક રજૂ કરતાં આપના નિયામકો આનંદ અનુભવે છે.

૧. નાણાકીય પરિણામો (રૂ. કરોડમાં)

ક્રમ નં.	વિગત	૨૦૨૦-૨૧	૨૦૧૯-૨૦
૧.	કુલ આવક	૩૨૨.૩૧	૨૭૪.૭૨
૨.	કુલ ખર્ચ	૨૬૪.૬૨	૧૮૫.૮૭
૩.	કરવેરા પહેલાંનો નફો	૫૭.૬૯	૭૮.૮૫
૪.	વિલંબિત કર સહિત કરવેરા	(૧૬.૪૪)	(૧૧.૪૦)
૫.	કરવેરા પછીનો નફો/(ખોટ)	૪૧.૨૫	૬૭.૪૫
૬.	અન્ય સર્વગ્રાહી આવક (ઓસીઆઈ)	૫૬.૨૬	૦૦.૧૮
૭.	આ સમયગાળાની કુલ સર્વગ્રાહી આવક	૯૭.૫૧	૬૭.૬૪

૨. ડિવિડન્ડ

ચાલુ વર્ષ દરમિયાન કંપનીએ નફો કર્યો છે. આમ છતાં, આગામી પ્રોજેક્ટ્સને કારણે આપના નિયામકો વર્ષ ૨૦૨૦-૨૧ માટે કોઈ ડિવિડન્ડની ભલામણ કરતા નથી.

૩. અનામત ખાતે તબદીલી

નફાને અનામત ખાતે લઈ જવામાં આવે છે. .

૪. હકદાવો કરવામાં ન આવ્યો હોય એવા ડિવિડન્ડની ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ (આઈ.ઈ.પી.એફ.)માં તબદીલી

આઈ.ઈ.પી.એફ.માં તબદીલ કરવું પડે તેવું હકદાવો કર્યા વિનાનું / વણચુકવાયેલું કોઈ ડિવિડન્ડ ન હોવાથી કંપની અધિનિયમ-૨૦૧૩ની કલમ-૧૨૫ (૨)ની જોગવાઈઓ કંપનીને લાગુ પડતી નથી.

૫. થાપણો

૩૧મી માર્ચ, ૨૦૨૧ના રોજ પૂરાં થતાં વર્ષ દરમિયાન, કંપનીએ, “ઘ કંપનીઝ (એક્સેપ્ટન્સ ઓફ ડિપોઝીટ્સ) રુલ્સ ૨૦૧૪ હેઠળ વ્યાખ્યાયિત કરવામાં આવેલ “થાપણો”ના અર્થની મર્યાદામાં આવતી હોય એવી કોઈ થાપણો જાહેર જનતા પાસેથી સ્વીકારી નથી. આમ, “ઘ કંપનીઝ (એક્સેપ્ટન્સ ઓફ ડિપોઝીટ્સ) રુલ્સ, ૨૦૧૪ના નિયમ ૩(૨)ને “કંપનીઝ (એક્સેપ્ટન્સ) રુલ્સ, ૨૦૧૪ના નિયમો ૮(પ)(પ) અને (૬) સાથે અને કંપની અધિનિયમ-૨૦૧૩ની કલમ-૭૩ સાથે વાંચતાં, તે આ કંપનીને લાગુ પડતા નથી.

૬. હાથ ધરવામાં આવેલ પરિયોજનાઓની સ્થિતિ

(ક) વીજ પરિયોજનાઓ

૧) ૫૦૦ મે.વો.ભાવનગર લિગ્નાઈટ આધારિત વીજ પરિયોજના

આ પરિયોજના શરૂ કરવામાં આવી છે.

૨) જી.પી.સી.એલ.ની પોતાની વીજ પરિયોજનાઓ (સૌર/પવન)

ક. શિકારપુર ખાતે ૬ મે.વો. વિન્ડ મિલની વીજ પરિયોજના

જી.પી.સી.એલ. એ નાણાકીય વર્ષ ૨૦૧૦-૧૧ દરમિયાન કચ્છ જિલ્લાના રાપર તાલુકાના મનાબા અને પેથાપુર ગામો ખાતે ૬ મે.વો. વિન્ડ મિલની પરિયોજના સ્થાપી છે. આ પરિયોજના પૂર્ણરીતે કાર્યરત છે. વર્ષ ૨૦૨૦-૨૧માં, આ પરિયોજનાએ ૬.૧૫ એમ.યુ. વીજળીનું ઉત્પાદન કર્યું છે અને આશરે રૂ. ૨.૧૬ કરોડની આવક કરી છે.

ખ. જમનવાડા ખાતે ૧૦.૫ મે.વો. વિન્ડ મિલની વીજ પરિયોજના

જી.પી.સી.એલ. એ કચ્છ જિલ્લાના જમનવાડા ખાતે નાણાકીય વર્ષ ૨૦૧૧-૧૨ દરમિયાન ૬.૩ મે.વો.ની વિન્ડ મિલ પરિયોજના અને ૨૦૧૨-૧૩ દરમિયાન ૪.૨ મે.વો.ની વિન્ડ મિલ પરિયોજના સ્થાપી છે. આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે કાર્યરત છે. તેણે વર્ષ ૨૦૨૦-૨૧માં ૧૧.૧૩ એમ.યુ. વીજળીનું ઉત્પાદન કર્યું છે તથા આશરે રૂ. ૪.૨૦ કરોડની આવક કરી છે.

ગ. હાઈબ્રીડાઈઝેશનની સંકલ્પના હેઠળ ચારણકા ખાતે ૪.૨ મે.વો.ની વિન્ડ મિલ પરિયોજના

ચારણકા સોલાર પાર્ક ખાતે હાઈબ્રીડાઈઝેશનની સંકલ્પનાનો પ્રયોગ કરવા માટે વર્ષ ૨૦૧૨-૧૩માં જી.પી.સી.એલ. એ ૪.૨ મે.વો.ની વિન્ડ

મિલ પરિયોજના સ્થાપી છે. આ પરિયોજના સંપૂર્ણ કાર્યરત છે. વર્ષ ૨૦૨૦-૨૧માં તેણે ૨.૬૯ મે.વો. વીજળીનું ઉત્પાદન કર્યું છે અને આશરે ૩.૦૮૫ કરોડની આવક કરી છે.

ઘ. ચારણકા ખાતે ૫ મે.વો.નો સોલાર પ્રોજેક્ટ

જી.પી.સી.એલ.એ ચારણકા ખાતે વર્ષ ૨૦૧૧-૧૨માં ૫ મે.વો.નો સોલાર પાવર પ્રોજેક્ટ સ્થાપ્યો છે. આ પ્રોજેક્ટ કાર્યરત છે. વર્ષ ૨૦૨૦-૨૧માં તેણે ૪.૧૪ એમ.યુ. વીજળીનું ઉત્પાદન કર્યું છે અને આશરે ૩.૬૦૧ કરોડની આવક કરી છે.

ચ. મોઢેરા સૂર્ય મંદિર અને શહેરનું સૌર વીજળીકરણ

ગુજરાત સરકાર અને ભારત સરકાર સંયુક્ત રીતે મોઢેરા સૂર્ય મંદિર અને શહેરનું સૌર વીજળીકરણ કરવાનો એક અનન્ય નિદર્શન પ્રોજેક્ટ ઊભો કરી રહી છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ મોઢેરા સૂર્ય મંદિર અને શહેરને નિરંતર સૌર વીજળી પૂરી પાડવાનો છે. ગુજરાત સરકારે આ પ્રોજેક્ટ માટે જીપીસીએલને અમલકર્તા એજન્સી જાહેર કરી છે. જીપીસીએલએ રિવર્સ ઓક્શન બિડીંગ થકી મહિન્દ્રા સુસ્ટન પ્રા.લી.ને આ પ્રોજેક્ટ માટે ઈપીસી એજન્સી તરીકે પસંદ કરી છે. આ એજન્સીએ આ પ્રોજેક્ટની કામગીરી તા. ૦૫/૦૮/૨૦૨૦થી શરૂ કરી દીધી છે. પ્રોજેક્ટનું અંદાજિત ખર્ચ રૂ. ૬૯ કરોડ છે. આ સમગ્ર ભંડોળ ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટને કોવિડ-૧૯ મહામારીથી ગંભીર અસર થઈ હોવા છતાં આ પ્રોજેક્ટ નજીકના ભવિષ્યમાં પૂરો થવાની અપેક્ષા છે.

૩) ગુજરાત સોલાર પાર્ક

ગુજરાત સોલાર પાર્ક પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચારણકા ગામમાં ઊભો કરવામાં આવ્યો છે. આ સંકલિત ‘સોલાર પાર્ક’ વરસાદી પાણીનો સંગ્રહ કરવાની અને ઘરઆંગણે વીજળી મેળવવાની જોગવાઈ સાથે અતિ આધુનિક આધારમાળખું ધરાવે છે. ૩૬ ડેવલપર્સ સાથે ૭૩૦ મે.વો.ના સોલાર પ્રોજેક્ટની ક્ષમતા સ્થાપિત કરવામાં આવી છે.

૪) જે.એન.એન.એસ.એમ. તબક્કા-૨ યોજના હેઠળ ૧૦ મે.વો.નો સોલાર પાવર પ્રોજેક્ટ

જી.પી.સી.એલ. એ જે.એન.એન.એસ.એમ. તબક્કા-૨ હેઠળ રૂ. ૬૨ કરોડના ઈ.પી.સી. ખર્ચે પ્રથમ બેચની ૧૦ મે.વો.ની સૌર વીજ પરિયોજના શરૂ કરી છે. તારીખ ૨૦-૦૩-૨૦૧૫ના રોજ આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૦-૨૧માં તેણે ૨૦.૯૬ એમ.યુ. વીજળીનું ઉત્પાદન કર્યું છે અને આશરે ૯.૪૯ કરોડની આવક કરી છે.

૫) જી.પી.સી.એલ.નો પોતાનો ૧ મે.વો.નો સોલાર રુફટોપ પ્રોજેક્ટ

જી.પી.સી.એલ.એ તેના ગાંધીનગર અને અમદાવાદનાં જુદાં જુદાં સરકારી મકાનો પરના ૧ મે.વો.ના સોલાર રુફટોપ પ્રોજેક્ટ માટે ટેન્ડર પાવર લિ. સાથે પાવર પર્યાજ એગ્રીમેન્ટ (પીપીએ) કર્યા છે. જી.પી.સી.એલ.એ. ૯૮૩.૯૯ કિ.વો. વીજળીનું ઉત્પાદન વર્ષ ૨૦૧૩-૧૪માં સફળતા પૂર્વક શરૂ કર્યું છે. વર્ષ ૨૦૨૦-૨૧માં આ પ્રોજેક્ટે રૂ. ૯૫.૪૨ લાખની આવક કરી છે.

૬) ૭૦૦ + રાધાનેસડા અલ્ટ્રા મેગા સોલાર પાર્ક

આ પાર્કમાં ૪૦૦ મે.વો. સોલાર વીજળીનું ઉત્પાદન ચાલુ છે, ૨૦૦ મે.વો.ની ક્ષમતા માટેનું કામ ચાલુ છે અને ૧૦૦ મે.વો. ક્ષમતા માટેનો પ્લોટ હજુ ફાળવવાનો છે. ઉક્ત પાર્ક ખાતે માર્ગનું બાંધકામ પૂરું થયું છે. પાળાં, પાણી પુરવઠો, વરસાદી પાણીના નિકાલ માટેની ગટરો, જેવી આધારમાળખાકીય સુવિધાઓનાં કામો પૂરાં કરવાનાં છે.

૭) ૫૦૦ મે.વો.ના હર્ષદ સોલાર પાર્ક

ગુજરાત સરકાર અને ભારત સરકારે લગભગ ૧૦૦૦ હેક્ટરની પડતર જમીન પર ૫૦૦ મે.વો.નો સોલાર પાવર પાર્ક ઊભો કરવા માટે ‘સૈદ્ધાંતિક મંજૂરી’ આપી છે. ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લાના હર્ષદ, સુઈગામ ગામે ૬૯૮ હેક્ટર જમીનનો આગોતરો કબજો આપી દીધો છે. હાલમાં જીપીસીએલએ ગુજરાત સરકારને આ પાર્કની અમલીકરણસંબંધી બાબતો અંગે નિર્ણય કરવા વિનંતી કરી છે

૮) ૧૦૦૦ મે.વો.નો ધોલેરા અલ્ટ્રા મેગા સોલાર પાર્ક (તબક્કો-૧)

ગુજરાત સરકારે ૧૦૦૦ મે.વો.નો ધોલેરા અલ્ટ્રા મેગા સોલાર પાવર પાર્ક ઊભો કરવાની મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટમાં ધોલેરા સ્પેશીયલ ઈન્વેસ્ટમેન્ટ રીજીયન લાંબી મુદતના પટેથી જમીન પૂરી પાડવા માટે સૈદ્ધાંતિક રીતે સંમત થયું છે. જીયુવીએનએલએ આ પાર્કમાંથી સૌર વીજળી ખરીદવા અંગેનું પ્રારંભિક ટેન્ડર મંગાવ્યું છે. તે પૈકી ૩૦૦ મે.વો.ની ક્ષમતા જીયુવીએનએલ દ્વારા ટાઈ-અપ થયેલી છે. આ ક્ષમતાનું નિર્માણ ટાટા પાવર રિન્યુએબલ એનર્જી લિમિટેડ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેનો અમલ ચાલુ છે. જીપીસીએલ આ પાર્કના વિકાસ માટે જરૂરી આધારમાળખું પુરું પાડી રહ્યું છે.

૯) સમુદ્રના મોજાં આધારિત વિજળી પરિયોજના

સમુદ્રનાં મોજાં આધારિત ભરતી પરિયોજનાના અમલ માટે નોડલ એજન્સી તરીકે જી.પી.સી.એલ.ની નિમણૂક કરવામાં આવી છે.

(ખ) ખાણકામ પરિયોજનાઓ

(૧) ભાવનગર લિગ્નાઈટ ખાણકામ પરિયોજનાઓ

નીચે જણાવ્યા પ્રમાણે લિગ્નાઈટ ખાણકામ માટે જી.પી.સી.એલ. એ ભાવનગર જિલ્લામાં ત્રણ લિગ્નાઈટ બ્લોક/ ખાણકામ પટા નિયત કર્યા છે.

૧. ધોધા- સુરકાલિગ્નાઈટ ભંડાર (૧૩૫૫ હેક્ટર)

૨. ખડસાલિયા- ૧ લિગ્નાઈટ ભંડાર (૭૧૨ હેક્ટર) (આ પરિયોજના હજુ શરૂ થવાની બાકી છે.)

૩. ખડસાલિયા- ૨ લિગ્નાઈટ ભંડાર (૯૧૪ હેક્ટર) (આ પરિયોજના હજુ શરૂ થવાની બાકી છે.)

૧ ધોધા-સુરકા લિગ્નાઈટ ભંડાર

વાર્ષિક ૨.૨૫ એમએમટીની નિર્ધારિત ક્ષમતા સાથેના ૧૩૫૫ હેક્ટરના વિસ્તારના ઉત્ખનન પટા પૈકી ‘કન્સેન્ટ અવોર્ડ’ થકી લગભગ ૧૦૬૯ હેક્ટર ખનગી જમીન સંપાદિત કરી લેવામાં આવી છે. ઉત્ખનન પ્રવૃત્તિઓ માટે જરૂરી પરવાનગીઓ, મંજૂરીઓ/સંમતિઓ મેળવી લેવામાં/ અમલમાં મૂકવામાં આવી છે. ધોધા-સુરકા લિગ્નાઈટ ખાણ ખાતે ઉત્ખનન પ્રવૃત્તિ ૦૧/૦૪/૨૦૧૮ થી શરૂ કરવામાં આવી છે અને ભાવનગર થર્મલ પાવર સ્ટેશન (બીએલટીપીએસ)ને લિગ્નાઈટનો પુરવઠો તા. ૦૮/૦૮/૨૦૧૮થી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. તા. ૩૧/૦૩/૨૦૨૧ સુધીમાં બીએલટીપીએસને લગભગ ૨૫,૯૮,૦૭૭.૫૨ ટન લિગ્નાઈટનો પુરવઠો આપવામાં આવ્યો છે.

(૨) બૈતરણી પશ્ચિમ કોલસા બ્લોક

કોલ બ્લોકની ફાળવણી રદ કરવાની બાબત ઓરિસ્સા હાઈકોર્ટમાં પડતર છે. બીડબલ્યુસીસીએલ એ જિઓલોજીકલ રીપોર્ટ અને ભારત સરકારના કોલસા મંત્રાલયની સંમતિના ખર્ચ પેટે વળતર પ્રાપ્ત કર્યું છે અને જીપીસીએલને તેનો ૧/૩ હિસ્સો પાછો આપ્યો છે. બીડબલ્યુસીસીએલ એ જીપીસીએલને કટક હાઈકોર્ટ, ઓરિસ્સા સમક્ષ રૂ. ૭૫ કરોડની બેંક ગેરંટી છૂટી કરવા અંગેની પડતર કાર્યવાહી ઝડપી બનાવવાની ખાતરી આપી છે.

૭. ગૌણ / સહયોગી/ સંયુક્ત સાહસની કંપનીઓ

તા. ૩૧-૦૩-૨૦૨૧ના રોજ આ કંપની કોઈ ગૌણ કંપનીઓ ધરાવતી નથી.

કંપની એક સહયોગી કંપની એટલે કે બૈતરણી વેસ્ટ કોલ કંપની લિમિટેડ (બી.ડબલ્યુ.સી.સી.એલ.) ધરાવે છે અને તે ઉપરાંત ૧૦ ટકા કરતા ઓછા રોકાણ સાથેની અન્ય ૩ સંયુક્તરીતે નિયંત્રિત કંપનીઓ ધરાવે છે. કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ-૧૨૯ની પેટા કલમ-૩ના પ્રથમ પરંતુક હેઠળ જરૂરી છે તે મુજબ, ‘‘ ધ કંપનીઝ (એકાઉન્ટ્સ) રુલ્સ, ૨૦૧૪ના નિયમ-૫માં સમાવિષ્ટ નિર્દિષ્ટ ફોર્મ એ.ઓ.સી.૧માં સહયોગી સંયુક્ત સાહસોને લગતું નાણાકીય પત્રક આ અહેવાલ સાથે જોડાણ-૧ તરીકે આપવામાં આવ્યું છે. બી.ડબલ્યુ.સી.સી.એલ.ને ફાળવવામાં આવેલો કોલ બ્લોક ભારત સરકારના કોલસા મંત્રાલયે રદ કર્યો હોવાથી અને આ બાબત ઓરિસ્સા હાઈકોર્ટમાં ન્યાયાધીન હોવાથી બી.ડબલ્યુ.સી.સી.એલ.નાં નાણાકીય પત્રકોને આ કંપની સાથે એકત્રિત કરવામાં આવ્યાં નથી.

૮. નિયામકો અને મહત્વનો વ્યવસ્થાપકીય કર્મચારી વર્ગ

(ક) ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર

વર્ષ દરમિયાન શ્રીમતી સુનયના તોમર, આઈ.એ.એસ. કંપનીના આધ્યક્ષ હતા અને શ્રી એસ.બી.ખાલિયાને કંપનીના મેનેજિંગ ડિરેક્ટર હતા. શ્રીમતી સુનયના તોમર, આઈ.એ.એસ. એ કંપનીના આધ્યક્ષ તરીકે ૧૫/૦૬/૨૦૨૧ના રોજ રાજીનામું આપ્યું હતું અને તા. ૦૮/૦૭/૨૦૨૧થી શ્રીમતી મમતા વર્મા, આઈ.એ.એસ.ને કંપનીનાં આધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં અવ્યાં હતાં.

આ અહેવાલની તારીખે શ્રી એસ.બી.ખાલિયાએ તા. ૦૧/૧૦/૨૦૨૧ના રોજ કંપનીના મેનેજિંગ ડિરેક્ટરના પદેથી રાજીનામું આપ્યું હતું અને તા. ૧૧/૧૧/૨૦૨૧થી શ્રી વિકલ્પ ભારદ્વાજ, આઈ.એ.એસ.ને કંપનીના મેનેજિંગ ડિરેક્ટર નિયુક્ત કરવામાં અવ્યા હતા.

(ખ) સ્વતંત્ર નિયામકો

કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ-૧૪૯(દ) અન્વયે નિર્દિષ્ટ કરવામાં આવ્યા મુજબ નિયામકોની ‘સ્વતંત્રતા’ની વ્યાખ્યાના સંદર્ભમાં, શ્રી પી.કે. તનેજા, આઈ.એ.એસ. (નિવૃત્ત) વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન નિયામક મંડળમાં ‘નોન-એક્ઝીક્યુટીવ’ સ્વતંત્ર નિયામક હતા અને બીજા ‘નોન-એક્ઝીક્યુટીવ’ સ્વતંત્ર નિયામક ની નિમણૂક પ્રક્રિયા હેઠળ છે. સ્વતંત્ર નિયામકે કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ-૧૪૯ હેઠળ નિર્દિષ્ટ કરવામાં આવેલ જરૂરી એકરાર રજૂ કર્યા છે. તમામ નિયામકોએ નિર્દિષ્ટ કરવામાં આવેલી સંહિતાનું પાલન કરવા અંગેનો એકરાર રજૂ કર્યા છે.

(ગ) મહિલા નિયામક

કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ-૧૪૯ની જોગવાઈઓના સંદર્ભમાં, નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન કંપનીના નિયામકમંડળમાં મહિલા નિયામક તરીકે શ્રીમતી અંજુ શર્મા, આઈ.એ.એસ.હતા આમ છતાં અહેવાલની તારીખે શ્રીમતી મમતા વર્મા, આઈ.એ.એસ. અને સુશ્રી. દિપલ હડિયલ બોર્ડમાં મહિલા નિયામકો છે.

(ઘ) મહત્વનો વ્યવસ્થાપકીય કર્મચારી વર્ગ

૨૦૨૦-૨૧ના નાણાકીય વર્ષ દરમિયાન સુશ્રી કૃપા જોશી કંપનીના કંપની સેક્રેટરી તથા કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ-૨૦૩ હેઠળ કે. એમ. પી. પણ છે. શ્રી મેહુલ જે. ડનાયક કંપનીના ચીફ ફાઇનાન્સીયલ ઓફિસર તેમજ કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ-૨૦૩ હેઠળ કેએમપી પણ છે.

૯. નિયામક મંડળની બેઠકોની સંખ્યા.

સમીક્ષા હેઠળના નાણાકીય વર્ષ દરમિયાન નિયામક મંડળની ચાર બેઠકો તા. ૧૯/૦૬/૨૦૨૦, ૨૮/૦૮/૨૦૨૦, ૨૩/૧૨/૨૦૨૦, અને ૦૪/૦૨/૨૦૨૧ના રોજ મળી હતી. બે સળંગ બેઠકો વચ્ચેનો સમયગાળો કંપની અધિનિયમ, ૨૦૧૩ હેઠળ નિયત કરવામાં આવેલી સમય મર્યાદા મુજબનો હતો.

૧૦. નિયામક મંડળની સમિતિઓ

સમીક્ષા હેઠળનાં વર્ષ દરમિયાન કંપની અધિનિયમ, ૨૦૧૩ અને તે હેઠળ ઘડવામાં આવેલા નિયમોની સંબંધિત જોગવાઈઓની જરૂરિયાતોને અનુસાર

કંપની “નિગમિત સામાજિક જવાબદારી સમિતિ” અને વખતોવખત ઈકિવટી શેર્સની ફાળવણી કરવા માટે “શેર ઓફર એન્ડ એલોટમેન્ટ કમિટિ” ધરાવે છે.

(ક) નિગમિત સામાજિક જવાબદારી સમિતિ

કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ ૧૩૫ની જોગવાઈઓ અનુસાર, કંપનીએ નિગમિત સામાજિક જવાબદારી સમિતિની રચના કરી છે. તા. ૩૧/૦૩/૨૦૨૧ના રોજ નિગમિત સામાજિક જવાબદારી સમિતિ નીચે મુજબ છે.

- (૧) શ્રીમતી અંજુ શર્મા, આઈ.એ.એસ. - સમિતિનાં ચેર પર્સન
- (૨) શ્રી એસ.બી. ખયાલિયા - સભ્ય
- (૩) શ્રી પી. એચ. રાણા - સભ્ય

સમિતિની પ્રવૃત્તિઓનો વિગતવાર અહેવાલ “જોડણ-૨”માં આપવામાં આવ્યો છે.

૧૧. તકેદારી તંત્ર/વિહસલ બ્લોઅર પોલિસી

કંપનીએ એક તકેદારી તંત્ર અમલમાં મૂક્યું છે, જેને અનુસરીને વ્હીસલ બ્લોઅર્સ ગેરવાજબી કાર્ય-વર્તણૂક, વ્યવસ્થાપન પ્રયાસો, વ્યાપાર પ્રથાઓ, મનોવૈજ્ઞાનિક રીતે વિપરિત કાર્ય-પરિસ્થિતિઓ, ખરેખર અથવા શંકાસ્પદ છેતરપીંડીઓ અથવા આચારસંહિતાના ભંગ કે કાનૂની અથવા નિયંત્રક આવશ્યકતાઓના ભંગ, કોઈપણ ખોટાં નાણાકીય પત્રકો અથવા અહેવાલો અથવા નાણાકીય પત્રકો કે અહેવાલોની ખોટી રજૂઆત અને આવી અન્ય નકારાત્મક પ્રકારની પ્રવૃત્તિઓ જે કંપનીની છાપ બગાડતી હોવાનું કે સામાજિક પ્રતિષ્ઠા ઝાંખી પાડતી હોવાનું કે કામના સ્થળે કર્મચારીઓનો જુસ્સો અને સલામતી ઘટાડતી હોવાનું જણાય તેની સામે ચિંતા વ્યક્ત કરી શકશે. વ્હીસલ બ્લોઅર અપવાદરૂપ સંજોગોમાં સીધા જ ઓડિટ સમિતિના ચેરમેનનો સંપર્ક કરી શકે છે અને તેમની ચિંતા કે ફરિયાદ જણાવી શકે છે.

૧૨. કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ-૧૮૬ હેઠળ આપવામાં આવેલી લોન, ગેરંટી કે કરવામાં આવેલાં રોકાણોની વિગતો.

સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન કંપનીએ કરેલું રોકાણ અને આપેલી લોન વર્ષ ૨૦૨૦-૨૧નાં નાણાકીય પત્રકની અનુક્રમે નોંધ-૩ અને ૪ તથા નોંધ-૫માં દર્શાવ્યાં છે.

૧૩. સંબંધિત પક્ષકારો સાથે કરવામાં આવેલા કરારો અથવા ગોઠવણીની વિગતો

સંબંધિત પક્ષકારો સાથે આ નાણાકીય વર્ષ દરમિયાન કંપનીએ કરેલી તમામ લેવડદેવડો સામાન્ય કામકાજરૂપે જ અને યોગ્ય અંતર જાળવીને કરવામાં આવી હતી અને કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ-૧૮૮ લાગુ પડે એવી કોઈ લેવડદેવડ કરવામાં આવી નથી. વધુમાં, સમીક્ષા હેઠળના વર્ષ દરમિયાન કંપનીના પ્રમોટર્સ, નિયામકો અથવા મહત્વના વ્યવસ્થાપકીય કર્મચારીવર્ગ સાથે, કંપનીના હિત સાથે ઘર્ષણમાં આવે એવી કોઈ લેવડદેવડ સંબંધિત પક્ષકારો થકી કરવામાં આવી નથી. આપના નિયામકો વર્ષ ૨૦૨૦-૨૧નાં નાણાકીય પત્રકની નોંધ-૨૭ તરફ આપનું ધ્યાન દોરે છે જેમાં સંબંધિત પક્ષકારો સાથેની લેવડદેવડો દર્શાવવામાં આવી છે. વધુમાં જ્યારે હોલ્ડિંગ કંપની/ સહયોગી કંપની રાજ્ય નિયંત્રિત કંપની હોય ત્યારે આવી જાહેરાત કરવી જરૂરી નથી.

૧૪. વાર્ષિક રિટર્નની તારીખ

કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ-૧૩૪(૩)(ક), કલમ -૮૨ (૩)ને કંપનીઝ (મેનેજમેન્ટ એન્ડ એડમીનીસ્ટ્રેશન) રુલ્સ, ૨૦૧૪ના નિયમ-૧૨ સાથે વાંચતાં, તેમાં કરવામા આવેલી જોગવાઈ મુજબ, ૩૧મી માર્ચ, ૨૦૨૧ના રોજ મુજબનું નિર્દિષ્ટ ફોર્મ એમ.જી.ટી.-૮ આ અહેવાલના ભાગરૂપે જોડાણ-૩ તરીકે આપવામાં આવ્યું છે.

૧૫. ઓડિટરો અને ઓડિટરનાં અવલોકનો :

(ક) વૈધાનિક ઓડિટરો

કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ-૧૩૮ અને તે હેઠળ ઘડવામાં આવેલા નિયમોની જોગવાઈ મુજબ, ભારતના કોમ્પ્રોલર અને ઓડિટર જનરલની કચેરી, નવી દિલ્હીએ મે. અનિલ એન. શાહ એન્ડ કું, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, અમદાવાદની નિમણૂક ૨૦૨૦-૨૧ના વર્ષ માટે વૈધાનિક ઓડિટર તરીકે કરી છે. તેઓ આ હોદ્દો આગામી વર્ષની સામાન્ય સભાની તારીખ સુધી ધારણ કરી રાખશે.

(ખ) કોસ્ટ ઓડિટરો

કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ ૧૪૮(૧) હેઠળ કેંદ્ર સરકાર દ્વારા નિયત કરવામાં આવ્યા મુજબ, આ કંપનીએ કોસ્ટ એકાઉન્ટીંગ રેકર્ડ્ઝ રાખવું જરૂરી છે. તદનુસાર કંપની જરૂરી કોસ્ટ હિસાબો અને રેકર્ડ રાખે છે. કંપનીઝ (કોસ્ટ રેકર્ડ્ઝ એન્ડ ઓડિટ) રુલ્સ, ૨૦૧૪ મુજબ, મે. પી. એચ. દેસાઈ એન્ડ કું., કોસ્ટ એકાઉન્ટન્ટ્સ, અમદાવાદની નિમણૂક વર્ષ ૨૦૨૦-૨૧ માટે કંપનીના કોસ્ટ ઓડિટર તરીકે કરી છે.

(ગ) આંતરિક ઓડિટરો

કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ-૧૩૮ને, તે હેઠળ ઘડવામાં આવેલા નિયમો સાથે વાંચતાં, તેમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ, નિયામક મંડળે મે. સંદીપ દેસાઈ એન્ડ કું., ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, અમદાવાદની નિમણૂક વર્ષ ૨૦૨૦-૨૧ માટે કંપનીનું આંતરિક ઓડિટ કરવા માટે કંપનીના આંતરિક ઓડિટર તરીકે કરી છે. આંતરિક ઓડિટરોનાં અવલોકનો અને ભલામણો ઓડિટ સમિતિને જણાવવામાં આવે છે અને ઓડિટ સમિતિ તે અંગે યોગ્ય કાર્યવાહી કરે છે.

(ઘ) સેક્રેટરિયલ ઓડિટર્સ

કલમ-૨૦૪ અને તે હેઠળ ઘડવામાં આવેલા નિયમોની જોગવાઈ મુજબ કંપનીએ મે. ધારા પટેલ, કંપની સેક્રેટરીઝ, પ્રેક્ટીસીંગ કંપની સેક્રેટરી, અમદાવાદની નિમણૂક વર્ષ ૨૦૨૦-૨૧ માટે સેક્રેટરિયલ ઓડિટર તરીકે કરી છે. સેક્રેટરીયલ ઓડિટરનો અહેવાલ આ સાથેના જોડાણ-૪માં આપવામાં આવ્યો છે.

(ચ) વૈધાનિક ઓડિટરે તેમના ઓડિટ અહેવાલમાં અને સેક્રેટરિયલ ઓડિટરે તેમના સેક્રેટરિયલ ઓડિટર અહેવાલમાં દર્શાવેલા દરેક કવોલિફિકેશન/રિઝર્વેશન/વિપરિત રિમાર્ક અથવા અસ્વિકરણ (ડિસ્કેઈમર) અંગે નિયામક મંડળનો ખુલાસો અથવા ટિકા-ટિપ્પણ.

વૈધાનિક ઓડિટરે તેમના ઓડિટ અહેવાલમાં કોઈ કવોલિફિકેશન, રિઝર્વેશન દર્શાવ્યાં નથી અને કોઈ વિપરિત નોંધ પણ કરી નથી. તેમણે કોઈ અસ્વિકરણ (ડિસ્કેઈમર) પણ આપ્યું નથી. જણાવવામાં આવેલ અનુપાલન અંગેનો વિલંબ કોવિડ-૧૯ મહામારીની અસરોને કારણે થયો હોવાથી, સેક્રેટરિયલ ઓડિટરનાં અવલોકનો સ્વયંસ્પષ્ટ છે.

૧૬. કંપનીની નાણાકીય સ્થિતિને અસર કરતા પ્રત્યક્ષ ફેરફારો અને પ્રતિબદ્ધતાઓ :

નાણાકીય વર્ષના અંત એટલે કે ૩૧મી માર્ચ, ૨૦૨૧ અને નિયામકોના અહેવાલની તારીખ વચ્ચેના સમયગાળામાં રાબેતા મુજબના ધંધાકીય સોદા સિવાય એવા કોઈ પ્રત્યક્ષ ફેરફારો કે પ્રતિબદ્ધતાઓ કરવામાં આવી નથી જેનાથી કંપનીની નાણાકીય સ્થિતિ પર વિપરિત અસર પડે. કંપનીના કામકાજના પ્રકારમાં કોઈ ફેરફાર થયો નથી. કંપનીના ચાલુ કામકાજ પર કે ભાવિ કામગીરી પર અસર કરે એવા કોઈ મહત્વના કે પ્રત્યક્ષ હુકમો નિયંત્રકો અથવા કોર્ટ અથવા ટ્રિબ્યુનલે ઇસ્યુ કર્યા નથી.

૧૭. કર્મચારીઓની વિગતો

આ એક સરકારી કંપની હોવાથી, કોર્પોરેટ બાબતોના મંત્રાલયના તા. ૦૫/૦૬/૨૦૧૫ના જાહેરનામા મુજબ, કલમ ૧૯૭ આ કંપનીને લાગુ પડતી નથી.

૧૮. શેર મૂડી

આ કંપની માત્ર એક જ વર્ગના શેર્સ એટલે કે ઈકિવટી શેર્સ ધરાવે છે. તા. ૩૧/૦૩/૨૦૨૧ના રોજ કંપનીની અધિકૃત શેર મૂડી રૂ. ૬૦૦ કરોડ હતી, જે રૂ. ૧૦૦/-નો એક એવા ૬ કરોડ શેર્સમાં વિભાજિત થયેલી છે. તા. ૩૧/૦૩/૨૦૨૧ના રોજ કંપનીની ઇસ્યુ, સબસ્ક્રાઈબ અને ભરપાઈ થયેલ શેર મૂડી રૂ. ૫,૧૩,૨૨,૫૬,૦૫૦ હતી. મૂડી સંબંધી અન્ય વિગતો નીચે મુજબ છે.

(ક) જામીનગીરીઓ પાછી ખરીદવી

કંપનીએ સમીક્ષા હેઠળના વર્ષ દરમિયાન તેની કોઈ જામીનગીરી પાછી ખરીદી નથી.

(ખ) સ્વીટ ઈકિવટી

કંપનીએ સમીક્ષા હેઠળના વર્ષ દરમિયાન કોઈ સ્વીટ ઈકિવટી શેર્સ ઇસ્યુ કર્યા નથી.

(ગ) બોનસ શેર્સ

સમીક્ષા હેઠળના વર્ષ દરમિયાન કોઈ બોનસ શેર ઇસ્યુ કરવામાં આવ્યા નથી.

(ઘ) કર્મચારીઓનો સ્ટોક ઓપ્શન પ્લાન

કંપનીએ કર્મચારીઓને કોઈ સ્ટોક ઓપ્શન પ્લાન પૂરો પાડ્યો નથી.

૧૯. ઊર્જા, પ્રૌદ્યોગિકીનું ગ્રહણ અને વિદેશી હુંડિયામણની આવક જાવક :

(ક) ઊર્જાનું ગ્રહણ : સમીક્ષા હેઠળના વર્ષ દરમિયાન, જેની જાહેરાત કરવી પડે એવી ઊર્જાની કોઈ વપરાશ થઈ ન હતી.

(ખ) ટેકનોલોજીનું ગ્રહણ : સમીક્ષા હેઠળના વર્ષ દરમિયાન આપની કંપનીએ કોઈ ટેકનોલોજીની આયાત કરી નથી.

(ગ) વિદેશી હુંડિયામણની આવક અને જાવક : શૂન્ય

૨૦. જોખમ વ્યવસ્થાપન

કંપનીની સંપત્તિ અને મીલકતોનો પૂરતો વીમો ઉતારવમાં આવ્યો છે. આમ છતાં, કંપની માટે જોખમ ઊભું કરે એવા તત્ત્વોને આવરી લેતી જોખમ વ્યવસ્થાપન નીતિ ઘડવાની અને તેને અમલમાં મૂકવાની બાકી છે.

૨૧. આંતરિક ઓડિટ અને નિયંત્રણ પદ્ધતિ

કંપની તેના કદ અને કામગીરીના પ્રમાણને સુસંગત એવી યોગ્ય આંતરિક નિયંત્રણ પદ્ધતિ અને પ્રક્રિયાઓ ધરાવે છે. જે થકી કંપની નિર્ધારિત નીતિઓ અને પદ્ધતિઓનું પાલન સુનિશ્ચિત કરે છે, જેથી ઓડિટ હેઠળ આવતા પ્રત્યેક વિષય અંગેના જોખમો ઘટાડી શકાય. આ માટે કંપનીના સ્ટેન્ડ અલોન આઈએનડી એએસ નાણાકીય પત્રકો અંગેના સ્વતંત્ર ઓડિટરના સમાન તારીખના અહેવાલ સાથેનું જોડાણ-૨ જુઓ.

૨૨. કામના સ્થળે સ્ત્રીઓની જાતીય સતામણી (નિવારણ, પ્રતિબંધ અને ઉકેલ) અધિનિયમ, ૨૦૧૩ હેઠળ જાહેરાત

સમીક્ષા હેઠળના વર્ષ દરમિયાન કંપનીને મહિલા કર્મચારીઓની જાતીય સતામણી અંગે શૂન્ય ફરિયાદ પ્રાપ્ત થઈ હતી. કામના સ્થળે સ્ત્રીઓની જાતીય સતામણી (નિવારણ, પ્રતિબંધ અને ઉકેલ) અધિનિયમ, ૨૦૧૩ની જોગવાઈઓ હેઠળ આંતરિક ફરિયાદ સમિતિની રચના હજુ કરવાની છે.

૨૩. નિયામક મંડળનું મૂલ્યાંકન

આ એક સરકારી કંપની હોવાથી, ભારત સરકારના કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તા પમી જુન, ૨૦૧૫ના જાહેરનામા ક્રમાંક જીએસઆર-૧૬૩(ચ)ને ધ્યાનમાં લેતાં, અધિનિયમ, ૨૦૧૩ની કલમ ૧૩૪(૩)(ધ)ની જોગવાઈઓ લાગુ પડતી નથી.

૨૪. નિયામકોની જવાબદારી અંગેનું નિવેદન

કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ ૧૩૪(પ)ની જોગવાઈઓ મુજબ નિયામક મંડળ તેની જવાબદારી અંગે નિવેદન કરે છે કે -

- આ વાર્ષિક અહેવાલો તૈયાર કરવામાં મહત્વનાં વિચલન સંબંધી યોગ્ય ખુલાસાઓ સાથે લાગુ પાડવાપાત્ર હિસાબી ધોરણો અનુસરવામાં આવ્યાં છે.
- નિયામકોએ નાણાકીય વર્ષના અંતે કંપનીની સ્થિતિનું અને કંપનીના નફા-નુકસાનનું સાચું અને યોગ્ય ચિત્ર આપે એવી હિસાબી નીતિઓ પસંદ કરી છે અને એમને એકધારી લાગુ પાડવામાં આવી છે અને ઉચિત અને વિવેકી નિર્ણયો અને અંદાજો કર્યા છે.
- નિયામકોએ કંપનીની મિલકતની સલામતી માટે અને છળકપટ તથા અન્ય અનિયમિતતાઓ રોકવા અને શોધી કાઢવા, આ અધિનિયમની જોગવાઈઓ અનુસાર પૂરતું હિસાબી રેકર્ડ રાખવા માટે યોગ્ય અને પૂરતી કાળજી લીધી છે.
- નિયામકોએ આ વાર્ષિક હિસબો ચાલુ ધંધાના આધારે તૈયાર કર્યા છે.
- (કંપની લિસ્ટેડ કંપની ન હોવાથી લાગુ પડતું નથી)
- નિયામકોએ એવી યોગ્ય પદ્ધતિઓ ઘડી છે કે જેથી લાગુ પાડવાપાત્ર તમામ કાયદાઓનું અનુપાલન થાય અને આવી પદ્ધતિઓ પર્યાપ્ત અને અસરકારક રીતે કામ કરે તે સુનિશ્ચિત કરી શકાય.

૨૫. અન્ય જહેરાતો

- વર્ષ દરમિયાન કંપનીના કામકાજના પ્રકારમાં કોઈ ફેરફાર થયો નથી.
- કંપની અધિનિયમ ૨૦૧૩ની કલમ ૧૪૩(૧૨)ના સંદર્ભમાં, વૈધાનિક ઓડિટરોના ઓડિટ દરમિયાન કોઈ છેતરપીંડી જોવા કે જાણવા મળી નથી.
- આ અહેવાલમાં અન્ય જણાવવામાં આવ્યું છે એ સિવાય, રેગ્યુલેટર્સ અથવા કોર્ટ્સ અથવા ટ્રિબ્યુનલ્સ દ્વારા એવા કોઈ મહત્વના કે પ્રત્યક્ષ હુકમો કરવામાં આવ્યા નથી જેની ચાલુ ધંધા પર કે કંપનીના ભવિષ્યના કામકાજ પર કોઈ અસર પડે.
- કંપનીએ લાગુ પડતા સેક્રેટરિયલ ધોરણોનું પાલન કર્યું છે.

૨૭. ઋણસ્વીકાર :

આપના નિયામકો તમામ કર્મચારીઓએ કંપની પ્રત્યે દાખવેલી નિષ્ઠા, વફાદારી અને સહકાર બદલ તેમનો આભાર માને છે. આપના નિયામકો ગુજરાત સરકારના જુદા જુદા વિભાગો, ખાસ કરીને ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, ગ્રાહકો, બેંકર્સ અને અન્ય નિયમકારી સત્તામંડળો તરફથી મળેલ બહુમૂલ્ય યોગદાન, સહકાર અને સહાયની સાભાર નોંધ લે છે.

સ્થળ : ગાંધીનગર

તા. ૨૯-૧૨-૨૦૨૧

નિયામક મંડળના નામે અને
તેમના વતી
સહી/-
(શ્રીમતી મમતા વર્મા, આઈ.એ.એસ.)
અધ્યક્ષ
ડીઆઈએન: ૦૧૮૫૪૩૧૫

જોડાણ-૧

ફોર્મ - એઓસી-૧

(કલમ-૧૨૮ની પેટા કલમ (૩)ના પહેલા પરંતુકને કંપનીઝ (એકાઉન્ટ્સ) રુલ્સ, ૨૦૧૪ના નિયમ-૫ સાથે વાંચતાં, તેમાં કરવામાં આવેલી જોગવાઈ અનુસાર)

કંપનીની શાખાઓ/ સહયોગી કંપનીઓ/ સંયુક્ત સહાયોનાં નાણાકીય પત્રોની લાક્ષણિકતાઓનો સમાવેશ કરતું પત્રક

ભાગ- 'ક' - શાખાઓ- લાગુ પડતું નથી (કંપની તેની કોઈ શાખા ધરાવતી નથી.)

ભાગ- 'ખ' - સહયોગી કંપનીઓ અને સંયુક્ત સાહસો

સહયોગી કંપનીઓ સાથે સંબંધિત, કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ- ૧૨૮(૩)ને અનુસરીને પત્રક

સહયોગી કંપનીનું નામ	બૈતરણી વેસ્ટ કોલ કંપની લિમિટેડ (BWCCCL)
૧. ઓડિટ કરવામાં આવેલાં છેલ્લાં પાકાં સરવૈયાની તારીખ.	૩૧-૦૩-૨૦૨૧
૨. વર્ષના અંતે કંપનીએ ધારણ કરેલા સહયોગી કંપનીના શેર્સ હોલ્ડીંગનું પ્રમાણ	રૂ. ૧૦૦૦/-નો એક એવા ૧૦૦૦૦૦
સહયોગી કંપની/ સંયુક્ત સાહસમાં રોકાણ કરવામાં આવેલી રકમ હોલ્ડીંગનું પ્રમાણ %	રૂ. ૧૦,૦૦,૦૦,૦૦૦/- ૩૩.૩૩ ટકા
૩. નોંધપાત્ર પ્રભાવ કેવી રીતે પડે છે તેનું વર્ણન	ગુજરાત સરકારની કંપની છે. (જેનું પ્રતિનિધિત્વ ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ કરે છે), ઓરિસ્સા સરકાર અને કેરાલા સરકારની આ સંયુક્ત સાહસની કંપની છે, જેમાં દરેક સરકારનો ૩૩.૩૩ ટકા હિસ્સો છે.
૪. સહયોગી કંપની/ સંયુક્ત સાહસને એકત્રિત ન કરવાનાં કારણો.	BWCCCLને ભારત સરકારના કોલસા મંત્રાલય દ્વારા ફાળવવામાં આવેલો કોલ બ્લોક રદ કરવામાં આવ્યો છે. આ બાબત ઓરિસ્સાની હાઈકોર્ટમાં સબજ્યુડિસ (ન્યાયાધીન) છે. તેથી નાણાકીય પત્રોને કંપની સાથે એકત્રિત કરવામાં આવ્યાં નથી.
૫. ઓડિટ કરવામાં આવેલાં છેલ્લાં પાકાં સરવૈયા મુજબ શેરહોલ્ડીંગ મુજબ ચોખ્ખી કિંમત.	BWCCCLની કુલ કિંમત રૂ. ૩૨,૮૫,૮૧,૬૦૮/- છે. જીપીસીએલ તેમાંથી ૩૩.૩૩ ટકા એટલે કે રૂ. ૧૦,૮૮,૫૨,૮૮૩/-ના શેર્સ ધરાવે છે.
૬. વર્ષનો નફો/ ખોટ	ચોખ્ખો નફો રૂ. ૮૫,૫૧,૭૬૭ /- જીપીસીએલના ભાગે આવેલ નફો રૂ. ૨૮,૫૦,૩૦૪/-
૧. એકત્રિકરણમાં ધ્યાને લેવામાં આવેલી	શૂન્ય
૨. એકત્રિકરણમાં ધ્યાને લેવામાં ન આવેલી	રૂ. ૨૮,૫૦,૩૦૪/- એનએ તરીકે

૧. કામગીરી હજુ ચાલુ કરવાની હોય એવી સહયોગી કંપનીઓ અથવા સંયુક્ત સાહસોનાં નામ.

૨. વર્ષ દરમિયાન ફડયામાં ગયેલી અથવા વેચી નાખવામાં આવેલી સહયોગી કંપનીઓ અથવા સંયુક્ત સાહસોનાં નામ.

નોંધ : આ ફોર્મને, પાકા સરવૈયાને કરવામાં આવે છે તે જ રીતે પ્રમાણિત કરવાનું છે.

તા. ૨૯-૧૨-૨૦૨૧

સ્થળ : ગાંધીનગર

નિયામક મંડળના નામે

અને તેમના વતી

સહી

અધ્યક્ષ

ડીઆઈએન-૦૧૮૫૪૩૧૫

સહી

ચીફ ફાઈનાન્સીઅલ

ઓફીસર

સહી

મેનેજીંગ ડીરેક્ટર

ડીઆઈએન-૦૮૩૮૬૨૨૨

સહી

કંપની સેક્રેટરી

જોડાણ- ૨

કોર્પોરેટ સોશ્યલ રીસ્પોન્સીબીલીટી (સીએસઆર) પ્રવૃત્તિઓ અંગે વાર્ષિક અહેવાલ

૧. હાથ ધરવાનું વિચારાણું હોય એવા પ્રોજેક્ટ્સ અથવા કાર્યક્રમો સહિત, કંપનીની સીએસઆર નીતિની ટૂંકી રૂપરેખા તથા સીએસઆર નીતિ તેમ જ પ્રોજેક્ટ્સ અથવા કાર્યક્રમોની વેબ-લિન્કનો રેફરન્સ.
કંપની સમજે છે કે કંપની સમાજનો એક ભાગ હોવાથી સમાજની શક્ય એટલી વધુ સેવા કરવી અને સમાજને મદદરૂપ બનવું તે કંપનીની નૈતિક જવાબદારી છે. આ સીએસઆર નીતિનો, સીએસઆર હેઠળનાં પહેલરૂપ પ્રયાસો થકી ઉદ્દેશ કંપની જે સમુદાયો વચ્ચે રહીને કામ કરે છે તેમનો સર્વત્રાણી વિકાસ કરવાનો અને સમાજ માટે સામાજિક, પર્યાવરણલક્ષી અને આર્થિક મૂલ્ય ઊભું કરવાનો છે.
કંપનીની કોર્પોરેટ સોશ્યલ રીસ્પોન્સીબીલીટી નીતિ કંપનીની વેબ સાઈટ www.gpcl.gujarat.gov.in પર ઉપલબ્ધ છે.
૨. સીએસઆર સમિતિની રચના
શ્રીમતી અંજુ શર્મા, આઈ.એ.એસ. - ચેરપર્સન (૨૮/૦૭/૨૦૨૧ સુધી)
શ્રી એસ.બી.ખયાલિયા - સભ્ય (૦૧/૧૦/૨૦૨૧ સુધી)
શ્રી પી.એચ.રાણા - સભ્ય
૩. છેલ્લાં ત્રણ વર્ષનો કંપનીનો સરેરાશ ચોખ્ખો નફો
સરેરાશ ચોખ્ખો નફો (૨૦૧૭-૧૮ થી ૨૦૧૯-૨૦) : રૂ. ૬૭,૭૫,૫૪,૦૨૭/-
૪. નિર્દિષ્ટ સી.એસ.આર ખર્ચ (ઉપર (૩)માં જણાવેલી બાબતની રકમના ૨ ટકા)
સીએસઆર પેટે રૂ. ૧,૩૫,૫૧,૦૮૧/-
૫. નાણાકીય વર્ષ દરમિયાન સી.એસ.આર પેટે વાપરવામાં આવેલી રકમની વિગતો.
(ક) નાણાકીય વર્ષ દરમિયાન વાપરવામાં આવેલ કુલ રકમ: રૂ. ૨૭,૫૦,૦૦૦/- (ના.વ. ૨૦૨૦-૨૧માં મંજૂર થયેલ પરંતુ ના.વ. ૨૦૨૧-૨૨માં ખર્ચવામાં આવેલ)
(ખ) વણવપરાયેલી રકમ, કોઈ હોય તો: રૂ.૧,૩૫,૫૧,૦૮૧/- (ના.વ. ૨૦૨૦-૨૧માં મંજૂર થયેલ પરંતુ ના.વ. ૨૦૨૧-૨૨માં ખર્ચવામાં આવેલ)
(ગ) નાણાકીય વર્ષ દરમિયાન રકમ કે વી રીતે ખર્ચવામાં આવી તે નીચે દર્શાવ્યું છે.

ક્રમ નં.	નક્કી કરવામાં આવેલ સીએસઆર પ્રોજેક્ટ અથવા પ્રવૃત્તિ	પ્રોજેક્ટ જે હેઠળ આવરી લેવામાં આવ્યો છે તે સેક્ટર	પ્રોજેક્ટ અથવા કાર્યક્રમ (૧) સ્થાનિક અથવા અન્ય (૨) પ્રોજેક્ટ અથવા કાર્યક્રમ જ્યાં હાથ ધરવામાં આવ્યો હોય તે રાજ્ય અને જિલ્લાનું નામ જણાવો.	ખર્ચ જોગવાઈ (બજેટ) પ્રોજેક્ટ અથવા કાર્યક્રમવાર	પ્રોજેક્ટ અથવા કાર્યક્રમના પ ટા- સદરો હેઠળ ખર્ચવામાં આવેલી રકમ (૧) પ્રોજેક્ટ અથવા કાર્યક્રમનું સીધું ખર્ચ (૨) ઓવર હેડ્ડ	અહેવાલના સમયગાળા સુધી એકત્રિત ખર્ચ	ખર્ચવામાં આવેલી રકમ સીધી અથવા અમલકર્તા એજન્સી મારફત
*૧.	સરકારી આર્ટ્સ અને કોમર્સ કોલેજ, ભાવનગર	શિક્ષણ અને આરોગ્ય સંભાળને પ્રોત્સાહન	ભાવનગર, ગુજરાત	રૂ. ૮,૫૦,૦૦૦/-	સીધું ખર્ચ રૂ. ૮,૫૦,૦૦૦/-	રૂ. ૪,૮૩,૩૭૯/-	સીધું
**૨.	ધ અક્ષયપાત્ર ફાઉન્ડેશન, ગુજરાત	કુપોષણ નાબૂદ કરવું અને આરોગ્ય સંભાળને પ્રોત્સાહન	ભાવનગર, ગુજરાત	રૂ. ૯,૦૦,૦૦૦/-	સીધું ખર્ચ રૂ. ૯,૦૦,૦૦૦/-	રૂ. ૯,૦૦,૦૦૦/-	સીધું
*&**નીચેની નોંધ જુઓ							

- *૧. રૂ. ૮,૫૦,૦૦૦/- નો કુલ સીએસઆર ફાળો નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦થી આગળ ખેંચવામાં આવ્યો છે અને તે પૈકી રૂ. ૪,૮૩,૩૭૯/-ની રકમ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ખર્ચવામાં આવી છે. બાકીની રકમ વણવપરાયેલ નીગમિત સામાજિક જવાબદારી ખાતામાં તબદીલ કરવામાં આવી છે, જે ચાલુ પ્રોજેક્ટ માટેની છે.
- **૨. રૂ. ૯,૦૦,૦૦૦/-નો ઉક્ત ફાળો નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦થી આગળ ખેંચવામાં આવ્યો છે અને તે સમગ્ર રકમ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ખર્ચવામાં આવી છે.
૩. આ ઉપરાંત, નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ખર્ચવાની સીએસઆર હેઠળની કુલ રૂ. ૧,૩૫,૫૧,૦૮૧/- પૈકી રૂ. ૨૭,૫૦,૦૦૦/- ની રકમ અક્ષય પાત્ર ફાઉન્ડેશનને નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન હેપીનેસ કિટના વિતરણ માટે આપવાની મંજૂરી મળી હતી પરંતુ કોવિડ-૧૯ને કારણે તે ખર્ચ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં કરવામાં આવ્યું હતું. બાકીની રૂ. ૧,૦૭,૦૫,૯૭૦/-ની રકમ, તા. ૨૨-૦૧-૨૦૨૧ના સુધારેલા સીએસઆર જાહેરનામા મુજબ પીએમ (કેસ) ફંડમાં તબદીલ કરવામાં આવ્યા હતા.
૬. કંપની છેલ્લાં ત્રણ નાણાકીય વર્ષો કે તેના ભાગના સરેરાશ નફાના બે ટકાનો ખર્ચ ન કરી શકી હોય તો કંપની તેના નિયામકોના અહેવાલમાં તે માટેનાં કારણો રજૂ કરશે.
ઉપરની નોંધો જુઓ
૭. કંપનીની સીએસઆર સમિતિ આથી એ બાબતનું સમર્થન કરે છે કે સીએસઆર નીતિનો અમલ અને દેખરેખ કંપનીના સીએસઆર ઉદ્દેશો અને નીતિને અનુસરીને કરવામાં આવે છે.
કંપનીની સીએસઆર સમિતિ આથી એ બાબતનું સમર્થન કરે છે કે સીએસઆર નીતિનો અમલ અને દેખરેખ કંપનીના સીએસઆર ઉદ્દેશો અને નીતિને અનુસરીને કરવામાં આવે છે.

સહી
ચેરમેન - (સીએસઆર સમિતિ)
ડીઆઈએન: ૦૦૦૧૦૫૮૯

સહી
મેનેજીંગ ડિરેક્ટર
ડીઆઈએન: ૦૮૩૯૬૨૨૨

ફોર્મ નં. એમ.જી.ટી.-૯
વાર્ષિક રિટર્નની તારીખ

૩૧મી માર્ચ, ૨૦૨૧ના રોજ પૂરા થતા વર્ષ મુજબ

(કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ ૯૨(૩) અને કંપનીઝ મેનેજમેન્ટ એન્ડ એડમીનીસ્ટ્રેશન) રુલ્સ, ૨૦૧૪ના નિયમ ૧૨(૧)ને અનુસરીને)

૧. નોંધણી અને અન્ય વિગતો :

- (૧) સી.આઈ.એન. - યુ ૪૦૧૦૦ જીજે ૧૯૯૦ એસજીસી ૦૧૩૯૬૧
- (૨) નોંધણીની તારીખ : ૨૮ જૂન, ૧૯૯૦
- (૩) કંપનીનું નામ : ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ
- (૪) કંપનીની કક્ષા/ પેટા કક્ષા : શેર મૂડી ધરાવતી/ રાજ્ય સરકારની કંપની
- (૫) રજિસ્ટર્ડ ઓફિસ અને સંપર્કની વિગત : બ્લોક નં. ૬ અને ૮, ૬ઠ્ઠો માળ, ઉદ્યોગ ભવન, સેક્ટર-૧૧, ગાંધીનગર-૩૮૨૦૧૦
ફોન નં. ૦૭૯-૨૩૨૫૧૨૫૫-૬૦, ફેક્સ-૦૭૯-૨૩૨૫૧૨૫૪

ઈમેઇલ : .cosecgpcpl@yahoo.co.in- વેબસાઇટ - www.gpcl.gujarat.gov.in

૬. કંપની લીસ્ટેડ છે? : ના

૭. રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટનું નામ, સરનામું અને સંપર્ક વિગતો- લાગુ પડતું નથી.

૨. કંપનીની મુખ્ય ધંધાકીય પ્રવૃત્તિઓ

જેનો કંપનીના કુલ ટર્ન ઓવરમાં ૧૦ ટકા કે તેથી વધુ ફાળો હોય તેવી તમામ ધંધાકીય પ્રવૃત્તિઓ જણાવવી.

ક્રમ નં.	મુખ્ય બનાવટ/ સેવાઓનાં નામ અને વર્ણન	બનાવટ/ સેવાનો એન.આઈ.સી. કોડ નં.	કંપનીના કુલ ટર્નઓવરમાં ટકાવારી
૧.	સૌર ઊર્જાનું ઉત્પાદન	૪૦૧૦૬	૧૦ ટકાથી વધુ
	ઊર્જાના અન્ય બિન પરંપરાગત સ્ત્રોતોમાંથી વીજળીનું ઉત્પાદન	૪૦૧૦૮	
	ખાણકામ સાથે સંકળાયેલ હોય એ સિવાયનું "સાઈટ-પ્રિપરેશન" (સોલાર પાર્કનો વિકાસ)	૪૫૧૦૨	

૩. હોલ્ડીંગ, સબસીડીઅરી અને સહયોગી (એસોસીએટ) કંપનીઓની વિગતો

ક્રમ નં.	કંપનીનું નામ અને સરનામું	સી.આઈ.એન./ જી.એલ.એન.	હોલ્ડીંગ/ સબ સીડીઅરી/ એસોસીએટ	ધારણ કરેલા શેર્સની ટકાવારી	લાગુ પડતી કલમ
૧.	બૈતરણી વેસ્ટ કોલ કંપની લિમિટેડ, ૩જો માળ, સેતુ ભવન, (ઓરિસ્સા બ્રિજ એન્ડ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન બિલ્ડિંગ) પ્લોટ નં. ૩ (ડી), નયા પલ્લી, બીબીએસઆર-૭૫ ૧૦૧૨	યુ૪૦૧૦૨૦ આર૨૦૦૮એસ જીસી ૦૦૯૯૫૫	એસોસીએટ કંપની	૩૩.૩૩ ટકા	૨ (દ)

૪. શેર હોલ્ડીંગ પેટર્ન (કુલ ઈકિવટીની ટકાવારી તરીકે ઈકિવટી શેર મૂડીનું વિભાજન (બ્રેકઅપ)

(૧) કક્ષાવાર શેર હોલ્ડીંગ

શેરધારકોની કક્ષા	વર્ષની શરૂઆતમાં ધારણ કરેલા શેર્સ				વર્ષના અંતે ધારણ કરેલા શેર્સ				વર્ષ દરમિયાન ટકાવારીમાં ફેરફાર
	ડીમેટ	વાસ્તવિક	સરવાળો	કુલ શેર્સની ટકાવારી	ડીમેટ	વાસ્તવિક	સરવાળો	કુલ શેર્સની ટકાવારી	
ક. પ્રમોટર્સ (૧) ભારતીય									
(ક) વ્યક્તિગત/(એચ. યુ.એફ)	-	૮૫.૫	૮૫.૫	૦.૦૦	-	૮૫.૫	૮૫.૫	૦.૦૦	-
(ખ) કેન્દ્ર સરકાર	-	-	-	-	-	-	-	-	-
(ગ) રાજ્ય સરકાર(રો)	-	૪૮૫૭૨૪૬૨	૪૮૫૭૨૪૬૨	૯૬.૧૮	-	૪૮૩૯૨૪૬૨	૪૮૩૯૨૪૬૨	૯૬.૨૪	(+)૦.૦૬%
(ઘ) બોડીઝ કોર્પોરેટ		૧૯૩૦૦૧૩	૧૯૩૦૦૧૩	૦૩.૮૨		૧૯૩૦૦૧૩	૧૯૩૦૦૧૩	૦૩.૭૬	(-)૦.૦૬%
(ચ) બેંકો/ નાણાકીય સંસ્થાઓ	-	-	-	-	-	-	-	-	-
(છ) અન્ય કોઈ	-	-	-	-	-	-	-	-	-
પેટા સરવાળો.(ક)(૧)		૫૦૫૦૨૫૬૦.૫	૫૦૫૦૨૫૬૦.૫	૧૦૦		૫૧૩૨૨૫૬૦.૫	૫૧૩૨૨૫૬૦.૫	૧૦૦	-
(ર) વિદેશી પેટા સરવાળો ક(૨)	-	-	-	-	-	-	-	-	-
પ્રમોટર (ક)નું કુલ શેરહોલ્ડીંગ= ક(૧)+ ક(૨)	-	૫૦૫૦૨૫૬૦.૫	૫૦૫૦૨૫૬૦.૫	૧૦૦	-	૫૧૩૨૨૫૬૦.૫	૫૧૩૨૨૫૬૦.૫	૧૦૦	-
(ખ) જાહેર શેર હોલ્ડીંગ	-	-	-	-	-	-	-	-	-
કુલ જાહેર શેર હોલ્ડીંગ (ખ)= ખ(૧) + ખ(૨)	-	-	-	-	-	-	-	-	-
ગ. જી.ડી.આર.એસ. અને એ.ડી.આર.એસ. વતી કસ્ટોડિયન દ્વારા ધારણ કરવામાં આવેલા શેર્સ	-	-	-	-	-	-	-	-	-
કુલ સરવાળો (ક + ખ + ગ)	-	૫૦૫૦૨૫૬૦.૫	૫૦૫૦૨૫૬૦.૫	૧૦૦	-	૫૧૩૨૨૫૬૦.૫	૫૧૩૨૨૫૬૦.૫	૧૦૦	-

(૨) પ્રમોટર્સનું શેરહોલ્ડીંગ

ક્રમ નં.	શેર ધારકનું નામ	વર્ષના આરંભમાં શેર હોલ્ડીંગ			વર્ષના અંતે શેર હોલ્ડીંગ			વર્ષ દરમિયાન શેર હોલ્ડીંગમાં બદલાયેલી ટકાવારી
		શેર્સની સંખ્યા	કંપનીના કુલ શેર્સની ટકાવારી	કુલ શેર્સ સામે તારણમાં મુકેલા શેર્સ	શેર્સની સંખ્યા	કંપનીના કુલ શેર્સની ટકાવારી	કુલ શેર્સ સામે તારણમાં મુકેલા શેર્સ	
૧.	ગુજરાતના રાજ્યપાલ	૪૮૫૭૨૪૬૨	૮૬.૧૮	-	૪૮૩૮૨૪૬૨	૮૬.૨૪	-	(+)૦.૦૬
૨.	ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ	૧૮૩૦૦૧૩	૦૩.૮૨	-	૧૮૩૦૦૧૩	૩.૭૬	-	(-)૦.૦૪
૩.	*અન્ય	૮૫.૫	૦.૦૦	-	૮૫.૫	૦.૦૦	-	-
	સરવાળો	૫૦૫૦૨૫૬૦.૫	૧૦૦	-	૫૧૩૨૨૫૬૦.૫	૧૦૦	-	-

* અન્યમાં ગુજરાતના રાજ્યપાલ તેમ જ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડના નામનિયુક્તોનો સમાવેશ થાય છે.

૩. પ્રમોટરના શેરહોલ્ડીંગમાં ફેરફાર (કોઈ ફેરફાર ન હોય તો પણ જણાવવું)**

	વર્ષના આરંભમાં શેર હોલ્ડીંગ		વર્ષ દરમિયાન એકત્રિત શેર હોલ્ડીંગ	
	શેરોની સંખ્યા	કંપનીના કુલ શેર્સની ટકાવારી	શેર્સની સંખ્યા	કંપનીના કુલ શેર્સની ટકાવારી
વર્ષના આરંભમાં	૪૮૫૭૨૪૬૨	૮૬.૧૮	૪૮૫૭૨૪૬૨	૮૬.૧૮
ગુજરાતના રાજ્યપાલ				
(ક) ૨૩-૧૦-૨૦૨૦ના રોજ ગુજરાતના રાજ્યપાલશ્રીને ફાળવવામાં આવેલા, રૂ. ૧૦૦નો એક એવા ૩૩૩૩૩૦ શેર્સ અધિકારના આધારે	૩૩૩૩૩૦		૩૩૩૩૩૦	
(ખ) ૧૨-૧૦-૨૦૨૦ના રોજ ગુજરાતના રાજ્યપાલશ્રીને ફાળવવામાં આવેલા, રૂ. ૧૦૦નો એક એવા ૪૮૬૬૭૦ શેર્સ અધિકારના આધારે	૪૮૬૬૭૦		૪૮૬૬૭૦	
વર્ષના અંતે			૪૮૩૮૨૪૬૨	૮૬.૨૪

** પ્રમોટરની કક્ષામાં આવતા ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ અને અન્યમાં કોઈ ફેરફાર નથી.

(૪) સર્વોચ્ચ ૧૦ શેરધારકો, (નિયામકો, પ્રમોટરો અને ષ્ટ્રીજ તથા ADRs સિવાય)ની શેરહોલ્ડીંગ પેટર્ન

ક્રમ નં.	સર્વોચ્ચ-૧૦ પૈકીના પ્રત્યેક શેરધારકો માટે	વર્ષના આરંભમાં શેરહોલ્ડીંગ		વર્ષ દરમિયાન એકત્રિત શેરહોલ્ડીંગ	
		શેર્સની સંખ્યા	કંપનીના કુલ શેર્સની ટકાવારી	શેર્સની સંખ્યા	કંપનીના કુલ શેર્સની ટકાવારી
	વર્ષના આરંભમાં	લાગુ પડતું નથી.	લાગુ પડતું નથી.	લાગુ પડતું નથી.	લાગુ પડતું નથી.
	વર્ષ દરમિયાન શેર હોલ્ડીંગમાં તારીખવાર થયેલો વધારો/ ઘટાડો; વધારો/ ઘટાડો થવાનાં કારણો જણાવવાં (જેમ કે ફાળવણી/ તબદિલી/ બોનસ/ સ્વીટ ઈકિવટી વગેરે)	લાગુ પડતું નથી.	લાગુ પડતું નથી.	લાગુ પડતું નથી.	લાગુ પડતું નથી.
	વર્ષના અંતે (અથવા વર્ષ દરમિયાન અલગ પાડવામાં આવ્યા હોય તો અલગ પડવાની તારીખ)	લાગુ પડતું નથી.	લાગુ પડતું નથી.	લાગુ પડતું નથી.	લાગુ પડતું નથી.
	સરવાળો..				

(૫) નિયામકો અને મુખ્ય વ્યવસ્થાપકીય કર્મચારીવર્ગનું શેર હોલ્ડીંગ

ક્રમ નં.	નિયામકશ્રીનું નામ/મુખ્ય વ્યવસ્થાપકીય કર્મચારીવર્ગના નામ	વર્ષના આરંભમાં શેરહોલ્ડીંગ		વર્ષ દરમિયાન એકત્રિત શેરહોલ્ડીંગ	
		શેર્સની સંખ્યા	કંપનીના કુલ શેર્સની ટકાવારી	શેર્સની સંખ્યા	કંપનીના કુલ શેર્સની ટકાવારી
	વર્ષના આરંભમાં	લાગુ પડતું નથી.	લાગુ પડતું નથી.	લાગુ પડતું નથી.	લાગુ પડતું નથી.
	વર્ષ દરમિયાન શેર હોલ્ડીંગમાં તારીખવાર થયેલો વધારો/	લાગુ પડતું નથી.	લાગુ પડતું નથી.	લાગુ પડતું નથી.	લાગુ પડતું નથી.
	વર્ષના અંતે	લાગુ પડતું નથી.	લાગુ પડતું નથી.	લાગુ પડતું નથી.	લાગુ પડતું નથી.

નોંધ : કોઈપણ નિયામક/ મુખ્ય વ્યવસ્થાપકીય કર્મચારી કંપનીના શેર ધરાવતા નથી.

૫. કંપનીનું દેવું

બાકી/ઉપાર્જિત પરંતુ ચૂકવવાનો સમય પાક્યો ન હોય તેવા વ્યાજ સહિત કંપનીનું દેવું

(રૂ. લાખમાં)

	થાપણો સિવાય તારણવાળી લોન	તારણ વિનાની લોન	થાપણો	કુલ દેવું
નાણાકીય વર્ષના આરંભમાં દેવું				
(૧) મુદ્દલ રકમ	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
(૨) પાકેલું પણ ન ચૂકવાયેલું વ્યાજ	શૂન્ય	₹ ૧૮૮.૭૮	શૂન્ય	₹ ૧૮૮.૭૮
(૩) ઉપાર્જિત પરંતુ ચૂકવવાનો સમય પાક્યો ન હોય તેવું વ્યાજ (૧લી એપ્રિલ)		શૂન્ય		શૂન્ય
કુલ સરવાળો... (૧ + ૨ + ૩)	શૂન્ય	₹ ૧૮૮.૭૮	શૂન્ય	₹ ૧૮૮.૭૮
નાણાકીય વર્ષ દરમિયાન દેવામાં વધ/ઘટ				
· વધારો	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
· ઘટાડો	શૂન્ય	₹ ૧૮૮.૭૮	શૂન્ય	₹ ૧૮૮.૭૮
ચોખ્ખો ફેરફાર	શૂન્ય	₹ ૧૮૮.૭૮	શૂન્ય	₹ ૧૮૮.૭૮
નાણાકીય વર્ષના અંતે દેવું				
(૧) મુદ્દલ રકમ	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
(૨) પાકેલું પણ ન ચૂકવાયેલું વ્યાજ	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
(૩) ઉપાર્જિત પરંતુ ચૂકવવાનો સમય પાક્યો ન હોય તેવું વ્યાજ (૧લી એપ્રિલ)	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
કુલ સરવાળો... (૧ + ૨ + ૩)	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય

૬. નિયામકો અને મુખ્ય વ્યવસ્થાપકીય કર્મચારીવર્ગનું મહેનતાણું
(ક) મેનેજિંગ ડિરેક્ટરનું મહેનતાણું

ક્રમ નં.	મહેનતાણાની વિગત	કુલ રકમ	
		શ્રી એસ.બી.ખ્યાલિયા,	
૧.	કુલ પગાર (ક) આવકવેરા અધિનિયમ, ૧૯૬૧ની કલમ ૧૭(૧)માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ પગાર (ખ) આવકવેરા અધિનિયમ, ૧૯૬૧ની કલમ ૧૭(૨) હેઠળના લાભોની રકમ (ગ) આવકવેરા અધિનિયમ, ૧૯૬૧ની કલમ ૧૭(૩) હેઠળ પગારના બદલે મળતા લાભો.	૩૮,૩૬,૨૬૬/- ૩,૮૦,૪૬૬/-	૩૮,૩૬,૨૬૬/- ૩,૮૦,૪૬૬/-
૨.	સ્ટોક વિકલ્પ	---	---
૩.	સ્વીટ ઇકિવટી	---	---
૪.	કમિશન - નફાની ટકાવારી પેટે - અન્ય, જણાવો	---	---
૫.	અન્ય, જણાવો* સરવાળો.. (ક) અધિનિયમ મુજબ ટોચ મર્યાદા	૬૦૦૦ ૪૨,૨૫,૭૩૨	૬૦૦૦ ૪૨,૨૫,૭૩૨
		લાગુ પડતું નથી.	

(ખ) અન્ય નિયામકોને મહેનતાણું

કક્ષા	મહેનતાણાની વિગતો			સરવાળો
	બોર્ડ અને સમિતિઓની બેઠકો માટે સીટીંગ ફી	કમિશન	અન્ય (બોર્ડ અને સમિતિઓની બેઠકો માટેની પ્રાસંગિક ફી)	
અધ્યક્ષા-શ્રીમતી સુનયના તોમર	***	-	૪૦૦૦	૪૦૦૦
સ્વતંત્ર નિયામકો				
શ્રી પી.કે.તનેજા, આઈએએસ (નિવૃત્ત)	૫૪૦૦	-	૨૦૦૦	૭૪૦૦
સરવાળો.. (ક)	૫૪૦૦	-	૬૦૦૦	૧૧૪૦૦
અન્ય નોન-એક્ઝીક્યુટિવ નિયામકો	-	-	-	-
શ્રીમતી અંજુ શર્મા, આઈએએસ ***	-	-	૪૦૦૦	૪૦૦૦
શ્રી પી.એચ. રાણા	૨૪૩૦૦	-	૬૦૦૦	૩૦૩૦૦
સુશ્રી દિપલ હડિયલ	-	-	૧૦૦૦	૧૦૦૦
શ્રી આર.જી દેસાઈ	-	-	૧૦૦૦	૧૦૦૦
સરવાળો.. ખ	૨૪૩૦૦	-	૧૫૦૦૦	૩૦૩૦૦
સરવાળો- વ્યવસાયકીય મહેનતાણું (ક + ખ)	૨૯૭૦૦	-	૨૧૦૦૦	૫૦૭૦૦
અધિનિયમ મુજબ ટોચ મર્યાદા	-	-	-	-

*** સેવા બજાવતા આઈ.એ.એસ. અધિકારીઓ અથવા ગુજરાત સરકારના નામ નિયુક્તોના સંદર્ભમાં બેઠક દીઠ રૂ. ૩૦૦૦/-ની સીટીંગ ફી સીધી સરકારી તિજોરીમાં જમા કરાવવામાં આવી છે અને બેઠક દીઠ રૂ. ૧૦૦૦/- (૧૦% ટીડીએસ)ના દરે પ્રાસંગિક ખર્ચ સીધું સંબંધિત નિયામક/કોને ચુકવવામાં આવ્યું છે.

૭. મેનેજિંગ ડિરેક્ટર/ મેનેજર/ ડબલ્યુટીડી સિવાયના મુખ્ય વ્યવસ્થાપકીય કર્મચારી વર્ગને મહેનતાણું

ક્રમ નં.	મહેનતાણાની વિગતો	મહત્વનો વ્યવસાયકીય કર્મચારી વર્ગ		
		સીઈઓ	સીએસ	સીએફઓ
૧.	કુલ પગાર	-		
(ક)	આવકવેરા અધિનિયમ, ૧૯૬૧ની કલમ-૧૭(૧)માં સમાવિષ્ટ જોગવાઈ મુજબ પગાર	-	૮,૨૬,૩૬૦/-	૧૮,૧૦,૮૩૨/-
(ખ)	આવકવેરા અધિનિયમ, ૧૯૬૧ની કલમ ૧૭(૨) હેઠળના લાભોની રકમ	-		
(ગ)	આવકવેરા અધિનિયમ, ૧૯૬૧ની કલમ ૧૭(૩) હેઠળ પગારના બદલે મળતા લાભો.	-		
૨.	સ્ટોક વિકલ્પ	-	-	-
૩.	સ્વીટ ઇકિવટી	-	-	-
૪.	કમિશન - નફાની ટકાવારી મુજબ - અન્ય, જણાવો	-	-	-
૫.	અન્ય, જણાવો સરવાળો..	-	રૂ. ૮.૨૬લાખ	રૂ. ૧૮.૧૦ લાખ

૭. ગુનાઓની સજા/ દંડ/ માફી

પ્રકાર	ટૂંકું વર્ણન	વિગત			સત્તામંડળ આર. ડી./ ચએન.સી. એલ.ટી./ કોર્ટ	અપીલ કરવામાં આવી છે. (વિગતો આપો)
		દંડની	સજાની	માફીની		
ક. કંપની			લાગુ પડતું નથી.		લાગુ પડતું નથી.	લાગુ પડતું નથી.
ખ. નિયામકો			લાગુ પડતું નથી.		લાગુ પડતું નથી.	લાગુ પડતું નથી.
ગ. ચૂક કરનાર અન્ય અધિકારીઓ			લાગુ પડતું નથી.		લાગુ પડતું નથી.	લાગુ પડતું નથી.

તા. ૨૮/૧૨/૨૦૨૧
ગાંધીનગર

સહી/-
ચેરમેન
ડીઆઈએન: ૦૧૮૫૪૩૧૫

નિયામક મંડળના નામે અને તેના વતી
સહી/-
મેનેજિંગ ડિરેક્ટર
ડીઆઈએન: ૦૮૩૮૬૨૨૨

સેક્રેટરીઅલ ઓડિટ અહેવાલ

૩૧ માર્ચ, ૨૦૨૧ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ માટે
(કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ ૨૦૪(૧) અને કંપનીઝ અપોઇન્ટમેન્ટ એન્ડ રેમ્યુનરેશન પસીનલ),
રુલ્સ, ૨૦૧૪ના નિયમ-૮ નં. અનુસરીને)

પ્રતિ

સભાસદો

ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ,

૬૬૦ માળ, બ્લોક નં. ૬ અને ૮

ઉદ્યોગ ભવન, સેક્ટર-૧૧,

ગાંધીનગર - ૩૮૨૦૧૧

અમે, લાગુ પડતી વૈધાનિક જોગવાઈઓ મુજબ, સારી કોર્પોરેટ પદ્ધતિઓનું પાલન કરતા ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડનું સેક્રેટરીઅલ ઓડિટ કર્યું છે. આ સેક્રેટરીઅલ ઓડિટ અમે એ પ્રકારે કર્યું છે જે અમને કોર્પોરેટ રીતભાત/વૈધાનિક અનુપાલનનું મૂલ્યાંકન કરવા અને તે અંગે અમારો અભિપ્રાય આપવા માટે યોગ્ય આધાર પૂરો પાડે છે. કંપનીના ચોપડા, કાગળો, મિનિટ બુક્સ, ફોર્મ્સ અને કંપનીએ ફાઇલ કરેલાં રિટર્ન્સ અને જાળવેલા અન્ય રેકર્ડ તથા પૂરી પાડેલી માહિતીના આધારે કંપની, તેના અધિકારીઓ, એજન્ટો, અધિકૃત પ્રતિનિધિઓએ સેક્રેટરીઅલ ઓડિટની કામગીરી દરમિયાન પૂરી પાડેલી માહિતીના આધારે અમે આથી જણાવીએ છીએ કે અમારા મતે, કંપનીએ, ૩૧મી માર્ચ, ૨૦૨૧ના રોજ પૂરાં થતાં નાણાકીય વર્ષને આવરી લેતા સમયગાળા દરમિયાન અહીં નીચે જણાવેલી વૈધાનિક જોગવાઈઓનું પાલન કર્યું છે અને અમે અહીં નીચે જણાવ્યાં છે એ વિષયો અને પદ્ધતિ પૂરતું કંપની બોર્ડ સંબંધી પ્રક્રિયાઓ અને અનુપાલન વ્યવસ્થા ધરાવે છે.

અમે, કંપનીએ નીચે જણાવેલા કાયદાઓની જોગવાઈઓ મુજબ, ૩૧મી માર્ચ, ૨૦૨૧ અંતિત નાણાકીય વર્ષ માટે હિસાબના ચોપડા, પેપર્સ, મિનિટ બુક્સ, ફોર્મ્સ અને ફાઇલ કરેલાં રિટર્ન્સ અને જાળવેલા રેકર્ડ તપાસ્યા છે.

- (૧) કંપની અધિનિયમ, ૨૦૧૩ (અધિનિયમ) અને તે હેઠળ ઘડવામાં આવેલા નિયમો.
 - (૨) ધ સીક્યુરીટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) એક્ટ, ૧૯૫૬ (એસ.સી.આર.એ.) અને તે હેઠળ ઘડવામાં આવેલા નિયમો.
 - (૩) ધ ડિપોઝીટરીઝ એક્ટ, ૧૯૯૬ અને તે હેઠળ ઘડવામાં આવેલા વિનિયમો અને પેટા-કાયદા કંપનીને લાગુ પડતા નથી કારણ કે સરકારી કંપનીઓને તા. ૨૨મી જાન્યુઆરી ૨૦૧૮ના એમસીએ જાહેરનામા હેઠળ શેર્સના ફરજિયાત ડીમટીરીઅલાઈઝેશનમાંથી મૂકિત આપવામાં આવી છે.
 - (૪) ફોરેન એક્સ્ચેન્જ મેનેજમેન્ટ એક્ટ, ૧૯૯૮ અને તે હેઠળ ઘડવામાં આવેલા નિયમો અને વિનિયમો, સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન સીધા વિદેશી રોકાણ, સીધા દરિયાપારના રોકાણ અને બહારથી મેળવવામાં આવેલા વાણિજ્યિક કરજ પૂરતા કંપનીને લાગુ પડતા નથી.
 - (૫) સીક્યુરીટીઝ એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, ૧૯૯૨ (એસ.ઈ.બી.આઈ. એક્ટ) હેઠળ નિર્દિષ્ટ કરવામાં આવેલાં નીચેનાં વિનિયમો અને માર્ગદર્શક સૂચનાઓ કંપનીને લાગુ પડતાં નથી કારણ કે કંપની, સમીક્ષાના સમયગાળા દરમિયાન અનલિસ્ટેડ કંપની હતી.
 - (ક) ધ સીક્યુરીટીઝ એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સબસ્ટાન્શિયલ એકવીઝીશન ઓફ શેર્સ એન્ડ ટેક ઓવર્સ) રેગ્યુલેશન્સ, ૨૦૧૧;
 - (ખ) ધ સીક્યુરીટીઝ એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (પ્રોહીબીશન ઓફ ઇનસાઈડર ટ્રેડિંગ) રેગ્યુલેશન્સ, ૧૯૯૨;
 - (ગ) ધ સીક્યુરીટીઝ એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (ઈસ્યુ ઓફ કેપિટલ એન્ડ ડિસ્કલોઝર રીકવાયરમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, ૨૦૦૮;
 - (ઘ) ધ સીક્યુરીટીઝ એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (એમ્લોઈ સ્ટોક ઓપ્શન સ્કીમ એન્ડ એમ્લોઈ સ્ટોક પર્યેઝ સ્કીમ) ગાઈડ લાઈન્સ, ૧૯૯૯;
 - (ચ) ધ સીક્યુરીટીઝ એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (ઈસ્યુ એન્ડ લીસ્ટીંગ ઓફ ડેટ સીક્યુરીટીઝ) રેગ્યુલેશન્સ, ૨૦૦૮;
 - (છ) ધ સીક્યુરીટીઝ એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (રજિસ્ટ્રાર્સ ટુ એન ઇસ્યુ એન્ડ શેર ટ્રાન્સફર એજન્ટ્સ) રેગ્યુલેશન્સ, ૧૯૯૩- કંપની અધિનિયમ અને કલાયન્ટ સાથેના વ્યવહાર અંગે.
 - (જ) ધ સીક્યુરીટીઝ એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (ડીલિસ્ટીંગ ઓફ ઇક્વિટી શેર્સ) રેગ્યુલેશન્સ, ૨૦૦૮; અને
 - (ઝ) ધ સીક્યુરીટીઝ એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (બાયબેક ઓફ સીક્યુરીટીઝ) રેગ્યુલેશન્સ, ૧૯૯૮
- હું વધુમાં જણાવું છું કે કંપનીમાં પ્રવર્તમાન અનુપાલન પદ્ધતિના સંદર્ભમાં અને તેને અનુસરીને સંબંધિત દસ્તાવેજો તથા રેકર્ડ્સની ટેસ્ટ ચેકના આધારે તપાસ કરતાં, કંપનીએ ખાસ તેને લાગુ પડતા નીચેના કાયદાઓનું પાલન કર્યું છે.
- (૧) ધ ઇલેક્ટ્રીસિટી એક્ટ, ૨૦૦૩

(૨) માઈન્સ એક્ટ, ૧૯૫૨

(૩) ધ એન્વાયર્મેન્ટ (પ્રોટેક્શન) એક્ટ, ૧૯૮૬ મેં નીચેના લાગુ પડતા ખંડોના પાલન સંબંધી તપાસ પણ કરી છે.

(૧) ધ ઇન્સ્ટીટ્યુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલા સેક્રેટરીયલ સ્ટાન્ડર્ડ્સ.

(૨) કંપની અનલીસ્ટેડ હોવાથી તેણે લીસ્ટીંગ એગ્રીમેન્ટ ઓફ સ્ટોક એક્સ્ચેન્જનું પાલન કરવું જરૂરી નથી.

સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન કંપનીએ, અમારાં નીચેનાં અવલોકનોને અધીન રહીને ઉપર જણાવેલાં અધિનિયમો, નિયમો, વિનિયમો, માર્ગદર્શક સૂચનાઓ, ધોરણો વગેરેનું પાલન કર્યું છે.

૧. બે સ્વતંત્ર નિયામકો એટલે કે શ્રી પ્રકાશ શાહ, આઈ.એ.એસ. (નિવૃત્ત) અને શ્રી ભરતકુમાર મોદીની નિયુક્તિની મુદત તા. ૩૧/૦૩/૨૦૨૦ના રોજ પૂરી થવાને કારણે કંપનીએ તે પૈકીની એક સ્વતંત્ર નિયામકની જગ્યા તા. ૨૬/૧૧/૨૦૨૦ના રોજ ભરી છે અને બીજા એક સ્વતંત્ર નિયામકની નિમણૂક કરવાની હજુ બાકી છે અને તદ્દનુસાર, સમિતિઓની રચના કંપની અધિનિયમ ૨૦૧૩ હેઠળની જરૂરિયાત મુજબ કરવાની છે.

૨. કંપનીની વાર્ષિક સામાન્ય સભા તા. ૨૮/૧૨/૨૦૨૦ના રોજ બોલાવવામાં આવી હતી. આમ છતાં આ વાર્ષિક સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી હતી અને ઓડિટ થયેલા હિસાબો વાર્ષિક સામાન્ય સભાની મુલતવી રાખવામાં આવેલી તા. ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ બોલાવવામાં આવેલી બેઠકમાં એટલે કે, વાર્ષિક સામાન્ય સભા બોલાવવાની નિયત તારીખ પછી (વાર્ષિક સામાન્ય સભા બોલાવવા માટે તા. ૩૧/૧૨/૨૦૨૦ સુધી લંબાવવામાં આવેલ સમય સહિત) બોલાવવામાં આવી હતી.

અમે વધુમાં જણાવીએ છીએ કે -

તા. ૩૧/૦૩/૨૦૨૧ના રોજ મુજબ, ઉપર મુદ્દા (૧)માં જણાવવામાં આવેલા અમારા અવલોકનોને અધીન, કંપનીના નિયામક મંડળની રચના યોગ્ય રીતે, એકઝીક્યુટીવ ડિરેક્ટર્સ અને નોન-એકઝીક્યુટીવ ડિરેક્ટર્સ સાથે કરવામાં આવી છે. સમીક્ષાના સમયગાળા દરમિયાન નિયામક મંડળની રચનામાં કરવામાં આવેલા ફેરફારો, અધિનિયમની જોગવાઈઓ મુજબ કરવામાં આવ્યા હતા.

તમામ નિયામકોને બોર્ડની બેઠકના સમયની પર્યાપ્ત નોટિસ આપવામાં આવી છે અને એજન્ડા તથા એજન્ડા અંગેની વિગતવાર નોંધો સાત દિવસ અગાઉ મોકલી દેવામાં આવી છે અને ટૂંકી મુદતની નોટિસ મોકલતી વખતે કંપની અધિનિયમ ૨૦૧૩ની જોગવાઈનું પાલન કરવામાં આવે છે અને બેઠક યોજતા પહેલાં એજન્ડા અંગે વધુ માહિતી અને સ્પષ્ટતા મેળવવાની પદ્ધતિ અસ્તિત્વ ધરાવે છે જેથી બેઠકમાં પૂરતી જાણકારી સાથે ભાગ લઈ શકાય.

સામાન્ય રીતે નિયામક મંડળ અને સમિતિઓની બેઠકોમાં તમામ નિર્ણયો, નિયામક મંડળ અથવા યથાપ્રસંગ સમિતિની બેઠકોની કાર્યવાહી નોંધમાં નોંધાયા મુજબ જ લેવામાં આવે છે.

અમે વધુમાં જણાવીએ છીએ કે -

કંપની તેના કદ અને કામગીરીઓને અનુરૂપ, લાગુ પડતા કાયદા, નિયમો, વિનિયમો અને માર્ગદર્શક સૂચનાઓ પર દેખરેખ નિયંત્રણ રાખી શકાય અને તેમનું અનુપાલન કરી શકાય તેવી પર્યાપ્ત પદ્ધતિઓ અને પ્રક્રિયાઓ ધરાવે છે.

અમે વધુમાં જણાવીએ છીએ કે -

૧. સમીક્ષા હેઠળના વર્ષ દરમિયાન નીચે મુજબની ફાળવણી કરવામાં આવી હતી.

(૧) કંપનીએ રૂ. ૧૦૦નો એક એવા કુલ રૂ. ૩,૩૩,૩૩,૦૦૦/-ના ૩,૩૩,૩૩૦ ઇક્વિટી શેર્સ તા. ૨૩/૧૦/૨૦૨૦ના રોજ ગુજરાતના રાજ્યપાલશ્રીને અધિકારના ધોરણે ફાળવ્યા છે.

(૨) કંપનીએ રૂ. ૧૦૦નો એક એવા કુલ રૂ. ૪,૮૬,૬૭,૦૦૦/-ના ૪,૮૬,૬૭૦ ઇક્વિટી શેર્સ તા. ૦૮/૧૧/૨૦૨૦ના રોજ ગુજરાતના રાજ્યપાલશ્રીને અધિકારના ધોરણે ફાળવ્યા છે.

સહી/-

પ્રોપ્રાઈટર

(ધારા પટેલ)

એસીએસ નં. ૨૮૧૯૮, સીપી નં. ૧૦૯૭૯

યુડીઆઈએન: યુ૪૦૧૦૦જે૧૯૯૦એસજીસી૦૧૩૯૬૧

તારીખ: ૨૮/૧૨/૨૦૨૧

સ્થળ: ગાંધીનગર

(આ અહેવાલ, જોડાણ-ક તરીકે જોડવામાં આવેલા સમાન તારીખના પત્ર સાથે વાંચવાનો છે, જે આ અહેવાલનો અભિન્ન ભાગ બને છે.)

જોડાણ - ૬

પ્રતિ

સભાસદો

ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ,

૬ શ્રી માળ, બ્લોક નં. ૬ અને ૮

ઉદ્યોગ ભવન, સેક્ટર-૧૧

ગાંધીનગર- ૩૮૨૦૧૧

અમારો સમાન તારીખનો અહેવાલ આ પત્ર સાથે વાંચવાનો છે.

૧. સેક્રેટરિઅલ રેકર્ડની જાળવણી આ કંપનીના વ્યવસ્થાપક મંડળની જવાબદારી છે. અમારી જવાબદારી, અમારા ઓડિટના આધારે આ સેક્રેટરિઅલ રેકર્ડ અંગે અભિપ્રાય આપવાની છે.
૨. અમે, સેક્રેટરિઅલ રેકર્ડના વિષયવસ્તુની સચ્ચાઈ વિશે યોગ્ય ખાતરી મેળવવા માટે યોગ્ય એવી ઓડિટ પદ્ધતિઓ અને પ્રક્રિયાઓને અનુસર્યા છીએ. સેક્રેટરિઅલ રેકર્ડમાં સાચી હકીકતો દર્શાવવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે પરીક્ષણના આધારે (ટેસ્ટ બેસીસ) ખરાઈ કરવામાં આવી છે. અમારું માનવું છે કે અમે અનુસરેલી પ્રક્રિયાઓ અને પદ્ધતિઓ અમારા અભિપ્રયને યોગ્ય આધાર પૂરો પાડે છે.
૩. અમે કંપનીના નાણાકીય પત્રકોની સચ્ચાઈ અને યોગ્યતાની ખરાઈ કરી નથી.
૪. કોર્પોરેટ તેમજ અન્ય લાગુ પડતા કાયદા, નિયમો, વિનિયમો, ધોરણોની જોગવાઈઓનું અનુપાલન કરાવવાની જવાબદારી વ્યવસ્થાપક મંડળની છે. અમારી તપાસ પરીક્ષણના આધારે કાર્યપદ્ધતિઓની ખરાઈ કરવા પૂરતી મર્યાદિત છે.
૫. સેક્રેટરીઅલ ઓડિટ અહેવાલ, કંપનીની ભાવિ નભાઉ ક્ષમતાની ખાતરી આપતો નથી.
૬. કોવિડ-૧૯ને કારણે રેકર્ડ્સની પ્રત્યક્ષ ખરાઈ કરવી શક્ય ન હોવાથી સેક્રેટરિઅલ ઓડિટ મર્યાદિત સમીક્ષા સાથે કરવામાં આવ્યું છે.

કંપની સેક્રેટરી ધારા પટેલ વતી

સહી/-

પ્રોપ્રાઈટર

(ધારા પટેલ)

એસીએસ નં. ૨૮૧૯૮, સીપી નં. ૧૦૯૭૯

તારીખ : ૨૮/૧૨/૨૦૨૧

સ્થળ : ગાંધીનગર

તા.૩૧મી માર્ચ, ૨૦૨૧ના રોજ પૂરા થતા વર્ષ માટે, ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડના હિસાબો પર કંપની અધિનિયમ ૨૦૧૩ની કલમ ૧૪૩(૬)(બી) હેઠળ ભારતના કોમ્પ્રોલર અને ઓડિટર જનરલનાં ટિકા-ટિપ્પણ.

કંપની અધિનિયમ, ૨૦૧૩ હેઠળ નિર્દિષ્ટ કરવામાં આવેલ નાણાકીય અહેવાલની રૂપરેખા મુજબ, ૩૧મી માર્ચ, ૨૦૨૧ના રોજ પૂરા થતા વર્ષ માટેના ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડના નાણાકીય પત્રકો તૈયાર કરવાની જવાબદારી કંપનીના વ્યવસ્થાપક મંડળની છે. ઉક્ત અધિનિયમની કલમ ૧૩૯(૫) હેઠળ ભારતના કમ્પ્રોલર અને ઓડિટર જનરલ દ્વારા નીમવામાં આવેલા વૈધાનિક ઓડિટરોની જવાબદારી, અધિનિયમની કલમ ૧૪૩(૧૦) હેઠળ નિર્દિષ્ટ કરવામાં આવેલા 'ઓડિટીંગ એન્ડ એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ્સ' ના આધારે, અધિનિયમની કલમ-૧૪૩ હેઠળ આ નાણાકીય પત્રકો અંગે અભિપ્રાય વ્યક્ત કરવાની છે. જે તેઓના તા. ૨૩મી ફેબ્રુઆરી, ૨૦૨૨ના ઓડિટ અહેવાલ અન્વયે વ્યક્ત કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.

ભારતના કોમ્પ્રોલર અને ઓડિટર જનરલ વતી મેં ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડના ૩૧મી માર્ચ, ૨૦૨૧ના રોજ પૂરા થતા વર્ષ માટેના નાણાકીય પત્રકોનું અધિનિયમની કલમ ૧૪૩(૬)(એ) હેઠળ પૂરક ઓડિટ (સપ્લીમેન્ટરી ઓડિટ) કર્યું છે. આ પૂરક ઓડિટ, વૈધાનિક ઓડિટરોના કામકાજ અંગેના કોઈ પણ કાગળો જોયા વિના, સ્વતંત્ર રીતે કરવામાં આવ્યું છે અને તે મુખ્યત્વે વૈધાનિક ઓડિટરો અને કંપનીના કર્મચારીવર્ગને કરવામાં આવેલી પૂછપરછ તેમજ પસંદ કરવામાં આવેલા કેટલાક હિસાબી રેકર્ડ્સની તપાસ પૂરતું મર્યાદિત છે.

મારા પૂરક ઓડિટના આધારે મારા ધ્યાન પર એવી કોઈ મહત્વની બાબત આવી નથી જે અંગે અધિનિયમની કલમ ૧૪૩(૬)(બી) હેઠળ, વૈધાનિક ઓડિટરના અથવા તેને પૂરક હોય એવા અહેવાલ સંબંધે કોઈ ટિકાટિપ્પણ કરવા જરૂરી બને.

ભારતના કોમ્પ્રોલર ઓડિટરના નામે અને તેમના

વતી

સ્થળ : અમદાવાદ

તારીખ : ૨૩/૦૨/૨૦૨૨

સહી/-

(એચ.કે.ધર્મદર્શી)

પ્રિન્સીપાલ એકાઉન્ટન્ટ જનરલ

(ઓડિટ-II), ગુજરાત

સ્વતંત્ર ઓડિટરનો અહેવાલ

પ્રતિ,

સભાસદો

ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ

ગાંધીનગર.

ભારતીય હિસાબી ધોરણો મુજબનાં નાણાકીય પત્રકો અંગેનો અહેવાલ

અભિપ્રાય

અમે, ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ, (કંપની)ના આ સાથેના નાણાકીય પત્રકો ઓડિટ કર્યા છે, જેમાં તા. ૩૧મી માર્ચ, ૨૦૨૧ રોજ મુજબના પાકા સરવૈયા, નફા અને નુકસાન ખાતાના પત્રક (અન્ય સર્વગ્રાહી આવક સહિત), રોકડ - પ્રવાહ (કેશ - ફ્લો)નું પત્રક અને તે તારીખે પૂરાં થતાં વર્ષમાં ઇકિવટીમાં થયેલા ફેરફારનું પત્રક તેમજ અન્ય સ્પષ્ટીકરણાત્મક માહિતીનો સમાવેશ થાય છે. (હવે પછી અહીં જેનો ઉલ્લેખ ભારતીય હિસાબી ધોરણ મુજબનાં નાણાકીય પત્રકો તરીકે કરવામાં આવ્યો છે.)

અમારા મંતવ્ય અને અમારી શ્રેષ્ઠ જાણકારી તથા અમને આપવામાં આવેલા ખુલાસા મુજબ આ નાણાકીય પત્રકો કંપની અધિનિયમ ૨૦૧૩ (“અધિનિયમ”) અન્વયે જરૂરી બનાતોની માહિતી, અધિનિયમની કલમ ૧૩૩ને કંપનીઝ સુધારેલા (ઈન્ડિયન એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ) રુલ્સ, ૨૦૧૫ સાથે વાંચતાં, તે હેઠળ નિર્દિષ્ટ કરવામાં આવેલાં, ભારતમાં સામાન્ય રીતે સ્વીકૃત હિસાબી સિધ્ધાંતોને સુસંગત રહીને ૩૧મી માર્ચ, ૨૦૨૧ના રોજ કંપનીના પાકા સરવૈયા અને કંપનીના કામકાજની સ્થિતિ અંગે અને તે તારીખે પૂરા થતા વર્ષ માટેના નફા, કુલ સર્વગ્રાહી આવક, ઇકિવટીમાં થયેલ ફેરફાર અને તેના રોકડ પ્રવાહ અંગે સાચું અને યોગ્ય ચિત્ર રજૂ કરે છે.

અભિપ્રાય માટેનો આધાર

અમે નાણાકીય પત્રકોનું અમારું ઓડિટ અધિનિયમ (એસએએસ)ની કલમ ૧૪૩(૧૦) હેઠળ નિર્દિષ્ટ કરવામાં આવેલાં ઓડિટિંગ અંગેનાં ધોરણો મુજબ કર્યું છે. એ ધોરણો હેઠળની અમારી જવાબદારીઓ વધુમાં અમારા અહેવાલના નાણાકીય પત્રકોના ભાગમાં, ઓડિટ માટેની ઓડિટરોની જવાબદારીઓમાં વર્ણવવામાં આવી છે. ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા “કોડ ઓફ એથીક્સ” તેમ જ અધિનિયમની જોગવાઈઓ તેમ જ તે હેઠળ ઘડવામાં આવેલા નિયમો હેઠળ નાણાકીય પત્રકોના અમારા ઓડિટ સાથે સુસંગત એવી નૈતિક જરૂરિયાતો મુજબ અમે કંપનીથી સ્વતંત્ર છીએ અમે તે જરૂરિયાતો તથા “કોડ ઓફ એથીક્સ” મુજબ અમારી નૈતિક જવાબદારીઓ નિભાવી છે. અમે માનીએ છીએ કે અમે મેળવેલા ઓડિટ પુરાવા નાણાકીય પત્રકો અંગેના અમારા ઓડિટ અભિપ્રાયને આધાર પૂરો પાડવા માટે પર્યાપ્ત અને યોગ્ય છે.

ભાર મૂકવામાં આવેલી બાબતો

અમે, કંપની અને ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસિટી કોર્પોરેશન લિમિટેડ (જીએસઈસીએલ) વચ્ચેના હાલમાં પ્રગતિ હેઠળના ફ્યુઅલ સપ્લાય એગ્રીમેન્ટ અંગેની, નાણાકીય પત્રકોની નોંધ-૧૭ તરફ આપનું ધ્યાન દોરીએ છીએ. ફ્યુઅલ સપ્લાય એગ્રીમેન્ટ પડતર છે તે દરમિયાન, કંપનીએ જીએસઈસીએલ સાથે વચગાળાની વ્યવસ્થાના આધારે રૂ. ૨,૨૬,૮૦,૬૫,૦૮૨/-ના લિગનાઈટ પ્રોજેક્ટમાંથી આવક પ્રાપ્ત કરી છે. નાણાકીય પત્રકો અંગેનો અમારો અભિપ્રાય અને નીચે આપેલો “અન્ય કાનૂની તથા વિનિયંત્રક જરૂરિયાતો” અંગેનો અમારો અહેવાલ આ બાબતમાં બદલાયો નથી.

નાણાકીય પત્રકો અને તે અંગેના ઓડિટરોના અહેવાલ સિવાયની મહત્વની બાબતો

અન્ય બાબતોની માહિતી તૈયાર કરવાની જવાબદારી કંપનીના નિયામકમંડળની છે. અન્ય બાબતોની માહિતીમાં નિયામકમંડળના અહેવાલ સાથેનાં જોડાણો સહિત નિયામકમંડળના અહેવાલનો સમાવેશ થાય છે, પરંતુ તેમાં નાણાકીય પત્રકો તથા તે અંગેના અમારા ઓડિટરોના અહેવાલનો સમાવેશ થતો નથી. આ ઓડિટરોના અહેવાલની તારીખ પછી અમને અન્ય માહિતી ઉપલબ્ધ બનાવવામાં આવે તેવી અપેક્ષા છે.

નાણાકીય પત્રકો અંગેનો અમારો અભિપ્રાય અન્ય માહિતીને આવરી લેતો નથી અને અમે તે અંગે કોઈપણ પ્રકારની બાંધપરી અમારા તારણમાં વ્યક્ત કરતા નથી.

નાણાકીય પત્રકોના અમારા ઓડિટના સંબંધમાં અમારી જવાબદારી ઉપર જણાવેલી અન્ય માહિતી ઉપલબ્ધ બને ત્યારે તે વાંચવાની અને તેમ કરતી વખતે તે અન્ય

માહિતી નાણાકીય પત્રકો સાથે પ્રત્યક્ષરીતે વિસંગત છે કે કેમ અથવા અમારા ઓડિટ દરમિયાન અથવા અન્યથા અમને પ્રાપ્ત થયેલી જાણકારીથી જુદી પડે છે કે કેમ અથવા તે અંગે પ્રત્યક્ષ રીતે કોઈ ખોટું નિવેદન કરવામાં આવ્યું છે કે કેમ તે ધ્યાનમાં લેવાની છે.

અમે જ્યારે અન્ય માહિતી વાંચીએ ત્યારે અમે જો એવાં તારણ પર આવીએ કે આ અન્ય માહિતીમાં પ્રત્યક્ષરીતે કોઈ ખોટું નિવેદન કરવામાં આવ્યું છે તો અમારે તે હકીકત એસએ ૭૨૦ “અન્ય માહિતી અંગે ઓડિટરની જવાબદારી” હેઠળની જરૂરિયાત મુજબ, સંચાલનનો હવાલો ધરાવતા હોય તેઓને જણાવવી જરૂરી બને છે.

ભારતીય હિસાબી ધોરણો મુજબનાં નાણાકીય પત્રકો માટે વ્યવસ્થાપક મંડળની જવાબદારી

કંપની અધિનિયમ, ૨૦૧૩ (અધિનિયમ)ની કલમ-૧૩૪(પ)માં જણાવેલી બાબતોના સંદર્ભમાં, ભારતમાં સામાન્ય રીતે સ્વીકૃત હિસાબી સિધ્ધાંતો મુજબ કંપનીની નાણાકીય સ્થિતિ, અન્ય સર્વગ્રાહી આવક તથા કેશ-ફ્લો અને ઇકિવટીમાં થયેલા ફેરફાર સહિત નાણાકીય કામગીરીનું સાચું અને યોગ્ય ચિત્ર દર્શાવતાં આ નાણાકીય પત્રકો તૈયાર કરવાની જવાબદારી વ્યવસ્થાપક મંડળની છે. આ જવાબદારીમાં કંપનીની મિલકતોની સલામતી માટે અને બીજી છેતરપીંડીઓ અને અનિયમિતતાઓ રોકવા અને શોધવા માટે અધિનિયમની જોગવાઈઓ મુજબ પૂરતા હિસાબી રેકર્ડ જાળવવાનો; યોગ્ય હિસાબી પદ્ધતિઓ પસંદ કરી અપનાવવાનો; યોગ્ય અને વિવેકી નિર્ણયો કરવાનો; યોગ્ય રીતે અમલમાં મૂકી શકાય એવાં પૂરતાં આંતરિક નિયંત્રણો ઘડવાનો અને તેમને લાગુ પાડવાનો સમાવેશ થાય છે જેથી કોઈ છળકપટ અથવા ભૂલને કારણે વાસ્તવિક રીતે ખોટાં વિધાનોથી મુક્ત હોય એવાં નાણાકીય પત્રકો યોગ્ય રીતે તૈયાર કરવાના સંદર્ભમાં ચોક્કસાઈ અને પૂર્ણતા સુનિશ્ચિત કરી શકાય.

આ નાણાકીય પત્રકો તૈયાર કરવામાં વ્યવસ્થાપક મંડળ જો કંપનીને ફડયામાં લઈ જવા કે કંપનીનું કામકાજ બંધ કરી દેવાનો ઈરાદો ધરાવતું ન હોય તો, કંપનીની ચાલુ ધંધાના ધોરણે ચાલુ રહેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરવા અને ચાલુ ધંધા સંબંધિત લાગુ પડતી બાબતો જાહેર કરવા માટે જવાબદાર છે.

નિયામક મંડળ કંપનીના નાણાકીય અહેવાલ તૈયાર કરવા ઉપર દેખરેખ રાખવા માટે પણ જવાબદાર છે.

નાણાકીય પત્રકોના ઓડિટ અંગે ઓડિટરની જવાબદારી :

અમારો ઉદ્દેશ કોઈ છેતરપીંડી અથવા ભૂલને કારણે નાણાકીય પત્રકોમાં કોઈ ખોટું નિવેદન કરવામાં આવ્યું ન હોવાની યોગ્ય ખાતરી મેળવવાનો છે અને ઓડિટરોનો અહેવાલ બહાર પાડવાનો પણ છે, જેમાં અમારા અભિપ્રાયનો સમાવેશ થાય છે. યોગ્ય ખાતરી મેળવવી એ ઉચ્ચ પ્રકારની ખાતરી મેળવવા જેવું છે. પરંતુ તે કોઈ એવી ગેરંટી નથી કે એસએ મુજબ કરવામાં આવેલ ઓડિટ કોઈ પ્રત્યક્ષ ખોટું નિવેદન કરવામાં આવ્યું હશે તો તેને શોધી જ કાઢશે. છેતરપીંડી અથવા ભૂલને કારણે ખોટું નિવેદન ઊભું થઈ શકે છે અને આ નાણાકીય પત્રકોના આધારે તેનો ઉપયોગ કરનારા દ્વારા લેવામાં આવેલા આર્થિક નિર્ણયોને તે નોંધપાત્ર પ્રમાણમાં વ્યક્તિગત કે એકંદરરીતે પ્રભાવિત કરે તેવી સંભાવના રહેલી હોય તો તેને પ્રત્યક્ષ ભૂલ કે છેતરપીંડી ગણવામાં આવે છે.

એસએ મુજબ કરવામાં આવેલા ઓડિટના ભાગરૂપે અમે વ્યાવસાયિક નિર્ણયો લઈએ છીએ અને સમગ્ર ઓડિટ દરમિયાન વ્યવસાયિક શંકા જાળવી રાખીએ છીએ. આ ઉપરાંત અમે-

- છેતરપીંડી અથવા ભૂલને કારણે નાણાકીય પત્રકોમાં કોઈ ખોટું નિવેદન થયું હોય તો તેને પારખીને તેનાથી ઊભા થનારા ખતરાનો ક્યાસ પણ કાઢીએ છીએ અને તે ખતરાના ઉકેલરૂપ ઓડિટ કાર્યપદ્ધતિઓ ઘડીને તેને લાગુ પણ પાડીએ છીએ તથા અમારા અભિપ્રાયના સમર્થનમાં યોગ્ય અને પૂરતા પુરાવા પણ મેળવીએ છીએ. કોઈ ભૂલની તુલનામાં છેતરપીંડીને પરિણામે થયેલા ખોટા નિવેદન ન શોધી શકવાનું જોખમ વધુ રહે છે કારણ કે છેતરપીંડીમાં મેળાપીપણું, બનાવટ, ઈરાદાપૂર્વકની ક્ષતિ, ઉચાપત અથવા આંતરિક નિયંત્રણની અવહેલના થાય છે.
- ઓડિટને સુસંગત આંતરિક નિયંત્રણની સમજ મેળવીએ છીએ, જેથી જે તે સંજોગોને અનુરૂપ ઓડિટ કાર્યપદ્ધતિઓ ઘડી શકાય. કંપની અધિનિયમની કલમ ૨૪૩(૩)(૧) હેઠળ અને કંપની પર્યાપ્ત આંતરિક નાણાકીય નિયંત્રણ પદ્ધતિ ધરાવે છે કે કેમ અને આવાં નિયંત્રણો વાસ્તવમાં અસરકારક રીતે લાગુ પડે છે કે નહીં તે અંગેનો અમારો અભિપ્રાય વ્યક્ત કરવાની પણ અમારી જવાબદારી છે.
- ઉપયોગમાં લેવામાં આવેલી હિસાબી નીતિઓની યોગ્યતા તથા વ્યવસ્થાપકમંડળ દ્વારા કાઢવામાં આવેલા હિસાબી અંદાજો અને કરવામાં આવેલી સંબંધિત જાહેરાતોની મૂલવણી પણ કરીએ છીએ.
- વ્યવસ્થાપકમંડળ દ્વારા હિસાબના ચાલુ ઉપક્રમના ઉપયોગના ઔચિત્ય તથા પ્રાપ્ત કરવામાં આવેલા ઓડિટ પુરાવાના આધારે કંપની ચાલુ ઉપક્રમ તરીકે ચાલુ રહેવાની ક્ષમતા પર નોંધપાત્ર શંકા ઊભી કરે તેવી ઘટનાઓ અથવા પરિસ્થિતિઓ સંબંધી કોઈ પ્રત્યક્ષ અનિશ્ચિતતા અસ્તિત્વ ધરાવે છે કે કેમ તે પણ નક્કી કરીએ છીએ. કોઈ પ્રત્યક્ષ અનિશ્ચિતતા અસ્તિત્વ ધરાવતી હોવાનું અમને જણાય તો અમે અમારા ઓડિટરના અહેવાલમાં નાણાકીય પત્રકોમાં સંબંધિત જાહેરાતો તરફ ધ્યાન દોરીએ છીએ અને જો આવી જાહેરાતો અપર્યાપ્ત હોય તો અમે અમારા અભિપ્રાયમાં ફેરફાર કરીએ છીએ. અમારાં તારણો અમારા

ઓડિટરના અહેવાલની તારીખ સુધી મેળવવામાં આવેલા ઓડિટના પુરાવા પર આધારિત હોય છે. આમ છતાં, ભાવિ ઘટનાઓ અથવા પરિસ્થિતિઓને કારણે કંપની તેની ચાલુ કામગીરી કરવાનું બંધ કરે એવું બની શકે છે.

- જાહેરાતો સહિત નાણાકીય પત્રકોની એકંદર રજૂઆત, માળખું અને વિષયવસ્તુનું મૂલ્યાંકન કરીએ છીએ અને નાણાકીય પત્રકોમાં લેવડ-દેવડો અને ઘટનાઓની યોગ્ય રજૂઆત થઈ છે કે નહીં તે પણ તપાસીએ છીએ.

અમે સંચાલનની કામગીરી કરતા લોકોને અન્ય બાબતોની સાથેસાથે ઓડિટના આયોજિત કાર્યક્ષેત્ર તથા સમય તેમ જ મહત્વનાં ઓડિટ તારણોની પણ જાણ કરીએ છીએ જેમાં અમારા ઓડિટ દરમિયાન અમને જોવા મળેલી આંતરિક નિયંત્રણ અંગેની ખામીઓનો સમાવેશ થાય છે.

સંચાલનની કામગીરી સંભાળતા લોકોને અમે લિખિત નિવેદન પણ આપીએ છીએ કે અમે સ્વતંત્રતા અંગેની સંબંધિત નૈતિક જરૂરિયાતોનું અનુપાલન કર્યું છે અને અમારી સ્વતંત્રતાને પ્રભાવિત કરે તેવા તમામ સંબંધો તથા અન્ય બાબતોની તેમજ લાગુ પડતું હોય ત્યાં સંબંધિત સુરક્ષાસંબંધી બાબતોની પણ જાણ કરીએ છીએ.

સંચાલકોએ જણાવેલી બાબતો પૈકી ચાલુ સમયગાળાના નાણાકીય પત્રકોના ઓડિટમાં સૌથી મહત્વની હોય તેવી બાબતો અમે નક્કી કરીએ છીએ. કાયદો અથવા વિનિયમો હેઠળ આવી બાબતો જાહેર કરવા અંગે કોઈ બાધ ન હોય તો અથવા અત્યંત જૂજ કિસ્સાઓમાં જ્યારે અમને લાગે કે જાહેર હિતમાં કોઈ બાબત જણાવવી યોગ્ય નથી તે સિવાય અમે અમારા ઓડિટ અહેવાલમાં તે બાબતો જાહેર કરીએ છીએ કારણ કે તે બાબતો જાહેર કરવાથી જાહેર હિતમાં થનારા લાભોની તુલનામાં ઊભાં થનારાં વિપરિત પરિણામોની અસર વધુ ગંભીર હોવાની અપેક્ષા હોય છે.

અન્ય કાનૂની અને નિયંત્રક જરૂરિયાતો અંગેનો અહેવાલ

- કંપની અધિનિયમની કલમ-૧૪૩ની પેટા-કલમ (૧૧)ના સંદર્ભમાં ભારતની કેન્દ્ર સરકાર દ્વારા બહાર પડવામાં આવેલા, કંપનીઝ (ઓડિટર્સ રિપોર્ટ) ઓર્ડર, ૨૦૧૬ (ધ ઓર્ડર)ની જરૂરિયાત મુજબ, અમે જોડાણ-કમાં, “ધ ઓર્ડર”ના ફકરા ૩ અને ૪માં નિર્દિષ્ટ કરવામાં આવેલી બાબતો અંગેનું એક પત્રક આપ્યું છે.
- અમે, ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ દ્વારા ઈસ્યુ કરવામાં આવેલા નિર્દેશો અને પેટાનિર્દેશોના આધારે જોડાણ-૨માં, અમને આપવામાં આવેલી માહિતી અને કરવામાં આવેલા ખુલાસા મુજબ અને કંપનીના ચોપડા અને રેકર્ડની અમને યોગ્ય જણાઈ છે તેવી તપાસના આધારે, અધિનિયમની કલમ ૧૪૩(૫)ના સંદર્ભમાં અમારો અહેવાલ રજૂ કરીએ છીએ.
- કંપની અધિનિયમનીની કલમ ૧૪૩(૩)ની જરૂરિયાત મુજબ અમે જણાવીએ છીએ કે-
 - આ ઓડિટ માટે અમારી જાણકારી અને માન્યતા મુજબ જરૂરી હોય તેવી તમામ માહિતી અને ખુલાસા અમે મેળવ્યાં છે.
 - અમારા મતે, કાયદા અન્વયે જાળવવાના થતા હિસાબના યોગ્ય ચોપડા કંપનીએ જાળવ્યા હોવાનું અમને હિસાબોના ચોપડાની અમે કરેલી તપાસ દરમિયાન જણાયું છે.
 - આ અહેવાલમાં, રજૂ કરવામાં આવેલાં પાકા સરવૈયા, અન્ય સર્વગ્રાહી આવક તથા કેશ-ફ્લો અને ઈકિવટીમાં થયેલા ફેરફાર સહિત નફા અને નુકસાન પત્રક હિસાબના ચોપડા સાથે સુસંગત છે.
 - અમારા મતે, ઉક્ત નાણાકીય પત્રકો અધિનિયમની કલમ-૧૩૩ને કંપનીઝ (ઈન્ડિયન એકાઉન્ટીંગ સ્ટાન્ડર્ડ્ઝ) રુલ્સ, ૨૦૧૫ સાથે વાંચતાં, તેમાં નિર્દિષ્ટ કરવામાં આવેલાં હિસાબી ધોરણોનું પાલન કરે છે.
 - નિયામકમંડળે જેને રેકર્ડ પર લીધી છે એ, ૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ મુજબ નિયામકો તરફથી મળેલી લિખિત રજૂઆત મુજબ, અધિનિયમની કલમ ૧૬૪(૨) અન્વયે કંપનીના કોઈ નિયામક તા. ૩૧-૩-૨૦૨૧ના રોજ નિયામક તરીકે નિમણૂક પામવા માટે ગેરલાયક નથી.
 - કંપનીનાં નાણાકીય પત્રકો તૈયાર કરવાની પ્રક્રિયા પર આંતરિક નાણાકીય નિયંત્રણોની પર્યાપ્તતા અને આવાં નિયંત્રણોની કાર્યલક્ષી અસરકારકતા અંગે જુઓ આ અહેવાલ સાથે જોડાણ-૩ માં જોડેલ અલગ અહેવાલ. અમારો અહેવાલ નાણાકીય પત્રકો તૈયાર કરવાની પ્રક્રિયા ઉપર કંપનીનાં આંતરિક નિયંત્રણની પર્યાપ્તતા અને અસરકારકતા અંગેનો અમારો અમારો અભિપ્રાય વ્યક્ત કરે છે, જેમાં કોઈ ફેરફાર થયો નથી.
 - સુધારવામાં આવેલા અધિનિયમની કલમ ૧૮૭(૧૬)ની જરૂરિયાત મુજબ ઓડિટરના અહેવાલમાં સામેલ કરવાની અન્ય બાબતોના સંદર્ભમાં:

અમારા મતે અને અમને આપવામાં આવેલી માહિતી અને કરવામાં આવેલા ખુલાસા મુજબ કંપનીએ તેના નિયામકોને અધિનિયમની કલમ ૧૮૭ મુજબ મહેનતાણું ચુકવેલ છે.

- કંપનીઝ (ઓડિટ એન્ડ ઓડિટર્સ) રુલ્સ, ૨૦૧૪ના નિયમ-૧૧ મુજબ, ઓડિટરોના અહેવાલમાં સમાવવાની અન્ય બાબતોના સંદર્ભે, અમારા મતે અને અમારી શ્રેષ્ઠ જાણકારી મુજબ તથા અમને કરવામાં આવેલા ખુલાસા મુજબ-
- કંપનીએ તેના નાણાકીય પત્રકોમાં, તેના પડતર કોર્ટ કેસોની નાણાકીય સ્થિતિ પર પડનારી અસર જાહેર કરી છે. (જુઓ નોંધ નં. ૩૧ (ન))
- નજીકના ભવિષ્યમાં નુકસાન થાય તેવા, ડેરીવેટીવ કોન્ટ્રાક્ટ સહિતના કોઈ લાંબા ગાળાના કોન્ટ્રાક્ટ કંપની ૩૧ માર્ચ, ૨૦૨૧ના રોજ ધરાવતી નથી.
- કંપનીએ ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડમાં તબદીલ કરવી જરૂરી હોય તેવી કોઈ રકમ ન હતી.

સ્થળ: અમદાવાદ

તારીખ : ૨૯-૧૨-૨૦૨૧

યુડીઆઈએન: ૨૨૧૪૧૮૨૫એએએએડી૧૦૮૯

અનિલ એન. શાહ એન્ડ કું.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ

પેઠી નોંધણી નં. ૧૧૪૧૩૧W વતી

સહી/-

(જિજ્ઞા.એચ. શાહ)

ભાગીદાર

મેમ્બરશીપ નં. ૧૪૧૮૨૫

ઓડિટરના અહેવાલ સાથેનું “જોડાણ-૧”

(અમારા સમાન તારીખના અહેવાલના “અન્ય કાનૂની અને વિનિયમનકારી જરૂરિયાતો અંગેનો અહેવાલ” હેઠળના ફકરા-૧ માં જણાવેલ)

૩૧ માર્ચ ૨૦૨૧ના રોજ પૂરાં થતાં વર્ષ માટેનાં, ભારતીય હિસાબી ધોરણો મુજબનાં નાણાકીય પત્રકો અંગે કંપનીના સભ્યો સમક્ષના અમારા સ્વતંત્ર ઓડિટરના અહેવાલના જણાવેલ જોડાણ-૧ માં અમે જણાવીએ છીએ કે-

(૧) સ્થાયી મિલકતોની બાબતમાં

(ક) કંપનીએ પ્રમાણાત્મક વિગતો અને સ્થિતિ સહિત પૂરી વિગતો દર્શાવતું યોગ્ય રેકર્ડ જાળવ્યું છે.

(ખ) કંપની તેની સ્થાયી મિલકતો (સંપત્તિ, પ્લાન્ટ અને સાધનસામગ્રી)ની ખરાઈ તબક્કાવાર કાર્યક્રમ મુજબ કરે છે, જે અમારા મતે કંપનીના કદ અને તેની મિલકતોના સંદર્ભમાં યોગ્ય છે. આ કાર્યક્રમને અનુસરીને વર્ષ દરમિયાન વ્યવસ્થાપકમંડળે કેટલીક સ્થાયી મિલકતોની પ્રત્યક્ષ ખરાઈ કરી હતી. અમને આપવામાં આવેલી માહિતી અને કરવામાં આવેલા ખુલાસા મુજબ આ ખરાઈમાં કોઈ પ્રત્યક્ષ વિસંગતતા જણાઈ નથી.

(ગ) અમને આપવામાં આવેલી માહિતી અને કરવામાં આવેલા ખુલાસા મુજબ અમે જણાવીએ છીએ કે, કંપનીની જમીન અને મકાનોની તમામ સ્થાવર મિલકતો સરવૈયાની તારીખે કંપનીના નામે ધારણ થયેલી છે અને લીઝ હોલ્ડ સંપત્તિઓ માટે કંપની ચોખ્ખાં ટાઈટલ/લીઝ ડીડ ધરાવે છે. કંપનીની જમીન અને મકાનોની સ્થાવર મિલકતો પટેથી લેવામાં આવી છે અને નાણાકીય પત્રકોમાં સ્થાયી મિલકતો તરીકે જાહેર કરવામાં આવી છે તે કંપનીના નામે છે.

૨. અમારા મતે, વર્ષ દરમિયાન માલસામગ્રીની ભૌતિક ચકાસણી વ્યવસ્થાપક મંડળ દ્વારા યોગ્ય સમયાંતરે કરવામાં આવી છે. અમને આપવામાં આવેલી માહિતી અને કરવામાં આવેલા ખુલાસા મુજબ હિસાબના ચોપડાની તુલનામાં ભૌતિક ખરાઈ દરમિયાન ધ્યાનમાં આવેલી માલસામગ્રીની વિસંગતતાને હિસાબના ચોપડે નિપટાવી લેવામાં આવી છે અને તે મહત્વની ગણી શકાય એવી નથી.

૩. અમને આપવામાં આવેલી માહિતી અને કરવામાં આવેલા ખુલાસા મુજબ, કંપનીએ, કંપની અધિનિયમ ૨૦૧૩ની કલમ -૧૮૯ હેઠળ જાળવવામાં આવેલા રજિસ્ટરમાં નોંધાયેલી કંપનીઓ, પેઢીઓ, મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારીઓ અથવા અન્ય પાર્ટીઓને કોઈ તારણવાળી કે તારણ વિનાની લોન આપી નથી. તેથી, ધ સીએઆરઓના ફકરા (૩)(૩)(ક)(ખ) અને (ગ)ની જોગવાઈ કંપનીને લાગુ પડતી નથી.

૪. કંપની અધિનિયમની કલમ ૧૮૫ હેઠળ કંપનીએ કોઈ લોન, રોકાણો, ગેરંટી આપી નથી. અમને આપવામાં આવેલી માહિતી અને કરવામાં આવેલા ખુલાસા મુજબ કંપનીએ તેણે કરેલા રોકાણોના સંદર્ભમાં અધિનિયમની કલમ ૧૮૬ની જોગવાઈઓનું પાલન કર્યું છે.

૫. અમને આપવામાં આવેલી માહિતી અને કરવામાં આવેલા ખુલાસા મુજબ કંપનીએ વર્ષ દરમિયાન, અધિનિયમની કલમ ૭૩ થી ૭૬ અને તે હેઠળ ઘડવા માં આવેલા નિયમોની જોગવાઈઓ હેઠળ અથવા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલા નિર્દેશો હેઠળ જાહેર જનતા પાસેથી કોઈ થાપ ણો સ્વીકારી નથી તેથી ધ ઓર્ડરના ખંડ (૩)(૫)ની જોગવાઈ કંપનીને લાગુ પડતી નથી.

૬. કંપની અધિનિયમ-૨૦૧૩ની કલમ ૧૪૮(૧) હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા નિર્દિષ્ટ કરવામાં આવ્યા મુજબ અમે કંપની દ્વારા જાળવવામાં આવેલા હિસાબના ચોપ ડા તપાસ્યા છે અને અમારા મતે કંપનીએ નિર્દિષ્ટ હિસાબો અને કોસ્ટ રેકર્ડ્સ પ્રથમ દ્રષ્ટિએ જાળવ્યાં છે. આમ છતાં અમે કોસ્ટ રેકર્ડ્સ સાચા અને સંપૂર્ણ છે કે નહીં તે નક્કી કરવાની દ્રષ્ટિએ તે વિગતવાર તપાસ્યા નથી.

૭. (ક) અમને આપવામાં આવેલી માહિતી અને કરવામાં આવેલા ખુલાસા મુજબ અને અમે તપાસેલા કંપનીના રેકર્ડ્સ મુજબ કંપની ભવિષ્યનિધિ, કર્મચારીઓનો રાજ્ય વીમો, આવકવેરો, વેચાણવેરો, સેવા કર, જીએસટી, આબકારી શુલ્ક, જકાત, મૂલ્ય વર્ધિત કર અથવા ઉપકર તેમજ તેને લાગુ પડતી અન્ય વૈધાનિક રકમો સહિત ચૂકવવાપાત્ર તમામ નિર્વિવાદ વૈધાનિક રકમો યોગ્ય સત્તામંડળોને નિયમિતરીતે ચૂકવે છે. અમને આપવામાં આવેલી માહિતી અને કરવામાં આવેલા ખુલાસા મુજબ અને અમે તપાસેલા કંપનીના રેકર્ડ્સ મુજબ, કોઈ નિર્વિવાદ રકમ ૩૧ માર્ચ ૨૦૨૧ના રોજ, તે ચૂકવવાપાત્ર બન્યા તે તારીખથી છ મહિના કરતા વધુ સમયથી સંબંધિત સત્તામંડળો પાસે કોઈ વિવાદના કારણે જમા કરાવવાના બાકી ન હતી.

(ખ) અમને આપવામાં આવેલી માહિતી અને કરવામાં આવેલા ખુલાસા મુજબ અને અમે તપાસેલા કંપનીના રેકર્ડ્સ મુજબ કંપનીએ જમા ન કરાવી હોય તેવી મૂલ્યવર્ધિત કર, જીએસટી, આબકારી શુલ્ક અને જકાતની કોઈ વિવાદિત રકમ ન હતી. વિવાદના કારણે ૩૧ માર્ચ, ૨૦૨૧ના રોજ મુજબ જમા કરાવી નથી શકાયા તેવી આવક વેરા અને સર્વિસ ટેક્સની રકમોની વિગત નીચે મુજબ છે.

કાયદાનું નામ	લેણાંનો પ્રકાર	બાકી વિવાદી રકમ (રૂ. લાખમાં)	રકમને લગતું નાણાકીય વર્ષ	વિવાદ જ્યાં પડતર હોય તે ફોરમનું નામ
આવકવેરા અધિનિયમ, ૧૯૬૧	આવક વેરો	૧૫.૦૬	૧૯૯૧-૯૨	હાઈકોર્ટે તા. ૨૬/૦૬/૨૦૧૨ના રોજ હુકમ કર્યો છે.
આવકવેરા અધિનિયમ, ૧૯૬૧	આવક વેરો	૫૧.૯૦	૧૯૯૨-૯૩	હાઈકોર્ટે તા. ૧૭/૧૦/૨૦૧૪ના રોજ હુકમ કર્યો છે.
આવકવેરા અધિનિયમ, ૧૯૬૧	આવક વેરો	૯૫૭૭.૦૩	૨૦૦૧-૦૨	હાઈકોર્ટે તા. ૩૦/૦૭/૧૨ના રોજ જીપીસીએલની તરફેણમાં હુકમ કર્યો છે. સુપ્રિમ કોર્ટ સમક્ષ અપીલ પડતર છે.
આવકવેરા અધિનિયમ, ૧૯૬૧	આવક વેરો	૪૧૦.૬૫	૨૦૦૨-૦૩	આઈટીએટી એ તા. ૩૧/૦૭/૨૦૧૯ના રોજ હુકમ કર્યો છે. હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી છે અને સુનાવણી બાકી છે.
આવકવેરા અધિનિયમ, ૧૯૬૧	આવક વેરો	૮.૦૫	૨૦૦૩-૦૪	આઈટીએટી એ તા. ૩૧/૦૭/૨૦૧૯ના રોજ હુકમ કર્યો છે. હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી છે અને સુનાવણી બાકી છે.
આવકવેરા અધિનિયમ, ૧૯૬૧	આવક વેરો	૪૬૦.૭૯	૨૦૦૪-૦૫	આઈટીએટી એ તા. ૩૧/૦૭/૨૦૧૯ના રોજ હુકમ કર્યો છે. હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી છે અને સુનાવણી બાકી છે.
આવકવેરા અધિનિયમ, ૧૯૬૧	આવક વેરો	૩૦.૭૨	૨૦૦૬-૦૭	આઈટીએટી એ તા. ૩૧/૦૭/૨૦૧૯ના રોજ હુકમ કર્યો છે. હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી છે અને સુનાવણી બાકી છે.
આવકવેરા અધિનિયમ, ૧૯૬૧	આવક વેરો	૫૫.૧૬	૨૦૦૭-૦૮	આઈટીએટી એ તા. ૩૧/૦૭/૨૦૧૯ના રોજ હુકમ કર્યો છે. હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી છે અને સુનાવણી બાકી છે.
આવકવેરા અધિનિયમ, ૧૯૬૧	આવક વેરો	૫૫.૮૧	૨૦૦૮-૦૯	આઈટીએટી એ તા. ૩૧/૦૭/૨૦૧૯ના રોજ હુકમ કર્યો છે. હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી છે અને સુનાવણી બાકી છે.
આવકવેરા અધિનિયમ, ૧૯૬૧	આવક વેરો	૫૯.૬	૨૦૦૨-૦૩	બાબત આઈટીએટી પાસે પડતર છે.
આવકવેરા અધિનિયમ, ૧૯૬૧	આવક વેરો	૮૧.૧૩	૨૦૦૩-૦૪	બાબત આઈટીએટી પાસે પડતર છે.
આવકવેરા અધિનિયમ, ૧૯૬૧	આવક વેરો	૧૩૭.૫૨	૨૦૦૪-૦૫	બાબત આઈટીએટી પાસે પડતર છે.
આવકવેરા અધિનિયમ, ૧૯૬૧	આવક વેરો	૧૦૯.૭૯	૨૦૦૫-૦૬	બાબત આઈટીએટી પાસે પડતર છે.
આવકવેરા અધિનિયમ, ૧૯૬૧	આવક વેરો	૨૩.૦૫	૨૦૦૯-૧૦	સીઆઈટી (એ)એ તા. ૨૨/૦૮/૨૦૧૩ના રોજ હુકમ કર્યો છે.
આવકવેરા અધિનિયમ, ૧૯૬૧	આવક વેરો	૪૩૬.૪૬	૨૦૧૦-૧૧	આઈટીએટી એ તા. ૧૦/૦૭/૨૦૧૯ના રોજ હુકમ કર્યો છે. હાઈકોર્ટમાં કેવિએટ દાખલ કરવામાં આવી છે.
આવકવેરા અધિનિયમ, ૧૯૬૧	આવક વેરો	૨૮.૫૩	૨૦૧૧-૧૨	આઈટીએટી એ તા. ૧૦/૦૭/૨૦૧૯ના રોજ હુકમ કર્યો છે. હાઈકોર્ટમાં કેવિએટ દાખલ કરવામાં આવી છે.
આવકવેરા અધિનિયમ, ૧૯૬૧	આવક વેરો	૧૧.૨૮	૨૦૧૨-૧૩	આઈટીએટી એ તા. ૧૯/૦૯/૨૦૧૯ના રોજ હુકમ કર્યો છે. હાઈકોર્ટમાં કેવિએટ દાખલ કરવામાં આવી છે.
આવકવેરા અધિનિયમ, ૧૯૬૧	આવક વેરો	૪૮.૬૩	૨૦૧૩-૧૪	આઈટીએટી એ તા. ૨૦/૦૯/૨૦૧૯ના રોજ હુકમ કર્યો છે. હાઈકોર્ટમાં કેવિએટ દાખલ કરવામાં આવી છે.
સર્વિસ ટેક્સ એક્ટ	સર્વિસ ટેક્સ	૨૯૪૫	એપ્રિલ, ૨૦૦૯ થી ડિસેમ્બર, ૨૦૧૨	આ બાબત સીઈએસટીએટીસમક્ષ પડતર છે.
સર્વિસ ટેક્સ એક્ટ	સર્વિસ ટેક્સ	૮.૬૬	એપ્રિલ, ૨૦૧૬ થી જૂન, ૨૦૧૭	આ બાબત જીએસટીના કમિશનરશ્રી (અપીલ્સ) સમક્ષ પડતર છે.

૮. અમને આપવામાં આવેલી માહિતી અને કરવામાં આવેલા ખુલાસા મુજબ વર્ષ દરમિયાન કંપની કોઈ લોન લીધી ન હતી.
૯. અમને આપવામાં આવેલી માહિતી અને કરવામાં આવેલા ખુલાસા મુજબ, કંપનીએ વર્ષ દરમિયાન પ્રારંભિક પબ્લિક ઓફર અથવા વધુ પબ્લિક ઓફર થકી કોઈ નાણાં (દેવા ખત સહિત) ઊભાં કર્યાં નથી. તેથી ધ ઓર્ડરના ખંડ (૩)(૯) લાગુ પડતો નથી.
૧૦. અમારી જાણકારી અને માન્યતા મુજબ તેમજ અમને આપવામાં આવેલી માહિતી અને કરવામાં આવેલા ખુલાસા પ્રમાણે, ઓડિટ દરમિયાન કંપની દ્વારા અથવા કંપનીના અધિકારીઓ અથવા કર્મચારીઓ દ્વારા કંપની સાથે કોઈ છેતરપીંડી કરવામાં આવી હોય એવું અમારા ધ્યાનમાં કે જાણમાં આવ્યું નથી.
૧૧. તા. ૫મી જૂન, ૨૦૧૫ના જાહેરનામા ક્રમાંક : જીએસઆર ૪૬૩ (ઈ)ને ધ્યાનમાં લેતાં, સરકારી કંપનીઓને કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ-૧૯૭ લાગુ પડતી નથી. તદ્દનુસાર, 'ધ ઓર્ડર'નો ખંડ ૩(૧૧) કંપનીને લાગુ પડતો નથી.
૧૨. આ કંપની કોઈ નિધિ કંપની નથી. તેથી 'ધ ઓર્ડર'નો ખંડ (૧૨) કંપનીને લાગુ પડતો નથી.
૧૩. અમને આપવામાં આવેલી માહિતી અને કરવામાં આવેલા ખુલાસા મુજબ, કંપની અધિનિયમ-૨૦૧૩ની કલમ-૧૭૭ અને ૧૮૮ હેઠળ અનુપાલન કરવાનું લાગુ પડતું હોય ત્યાં કંપનીએ તેમનું પાલન કર્યું છે, અને ભારતીય હિસાબી ધોરણો મુજબનાં નાણાકીય પત્રકોમાં હિસાબી ધોરણ-૨૪ "સંબંધિત પાટીઓ અંગેની જાહેરાત"ની વિગતો જાહેર કરવામાં આવી છે.
૧૪. અમને આપવામાં આવેલી માહિતી અને કરવામાં આવેલા ખુલાસા મુજબ અને અમે તપાસેલા રેકર્ડ અનુસાર, વર્ષ દરમિયાન કંપનીએ શેર્સની અથવા સંપૂર્ણ કે અંશતઃ ચુકવાયેલા રિબેન્ડર્સની પસંદગી મુજબની ફાળવણી (પ્રેફરેન્સિયલ અલોટમેન્ટ) કરી નથી અને તેથી 'ધ ઓર્ડર'નો ખંડ ૩(૧૪) કંપનીને લાગુ પડતો નથી.
૧૫. અમારા મતે અને અમને આપવામાં આવેલી માહિતી અને કરવામાં આવેલા ખુલાસા મુજબ, કંપનીએ વર્ષ દરમિયાન તેના નિયામકો અથવા તેમની સાથે સંકળાયેલી વ્યક્તિઓ સાથે કોઈ બિન-રોકડ લેવડ દેવડ કરી નથી. તેથી ખંડ(૧૫) કંપનીને લાગુ પડતો નથી.
૧૬. અમને આપવામાં આવેલી માહિતી અને કરવામાં આવેલા ખુલાસા મુજબ કંપનીને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એક્ટ, ૧૯૩૪ની કલમ ૪૫-આઈએ હેઠળ નોંધણી કરાવવાની જરૂર નથી.

સ્થળ: અમદાવાદ
તારીખ : ૨૯-૧૨-૨૦૨૧
યુડીઆઈએન: ૨૨૧૪૧૮૨૫એએએએડી૧૦૮૮

અનિલ એન. શાહ એન્ડ કું.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ
પેઠી નોંધણી નં. ૧૧૪૧૩૧W વતી
સહી/-
(જિજ્ઞા.એચ. શાહ)
ભાગીદાર
મેમ્બરશીપ નં. ૧૪૧૮૨૫

સ્વતંત્ર ઓડિટરના અહેવાલ સાથેનું જોડાણ-૨
(અમારા સમાન તારીખના અહેવાલના "અન્ય કાનૂની અને વિનિયમનકારી જરૂરિયાતો અંગેનો અહેવાલ" હેઠળના ફકરા-૨માં જણાવેલ)
કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ-૧૪૩(૫) હેઠળ વર્ષ ૨૦૨૦-૨૧ માટેનો અહેવાલ

૧. મૂખ્ય નિર્દેશો

ક્રમ નં.	નિર્દેશો અને પેટા નિર્દેશો	પ્રતિભાવ/ ઉપચારાત્મક પગલાં
૧.	કંપની તમામ હિસાબી લેવડદેવડો આઈટી પ્રણાલી મારફત પ્રોસેસ કરવાની સીસ્ટમ ધરાવે છે? જો હા, તો આઈટી સીસ્ટમની બહાર હિસાબી લેવડદેવડો કરવાની હિસાબોની ચોકસાઈ પર થનારી અસરો અને તેની સૂચિત નાણાકીય અસરો જણાવો.	હા, કંપની તમામ હિસાબી લેવડદેવડો આઈટી પ્રણાલી મારફત પ્રોસેસ કરવાની સીસ્ટમ ધરાવે છે. આઈટી સીસ્ટમની બહાર કોઈ હિસાબી લેવડદેવડો કરવામાં આવતી ન હોવાથી હિસાબોની ચોકસાઈ પર કોઈ અસર પડશે નહીં અને તેની કોઈ નાણાકીય અસરો પડશે નહીં.
૨.	કંપની લોન પરત ચુકવી શકી ન હોવાના કારણે કોઈ વર્તમાન લોનનું પુનર્ગઠન (રીસ્ટ્રક્ચરીંગ) કરવાનો અથવા લોન આપનારે કંપનીના દેવાં/લોન/વ્યાજ વગેરે માંડવાળ/રાઈટ ઓફ કરવાનો કોઈ કિસ્સો છે? જો હા, તેની નાણાકીય અસરો જણાવો.	લાગુ પડતું નથી.
૩.	કોઈ ચોક્કસ યોજના માટે કેન્દ્ર/રાજ્યની એજન્સીઓ પાસેથી મેળવેલ/મળવાપાત્ર ભંડોળ તેની શરતો મુજબ હિસાબે લેવામાં/વાપરવામાં આવ્યું છે? તેમાં કોઈ માર્ગીતર હોય તો જણાવો.	લાગુ પડતું નથી

૨. વર્ષ ૨૦૨૦-૨૧ માટે કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ ૧૪૩(૫) હેઠળ બહાર પાડવામાં આવેલા પેટા-નિર્દેશો (ઈન્વાસ્ટ્રકચર સેક્ટર)

ક્રમ નં.	વિગતો	વિશેષ નોંધ
૧.	કંપનીએ તેની માલિકીની ફાજલ પડેલી જમીન પર દબાણ થતું અટકાવવા માટે પૂરતાં પગલાં લીધાં છે? કંપનીની કોઈ જમીન પર દબાણ થયું છે? તે અંગે કેસ ચાલે છે? તે ઉપયોગમાં લેવામાં આવી નથી અથવા ફાજલ જાહેર કરવામાં આવી છે? વિગતો આપવી.	હા ના
૨.	જાહેર-ખાનગી ભાગીદારી હેઠળ હાથ ધરવામાં આવેલા પ્રકલ્પોની પરખ કરવા માટે સરકારની માર્ગદર્શક સૂચનાઓ/નીતિઓ સાથે સુસંગત હોય એવી કોઈ વ્યવસ્થા છે? તેમાં કોઈ માર્ગીતર થયું હોય તો જણાવો.	લાગુ પડતું નથી
૩.	શું કરારમાં નિર્દેષ્ટ કરવામાં આવેલાં સીમાચિહ્નોની તુલનામાં થયેલાં કામો અંગે દેખરેખ નિયંત્રણ રાખવા માટેની વ્યવસ્થા અસ્તિત્વ ધરાવે છે અને કોઈ ભાવ વધારો હોય અથવા કરારમાંથી કોઈ આવક/ખોટ થઈ હોય તો તેની અસર હિસાબના ચોપ ડામાં યોગ્ય રીતે આપવામાં આવે છે?	હા
૪.	કેન્દ્ર/ રાજ્યની એજન્સીઓમાંથી ચોક્કસ યોજનાઓ માટે મળેલા/ મળવાપાત્ર ભંડોળ યોગ્ય રીતે ઉપયોગમાં/ હિસાબે લેવામાં આવે છે? આમાં કોઈ માર્ગીતર થયું હોવાના કિસ્સા બન્યા હોય તો જણાવો.	હા
૫.	બેંક ગેરંટી સમયસર રીવેલીડિટ કરવામાં આવી છે?	હા
૬.	નીચેનાની સિલકો અંગે ટિકા-ટિપ્પણ કરો ક. ધંધા સંબંધી મળવાપાત્ર, ધંધા સંબંધી ચુકવવાપાત્ર ખ. મુદતી થાપણો, બેંક ખાતાં અને મેળવેલી રોકડ	ના હા
૭.	પડતા મૂકવામાં આવેલા પ્રકલ્પો અંગે કરવામાં આવેલા ખર્ચનું પ્રમાણ નક્કી કરવું અને ખરેખર રાઈટ ઓફ કરવામાં આવેલી રકમ જણાવવી.	લાગુ પડતું નથી.

વીજ ક્ષેત્ર

ક્રમ નં.	વિગતો	વિશેષ નોંધ
૧.	કંપનીની માલિકીની ફાજલ પડેલી જમીન પર દબાણ થતું રોકવા માટે લેવામાં આવેલાં પગલાં પૂરતાં છે કે નહીં તે તપાસવું.	હા
	કંપનીની જમીન પર દબાણ થયું હોય, તે સંબંધે કેસ ચાલતો હોય, તેનો ઉપયોગ થતો ન હોય અથવા તેને ફાજલ જાહેર કરવામાં આવી હોય તો તેની વિગતો જણાવવી.	લાગુ પડતું નથી.
૨.	નવી પરિયોજનાઓ શરૂ કરવા માટે જ્યાં જમીન સંપાદનનો મુદ્દો સંકળાયેલો હોય ત્યાં બાકી લેણાંની પતાવટ તમામ કેસોમાં ઝડપ થી અને પારદર્શી રીતે કરવામાં આવી છે કે નહીં તે જણાવો. કોઈ માર્ગીતર (ક્લિટીફેસ)નો કેસ હોય તો તેની વિગતો આપો.	હા
૩.	કંપની કરારની શરતો મુજબ મહેસૂલની વસૂલાત કરવા માટેની અસરકારક પ્રણાલી ધરાવે છે કે કેમ અને તે મહેસૂલ, લાગુ પડતાં હિસાબી ધોરણોનું પાલન કરીને હિસાબના ચોપડે યોગ્ય રીતે હિસાબે લેવામાં આવે છે કે નહીં.	હા
૪.	પડતી મૂકવામાં આવેલી પરિયોજનાઓ અંગે કેટલું ખર્ચ કરવામાં આવ્યું છે અને તેમાંથી કેટલું ખર્ચ રાઈટ ઓફ કરવામાં આવ્યું છે.	લાગુ પડતું નથી.

નિર્માણ

ક્રમ નં.	વિગતો	વિશેષ નોંધ
૧.	થર્મલ પાવર પ્રોજેક્ટના કિસ્સામાં, જુદા જુદા પ્રદૂષણ નિયંત્રણ અધિનિયમોનું અનુપાલન તથા રાખ (એશ)ના ઉપયોગ અને નિકાલ સહિત, તેની અસર અને આ સંદર્ભે કંપનીની નીતિ અંગે તપાસ કરવી અને તે અંગે ટીકા-ટિપ્પણ આપવાં.	લાગુ પડતું નથી.
૨.	ખાણના તળિયે (પીટ એન્ડ) કોલસાનું ઉત્પન્ન કરવા માટેની ખાનગી પક્ષકારો સાથે હિસ્સેદારીથી આવક વહેંચવા માટેના કરાર કંપનીએ કર્યા છે અને કંપનીનાં નાણાકીય હિતોની પૂરતી રક્ષા કરવામાં આવે છે?	લાગુ પડતું નથી.
૩.	ઓર્ડર કરવામાં આવેલા અને પ્રાપ્ત થયેલા કોલસાની ગુણવત્તા / પ્રમાણનો હિસાબમેળ કરવાની યોગ્ય પ્રણાલી કંપની ધરાવે છે? અને કોલસાના ભેજનો ગ્રેડ તથા નુકસાની વગેરેની નોંધ હિસાબના ચોપડે યોગ્ય રીતે કરવામાં આવે છે?	લાગુ પડતું નથી.
૪.	રાજ્ય સરકારને વિનામૂલ્ય વીજળીનો કેટલો હિસ્સો મળવાપાત્ર છે? અને તેની ગણતરી પરસ્પર સંમતિ સધાયા મુજબની શરતો પ્રમાણે કરીને, હિસાબનાં સ્વીકૃત ધોરણો મુજબ હિસાબોમાં તે દર્શાવવામાં આવે છે?	લાગુ પડતું નથી.
૫.	જળ વિદ્યુત પરિયોજનાઓના કેસમાં પાણીનો નિકાલ જેવવૈવિધ્યની જાળવણી માટે રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી નીતિ/ માર્ગદર્શક સૂચનાઓ મુજબ કરવામાં આવે છે? જેવૈવિધ્યની જાળવણી ન કરવા બદલ ચુકવણી/ ચુકવવાપાત્ર દંડ વિશે જણાવવું.	લાગુ પડતું નથી.

સ્થળ: અમદાવાદ
તારીખ : ૨૯-૧૨-૨૦૨૧
યુડીઆઈએન: ૨૨૧૪૧૮૨૫એએએએડી૧૦૮૮

અનિલ એન. શાહ એન્ડ કું.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ

પેઠી નોંધણી નં. ૧૧૪૧૩૧W વતી
સહી/-
(જિજ્ઞા.એચ. શાહ)
ભાગીદાર
મેમ્બરશીપ નં. ૧૪૧૮૨૫

સ્વતંત્ર ઓડિટરોના અહેવાલ સાથેનું જોડાણ-૩

(અમારા સમાન તારીખના અહેવાલના “અન્ય કાનૂની અને વિનિયમનકારી જરૂરિયાતો અંગેનો અહેવાલ” હેઠળના ફકરા-૩નાં ખંડ (છ)માં જણાવેલ) કંપની અધિનિયમ, ૨૦૧૩ (અધિનિયમ)ની કલમ-૧૪૩ની પેટા કલમ-૩ના ખંડ (આઈ) હેઠળ નાણાકીય અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા પરનાં આંતરિક નાણાકીય અંકુશો અંગેનો અહેવાલ

૩૧ માર્ચ, ૨૦૨૧ અંતિત વર્ષ માટેનાં ભારતીય હિસાબી ધોરણો મુજબનાં નાણાકીય પત્રકો અંગે કંપનીના સભ્યો સમક્ષ રજૂ કરવામાં આવેલા અમારા અહેવાલમાં ઉલ્લેખેલ જોડાણ-૩માં, અમે જણાવીએ છીએ કે ૩૧મી માર્ચ, ૨૦૨૧ના રોજ મુજબ ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ (કંપની)નાં નાણાકીય અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા પરનાં આંતરિક નાણાકીય અંકુશોનું ઓડિટ, તે તારીખે પૂરા થતા વર્ષ માટેના આ કંપનીના નાણાકીય પત્રકોના ઓડિટ સાથે કર્યું છે.

આંતરિક નાણાકીય અંકુશો માટેની વ્યવસ્થાપક મંડળની જવાબદારી :

કંપનીનું વ્યવસ્થાપક મંડળ, ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલી, નાણાકીય અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા પરનાં આંતરિક નાણાકીય અંકુશોના ઓડિટ અંગેની માર્ગદર્શક નોંધ (ગાયડન્સ નોટ)માં જણાવવામાં આવેલા આંતરિક અંકુશના આવશ્યક ઘટકોને ધ્યાનમાં રાખીને, કંપની દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા નાણાકીય અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા પરના આંતરિક અંકુશો પર આધારિત આંતરિક નાણાકીય અંકુશો સ્થાપિત કરવાની અને તેમને જાળવવાની છે. આ જવાબદારીમાં, અધિનિયમ હેઠળ જરૂરી છે તે મુજબ કંપનીની નીતિઓના અનુપાલન, તેની મિલકતોની રક્ષા, છેતરપિંડી અને ભૂલોના કિસ્સા નિવારવા અને તેમને શોધવા, હિસાબી રેકર્ડ સંપૂર્ણ અને સાચું હોય તે સુનિશ્ચિત કરવું અને વિશ્વાસપાત્ર નાણાકીય માહિતી સમયસર તૈયાર કરવા સહિત, કામકાજ વ્યવસ્થિત અને કાર્યક્ષમ રીતે થાય તે સુનિશ્ચિત કરવા માટે અસરકારક રીતે કામ કરતા પર્યાપ્ત આંતરિક નાણાકીય અંકુશો તૈયાર કરવાની, તેમનો અમલ કરવાની અને તેમને જાળવવાની છે.

ઓડિટરની જવાબદારી

અમારી જવાબદારી, અમારા ઓડિટના આધારે કંપનીના આંતરિક નાણાકીય અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા વિશે અમારો અભિપ્રાય આપવાની છે. અમે અમારું ઓડિટ, નાણાકીય અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા પરના આંતરિક નાણાકીય અંકુશો અંગેની માર્ગદર્શક નોંધ (ગાયડન્સ નોટ ઓન ઓડિટ ઓફ ઈન્ટર્નલ ફાઈનાન્સિયલ કંટ્રોલ્સ ઓવર ફાઈનાન્સિયલ રિપોર્ટીંગ) તેમ જ અધિનિયમની કલમ-૧૪૩ (૧૦) હેઠળ નિર્દિષ્ટ કરવામાં આવેલા અને આઈ.સી.એ.આઈ. દ્વારા બહાર પાડવામાં આવેલાં ઓડિટ અંગેનાં ધોરણો મુજબ, તે બન્ને આંતરિક નાણાકીય અંકુશોને જેટલા પ્રમાણમાં લાગુ પડે છે તે મુજબ કર્યું છે. ઓડિટ અંગેનાં એ ધોરણો અને ગાયડન્સ નોટની જરૂરિયાત મુજબ અમે નૈતિક આવશ્યકતાઓનું પાલન કર્યું છે અને નાણાકીય અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા ઉપર પર્યાપ્ત આંતરિક નાણાકીય અંકુશો સ્થાપિત કરવામાં અને જાળવવામાં આવ્યા હતા કે નહીં અને તમામ ભૌતિક બાબતોમાં તે અંકુશો અસરકારક રીતે કામ કરતા હતા કે નહીં તે વિશે ખાતરી થઈ શકે એ રીતે અમારું ઓડિટ કર્યું છે.

અમારા ઓડિટમાં, નાણાકીય અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા ઉપરના આંતરિક નાણાકીય અંકુશો પર્યાપ્ત છે કે નહીં તે અંગેના તેમ જ તેની અસરકારકતા અંગેના પુરાવા મેળવવા માટેની કાર્યપદ્ધતિનો સમાવેશ થાય છે. નાણાકીય અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા ઉપરના આંતરિક નાણાકીય અંકુશો અંગેના અમારા ઓડિટમાં નાણાકીય બાબતો ઉપરના આંતરિક નાણાકીય અંકુશોની સમજ પ્રાપ્ત કરવાનો, કોઈ ભૌતિક ઊણપ અસ્તિત્વ ધરાવતી હોય તો તે અંગેનું જોખમ નક્કી કરવાનો તેમ જ આવા જોખમના આધારે આંતરિક અંકુશોની રૂપરેખા તથા અસરકારકતા તપાસવાનો અને તેનું વિશ્લેષણ કરવાનો સમાવેશ થાય છે. પસંદ કરવામાં આવેલી કાર્યપદ્ધતિઓ ઓડિટરના નિર્ણય (જજમેન્ટ) પર આધાર રાખે છે. જેમાં છેતરપિંડી અથવા ભૂલને કારણે રજૂ કરવામાં આવેલાં પ્રત્યક્ષ ખોટાં નિવેદનો અને નાણાકીય પત્રકોનાં જોખમો નક્કી કરવાનો સમાવેશ થાય છે.

અમારું માનવું છે કે અમે મેળવેલા ઓડિટ પુરાવા, પૂરતા અને યોગ્ય છે તથા નાણાકીય અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા પરના કંપનીના આંતરિક નાણાકીય અંકુશો અંગેના અમારા ઓડિટ અભિપ્રાયને ઉચિત આધાર પૂરો પાડે છે.

નાણાકીય અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા ઉપરના આંતરિક નાણાકીય અંકુશોનો અર્થ

નાણાકીય અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા પર કંપનીનો આંતરિક નાણાકીય અંકુશ એ, સામાન્ય રીતે સ્વીકૃત હિસાબી સિદ્ધાંતો મુજબ, બાલ્ક હેતુઓ માટે નાણાકીય પત્રકો તૈયાર કરવાની અને તેને રજૂ કરવાની વિશ્વસનીયતા વિશે યોગ્ય ખાતરી આપવા માટે ઘડવામાં આવેલી પ્રક્રિયા છે. કોઈપણ કંપનીના નાણાકીય અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા ઉપરના આંતરિક નાણાકીય અંકુશમાં એ નીતિઓ અને કાર્યપદ્ધતિઓનો સમાવેશ થાય છે જે -

(૧) તે કંપનીની મિલકતોની લેવડદેવડોને યોગ્ય અને સાચી રીતે દર્શાવતા વિગતવાર રેકર્ડની જાળવણી સાથે સંબંધ ધરાવતી હોય.

(૨) એ બાબતની યોગ્ય ખાતરી પૂરી પાડતી હોય કે લેવડદેવડો, સામાન્ય રીતે સ્વીકૃત હિસાબી સિદ્ધાંતો મુજબ ભારતીય હિસાબી ધોરણો મુજબનાં નાણાકીય પત્રકો જે રીતે તૈયાર કરવા જરૂરી છે તે મુજબ નોંધવામાં આવી છે અને કંપનીની પ્રાપ્તિઓ અને ખર્ચાઓ, કંપનીના વ્યવસ્થાપક મંડળ તથા નિયામકોની અધિકૃતિ મુજબ જ થાય છે; અને

(૩) કંપનીનાં ભારતીય હિસાબી ધોરણો મુજબનાં નાણાકીય પત્રકો પર જેની અસર પડી શકે તેમ હોય તેવી, કંપનીની મિલકતોના અનધિકૃત સંપાદન, ઉપયોગ અથવા 'ડિપોઝીશન' નિવારવા અથવા તેને સમયસર શોધી કાઢવાની યોગ્ય ખાતરી પૂરી પાડતી હોય.

નાણાકીય અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા ઉપરના આંતરિક નાણાકીય અંકુશોની આંતરિક મર્યાદાઓ.

નાણાકીય પત્રકો તૈયાર કરવાની પ્રક્રિયા ઉપરના આંતરિક નાણાકીય અંકુશોની આંતરિક મર્યાદાઓને કારણે, ભૂલ અથવા છેતરપીંડીને પરિણામે ખોટાં નિવેદનો કરવામાં આવે અથવા તે શોધી ન શકાય એવું પણ બને. આ મર્યાદાઓમાં અયોગ્ય વ્યવસ્થાપન અથવા વ્યવસ્થાપન અંગેનાં નિયંત્રણોનું આંતરિક નાણાકીય અંકુશો સાથેના ઘર્ષણની સંભાવનાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પરિસ્થિતિઓ બદલાવાને કારણે અથવા નીતિઓ કે પદ્ધતિઓનું પાલન નબળું હોવાના કારણે પણ નાણાકીય અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા ઉપરના આંતરિક નાણાકીય અંકુશ અંગેના વિશ્લેષણનું પ્રક્ષેપણ ક્યારેક અપૂરતું સાબિત થાય છે.

અભિપ્રાય :

અમારા મતે કંપની, નાણાકીય અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા ઉપર તમામ ભૌતિક બાબતોમાં પૂરતા આંતરિક નાણાકીય અંકુશો ધરાવે છે અને આ અંકુશો, ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલી નાણાકીય અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા ઉપરના આંતરિક નાણાકીય અંકુશોના ઓડિટ અંગેની માર્ગદર્શક નોંધમાં જણાવવામાં આવેલા આંતરિક અંકુશના આવશ્યક ઘટકોને ધ્યાનમાં રાખીને કંપની દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા, નાણાકીય અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા ઉપરના આંતરિક અંકુશો પર આધારિત ૩૧મી માર્ચ, ૨૦૨૧ના રોજ મુજબ અસરકારકરીતે ચાલતા હતા.

સ્થળ: અમદાવાદ
તારીખ : ૨૯-૧૨-૨૦૨૧
યુડીઆઈએન: ૨૨૧૪૧૮૨૫એએએએડી૧૦૮૮

અનિલ એન. શાહ એન્ડ કું.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ

પેઠી નોંધણી નં. ૧૧૪૧૩૧W વતી
સહી/-
(જિજ્ઞા.એચ. શાહ)
ભાગીદાર
મેમ્બરશીપ નં. ૧૪૧૮૨૫

ગુજરાત પાવર કોર્પોરેશન લિ.
તા. ૩૧મી માર્ચ, ૨૦૨૧ના રોજ મુજબ પાકું સરવૈયું

(રકમ રૂ. માં)

વિગતો	નોંધો	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૦ના રોજ
મિલકતો			
બિન ચાલુ મિલકતો			
સંપત્તિ, પ્લાન્ટ અને સાધન સામગ્રી	૨	૩,૧૦,૧૮,૩૧,૮૭૦	૩,૩૨,૦૧,૭૨,૭૬૫
ઉત્પાદન વિકાસ મિલકત	૨	૩૮,૫૧,૮૧,૮૩૭	૪૦,૪૭,૮૮,૮૮૧
ગૌણ, સહાયક અને સંયુક્ત સાહસોમાં રોકાણ	૩	૩૪,૩૩,૭૬,૨૭૦	૩૪,૩૩,૭૬,૨૭૦
નાણાકીય મિલકતો			
રોકાણો	૪	૧,૨૮,૮૫,૦૫,૭૮૫	૭૨,૬૭,૪૦,૧૫૫
અન્ય નાણાકીય મિલકતો	૫	૧,૮૮,૨૮,૧૫૮	૧,૮૮,૨૮,૧૫૮
અન્ય બિન ચાલુ મિલકતો	૭	૪૭,૫૨,૦૧,૨૮૭	૫૫,૭૨,૩૧,૬૪૮
સરવાળો - બિન ચાલુ મિલકતો		૫,૬૨,૪૦,૨૫,૪૨૭	૫,૩૭,૧૧,૪૭,૮૮૮
ચાલુ મિલકતો			
માલ સામગ્રી	૮	૬૧,૩૫,૪૦,૦૨૫	૩૫,૭૨,૦૦,૭૬૮
નાણાકીય મિલકતો			
ધંધા સંબંધી મળવાપત્ર	૯	૭૪,૮૨,૬૮,૩૮૫	૧,૮૨,૬૪,૧૪,૭૮૮
રોકડ અને રોકડ સમાન	૧૦	૭૩,૩૪,૮૧,૪૫૩	૬૪,૨૪,૨૪૦
અન્ય બેંક સિલકો	૧૦	૭૭,૧૧,૮૨,૩૦૪	૭૧,૪૦,૫૧,૫૬૮
અન્ય નાણાકીય મિલકતો	૫	૮,૪૬,૦૫,૨૩,૬૮૧	૬,૦૨,૩૪,૬૨,૪૬૨
ચાલુ કર મિલકતો	૬	૫,૭૩,૬૭,૭૩૪	૩૩,૧૦,૭૬૫
અન્ય ચાલુ મલકતો	૭	૫૦,૨૧,૮૮,૫૮૫	૫૫,૭૦,૫૫,૧૭૮
સરવાળો - ચાલુ મિલકતો		૧૧,૮૮,૭૫,૮૩,૧૭૭	૮,૪૮,૭૮,૧૮,૭૭૮
કુલ મિલકતો..		૧૭,૫૧,૧૬,૦૮,૬૦૪	૧૪,૮૫,૯૦,૬૭,૬૬૮
ઈકિવટી અને જવાબદારીઓ			
ઈકિવટી			
ઈકિવટી શેર મૂડી	૧૧	૫,૧૩,૨૨,૫૬,૦૫૦	૫,૦૫,૦૨,૫૬,૦૫૦
અન્ય ઈકિવટી	૧૨	૭,૦૫,૨૦,૩૦,૩૮૮	૬,૦૭,૬૮,૩૧,૮૩૩
સરવાળો - ઈકિવટી		૧૨,૧૮,૪૨,૮૬,૪૩૮	૧૧,૧૨,૭૧,૮૭,૮૮૩
જવાબદારીઓ			
બિન ચાલુ જવાબદારીઓ			
નાણાકીય જવાબદારીઓ			
જોગવાઈઓ	૧૩	૧૪,૨૮,૦૩,૩૮૮	૧૩,૧૨,૫૦,૮૨૮
વિલંબિત કર જવાબદારીઓ (ચોખ્ખી)	૧૪	૪૧,૭૮,૬૧,૫૬૬	૪૨,૮૬,૬૮,૦૮૧
અન્ય બિનચાલુ જવાબદારીઓ	૧૫	૫૨,૮૨,૬૬,૬૨૧	૨૦,૬૮,૩૮,૮૦૭
સરવાળો - બિન ચાલુ જવાબદારીઓ		૧,૦૮,૮૦,૩૧,૫૮૬	૭૬,૬૭,૫૮,૮૧૭
ચાલુ જવાબદારીઓ			
નાણાકીય જવાબદારીઓ			
ધંધા સંબંધી ચુકવવાપાત્ર	૧૬	૩૨,૮૫,૮૫,૮૧૮	૮,૮૮,૨૬,૧૦૪
જોગવાઈઓ	૧૩	૬૨,૬૪,૨૧૫	૧૧,૨૧,૫૮૫
અન્ય ચાલુ જવાબદારીઓ	૧૫	૩,૮૦,૩૪,૪૦,૫૩૬	૨,૮૭,૪૧,૭૩,૧૭૮
સરવાળો - ચાલુ જવાબદારીઓ		૪,૨૩,૮૨,૮૦,૫૭૦	૨,૮૬,૫૧,૨૦,૮૬૮
સરવાળો - જવાબદારીઓ		૫,૩૨,૭૩,૨૨,૧૫૬	૩,૭૩,૧૮,૭૮,૬૮૫
સરવાળો - ઈકિવટી અને જવાબદારીઓ		૧૭,૫૧,૧૬,૦૮,૬૦૪	૧૪,૮૫,૯૦,૬૭,૬૬૮

મહત્વની હિસાબી નીતિઓ
આ સાથેની નોંધો નાણાકીય પત્રકોનો અભિન્ન ભાગ બને છે.
અમારા સમાન તારીખના અહેવાલ મુજબ

૧

અનિલ એન. શાહ એન્ડ કું.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એફ. આર. એન. નં. ૧૧૪૧૩૧W
વતી
જિજ્ઞા એચ. શાહ
ભાગીદાર સભ્ય નં. ૧૪૧૮૨૫
યુડીઆઈએન: ૨૨૧૪૧૮૨૫એએએએડી૧૦૮૮
તારીખ: ૨૯/૧૨/૨૦૨૧
સ્થળ: અમદાવાદ

મેહુલ જે. ડનાયક
ચીફ ફાઇનાન્સીયલ ઓફીસર
કૃપા એન. જોશી
કંપની સેક્રેટરી

વ્યવસ્થાપક મંડળના નામે અને તેમના વતી
(સીઆઈએન : યુ ૪૦૧૦૦ જીજે ૧૮૮૦ એસજીસી ૦૧૩૮૬૧)
મમતા વર્મા
અધ્યક્ષ
ડીઆઈએન : ૦૧૮૫૪૩૧૫
વિકલ્પ ભરદ્વાજ
મેનેજિંગ ડિરેક્ટર
ડીઆઈએન: ૦૮૩૮૬૨૨૨
તારીખ : ૨૯/૧૨/૨૦૨૧
સ્થળ : ગાંધીનગર

ગુજરાત પાવર કોર્પોરેશન લિ.

તા. ૩૧મી માર્ચ, ૨૦૨૧ના રોજ પૂરા થતાં વર્ષ માટેનું નફા અને નુકસાન ખાતુ

(રકમ રૂ. માં)

વિગતો	નોંધો	૩૧મી માર્ચ, ૨૦૨૧ અંતિત	૩૧મી માર્ચ ૨૦૨૦ અંતિત
આવક			
કામગીરીમાંથી આવક	૧૭	૨,૬૮,૮૨,૬૭,૮૮૮	૨,૨૬,૧૬,૩૮,૫૭૭
અન્ય આવક	૧૮	૩,૮૮,૮૨,૮૮૬	૨,૭૩,૮૦,૦૬૦
નાણા વ્યવસ્થામાંથી આવક	૧૯	૪૮,૩૮,૪૪,૩૫૬	૪૫,૮૨,૪૪,૦૮૧
સરવાળો - આવક (ક)		૩,૨૨,૩૦,૮૫,૨૫૦	૨,૭૪,૭૨,૭૩,૭૨૮
ખર્ચ			
બાંધકામ અને પ્લોટ્સના વિકાસ અંગેનું ખર્ચ	૨૦	-	૪,૭૭,૮૬,૨૬૬
ઉત્પાદન વિકાસ ખર્ચ	૨૧	૧,૮૮,૦૧,૨૧,૦૭૫	૧,૫૮,૪૧,૩૨,૫૫૦
કર્મચારીઓના લાભો અંગેનું ખર્ચ	૨૨	૩,૨૧,૪૨,૩૧૩	૨,૨૧,૮૩,૫૦૦
નાણા વ્યવસ્થા સંબંધી ખર્ચ	૨૩	૧૩,૩૧,૦૫,૪૦૩	૨,૮૮,૦૪,૫૧૨
ધસારા ઋણમુક્તિ અંગેનું ખર્ચ	૨	૧૩,૧૬,૧૫,૩૧૮	૧૩,૩૮,૩૦,૪૧૫
ઋણમુક્તિ અંગેનું ખર્ચ	૨	૧,૦૧,૨૬,૩૭૬	૬૧,૭૮,૨૬૮
અન્ય ખર્ચ	૨૪	૩૫,૮૧,૨૪,૨૬૦	૧૨,૫૫,૭૩,૮૮૪
સરવાળો - ખર્ચ (ખ)		૨,૬૪,૬૨,૩૪,૭૪૬	૧,૮૫,૮૭,૦૮,૫૦૭
અપવાદરૂપ બાબતો અને કરવેરા પહેલાંનો નફો/(ખોટ) (ક - ખ) અપવાદરૂપ બાબતો કરવેરા પહેલાંનો નફો (ખોટ)	૦	૫૭,૬૮,૫૦,૫૦૪	૭૮,૮૫,૬૪,૨૨૧
કરવેરા સંબંધી ખર્ચ			
ચાલુ કરવેરા		(૧૭,૬૮,૧૭,૮૭૧)	(૧૭,૪૮,૫૦,૨૪૫)
કરવેરા માટે ઓછી/વધુ જોગવાઈ		૧૬,૮૩,૮૮૪	૩૪,૮૨૦
વિલંબિત કર	૨૬	૧,૦૭,૭૪,૪૨૨	૬,૫૨,૦૮,૬૬૦
એમએટી કેડિટ એન્ટાઈટલમેન્ટ		-	(૪૨,૭૮,૩૧૮)
આ સમયગાળા માટે કરવેરા પછીનો નફો/(ખોટ) (ગ)		૪૧,૨૪,૧૦,૯૩૮	૬૭,૪૫,૮૦,૨૩૮
અન્ય સર્વગ્રાહી આવક			
નફા અને ખોટ પરત્વે જેમનું પુનઃ વગીકરણ કરવામાં નહીં આવે તેવી બાબતો			
એફવીટીઓસીઆઈ ઈકિવટી ખતોની વાજબી કિંમતમાં ફેરફાર		૫૬,૨૭,૬૫,૬૪૦	૨૨,૮૨,૩૫૩
નોકરી પછીના લાભો અંગેની જવાબદારીઓની પુનઃ ગણતરી		(૧,૧૦,૨૦૫)	(૫,૧૫,૦૬૪)
આ બાબતો અંગેનો આવકવેરો		૩૨,૦૮૨	૧,૪૮,૮૮૭
આ સમયગાળા માટેની સર્વગ્રાહી અન્ય આવક, કર બાદ કર્યા પછી (ઘ)		૫૬,૨૬,૮૭,૫૨૭	૧૮,૧૭,૨૭૬
આ સમયગાળા માટેની કુલ સર્વગ્રાહી આવક (ગ+ઘ)		૯૭,૫૦,૯૮,૪૬૬	૬૭,૬૪,૦૭,૫૧૪
આ સમયગાળા માટેનાં નફા માટે ઈકિવટી શેર દીઠ આવક (રૂ. ૧૦૦ની મૂળ કિંમતનો)	૨૫		
મૂળભૂત (રૂ.)		૮.૧૫	૧૩.૭૫
(ઘટેલી) (રૂ.)		૮.૧૫	૧૩.૭૫

મહત્વની હિસાબી નીતિઓ
આ સાથેની નોંધો નાણાકીય પત્રકોનો અભિન્ન ભાગ બને છે.
અમારા સમાન તારીખના અહેવાલ મુજબ

અનિલ એન. શાહ એન્ડ કું.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એફ. આર. એન. નં. ૧૧૪૧૩૧૫
વતી

જહા એચ. શાહ
ભાગીદાર સભ્ય નં. ૧૪૧૮૨૫
યુડીઆઈએન: ૨૨૧૪૧૮૨૫એએએએડી૧૦૮૮

તારીખ: ૨૮/૧૨/૨૦૨૧
સ્થળ: અમદાવાદ

મેહુલ જે. ડનાયક
ચીફ ફાઇનાન્સીયલ ઓફીસર

કૃપા એન. જોશી
કંપની સેક્રેટરી

વ્યવસ્થાપક મંડળના નામે અને તેમના વતી
(સીઆઈએન : યુ ૪૦૧૦૦ જીજે ૧૮૮૦ એસજીસી ૦૧૩૮૬૧)

મમતા વર્મા
અધ્યક્ષ
ડીઆઈએન : ૦૧૮૫૪૩૧૫

વિકલ્પ ભરદ્વાજ
મેનેજિંગ ડિરેક્ટર
ડીઆઈએન: ૦૮૩૮૬૨૨૨

તારીખ : ૨૮/૧૨/૨૦૨૧
સ્થળ : ગાંધીનગર

ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ

તા. ૩૧મી માર્ચ, ૨૦૨૧ના રોજ પૂરા થતા વર્ષનું કેશફલો પત્રક

વિગત	૩૧મી માર્ચ, ૨૦૨૧ અંતિત	૩૧મી માર્ચ ૨૦૨૦ અંતિત
સંચાલન પ્રવૃત્તિઓમાંથી રોકડ પ્રવાહ		
નફા અને નુકસાન પત્રક મુજબ કરવેરા પહેલાંનો ચોખ્ખો નફો	૫૭,૬૮,૫૦,૫૦૪	૭૮,૮૫,૬૪,૨૨૧
નીચેના માટે સમાયોજન :		
ધસારો, ઋણમુક્તિ, ધટાડો અને નુકસાન	૧૪,૧૭,૪૧,૬૮૫	૧૪,૦૧,૦૮,૬૮૪
કર્મચારી લાભોની પુનઃ ગણતરી	(૧,૧૦,૨૦૫)	(૫,૧૫,૦૬૪)
નાણાવ્યવસ્થા અંગેનું ખર્ચ	૧૩,૩૧,૦૫,૪૦૩	૨,૮૮,૦૪,૫૧૨
મિલકતોનાં વેચાણ અંગેની ખોટ	૮,૮૨,૭૪,૮૩૨	૪૬૭
ડિવિડન્ડની આવક	(૧,૬૧,૦૦,૦૧૮)	(૧,૫૭,૬૬,૮૫૮)
ઈન્ટર કોર્પોરેટ ડિપોઝીટમાંથી વ્યાજ	(૪૮,૩૮,૪૪,૩૫૬)	(૪૫,૮૨,૪૪,૦૮૧)
કરવેરાની ઓછી/વધુ જોગવાઈ	૧૬,૮૩,૮૮૪	૩૪,૮૨૦
કાર્યકારી મૂડીમાં ફેરફાર પહેલાં ચાલુ નફો	૪૩,૧૬,૨૧,૮૩૮	૪૮,૩૦,૮૬,૬૮૧
કાર્યકારી મૂડીમાં ફેરફારો માટેનું સમાયોજન		
માલસામગ્રી	(૨૫,૬૩,૩૮,૨૫૬)	૧,૫૭,૪૫,૦૬૬
ધંધાસંબંધી મળવાપાત્ર	૧,૦૭,૭૧,૪૬,૪૧૩	(૮૧,૩૩,૮૩,૨૦૧)
અન્ય નાણાકીય મિલકતો	(૨,૪૩,૭૦,૬૧,૨૧૮)	(૩૮,૭૦,૭૦,૫૩૨)
અન્ય ચાલુ મિલકતો	૭,૦૧,૮૭,૭૮૭	૨૫,૮૦,૮૬,૧૦૭
જોગવાઈઓ	૧,૬૭,૮૫,૧૦૦	(૭,૦૦,૨૭,૮૨૧)
અન્ય ચાલુ જવાબદારીઓ	૧,૦૨,૮૨,૬૭,૩૫૭	૨૪,૫૬,૮૭,૨૧૬
ધંધાસંબંધી ચુકવવાપાત્ર	૨૩,૮૭,૫૮,૭૧૫	(૧૩,૫૧,૮૬,૮૩૧)
અન્ય બેંક બેલેન્સ	(૫,૭૧,૪૦,૭૩૬)	(૧૫,૪૬,૩૮,૧૪૩)
કામગીરીમાંથી ઊભી થયેલી રોકડ	૧૧,૩૨,૩૭,૦૦૮	(૫૫,૭૬,૮૨,૬૪૭)
કરવેરા (ચુકવેલા) / રિફંડ	(૧૫,૭૭,૨૩,૧૮૭)	(૪,૨૩,૦૮,૭૫૩)
સંચાલન પ્રવૃત્તિઓમાંથી ચોખ્ખો રોકડ પ્રવાહ (ક)	(૪,૪૪,૮૬,૧૭૮)	(૬૦,૦૦,૦૧,૪૦૦)
રોકાણ પ્રવૃત્તિઓમાંથી રોકડ પ્રવાહ		
સ્થાયી મિલકતોની ખરીદી	(૨૧,૬૧,૨૭૮)	(૭,૩૮,૬૨૦)
લાંબા ગાળાનાં રોકાણો પર ડિવિડન્ડ	૧,૬૧,૦૦,૦૧૮	૧,૫૭,૬૬,૮૫૮
ઈન્ટરકોર્પોરેટ ડિપોઝીટમાંથી વ્યાજ	૪૮,૧૮,૨૨,૮૦૭	૪૫,૦૮,૧૧,૮૩૪
અન્ય બિન-ચાલુ મિલકતો	૫૪,૬૭,૮૩૪	(૧૦,૮૧,૫૨,૬૪૫)
સ્થાયી મિલકતોનું વેચાણ	૨,૪૮૮	૮,૦૦૨
રોકાણનું વેચાણ	-	૧૦
રોકાણ પ્રવૃત્તિઓમાંથી ચોખ્ખો રોકડ પ્રવાહ (ખ)	૫૦,૧૨,૩૧,૮૮૦	૩૫,૬૭,૮૪,૬૪૦
નાણા આપવાની પ્રવૃત્તિઓમાંથી રોકડ પ્રવાહ		
ઈકિવટી શેર્સ ઈસ્યુ કરવાથી ઊપજ (આવક)	૮,૨૦,૦૦,૦૦૦	૨૮,૬૧,૩૩,૦૦૦
શેરની ફાળવણી બાકી હોય એવા શેર અરજ નાણાં	-	(૧૬,૨૮,૦૦,૦૦૦)

નાણા વ્યવસ્થા અંગેનું ખર્ચ	(૧,૧૭,૧૩,૮૭૪)	(૧,૦૬,૧૬,૨૮૧)
અનુદાન પર વ્યાજ	(૧૨,૧૩,૮૧,૪૨૮)	(૧,૮૨,૮૮,૨૩૧)
બિન ચાલુ જવાબદારીની પ્રાપ્તિ/ (પરત ચુકવણી)	૩૨,૧૪,૨૬,૮૧૪	૬,૫૪,૭૫,૬૬૧
નાણા વ્યવસ્થા અંગેની પ્રવૃત્તિઓમાંથી ચોખ્ખો રોકડ પ્રવાહ (ગ)	૨૭,૦૩,૨૧,૪૧૨	૧૬,૮૮,૦૪,૧૪૮
રોકડ અને રોકડ સમાનમાં ચોખ્ખો વધારો/(ઘટાડો) (ઘ) (ક + ખ + ગ)	૭૨,૭૦,૬૭,૨૧૪	(૭,૩૩,૦૨,૬૧૨)
વર્ષની શરૂઆતમાં રોકડ અને રોકડ સમાન		
હાથ પરની રોકડ	૩૬,૪૨૪	૧૦,૪૨૦
બેંક બેલેન્સ	૬૩,૮૭,૮૧૬	૭,૮૭,૧૬,૪૩૩
વર્ષના અંતે રોકડ અને રોકડ સમાન	૬૪,૨૪,૨૪૦	૭,૮૭,૨૬,૮૫૪
હાથ પરની રોકડ	૫૧,૧૦૧	૩૬,૪૨૪
બેંક બેલેન્સ	૭૩,૩૪,૪૦,૩૫૨	૬૩,૮૭,૮૧૬
	૭૩,૩૪,૮૧,૪૫૩	૬૪,૨૪,૨૪૦

અનિલ એન. શાહ એન્ડ કું.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એફ. આર. એન. નં. ૧૧૪૧૩૧W
વતી
જીજ્ઞા એચ. શાહ
ભાગીદાર સભ્ય નં. ૧૪૧૮૨૫
યુડીઆઈએન: ૨૨૧૪૧૮૨૫એએએડી૧૦૮૮
તારીખ: ૨૮/૧૨/૨૦૨૧
સ્થળ: અમદાવાદ

મેહુલ જે. ડનાયક
ચીફ ફાઇનાન્સીયલ ઓફીસર
કૃપા એન. જોશી
કંપની સેક્રેટરી

વ્યવસ્થાપક મંડળના નામે અને તેમના વતી
(સીઆઈએન : યુ ૪૦૧૦૦ જીજે ૧૮૮૦ એસજીસી ૦૧૩૮૬૧)
મમતા વર્મા
અધ્યક્ષ
ડીઆઈએન : ૦૧૮૫૪૩૧૫
વિકલ્પ ભરદ્વાજ
મેનેજિંગ ડિરેક્ટર
ડીઆઈએન: ૦૮૩૮૬૨૨૨
તારીખ : ૨૮/૧૨/૨૦૨૧
સ્થળ : ગાંધીનગર

ગુજરાત પાવર કોર્પોરેશન લિ.
૩૧મી માર્ચ, ૨૦૨૧ અંતિત સમયગાળા માટે ઇકિવટીમાં ફેરફાર અંગેનું પત્રક

ક. ઇકિવટી શેરમૂડી

વિગત	શેરની સંખ્યા	રકમ
ઇસ્યુ થયેલ, સબસ્ક્રાઇબ થયેલ અને ભરપાઈ થયેલ શેરમૂડી રૂ. ૧૦૦નો એક એવા પૂરેપૂરી ભરપાઈ થયેલા ઇકિવટી શેર્સ		
૩૧મી માર્ચ, ૨૦૧૮ના રોજ	૪,૪૦,૪૧,૨૩૮	૪,૪૦,૪૧,૨૩,૦૫૦
ઇકિવટી શેર મૂડીમાં ફેરફારો	૩૫,૦૦,૦૦૦	૩૫,૦૦,૦૦,૦૦૦
૩૧મી માર્ચ, ૨૦૧૯ના રોજ	૪,૭૫,૪૧,૨૩૮	૪,૭૫,૪૧,૨૩,૦૫૦
ઇકિવટી શેર મૂડીમાં ફેરફારો	૨૮,૬૧,૩૩૦	૨૮,૬૧,૩૩,૦૦૦
૩૧મી માર્ચ, ૨૦૨૦ના રોજ	૫,૦૫,૦૨,૫૬૮	૫,૦૫,૦૨,૫૬,૦૫૦
ઇકિવટી શેર મૂડીમાં ફેરફારો	૮,૨૦,૦૦૦	૮,૨૦,૦૦,૦૦૦
૩૧મી માર્ચ, ૨૦૨૧ના રોજ મુજબ	૫,૧૩,૨૨,૫૬૮	૫,૧૩,૨૨,૫૬,૦૫૦

ખ. અન્ય ઇકિવટી

(રકમ રૂ. માં)

વિગત	અનામત અને પુરાંત			શેરની ફાળવણી બાકી હોય એવાં નાણાં	અન્ય સર્વગ્રાહી આવક થકી ઇકિવટી આવક	કુલ ઇકિવટી
	મૂડી અનામત	સામાન્ય અનામત	જાળવી રાખેલ આવક			
૧લી એપ્રિલ, ૨૦૧૮ના રોજ બેલેન્સ	-	૩૭,૭૫,૮૮૦	૫,૩૪,૬૧,૮૨,૮૬૭	૫,૦૦,૦૦,૦૦૦	૫૭,૫૫,૩૦,૦૨૮	૫,૮૭,૫૪,૮૮,૮૮૫
અન્ય હિસાબનીતિમાં ફેરફારો/ અગાઉના સમયગાળાની ભૂલો	-	-	-	-	-	-
અહેવાલના સમયગાળાના આરંભે પુનઃ જણાવવામાં આવેલી સિલક	-	૩૭,૭૫,૮૮૦	૫,૩૪,૬૧,૮૨,૮૬૭	૫,૦૦,૦૦,૦૦૦	૫૭,૫૫,૩૦,૦૨૮	૫,૮૭,૫૪,૮૮,૮૮૫
વર્ષ માટેનો નફો	-	-	(૩૭,૫૩,૨૮,૬૪૨)	-	-	(૩૭,૫૩,૨૮,૬૪૨)
વર્ષ માટેની અન્ય સર્વગ્રાહી આવક	-	-	-	-	(૧૪,૮૭,૨૪,૮૨૩)	(૧૪,૮૭,૨૪,૮૨૩)
વર્ષ માટેની કુલ સર્વગ્રાહી આવક	-	૩૭,૭૫,૮૮૦	૪,૯૭,૦૮,૫૩,૩૨૫	૫,૦૦,૦૦,૦૦૦	૪૨,૫૮,૦૫,૧૦૫	૫,૪૫,૦૪,૩૪,૪૨૦
ઇકિવટી શેર્સ ઇસ્યુ કર્યા	-	-	-	(૫,૦૦,૦૦,૦૦૦)	-	(૫,૦૦,૦૦,૦૦૦)
વર્ષ દરમિયાન વપરાશ	-	-	-	-	-	-
શેર ફાળવણી અંગેની આવક	-	-	-	૧૬,૨૮,૦૦,૦૦૦	-	૧૬,૨૮,૦૦,૦૦૦
૩૧મી માર્ચ, ૨૦૧૯ ના રોજ સિલક	-	૩૭,૭૫,૮૮૦	૪,૯૭,૦૮,૫૩,૩૨૫	૧૬,૨૮,૦૦,૦૦૦	૪૨,૫૮,૦૫,૧૦૫	૫,૫૬,૩૨,૩૪,૪૨૦
અહેવાલના સમયગાળાના આરંભે પુનઃ જણાવવામાં આવેલી સિલક	-	૩૭,૭૫,૮૮૦	૪,૯૭,૦૮,૫૩,૩૨૫	૧૬,૨૮,૦૦,૦૦૦	૪૨,૫૮,૦૫,૧૦૫	૫,૫૬,૩૨,૩૪,૪૨૦
વર્ષ માટેનો નફો	-	-	૬૭,૪૫,૮૦,૨૩૮	-	-	૬૭,૪૫,૮૦,૨૩૮
વર્ષ માટેની અન્ય સર્વગ્રાહી આવક	-	-	-	-	૧૮,૧૭,૨૭૬	૧૮,૧૭,૨૭૬
વર્ષ માટેની કુલ સર્વગ્રાહી આવક	-	૩૭,૭૫,૮૮૦	૫,૬૪,૫૪,૩૩,૫૬૩	૧૬,૨૮,૦૦,૦૦૦	૪૨,૭૭,૨૨,૩૮૦	૬,૨૩,૮૭,૩૧,૬૩૩
ઉમેરો: શેર મૂડી પેટે ફાળો	-	-	-	૧૩,૩૩,૩૩,૦૦૦	-	૧૩,૩૩,૩૩,૦૦૦
ઇકિવટી શેર્સ ઇસ્યુ કર્યા	-	-	-	(૨૮,૬૧,૩૩,૦૦૦)	-	(૨૮,૬૧,૩૩,૦૦૦)
વર્ષ દરમિયાન વપરાશ	-	-	-	-	-	-
૩૧મી માર્ચ, ૨૦૨૦ના રોજ બેલેન્સ	-	૩૭,૭૫,૮૮૦	૫,૬૪,૫૪,૩૩,૫૬૩	-	૪૨,૭૭,૨૨,૩૮૦	૬,૦૭,૬૬,૩૧,૬૩૩
અહેવાલના સમયગાળાના આરંભે પુનઃ જણાવવામાં આવેલી સિલક	-	૩૭,૭૫,૮૮૦	૫,૬૪,૫૪,૩૩,૫૬૩	-	૪૨,૭૭,૨૨,૩૮૦	૬,૦૭,૬૬,૩૧,૬૩૩
વર્ષ માટેનો નફો	-	-	૪૧,૨૪,૧૦,૮૩૮	-	-	૪૧,૨૪,૧૦,૮૩૮

વર્ષ માટેની અન્ય સર્વગ્રાહી આવક	-	-	-	૫૬,૨૬,૮૭,૫૨૭	૫૬,૨૬,૮૭,૫૨૭
વર્ષ માટેની કુલ સર્વગ્રાહી આવક	-	૩૭,૭૫,૯૯૦	૬,૦૫,૭૮,૪૪,૫૦૨	૯૯,૦૪,૦૯,૯૦૭	૭,૦૫,૨૦,૩૦,૩૯૯
ઉમેરો: શેર મૂડી પેટે ફાળો				૮,૨૦,૦૦,૦૦૦	૮,૨૦,૦૦,૦૦૦
ઈકિવટી શેર્સ ઈસ્યુ કર્યા	-	-	-	(૮,૨૦,૦૦,૦૦૦)	(૮,૨૦,૦૦,૦૦૦)
વર્ષ દરમિયાન વપરાશ				-	-
૩૧મી માર્ચ, ૨૦૨૧ના રોજ બેલેન્સ	-	૩૭,૭૫,૯૯૦	૬,૦૫,૭૮,૪૪,૫૦૨	૯૯,૦૪,૦૯,૯૦૭	૭,૦૫,૨૦,૩૦,૩૯૯

અનિલ એન. શાહ એન્ડ કું.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એન્ડ આર. એન. નં. ૧૧૪૧૩૧૧૫
વતી
જીજ્ઞા એચ. શાહ
ભાગીદાર સભ્ય નં. ૧૪૧૮૨૫
યુડીઆઈએન: ૨૨૧૪૧૮૨૫એએએડી૧૦૮૯
તારીખ: ૨૮/૧૨/૨૦૨૧
સ્થળ: અમદાવાદ

મેહુલ જે. ડનાયક
ચીફ ફાઇનાન્સીયલ ઓફીસર
કૃપા એન. જોશી
કંપની સેક્રેટરી

વ્યવસ્થાપક મંડળના નામે અને તેમના વતી
(સીઆઈએન : યુ ૪૦૧૦૦ જીજે ૧૯૯૦ એસજીસી ૦૧૩૯૬૧)
મમતા વર્મા
અધ્યક્ષ
ડીઆઈએન : ૦૧૮૫૪૩૧૫
વિકલ્પ ભરદ્વાજ
મેનેજિંગ ડિરેક્ટર
ડીઆઈએન: ૦૯૩૯૬૨૨૨
તારીખ : ૨૮/૧૨/૨૦૨૧
સ્થળ : ગાંધીનગર

ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ
૩૧મી માર્ચ, ૨૦૨૧ અંતિત વર્ષ માટેના નાણાકીય પત્રકો અંગેની નોંધો

૧. મહત્વની હિસાબી નીતિઓ અને પદ્ધતિઓ અંગે નિવેદન
ક. સામાન્ય માહિતી

આ નાણાકીય પત્રકોમાં ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ (કંપની) જે કંપની અધિનિયમ, ૨૦૧૩ હેઠળ રચાયેલી એક સરકારી કંપની છે, તેનાં નાણાકીય પત્રકોનો સમાવેશ થાય છે.

આ કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ છઠ્ઠો માળ, બ્લોક નં. ૬ અને ૮, ઉદ્યોગ ભવન, સેક્ટર-૧૧, ગાંધીનગર-૧૧ ખાતે આવેલી છે. આ કંપની વીજ ઉત્પાદનની કામગીરી કરે છે અને તેને સોલાર પાર્કના વિકાસ માટે ગુજરાત સરકારે નોડલ એજન્સી તરીકે પદનામિત કરી છે.

ખ. મહત્વની હિસાબી નીતિઓ

ખ.૧ ભારતીય હિસાબી ધોરણોના અનુપાલન અંગેનું પત્રક

આ સ્ટેન્ડઅલોન નાણાકીય પત્રકો કંપની અધિનિયમ-૨૦૧૩ની સંબંધિત જોગવાઈઓ હેઠળ જાહેર કરવામાં આવેલા નિયમો સહિત, તે અધિનિયમની કલમ -૧૩૩ હેઠળ નિર્દિષ્ટ કરવામાં આવેલાં ભારતીય હિસાબી ધોરણો મુજબ તૈયાર કરવામાં આવ્યાં છે.

ખ.૨ ઐતિહાસિક ખર્ચ- પરંપરા

નીચેની બાબતો કે જેમાં વાજબી કિંમતો સંબંધિત ભારતીય હિસાબી ધોરણોની આવશ્યકતા મુજબ તૈયાર કરવામાં આવી છે તે સિવાય આ નાણાકીય પત્રકો ભારતમાં સામાન્ય રીતે સ્વીકૃત હિસાબી સિદ્ધાંતો તેમજ કંપની અધિનિયમ, ૨૦૧૩ની સંબંધિત જોગવાઈઓ અને તે હેઠળ નિર્દિષ્ટ કરવામાં આવેલાં ભારતીય હિસાબી ધોરણો મુજબ તૈયાર કરવામાં આવે છે.

- વાજબી કિંમતે આપવામાં આવેલી કેટલીક નાણાકીય મિલકતો અને જવાબદારીઓ .

- નિર્ધારિત લાભ સંબંધી યોજનાઓ - વાજબી કિંમતે માપવામાં આવેલી યોજનાઓ અગાઉના સમયગાળાની / અગાઉથી ચુકવેલ બાબતો : વ્યવસ્થાપક મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલી અગાઉના સમયગાળાની બાબતો સંબંધિત હિસાબી સમયગાળાઓને પુનઃ જણાવીને પશ્ચાતવતી અસરથી હિસાબે લેવામાં આવે છે.

ખ.૩ અંદાજો અને નિર્ણયો (જજમેન્ટ્સ)નો ઉપયોગ

આ નાણાકીય પત્રકો ભારતીય હિસાબી ધોરણો મુજબ તૈયાર કરવા અને રજૂ કરવામાં આવ્યાં છે. ભારતીય હિસાબી ધોરણો મુજબ વ્યવસ્થાપક મંડળે અંદાજો અને ધારણાઓ બાંધવા અને નિર્ણયો લેવા જરૂરી છે. જેની અસર અહેવાલમાં જણાવવામાં આવેલી મિલકતો અને જવાબદારીઓ, આવક અને ખર્ચ તેમજ આકસ્મિક જવાબદારીઓની જાહેર કરવામાં આવેલી રકમો પર પડે છે. આ અંદાજો અને ધારણાઓ, નાણાકીય પત્રકો તૈયાર કરવાની તારીખે સંબંધિત હકીકતો અને સંજોગોના વ્યવસ્થાપક મંડળે કરેલા વિશ્લેષણ પર આધારિત છે.

અંદાજો અને ધારણાઓની નિરંતર ધોરણે સમીક્ષા કરવામાં આવે છે. હિસાબી અંદાજોનું પુનર્વિલોકન ધારણાના આધારે હિસાબે લેવામાં આવે છે. આ નીતિ એ બાબતોનું વિહંગાવલોકન પૂરું પાડે છે જેમાં નિર્ણયો કરવાના હોય છે અને જેમાં મૂળ આકારણી કરતાં અંદાજો અને ધારણાઓ જુદાં પડવાના કારણે બાબતોનું પ્રત્યક્ષ સમાયોજન કરવાની સંભાવના રહે છે. આવા દરેક અંદાજો અને નિર્ણયોની વિગતવાર માહિતીનો સમાવેશ, નાણાકીય પત્રકોમાં અસર પામેલી સંબંધિત બાબત અંગેની ગણતરી વિશેની માહિતી સાથે સંબંધિત નોંધોમાં પરિણામવાનું નોંધપાત્ર જોખમ ધરાવતી ધારણાઓ, અંદાજો અને અનિશ્ચિતતાઓ વિશેની માહિતીઓ નીચેની નોંધોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. - ચાલુ/વિલંબિત કર જવાબદારીઓ - જોગવાઈઓ અને આકસ્મિક જવાબદારીઓ - રોકાણોની યોગ્ય કિંમત નક્કી કરવી.

યોગ્ય કિંમતોની માપણી અંગેના સિદ્ધાંતો મહત્વની હિસાબી નીતિઓની નોંધ-(ત)માં આપવામાં આવેલ/ આવી છે.

ખ.૪ ચાલુ વિરુદ્ધ બિન-ચાલુ વગીકરણ

કંપની ભારતીય હિસાબી ધોરણોનું પાલન કરતી, કંપની અધિનિયમ, ૨૦૧૩ની અનુસૂચિ-૩ની આવશ્યકતાઓ મુજબ, ચાલુ/બિન ચાલુ વગીકરણના આધારે પાકા સરવૈયામાં મિલકતો અને જવાબદારીઓ દર્શાવે છે.

ગ. કરજસંબંધી ખર્ચ

પાત્ર (કવોલીફાઈંગ) મિલકતોના સંપાદન અથવા બાંધકામ દરમિયાન મેળવવાના કરજ અંગેનું ખર્ચ, મિલકતોના ખર્ચના ભાગ તરીકે મૂડીકૃત કરવામાં આવે છે. પાત્ર મિલકત એ એવી મિલકત છે જે તેના ઈચ્છિત ઉપયોગ માટે તૈયાર થવામાં ઘણો સમય લે છે. કરજસંબંધી અન્ય તમામ ખર્ચ મહેસૂલ ખર્ચ ખાતે ઉધારવામાં આવે છે.

ઘ. સંપત્તિ, પ્લાન્ટ અને સાધન સામગ્રી

સંપત્તિ, પ્લાન્ટ અને સાધનસામગ્રીની તમામ બાબતો સંપાદન/ બાંધકામના ઐતિહાસિક ખર્ચ (વસૂલાતપાત્ર કરવેરા પછીના ચોખ્ખા)માંથી સંચિત ઘસારો

અને નુકસાનની રકમ બાદ કરીને દર્શાવવામાં આવે છે.

ઐતિહાસિક ખર્ચમાં સંપાદન સાથે પ્રત્યક્ષરીતે જોડાયેલું હોય એવાં ખર્ચનો તેમજ બાંધકામ/ વસ્તુઓના ઈન્સ્ટોલેશન (ગોઠવણી)ના ખર્ચનો સમાવેશ થાય છે. પાછળથી થનાર ખર્ચને મિલકતની ચાલુ રકમમાં ત્યારે જ ઉમેરવામાં અથવા એક અલગ મિલકત તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે. જ્યારે તે બાબત જોડાયેલ ભાવિ આર્થિક લાભો કંપનીને મળવાની સંભાવના હોય અને તે બાબતનું ખર્ચ વિશ્વસનીય રીતે માપી શકાય તેમ હોય. અન્ય તમામ મારામત અને નિભાવનું ખર્ચ, તે જે દરમિયાન કરવામાં આવ્યું હોય તે અહેવાલના સમયગાળાના નફા અને નુકસાન ખાતામાં ઉધારવામાં આવે છે. મિલકતોના પ્રારંભિક સંપાદન બાદ પુનર્વસન અને પુનઃસ્થાપન અંગે કરવામાં આવેલું ખર્ચ, સંબંધિત વર્ષના નફા અને નુકસાન ખાતે ઉધારવામાં આવે છે.

ભારતીય હિસાબી ધોરણોમાં સંક્રાંતિ

ભારતીય હિસાબી ધોરણોમાં સંક્રાંતિ થતાં કંપનીએ, અગાઉના જીએએપી દ્વારા માપવામાં આવેલાં, ૧ એપ્રિલ, ૨૦૧૫ના રોજ ધ્યાનમાં લેવામાં આવેલાં, ચાલુ મૂડીકામો સહિતનાં તમામ સંપત્તિ, પ્લાન્ટ અને સાધન સામગ્રીની ચાલુ કિંમત સાથે આગળ વધવાનું અને તે ચાલુ કિંમતને સંપત્તિ, પ્લાન્ટ અને સાધન સામગ્રીની માની લીધેલી કિંમત તરીકે ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું છે.

કોઈ મિલકતોનો ઉપયોગ કર્યા બાદ ‘ડિકમીશનીંગ’ કરવા માટેના અપેક્ષિત ખર્ચની વર્તમાન કિંમત, જોગવાઈને ધ્યાનમાં લેવાના માપદંડો સંતોષતા હોય તો, સંબંધિત મિલકતના ખર્ચમાં સામેલ કરવામાં આવે છે.

ચાલુ મૂડી કામોમાં, જે હજુ કાર્યરત બનાવવાની છે એવી મિલકતોના સંપાદન/ બાંધકામને લગતા સીધા ખર્ચનો સમાવેશ થાય છે.

મિલકત, પ્લાન્ટ અથવા સાધનસામગ્રીની કોઈ બાબત, સંબંધિત મિલકતનો નિકાલ કરવામાં આવે ત્યારે અથવા તેના ચાલુ ઉપયોગમાંથી કોઈ ભાવિ આર્થિક લાભ મળવાની અપેક્ષા ન રહે ત્યારે ધ્યાને (હિસાબમાં) લેવાનું બંધ કરવામાં આવે છે. મિલકત, પ્લાન્ટ અને સાધન સામગ્રીની કોઈપણ બાબત નફા અને નુકસાનના પત્રકમાં ધ્યાને લેવામાં આવે છે.

મિલકત, પ્લાન્ટ અને ઈક્વિપમેન્ટનો ઘસારો, કંપની અધિનિયમ, ૨૦૧૩ને કંપનીની બાબતોના વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સંબંધિત પરિપત્રો સાથે વાંચતા, તેમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ પૂરો પાડવામાં આવે છે. ઘસારા માટે અપનાવવામાં આવેલી પદ્ધતિ સ્ટ્રેઈટ લાઈન મેથડ (SLM) છે. વર્ષ દરમિયાન સંપાદિત/ નિકાલ કરવામાં આવેલી મિલકતો અંગેનો ઘસારો ભાગે પડતા ધોરણે પૂરો પાડવામાં આવે છે.

મિલકતોની અંદાજિત ઉપયોગી આવરદા નીચે મુજબ છે.

વિગતો	ઉપયોગી આવરદા
૧. મકાન	૩ થી ૬૦ વર્ષ
૨. પ્લાન્ટ અને મશીનરી	૫ થી ૪૦ વર્ષ
૩. વિન્ડમીલ	૨૨ વર્ષ
૪. સોલાર પાર્ક	૨૫ વર્ષ
૫. ફર્નિચર અને જડાણો	૮ થી ૧૦ વર્ષ
૬. વાહનો	૮ વર્ષ
૭. કોમ્પ્યુટર	૩ વર્ષ
૮. કચેરી સાધન સામગ્રી	૫ થી ૩૫ વર્ષ

ઉત્પન્ન વિકાસ મિલકત

ઉત્પન્ન વિકાસ મિલકતમાં સામાન્ય રીતે લિગ્નાઈટની ખાણો માટેના પ્રારંભિક ખર્ચ અને ભવિષ્યમાં તે કામગીરી બંધ કરવા માટેના અંદાજિત ખર્ચનો સમાવેશ થાય છે. ઉત્પન્ન કામગીરી બંધ કરવામાં સામાન્ય રીતે સ્થળને પૂર્વવત બનાવવાનો સમાવેશ થાય છે. ઉત્પન્ન કામગીરી બંધ કરવા અંગેની જોગવાઈ જ્યારે કંપનીના શીરે ખાણોને પૂર્વવત બનાવવાની, સુવિધાઓ ડિસમેન્ટલ અથવા દૂર કરવાની અથવા કોઈ મિલકત અથવા પ્લાન્ટ અને સાધનસામગ્રીની કોઈ ચીજવસ્તુ દૂર કરવાની અને તે જ્યાં આવેલી હોય તે સ્થળને પૂર્વવત બનાવવાની કાનૂની અથવા સર્જનાત્મક જવાબદારી હોય ત્યારે ધ્યાનમાં લેવામાં આવે છે.

આ તબક્કે, કંપનીએ જેમનો પરામર્શ કર્યો છે તે ઉત્પન્ન નિષ્ણાતોના મતે ઉત્પન્ન કામગીરી બંધ કરવાની જવાબદારીનો અંદાજ કાઢવો શક્ય નથી અને તેથી એવું નક્કી કરવામાં આવે છે કે “ઓવર બર્ડન” દૂર કરવાની પ્રક્રિયા, જ્યારે તેનો વાજબી અંદાજ કાઢવાનું શક્ય હશે ત્યારે ઉત્પન્ન વિકાસ મિલકતનો ભાગ બનશે.

ઉત્પન્ન વિકાસ મિલકત સામાન્ય રીતે વર્ષ દરમિયાન ખરેખર કાઢવામાં આવેલા લિગ્નાઈટના જથ્થાના આધારે અથવા વાર્ષિક ધોરણે નક્કી કરેલા જથ્થાના આધારે ઋણમુક્ત કરવામાં આવે છે. આમ છતાં, ઋણમુક્તિની પદ્ધતિ અંગે એકવાર ખરીદનાર અને વેચનાર વચ્ચે એકવાર સંમતિ સધાય પછી ખાણની આવરદાના સમયગાળાપર્યંત તે નિરંતર ધોરણે લાગુ પાડવામાં આવે છે.

ચ. અમૂર્ત મિલકતો

અમૂર્ત મિલકતો (કોઈ કરવસૂલ કરવાનો હોય તો તે વસૂલ કર્યા બાદ ચોખ્ખા) ખર્ચ, પ્રારંભિક ઓળખ થયેથી માપવામાં આવે છે. ત્યારબાદ, અમૂર્ત મિલકતો ખર્ચમાંથી સંચિત ઋણમુક્તિ અને નુકસાની બાદ કરીને હિસાબે લેવામાં આવે છે.

છ. સરકારી અનુદાનો

સરકારના અનુદાનોને, તે મળવાની યોગ્ય ખાતરી હોય અને કંપની તેની સાથે જોડાયેલી તમામ શરતો પૂરી કરશે એવી ખાતરી હોય ત્યારે તેની વાજબી કિંમતે ધ્યાનમાં લેવામાં આવે છે.

આવકને લગતા સરકારી અનુદાનો તરત ધ્યાનમાં લેવામાં આવતાં નથી. પરંતુ તેના થકી જે ખર્ચ કરવાનો ઈરાદો હોય તે ખર્ચ કરવા માટે જરૂરી સમયગાળા દરમિયાન નફા અને નુકસાન ખાતે ધ્યાનમાં લેવામાં આવે છે અને અન્ય આવકની અંદર રજૂ કરવામાં આવે છે.

સંપત્તિ, પ્લાન્ટ અને સાધનસામગ્રી અથવા રોકાણ સંબંધી સંપત્તિની ખરીદી અથવા બાંધકામની બાબતોનાં અનુદાનોને વિલંબિત આવક તરીકે બિન-નાણાકીય જવાબદારીઓ તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે અને સંબંધિત મિલકતોની અપેક્ષિત આવરદાપર્યંત સુરેખ (સીધી લીટીના) ધોરણે નફા અને નુકસાન ખાતે જમા લેવામાં આવે છે અને અન્ય આવકોની અંદર રજૂ કરવામાં આવે છે.

મહેસૂલ સહાયકીના સ્વરૂપમાં નાણાકીય સહાય સંબંધિત ખર્ચમાંથી બાદ કરવામાં આવે છે. શરતી ધોરણે આપવામાં આવેલાં સરકારી અનુદાનો સંબંધિત ખર્ચ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે અને હજુ કરવાનાં બાકી હોય એવાં કામો/ કામના ભાગો માટે ઉપયોગમાં લેવા માટે ખાતામાં બાકી રહેલી સિલક અન્ય ચાલુ જવાબદારી તરીકે દર્શાવવામાં આવે છે.

જ. બિન-નાણાકીય મિલકતોની નુકસાની (ઈમ્પેરમેન્ટ)

કોઈપણ મિલકતની ચાલુ કિંમત (કાર્યરત રાખવાની કિંમત) તેની વસૂલાતપાત્ર કિંમત કરતા વધી જાય ત્યારે તેને નુકસાની મિલકત તરીકે ગણવામાં આવે છે. આવી નુકસાની અંગેની ખોટ, તે મિલકતને જે વર્ષે નુકસાની મિલકત તરીકે પારખવામાં આવે તે વર્ષે નફા અને નુકસાન ખાતે ઉધારવામાં આવે છે. વસૂલાતપાત્ર રકમના અંદાજમાં ફેરફાર હોય તો, અગાઉના હિસાબી સમયગાળામાં ધ્યાનમાં લેવામાં આવેલી નુકસાની સંબંધી ખોટ ઉલટાવવામાં (‘રિવર્સ’ કરવામાં) આવે છે. અમૂર્ત મિલકતોની નુકસાની સાયમિક ધોરણે ચકાસવામાં આવશે.

ઝ. પટાઓ

કોઈ વ્યવસ્થા, તે પટો છે. (અથવા તેમાં પટાનો સમાવેશ થાય છે) કે નહીં તે બાબત, પટાની શરૂઆતના સમયે તે વ્યવસ્થાના તથ્યોના આધારે નક્કી થાય છે. કોઈ ચોક્કસ મિલકત અથવા મિલકતોનો ઉપયોગ કોઈ વ્યવસ્થા પર આધારિત હોય અને તે વ્યવસ્થામાં સ્પષ્ટ રીતે કોઈ અધિકાર નિર્દિષ્ટ કરવામાં ન આવ્યો હોવા છતાં તે વ્યવસ્થા સંતોષવાથી તે મિલકત અથવા મિલકતોનો ઉપયોગ કરવાનો અધિકાર દર્શાવતી (સૂચવતી) હોય તો તે વ્યવસ્થા એ પટો છે. (અથવા તેમાં પટાનો સમાવેશ થાય છે.)

પટાનો હિસાબ

કોર્પોરેટ બાબતોના મંત્રાલયે, કંપનીઝ (ઈન્ડિયન એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડઝ) એમેન્ડમેન્ટ રૂલ્સ ૨૦૧૮ અને કંપનીઝ (ઈન્ડિયન એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડઝ) સેકન્ડ એમેન્ડમેન્ટ રૂલ્સ થકી હાલના ભારતીય હિસાબી ધોરણ ૧૭ “ભાડાપટાઓ” અને તેના અન્ય અર્થઘટનોના સ્થાને ભારતીય હિસાબી ધોરણ ૧૧૬ “ભાડાપટાઓ” નિર્દિષ્ટ કર્યું છે. ભારતીય હિસાબી ધોરણ ૧૧૬ “પટે આપનાર અને પટે લેનાર બંને માટે ભાડાપટાની સ્વીકૃતિ, માપણી, રજૂઆત અને જાહેરાત અંગેના સિદ્ધાંતો નિર્ધારિત કરે છે. તે ભાડાપટાઓ માટે એકલ, સરવૈયા ઉપરનું હિસાબી મોડલ પ્રસ્તુત કરે છે.

આ નવા ધોરણને અપનાવવાને પરિણામે કંપની, શરૂઆતની અરજીની તારીખથી ૧૨ મહિનાથી ઓછી ભાડાપટાની મુદત બાકી રહી હોય એવા ભાડાપટા સિવાયના તમામ અગાઉથી ચાલતાં ભાડાપટાના સંબંધમાં મિલકતના ઉપયોગના અધિકાર અને ભાડાપટા સંબંધિત અન્ય જવાબદારી ધ્યાનમાં લેતી થઈ છે.

આ કંપનીએ પહેલી એપ્રિલ ૨૦૧૮થી પશ્ચાદ્વતી ધોરણે, સુધારેલો અભિગમ અપનાવીને ભારતીય હિસાબી ધોરણ ૧૧૬ અપનાવ્યું છે અને ૨૦૧૮ના અહેવાલના સમયગાળા માટેની તુલનાત્મક બાબતો પુનઃ દર્શાવી નથી. કંપનીએ શરૂઆતની અરજીની તારીખના રોજ મુજબ, ભારિત સરેરાશ વધતા કરજ દરનો ઉપયોગ કરીને ડિસ્કાઉન્ટ કરવામાં આવેલી ભાડાપટાની બાકીની ચુકવણીને હાલની કિંમતે ભાડાપટાની જવાબદારીની માપણી કરી છે અને મિલકતની વપરાશના અધિકારની માપણી, ભાડાપટાની જવાબદારી જેટલી રકમના દરે કરવામાં આવી છે, જેનું સમાયોજન, શરૂઆતની અરજીની તારીખની તરત પહેલાના સરવૈયામાં ધ્યાનમાં લેવામાં આવેલા, તે ભાડાપટાના સંબંધમાં અગાઉથી કરવામાં આવેલી અથવા ભાડાપટાની ઉપાર્જિત ચૂકવણીઓની રકમ થી કરવામાં આવ્યું છે.

પટે લેનાર તરીકે કંપની

કંપની એ ધ્યાનમાં લે છે કે કોઈ કોન્ટ્રાક્ટ ભાડાપટો છે કે તેમાં ભાડાપટાનો સમાવેશ થાય છે. ભાડાપટાની વ્યાખ્યા “કોઈ અવેજના બદલામાં અમુક સમયગાળા માટે સંબંધિત મિલકતનો ઉપયોગ કરવા માટેનો અધિકાર આપતો કરાર અથવા કરાર નો કોઈ ભાગ” કરવામાં આવે છે. આ વ્યાખ્યા લાગુ

પાડવા માટે કંપની એ વાતનું મૂલ્યાંકન કરે છે કે કરાર ત્રણ મુખ્ય બાબતો સંતોષે છે કે કેમ, આ બાબતો છે:

- કરારમાં કોઈ નિશ્ચિત મિલકતનો સમાવેશ થાય છે કે કેમ, જે કરારમાં સ્પષ્ટ રીતે નિર્ધારિત કરવામાં આવી હોય અથવા કંપનીને તે મિલકત ઉપલબ્ધ બનાવવામાં આવે ત્યારે તેનો ઉલ્લેખ કરીને તેને પરોક્ષ રીતે નિર્દિષ્ટ કરવામાં આવી હોય.
- કંપની કરારની નિર્ધારિત સંભાવનાની અંદર રહીને તેના અધિકારોને ધ્યાનમાં લેતા, ઉપયોગના સમગ્ર સમયગાળા દરમિયાન, નિર્ધારિત કરવામાં આવેલી મિલકતના ઉપયોગમાંથી તમામ આર્થિક લાભો મહદંશે પ્રાપ્ત કરવાનો અધિકાર ધરાવે છે કે કેમ.
- વપરાશના સમગ્ર સમયગાળા દરમિયાન, નિર્ધારિત કરવામાં આવેલી મિલકતનો ઉપયોગ કરવાનો નિર્દેશ કરવાનો અધિકાર કંપની ધરાવે છે કે કેમ. કંપની એ વાતનું મૂલ્યાંકન કરે છે કે ઉપયોગના સમગ્ર સમયગાળા દરમિયાન તે મિલકત “કેવી રીતે અને કયા હેતુ માટે વાપરવી” તેનો નિર્દેશ કરવાનો અધિકાર કંપની ધરાવે છે કે કેમ.

માપણી અને સ્વીકૃતિ

ભાડાપટના પ્રારંભની તારીખે, કંપની મિલકતો અને જવાબદારીઓના પત્રકમાં મિલકતનો ઉપયોગ કરવાના અધિકાર અને ભાડાપટની જવાબદારી ધ્યાનમાં લે છે. મિલકતનો ઉપયોગ કરવાના અધિકારની માપણી પડતર કિંમતે કરવામાં આવે છે જેમાં આ જવાબદારીનું પ્રારંભિક માપ, કંપની દ્વારા કરવામાં આવેલું કોઈ પ્રારંભિક પ્રત્યક્ષ ખર્ચ, ભાડાપટો પૂર્ણ થયેથી મિલકત ઉતારી લેવા અને દૂર કરવા માટે કરવાના કોઈ ખર્ચનો અંદાજ અને ભાડાપટના પ્રારંભની તારીખ પહેલાં કરવામાં આવેલી ભાડાપટ અંગેની કોઈ ચુકવણી (પ્રાપ્ત થયેલા કોઈપણ પ્રોત્સાહનોને બાદ કરતા ચોખ્ખી)નો સમાવેશ થાય છે.

કંપની ભાડાપટના પ્રારંભની તારીખથી લઈને મિલકતના ઉપયોગના અધિકારના ઉપયોગની આવરદાના અંત અથવા ભાડાપટની મુદતના અંત, એ બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી, મિલકતનો ઉપયોગ કરવાના અધિકાર (રાઈટ ઓફ યુસ એસેટ્સ)નો સીધી રેખાના ધોરણે ઘસારો ગણે છે. જ્યારે પણ મિલકતનો ઉપયોગ કરવાના અધિકાર સંબંધે કોઈ નુકસાન થયું હોવાનો સંકેત મળ્યો હોય ત્યારે કંપની તેની આકારણી પણ કરે છે.

પ્રારંભની તારીખે કંપની ભાડાપટની જવાબદારીની ગણતરી, તે તારીખે વણચૂકવાયેલી ભાડાપટની ચુકવણીઓની વર્તમાન કિંમતે કરે છે જે, ભાડાપટમાં વ્યાજદર પરોક્ષ રીતે સામેલ હોય અને તે તત્કાલ ઉપલબ્ધ હોય તો, તે દર અથવા કંપનીના કરજ લેવા માટેના રેટનો ઉપયોગ કરીને ડિસ્કાઉન્ટ કરવામાં આવેલી હોય છે. પ્રારંભિક ગણતરી બાદ જવાબદારી, કરવામાં આવેલી ચૂકવણીના સંદર્ભમાં ઘટતી જશે અને વ્યાજના સંદર્ભમાં વધતી જશે. કોઈપણ પુનઃ મૂલ્યાંકન કે ફેરફાર દર્શાવવા, અથવા વાસ્તવમાં કોઈ

નિયત ચૂકવણીમાં ફેરફાર થયો હોય તો તે દર્શાવવા માટે તેની ગણતરી કરવામાં આવે છે.

પટની જવાબદારીની પુનઃમાપણી કરવામાં આવે ત્યારે, તેને સુસંગત સમાયોજન ઉપયોગ કરવાના અધિકારમાં દર્શાવવામાં આવે છે, અથવા ઉપયોગ કરવાનો અધિકાર ઘટીને શૂન્ય બની ચૂક્યો હોય તો, નફા અને નુકસાનમાં દર્શાવવામાં આવે છે.

વ્યવહારુ રીતે અનુકૂળ બાબતોનો ઉપયોગ કરીને, કંપનીએ ટૂંકાગાળાની અને નીચા મૂલ્યવાળી મિલકતો હિસાબે લેવાનું પસંદ કર્યું છે. મિલકત વાપરવાનો અધિકાર અને પોતાની જવાબદારી ધ્યાને લેવાને બદલે, આ અંગેની ચુકવણી, પટની મુદત દરમિયાન સીધી રેખાના ધોરણે નફા અથવા નુકસાનમાં ખર્ચ તરીકે ધ્યાને લેવામાં આવી છે.

પટે આપનાર તરીકે કંપની

ભાડાપટના ઉદભવ વખતે આ જૂથ તેના દરેક પટને કાર્યરત પટ તરીકે અથવા નાણાકીય પટ તરીકે વર્ગીકૃત કરે છે. કંપની કાર્યરત પટ લેઈને પ્રાપ્ત થયેલી ચૂકવણીઓને, પટની મુદત દરમિયાન સીધી રેખાના ધોરણે આવક તરીકે ધ્યાનમાં લે છે. નાણાકીય પટના કિસ્સામાં, નાણાં વ્યવસ્થાસંબંધી આવક મુદત દરમિયાન, પટે આપનારે પટમાં કરેલા ચોખ્ખા રોકાણ ઉપરના મળતરના અચળ સામયિક દર દર્શાવતી પેટર્નના આધારે ધ્યાનમાં લેવામાં આવે છે. કંપની જ્યારે પટે આપનાર તરીકે વચેટિયા તરીકે હોય ત્યારે તે મુખ્ય પટમાં અને ગૌણ પટમાં તેના વ્યાજને અલગ-અલગ ધ્યાનમાં લે છે. તે ગૌણ પટના પટ વર્ગીકરણને મુખ્ય પટમાંથી ઊભા થતા, મિલકતને વાપરવાના સંદર્ભમાં, નહીં કે નિર્ધારિત મિલકતના સંદર્ભમાં, આકારે છે. મુખ્ય પટો ટૂંકી મુદતનો પટો હોય, જેને જૂથ ઉપર જણાવેલ મુક્તિ લાગુ પાડતું હોય તો, આવા ગૌણ પટને તે કાર્યરત પટ તરીકે વર્ગીકૃત કરે છે.

૨. વેચાણ અને બંધ કરવામાં આવેલી કામગીરીઓ માટે ધારણ કરવામાં આવેલી બિન-ચાલુ મિલકતો

બિન-ચાલુ મિલકતોની ચાલુ રકમ, તેનો ઉપયોગ ચાલુ રાખીને વસૂલ કરવાને બદલે વેચાણ કરીને વસૂલ કરવાની હશે અને વેચાણની સંભાવના વધુ હશે તો તેને વેચાણ માટે ધારણ કરવામાં આવેલી મિલકત તરીકે વર્ગીકૃત કરવામાં આવશે. તેની માપણી તેમની ચાલુ કિંમત અને વાજબી કિંમતમાંથી વેચાણ સંબંધી ખર્ચ બાદ કર્યા બાદની કિંમત, એ બે માંથી જે ઓછી હોય તે કિંમતે કરવામાં આવે છે, સિવાય કે આ આવશ્યકતામાંથી જેમને ખાસ મુક્તિ આપવામાં આવી હોય એવી મિલકતો હોય જેમકે વિલંબિત કર સંબંધી મિલકતો, કર્મચારીઓના લાભોમાંથી ઊભી થતી મિલકતો, નાણાકીય મિલકતો અને વીમા કરારો હેઠળના કરારગત અધિકારો.

બિન-ચાલુ મિલકતોને વેચાણ માટે ધારણ કરી રાખવામાં આવી હોય ત્યારે તેમના પર ઘસારો અથવા ઋણમુક્તિ પૂરાં પાડવામાં આવતાં નથી. વેચાણ માટે ધારણ કરી રાખવામાં આવેલી બિન-ચાલુ મિલકતોને પાકા સરવૈયામાં અન્ય મિલકતોથી અલગ રીતે રજૂ કરવામાં આવે છે.

બંધ કરવામાં આવેલી કામગીરી એ કંપનીનો એવો ઘટક છે, જેને નિકાલ કરેલી અથવા વેચાણ માટે ધારણ કરી રાખવામાં આવેલી મિલકત તરીકે વર્ગીકૃત કરવામાં આવેલી હોય અને જે અલગ પ્રકારનો મહત્વનો ઘંધો અથવા કામગીરીનો ભૌગોલિક વિસ્તાર દર્શાવતો હોય અને તે ઘટક આવા મુખ્ય

ઘંધા અથવા કામગીરીનો નિકાલ કરવા માટેની એકલ સંકલિત યોજનાનો ભાગ છે અથવા પુનઃવેચાણ (રીસેલ) કરવાના લક્ષ સાથે ખાસ રીતે સંપાદિત કરવામાં આવેલ ગૌણ શાખા (સબસીડીયરી) છે. બંધ કરવામાં આવેલી કામગીરીઓનાં પરિણામો નફા અને નુકસાન ખાતમાં અલગ રીતે રજૂ કરવામાં આવે છે.

૬. નાણાકીય ખતો

નાણાકીય ખત એટલે કોઈપણ કરાર એક સંસ્થા (એન્ટીટી) માટે નાણાકીય મિલકત ઊભી કરતો હોય અને બીજી સંસ્થા માટે નાણાકીય જવાબદારી અથવા ઈકિવટી ખત ઊભું કરતો હોય.

૭. નાણાકીય મિલકતો

પ્રારંભિક ઓળખ

કંપની નાણાકીય ખતની કરારગત જોગવાઈઓનું પાલન કરવા માટે પક્ષકાર બને ત્યારે પાકા સરવૈયામાં નાણાકીય મિલકત ધ્યાનમાં લેવામાં આવે છે.

પ્રારંભિક માપણી

પ્રારંભિક ઓળખ વખતે કંપની (વાજબી કિંમતે માપવામાં ન આવેલી) નાણાકીય મિલકતની માપણી તેની વાજબી કિંમતમાં, તે નાણાકીય મિલકત સંપાદિત અથવા ઈસ્યુ કરવા માટે થયેલા પ્રત્યક્ષ લેવડ-દેવડ ખર્ચને ઉમેરી અથવા બાદ કરીને નફા અથવા નુકસાન થકી કરે છે.

પાછળથી કરવામાં આવતી માપણી

પાછળથી કરવામાં આવતી માપણી માટે નાણાકીય મિલકતોનું નીચે મુજબ વર્ગીકરણ કરવામાં આવે છે.

- ક. ઋણમુક્તિની કિંમતે માપવામાં આવેલી નાણાકીય મિલકતો;
- ખ. નફા અને નુકસાન થકી વાજબી કિંમતે માપવામાં આવેલી નાણાકીય મિલકતો (એફવીટીપીએલ); અને
- ગ. અન્ય સર્વગ્રાહી આવક થકી વાજબી કિંમતે માપવામાં આવેલી નાણાકીય મિલકતો.

કંપની તેની નાણાકીય મિલકતોને નીચેના આધારે ઉપર જણાવેલા વર્ગીકૃત કરે છે :

- ક. નાણાકીય મિલકતોનું વ્યવસ્થાપન કરવા માટેનું કંપનીનું બિઝનેસ મોડેલ; અને
- ખ. નાણાકીય મિલકતોની કરારગત રોકડ પ્રવાહલક્ષી લાક્ષણિકતાઓ.

નીચેની બંને શરતો સંતોષાતી હોય તો નાણાકીય મિલકતની માપણી ઋણમુક્ત કરવામાં આવેલી કિંમતે કરવામાં આવે છે.

- ક. નાણાકીય મિલકત ઘંધાના એવા મોડેલની અંદર ધારણ કરવામાં આવી હોય જેનો ઉદ્દેશ્ય કરારગત રોકડ પ્રવાહ એકમ કરવા માટે નાણાકીય મિલકત ધારણ કરવાનો હોય; અને
- ખ. નાણાકીય મિલકતની કરાર સંબંધી શરતો નિર્દિષ્ટ તારીખોએ એવો રોકડ પ્રવાહ ઊભો કરતા હોય જે બાકી મુદ્દલ રકમ અને તેના પરના વ્યાજની જ ચુકવણીઓ હોય.

નાણાકીય મિલકત અથવા નાણાકીય જવાબદારીની ઋણમુક્ત કરવામાં આવેલી કિંમત એટલે પ્રારંભિક ઓળખ વખતે નાણાકીય મિલકત અથવા નાણાકીય જવાબદારીની માપણી જે દરે કરવામાં આવે છે તે રકમમાંથી મુખ્ય ચુકવણીઓને બાદ કરીને, પ્રારંભિક રકમ અને પાકતી (મેચ્યુરીટી) રકમ તથા નાણાકીય મિલકતો માટે કોઈ ખોટ સંબંધે કરવામાં આવેલા સમાયોજન વચ્ચેના તફાવતની અસરકારક વ્યાજ-દર પદ્ધતિનો ઉપયોગ કરીને સંચિત ઋણમુક્તિનો ઉમેરો અથવા બાદબાકી કરતાં મળતી રકમ.

પાછળથી નાણાકીય મિલકતોની માપણી, અસરકારક વ્યાજ-દર પદ્ધતિનો ઉપયોગ કરીને, ઋણમુક્ત કરેલી કિંમતે માપવામાં આવે છે. ઋણમુક્ત કરેલી કિંમત, અસરકારક વ્યાજ-દરના અભિન્ન ભાગ રૂપ એવા, સંપાદન અંગેના કોઈપણ વળતર (ડિસ્કાઉન્ટ) અથવા પ્રિમિયમ અને ફી તથા ખર્ચોને ધ્યાનમાં લઈને ગણવામાં આવે છે. અસરકારક વ્યાજદરની ઋણમુક્તિનો નફા અને નુકસાનમાં નાણાકીય આવકમાં સમાવેશ કરવામાં આવે છે. નુકસાનમાંથી થતી ખોટ નફા અથવા નુકસાનમાં ધ્યાને લેવામાં આવે છે. નીચેની બંને શરતો સંતોષાતી હોય તો નાણાકીય મિલકતની માપણી અન્ય સર્વગ્રાહી આવક થકી વાજબી કિંમતે ફેરવામાં આવે છે.

- ક. નાણાકીય મિલકતો ઘંધાના એવા મોડેલની અંદર ધારણ કરવામાં આવી હોય જેનો હેતુ કરારગત રોકડ પ્રવાહ એકત્ર કરીને અને નાણાકીય મિલકતો વેચીને હાંસલ કરવામાં આવતો હોય; અને
- ખ. મિલકતનો કરારગત રોકડપ્રવાહ એસપીપીઆઈ દર્શાવતો હોય.

નાણાકીય મિલકત નફા અને નુકસાન થકી વાજબી કિંમતે માપવામાં આવે છે, સિવાય કે તે અન્ય સર્વગ્રાહી આવક થકી, ઋણમુક્ત કરવામાં આવેલી કિંમતે અથવા વાજબી કિંમતે માપવામાં આવતી હોય. વધુમાં, કંપની અન્યથા ઋણમુક્ત કરવામાં આવેલી કિંમત અથવા એફવીઓસીઆઈ ધોરણો સંતોષતી હોય એવી નાણાકીય મિલકતને એફવીટીપીઆઈ તરીકે પદનામિત કરી શકે છે. આમ છતાં, આનું કરવાથી માપણી સંબંધી વિસંગતતાઓ અથવા ઓળખ સંબંધી વિસંગતતાઓ (જેને હિસાબી વિસંગતતા (એકાઉન્ટિંગ મીસમેચ તરીકે ઓળખવામાં આવે છે) ઘટતી અથવા દૂર થતી હોય તો જ આવી પસંદગી કરવાની છૂટ છે.

ઘંધા સંબંધી મળવાપાત્ર

ઘંધા સંબંધી મળવાપાત્ર રકમો શરૂઆતમાં વાજબી કિંમતે અને ત્યારબાદ ઋણમુક્ત કરવામાં આવેલી કિંમતમાંથી નુકસાનીની જોગવાઈ બાદ કરીને ધ્યાને લેવામાં આવે છે.

ઈકિવટી ખતો

ભારતીય હિસાબી ધોરણોના વ્યાપમાં આવતા તમામ ઈકિવટી ખતો વાજબી કિંમતે માપવામાં આવે છે. ટ્રેડિંગ (ઘંધા) માટે ધારણ કરવામાં આવેલા ઈકિવટી ખતોને એફ.વી.ટી.પી.એલ. તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. અન્ય તમામ ઈકિવટી ખતો માટે કંપની, વાજબી કિંમતમાં પાછળથી થતા ફેરફારો અન્ય સર્વગ્રાહી આવકમાં દર્શાવવાની કાયમી પસંદગી કરી શકે છે. કંપની આવી પસંદગી પ્રત્યેક ખતના ધોરણે કરે છે. આ વર્ગીકરણ પ્રાથમિક ઓળખ વખતે કરવામાં આવે છે અને તેમાં ફેરફાર કરી શકાતો નથી. જો કંપની તેના કોઈ ઈકિવટી ખતને એફ.વી.ઓ.સી.આઈ. તરીકે વર્ગીકૃત કરવાનું નક્કી કરે તો રિવિડંડ સિવાયની તમામ વાજબી કિંમતોના ફેરફારોને અન્ય સર્વગ્રાહી આવકમાં ધ્યાને લેવામાં આવે છે. રોકાણોનું વેચાણ કરવામાં આવે ત્યારે એકત્રિત નફો અથવા નુકસાન અન્ય સર્વગ્રાહી આવકમાં ધ્યાને લેવામાં આવે છે અને તે રકમને નફા અથવા નુકસાન ખતે પુનઃવર્ગીકૃત કરવામાં આવતી નથી. એફ.વી.ટી.પી.એલ. કક્ષાની મર્યાદામાં સામેલ કરવામાં આવેલા ઈકિવટી ખતોની માપણી, નફા અને નુકસાનમાં ધ્યાને લેવામાં આવેલા તમામ ફેરફારો સાથે વાજબી કિંમતે કરવામાં આવે છે.

કંપનીએ તેના ઈકિવટી ખતો એફ.વી.ઓ.સી.આઈ. થકી માપવાનું પસંદ કર્યું છે.

ડીરેક્ટગનીશન (સરવૈયામાંથી દૂર કરવું)

કોઈપણ નાણાકીય મિલકતને (અથવા લાગુ પડતું હોય ત્યાં નાણાકીય મિલકતના ભાગને અથવા નાણાકીય મિલકતોના જૂથ અથવા સમાન પ્રકારની નાણાકીય મિલકતોને) નીચેના સંજોગોમાં “ડિરેક્ટગનાઈઝ” (એટલે કે કંપનીના પાકા સરવૈયામાંથી દૂર) કરવામાં આવે છે.

- ક. નાણાકીય મિલકતોમાંથી કરારગત રોકડ પ્રવાહ મળવાનું બંધ થયું હોય;
- ખ. કંપનીએ તે મિલકતમાંથી રોકડ પ્રવાહ મેળવવાના અધિકારો ત્રીજા પક્ષને તબદીલ કર્યા હોય અથવા મેળવેલા રોકડ પ્રવાહને કોઈ પ્રત્યક્ષ વિલંબ વિના, “પાસ-થ્રુ” વ્યવસ્થા હેઠળ સંપૂર્ણરિતે કોઈ ત્રીજા પક્ષને ચૂકવવાની જવાબદારી ધારણ કરી હોય; અને
- (૧) કંપનીએ મિલકતનાં તમામ જોખમો અને પુરસ્કારો મહદંશે તબદીલ કર્યા હોય; અથવા
- (૨) કંપનીએ મિલકતનાં તમામ જોખમો અને પુરસ્કારો તબદીલ પણ ન કર્યા હોય અને જાળવી પણ ન રાખ્યા હોય પરંતુ મિલકતનું નિયંત્રણ તબદીલ કર્યું હોય.

કંપનીએ જ્યારે મિલકતમાંથી રોકડ પ્રવાહ મેળવવાના તેના અધિકારો તબદીલ કર્યા હોય અથવા “પાસ-થ્રુ”ની વ્યવસ્થા કરી હોય ત્યારે તે, માલિકીનાં જોખમો અને પુરસ્કારો જાળવી રાખવા માંગે છે કે કેમ અને જો જાળવી રાખવા માંગતી હોય તો કેટલા પ્રમાણમાં જાળવી રાખવા માંગે છે તે બાબતનું કંપની વિશ્લેષણ કરે છે. કંપનીએ મિલકતના તમામ જોખમો અને પુરસ્કારો તબદીલ પણ ન કર્યા હોય અને જાળવી પણ ન રાખ્યા હોય કે મિલકતનું નિયંત્રણ પણ તબદીલ ન કર્યું હોય ત્યારે તે મિલકત સાથે કંપની જેટલા પ્રમાણમાં જોડાયેલી રહી હોય તેટલા પ્રમાણમાં તે તબદીલ કરેલી મિલકતને ધ્યાનમાં લેવાનું ચાલુ રાખે છે. તેવા કિસ્સામાં કંપની સહયોગી જવાબદારીને પણ ધ્યાને લે છે. તબદીલ કરેલી મિલકત અને સહયોગી જવાબદારી, કંપનીએ જાળવી રાખેલા અધિકારો અને જવાબદારીઓ દર્શાવે તેવી રીતે માપવામાં આવે છે.

તબદીલ કરવામાં આવેલી મિલકત પર બાંધધરીનું સ્વરૂપ ધારણ કરતું કંપનીનું ચાલુ રહેલું જોડાણ, તે મિલકતની મૂળ ચાલુ રકમ અને કંપનીએ પરત ચૂકવવો જરૂરી હોય તેવા અવેજની મહત્તમ રકમમાંથી જે ઓછું હોય તે દરે માપવામાં આવે છે.

નાણાકીય મિલકતોની નુકસાની

કંપની નીચેનાના અપેક્ષિત ધિરાણ-ખોટ મોડેલના આધારે મિલકતોની નુકસાનીની માપણી કરે છે.

- ક. ઋણમુક્ત કિંમતે માપવામાં આવેલી નાણાકીય મિલકતો.
- ખ. અન્ય સર્વગ્રાહી આવક થકી વાજબી કિંમતે માપવામાં આવેલી નાણાકીય મિલકતો
અપેક્ષિત ધિરાણ-ખોટ નીચેના જેટલી રકમના દરે ખોટ-સ્વીકાર થકી માપવામાં આવે છે :
- ક. દર મહિનાના અપેક્ષિત ધિરાણ ખોટ (અહેવાલની તારીખ પછીના ૧૨ મહિનાની અંદર સંભવિત હોય તેવા નાણાકીય ખતો પર ડિફોલ્ટની ઘટનાઓના પરિણામે ઊભા થતા અપેક્ષિત ધિરાણ ખોટ); અથવા
- ખ. પૂરા સમયના અપેક્ષિત ધિરાણ ખોટ (નાણાકીય ખતની આવરદા પર્યંત સંભવિત તમામ ડિફોલ્ટની ઘટનાઓના પરિણામે ઊભા થતા અપેક્ષિત ધિરાણ ખોટ). ઘંધા સંબંધી મળવાપાત્ર રકમો પર નુકસાની ખોટ સ્વીકાર ધ્યાનમાં લેવા માટે કંપની “સરળ અભિગમ”ને અનુસરે છે. તે દરેક અહેવાલની તારીખે, નાણાકીય ખતની સમગ્ર આવરદા માટેના અપેક્ષિત ધિરાણ-ખોટના આધારે નુકસાની-ખોટ સ્વીકારને, સરવૈયામાં તેના પ્રારંભથી ધ્યાનમાં લે છે. પ્રત્યેક અહેવાલની તારીખે, ઐતિહાસિક રીતે જોવા મળેલા ડિફોલ્ટ દરો અપડેટ કરવામાં આવે છે અને આગામી અંદાજોમાં થયેલા ફેરફારોનું પૃથક્કરણ કરવામાં આવે છે.

અન્ય નાણાકીય મિલકતો અંગેની નુકસાની ખોટ અને જોખમોની સંભાવના ધ્યાનમાં લેવા માટે કંપની, ધિરાણ સંબંધી જોખમ પ્રથમવાર ધ્યાનમાં લેવામાં આવ્યું ત્યારથી તેમાં નોંધપાત્ર વધારો થયો છે કે કેમ એ નક્કી કરે છે. ધિરાણ સંબંધી જોખમમાં નોંધપાત્ર વધારો થયો ન હોય તો, નુકસાની ખોટ પૂરી પાડવા માટે ૧૨

મહિનાની અપેક્ષિત ધિરાણ-ખોટ ઉપયોગમાં લેવામાં આવે છે. આમ છતાં ધિરાણ સંબંધી જોખમમાં નોંધપાત્ર વધારો થયો હોય તો આવરદા પર્યંતની ધિરાણ-ખોટનો ઉપયોગ કરવામાં આવે છે. પાછળના સમયગાળામાં નાણાકીય ખતના સંદર્ભમાં મળવાપાત્ર રકમોની ચુકવણીઓમાં એટલો સુધારો થાય કે ધિરાણ સંબંધી જોખમને પ્રથમવાર ધ્યાનમાં લેવામાં આવ્યું હોય તે પછી તેમાં કોઈ નોંધપાત્ર વધારો થતો ન હોય તો કંપની નુકસાની ખોટ-સ્વીકાર પુનઃ ૧૨ મહિનાની અપેક્ષિત ધિરાણ-ખોટના આધારે ધ્યાનમાં લેવાનું શરૂ કરે છે.

આ સમયગાળા દરમિયાન ધ્યાનમાં લેવામાં આવેલ અપેક્ષિત ધિરાણ-ખોટ, નુકસાની ખોટ સ્વીકાર (અથવા તેનું ‘રિવર્સલ’) એ નફા અને નુકસાન પત્રકમાં આવક/ખર્ચ તરીકે ધ્યાનમાં લેવામાં આવેલ છે. જુદાં જુદાં નાણાકીય ખતો માટે પાકા સરવૈયામાં કરવામાં આવેલું પ્રસ્તુતીકરણ નીચે વર્ણવવામાં આવ્યું છે.

- ક. ઋણમુક્ત કિંમતે માપવામાં આવેલ નાણાકીય મિલકતો અને મળવાપાત્ર કરારગત આવક-અપેક્ષિત ધિરાણ-ખોટને સ્વીકૃતી તરીકે એટલે કે તે મિલકતોની માપણીના એક અભિન્ન ભાગ તરીકે પાકા સરવૈયામાં દર્શાવવામાં આવી છે. આ સ્વીકૃતીને કારણે ચોખ્ખી ચાલુ રકમમાં ઘટાડો થાય છે. મિલકત તેને માંડવાળ કરવા માટેનાં ધોરણો ન સંતોષે ત્યાં સુધી કંપની તેની એકંદર ચાલુ રકમમાંથી નુકસાની-સ્વીકારની રકમ ઘટાડતી નથી.
- ખ. એફવીઓસીઆઈના દરે માપવામાં આવેલી નાણાકીય મિલકતો - નાણાકીય મિલકતોને વ્યાજબી કિંમતે જ દર્શાવાઈ હોવાથી તેની કિંમતમાંથી નુકસાની સ્વીકારની રકમ વધુ ઘટાડવામાં આવી નથી. અપેક્ષિત ધિરાણ-ખોટની રકમ અન્ય સર્વગ્રાહી આવકમાં સંચિત નુકસાનીની રકમ તરીકે દર્શાવવામાં આવી છે.

ધિરાણ સંબંધી જોખમ અને નુકસાની ખોટમાં થયેલો વધારો આકારવા માટે કંપની, ધિરાણ સંબંધી જોખમમાં થયેલો નોંધપાત્ર વધારો સમયસર જાણી શકાય તે તેવું પૃથક્કરણ કરવાના હેતુથી, નાણાકીય ખતોનું સંયોજન “શોર્ડ કેડિટ-રીસ્ક કેરેક્ટરીસ્ટીક્સ”ના આધારે કરે છે.

નાણાકીય જવાબદારીઓ

પ્રારંભિક ઓળખ અને માપણી

તમામ નાણાકીય જવાબદારીઓ પ્રારંભમાં વાજબી કિંમતે ધ્યાનમાં લેવામાં આવે છે અને લોન, કરજ અને ચુકવવાપાત્ર રકમોના કિસ્સામાં તે પ્રત્યક્ષ લેવડ દેવડ ખર્ચને બાદ કરીને ચોખ્ખી દર્શાવવામાં આવે છે.

પાછળથી તમામ નાણાકીય જવાબદારીઓ નફા અને નુકસાન પત્રક થકી, ઋણમુક્ત કિંમતે અથવા વાજબી કિંમતે માપવામાં આવે છે. કંપનીની નાણાકીય જવાબદારીઓમાં ઘંધા સંબંધી તેમજ અન્ય ચુકવવાપાત્ર રકમો, બેંક ઓવરડ્રાફ્ટ સહિત લોન અને કરજનો સમાવેશ થાય છે.

પાછળથી કરવામાં આવતી માપણી

- ક. ઋણમુક્ત કિંમતે માપવામાં આવતી નાણાકીય જવાબદારીઓ.
- ખ. પાછળથી નફા અને નુકસાન થકી વાજબી કિંમતે માપવામાં આવતી નાણાકીય જવાબદારીઓ.

નફા અને નુકસાન થકી વાજબી કિંમતે માપવામાં આવતી નાણાકીય જવાબદારીઓમાં, નફા અને નુકસાન થકી વાજબી કિંમતે પ્રારંભિક ઓળખ કરવામાં આવ્યેથી પદનામિત કરવામાં આવેલી નાણાકીય જવાબદારીઓ તેમ જ ઘંધા માટે ધારણ કરવામાં આવેલી નાણાકીય જવાબદારીઓનો સમાવેશ થાય છે. નજીકની મુદતમાં જેની પુનઃ ખરીદી કરવાના હેતુથી જે ઊભી કરવામાં આવી હોય તેવી નાણાકીય જવાબદારીઓને ઘંધા માટે ધારણ કરેલી નાણાકીય જવાબદારીઓ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. ઘંધા માટે ધારણ કરી રાખવામાં આવેલી નાણાકીય જવાબદારીઓ અંગેનો નફો અથવા ખોટ નફા અને નુકસાન ખાતે ધ્યાનમાં લેવામાં આવે છે.

નફા અને નુકસાન થકી વાજબી કિંમતે પ્રારંભિક ઓળખ કરવામાં આવ્યેથી પદનામિત કરવામાં આવેલી નાણાકીય જવાબદારીઓને પાકા સરવૈયામાં તેને પ્રથમવાર ધ્યાનમાં લેવામાં ત્યારે અને ભારતીય હિસાબી ધોરણ ૧૦૮નાં માપદંડો સંતોષતા હોય ત્યારે જ એ રીતે ધ્યાનમાં લેવામાં આવે છે. એફવીટીપીએલ તરીકે પદનામિત કરવામાં આવેલી નાણાકીય જવાબદારીઓ માટે, પોતાના જ ધિરાણ સંબંધી જોખમમાં ફેરફાર થવાને કારણે વાજબી કિંમતમાં થતા નફા/નુકસાનને અન્ય સર્વગ્રાહી આવકમાં ધ્યાને લેવામાં આવે છે. આ નફા/નુકસાનને પાછળથી નફા અને નુકસાન ખાતે તબદીલ કરવામાં આવતાં નથી. આમ છતાં, કંપની સંચિત લાભ અથવા નુકસાનને ઈકિવટીની અંદર જ તબદીલ કરી શકે છે. આવી જવાબદારીની વાજબી કિંમતમાં થતા તમામ ફેરફારો નફા અને નુકસાન પત્રકમાં ધ્યાનમાં લેવામાં આવે છે. કંપનીએ કોઈ નાણાકીય જવાબદારી નફા અને નુકસાન થકી વાજબી કિંમતે ધ્યાનમાં લીધી નથી.

ઘંધા સંબંધી તેમજ અન્ય ચુકવવાપાત્ર રકમો

આ રકમો, નાણાકીય વર્ષના અંત પહેલાં કંપનીને પૂરાં પાડવામાં આવેલાં માલસામાન અને સેવાઓ અંગેની એ જવાબદારીઓ દર્શાવે છે જેની ચુકવણી કરવામાં આવી ન હોય. અહેવાલના સમયગાળા પછી ૧૨ મહિનાની અંદર ચુકવણી કરવાની થતી ન હોય એ સિવાય ઘંધા સંબંધી અને અન્ય ચુકવવાપાત્ર રકમોને ચાલુ જવાબદારીઓ તરીકે દર્શાવવામાં આવે છે. તે શરૂઆતમાં વાજબી કિંમતે ધ્યાનમાં લેવામાં આવે છે અને ત્યારબાદ અસરકારક વ્યાજદર પદ્ધતિનો ઉપયોગ કરીને ઋણમુક્ત કિંમતે માપવામાં આવે છે.

ડીરેક્ટગનીશન (સરવૈયામાંથી દૂર કરવું)

કોઈપણ નાણાકીય જવાબદારી હેઠળનું દાવિયત્વ પૂરું થાય, રદ થાય અથવા સમાપ્ત થાય ત્યારે તેને સરવૈયામાં દર્શાવવામાં બંધ કરવામાં આવે છે. જ્યારે હાલમાં અસ્તિત્વ ધરાવતી કોઈ નાણાકીય જવાબદારીના સ્થાને તે જ ‘લેન્ડર’ પાસેથી અથવા મહદંશે જુદા જ પ્રકારની શરતો હેઠળ અન્ય જવાબદારી ઊભી કરવામાં આવે અથવા હાલમાં અસ્તિત્વ ધરાવતી જવાબદારીની શરતોમાં નોંધપાત્ર ફેરફાર કરવામાં આવે ત્યારે આવા વિનિમય અથવા ફેરફારને મૂળ

જવાબદારી ધ્યાને લેવાનું બંધ કરીને નવી જવાબદારીને ધ્યાને લેવામાં આવી હોવાનું ગણવામાં આવે છે. સંબંધિત જવાબદારીઓની ચાલુ કિંમત વચ્ચેના તફાવતને નફા અને નુકસાન પત્રકમાં ધ્યાને લેવામાં આવે છે.

ઢ. નાણાકીય ખતોની નુકસાન ભરપાઈ કરવી (ઓફ સેટીંગ)

નાણાકીય મિલકતો અને નાણાકીય જવાબદારીઓની નુકસાન ભરપાઈ (ઓફ સેટીંગ) કરીને ચોખ્ખી રકમ સરવૈયામાં ત્યારે જ દર્શાવવામાં આવે છે જ્યારે ધ્યાને લેવામાં આવેલી રકમને ‘ઓફ સેટ’ કરવાનો કાયદેસર અમલપાત્ર અધિકાર હોય અને જવાબદારીની પતાવટ કરવાનો અથવા મિલકતો પ્રાપ્ત કરવાની સાથેસાથે જ જવાબદારીઓની પતાવટ કરવાનો ઈરાદો હોય. કાયદેસર અમલપાત્ર અધિકાર ભવિષ્યની ઘટનાઓના સંદર્ભમાં આનુષંગિક ન જ હોવો જોઈએ અને તે ઘંધાના સામાન્ય કામકાજમાં અને કંપની અથવા પ્રતિપક્ષ ડિફોલ્ટ (ચૂક), નાદાર અથવા દેવાળિયો થઈ જાય એવા પ્રસંગે જ લાગુ પાડી શકાય તેવો હોવો જોઈએ.

ત. વાજબી કિંમત

કંપની પ્રત્યેક સરવૈયાની તારીખે કેટલાંક નાણાકીય ખતોની વાજબી કિંમતે માપણી કરે છે. વાજબી કિંમતે માપણી એ ધારણા પર આધારિત છે કે મિલકતના વેચાણ અથવા જવાબદારીને તબદીલ કરવા અંગેની લેવડ દેવડ-

ક. મિલકત અથવા જવાબદારીના મુખ્ય બજારમાં થાય છે, અથવા

ખ. મુખ્ય બજાર ન હોય તો, મિલકતો અને જવાબદારીઓ માટેના સૌથી ફાયદાકારક બજારમાં થાય છે.

મુખ્ય અથવા સૌથી ફાયદાકારક બજાર કંપનીને સુલભ હોવું જોઈએ. કોઈ મિલકત અથવા જવાબદારીની વાજબી કિંમતની માપણી ખરીદ-વેચાણમાં ભાગ લેનારી વ્યક્તિઓ તેમના પોતાના શ્રેષ્ઠ આર્થિક હિતમાં વર્તતા હોવાની ધારણા કરીને, તેઓ તે મિલકત અથવા જવાબદારી વિશે જે ધારણા કરે તેને કેન્દ્રમાં રાખીને કરવામાં આવે છે.

કંપની જે તે સંજોગોમાં યોગ્ય હોય અને વાજબી કિંમતે માપવા માટે જે અંગે પૂરતો ડેટા ઉપલબ્ધ હોય તેવી મૂલ્ય નિર્ધારણની ટેકનિકનો ઉપયોગ કરે છે અને આમ કરતી વખતે સંબંધિત દેખીતા ભાવનો સૌથી વધુ ઉપયોગ કરે છે અને દેખીતા ન હોય તેવા ભાવનો સૌથી ઓછો ઉપયોગ કરે છે.

નાણાકીય પત્રકોમાં જેની વાજબી કિંમત માપવામાં અથવા જાહેર કરવામાં આવી હોય તે તમામ મિલકતો અને જવાબદારીઓને, વાજબી કિંમતની માપણી માટે મહત્વના હોય એવા સૌથી ઓછા ભાવના આધારે નીચે મુજબ વાજબી કિંમતના ક્રમમાં મૂકવામાં આવે છે.

ક. લેવલ-૧ : કવોટેડ (બિન સમાયોજિત) સમાન પ્રકારની મિલકતો અથવા જવાબદારીઓ માટે સક્રિય બજારમાં બજાર કિંમત.

ખ. લેવલ-૨ : કિંમત નક્કી કરવાની એ તકનિકો જે માટે, સૌથી ઓછા ભાવો પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે જોઈ શકાતા હોય.

ગ. લેવલ-૩ : કિંમત નક્કી કરવા માટેની એ ટેકનિકો જે માટે સૌથી ઓછા ભાવો જોવા મળતા ન હોય.

નાણાકીય પત્રકોમાં આવર્તક ધોરણે ધ્યાનમાં લેવામાં આવતી હોય તેવી મિલકતો અને જવાબદારીઓ માટે કંપની, દરેક અહેવાલના સમયગાળાના અંતે, (એકંદર ધોરણે વાજબી કિંમતની માપણી માટે મહત્વના છે એવા સૌથી ઓછા ભાવના આધારે) વાજબી કિંમતના વગીકરણની પુનઃમુલવણી કરીને, વગીકરણના સ્તરો (લેવલ્સ) વચ્ચે તબદીલી થઈ છે કે કેમ તે નક્કી કરે છે.

આ નોંધમાં વાજબી કિંમત અંગેની હિસાબી નીતિનો સાર આપવામાં આવ્યો છે. વાજબી કિંમત સંબંધી અન્ય જાહેરાતો સંબંધિત નોંધોમાં આપવામાં આવી છે.

થ. માલસામગ્રી

માલસામગ્રીમાં વિકસિત પ્લોટ્સનો સમાવેશ થાય છે. વિકસિત પ્લોટ્સમાં પડતર જમીન સંપાદનનું ખર્ચ, બાંધકામ અને વિકાસ અંગેનું ખર્ચ, માલ સામાનનું ખર્ચ, સેવા, અને સોલાર પાર્ક-૧ સંબંધી અન્ય ખર્ચનો સમાવેશ થાય છે. વિકસિત પ્લોટ્સનું મૂલ્ય નિર્ધારણ પડતર કિંમત અથવા ચોખ્ખી મળી શકે તેવી કિંમત, એ બેમાંથી જે ઓછું હોય તે કરવામાં આવે છે.

ઢ. કર્મચારી સંબંધી લાભો

૧. ટૂંકાગાળાના કર્મચારી સંબંધી લાભો અંગેનું દાવિત્વ

કર્મચારીઓએ સંબંધિત સેવાઓ આપી હોય તે અહેવાલના સમયગાળાના અંત પછી ૧૨ મહિનાની અંદર જેમની પૂરેપૂરી પતાવટ કરવાની અપેક્ષા હોય તેવી, બિન-નાણાકીય લાભો સહિતની, પગાર-વેતન અંગેની જવાબદારીઓ, અહેવાલના સમયગાળાના અંત સુધીની કર્મચારીઓની સેવાઓના સંદર્ભમાં ધ્યાને લેવામાં આવે છે અને એ જવાબદારીઓની પતાવટ કરવાની હોય ત્યારે ચુકવવાની અપેક્ષિત રકમના દરે તેની માપણી કરવામાં આવે છે. સરવૈયામાં આ જવાબદારીઓ કર્મચારી લાભો અંગેના ચાલુ દાવિત્વ તરીકે રજૂ કરવામાં આવે છે.

૨. અન્ય લાંબાગાળાના, કર્મચારી સંબંધી લાભો અંગેનું દાવિત્વ

કર્મચારીઓએ સંબંધિત સેવાઓ જે દરમિયાન પૂરી પાડી હોય તે સમયગાળાના અંત પછીના ૧૨ મહિનામાં પ્રાપ્ત રજાઓ અને માંદગીની રજાઓ અંગેની જવાબદારીઓ પૂરેપૂરી પતાવવાની અપેક્ષા હોતી નથી. તેવી તેમની માપણી, પ્રોજેક્ટેડ યુનિટ કેડિટ મેથડનો ઉપયોગ કરીને, કર્મચારીએ અહેવાલના સમયગાળાના અંત સુધી પુરી પાડેલી સેવાઓના સંદર્ભમાં કરવાની અપેક્ષિત ભાવિ ચુકવણીની હાલની કિંમતે માપવામાં આવે છે. આ લાભો બજારની ઊપજનો ઉપયોગ કરીને સંબંધિત દાવિત્વની મુદત સુધીની સંબંધિત સમયગાળાની મુદતના અંદાજે લાભોમાં ઘટાડો કરવામાં આવે

છે. અનુભવ, સમાયોજન અને જોખમ સંબંધી ધારણાઓમાં ફેરફારોના પરિણામે કરવામાં આવેલી પુનઃમાપણી નફા અને નુકસાન ખાતામાં ધ્યાને લેવામાં આવે છે.

૩. રોજગાર પછીના દાવિત્વો

કંપની રોજગાર પછીની (નિવૃત્તિ પછીની) નીચે મુજબની યોજનાઓ ચલાવે છે.

ક. નિર્ધારિત લાભો અંગેની યોજના જેમકે ગ્રેચ્યુઈટી અને

ખ. નિર્ધારિત લાભો અંગેની યોજના જેમકે રજાનું રોકડમાં રૂપાંતર

ગ. નિર્ધારિત ફાળા અંગેની યોજના જેમકે ભવિષ્યનિધિ

ગ્રેચ્યુઈટી સંબંધી દાવિત્વ

ગ્રેચ્યુઈટી સંબંધી દાવિત્વ વાર્ષિક ત્રીજા પક્ષના જોખમ સંબંધી મૂલ્ય નિર્ધારણના આધારે માપવામાં આવે છે અને કર્મચારીએ આપેલી સેવાઓના સમયગાળા દરમિયાન ધ્યાને લેવામાં આવે છે. કંપની તેના કર્મચારીઓને ગ્રેચ્યુઈટી યોજનાઓના સ્વરૂપે નિર્ધારિત લાભ સંબંધી યોજનાઓ ઓફર કરે છે. કંપની ભારતીય જીવન વીમા નિગમને ભંડોળ આપે છે. દર વર્ષે ચુકવવામાં આવેલી પ્રિમિયમની રકમ નફા અને નુકસાન ખાતે ઉધારવામાં આવે છે.

રજાનું રોકડમાં રૂપાંતર

રજાના રોકડમાં રૂપાંતર માટેની જોગવાઈ જોખમ સંબંધી મૂલ્ય નિર્ધારણના આધારે નક્કી થાય છે અને ઊપાર્જિત થાય છે.

ભવિષ્ય નિધિ

નિર્ધારિત ફાળા સંબંધી યોજના ભવિષ્ય નિધિમાં ફાળો કાયદાના નિયમો મુજબ આપવામાં આવે છે અને તે, કર્મચારીએ જ્યારે તે ફાળા માટે હકદાર બનવા જેટલી સેવાઓ બજાવી હોય ત્યારે ખર્ચ તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે.

ધ. વિદેશી ચલણમાં લેવડદેવડ

વિદેશી ચલણમાં લેવડ દેવડોને, લેવડ દેવડની તારીખે જે વિનિમય દર ચાલતો હોય તેનો ઉપયોગ કરીને ચાલુ ચલણમાં રૂપાંતરિત કરવામાં આવે છે. વર્ષના અંતે આવી લેવડ દેવડોની પતાવટમાંથી અને વિદેશી ચલણની સંજ્ઞા (ડીનોમીનેશન) વાળી નાણાકીય મિલકતો અને જવાબદારીઓના રૂપાંતરણમાંથી થયેલા વિદેશી ચલણ સંબંધી લાભ અને નુકસાનને સામાન્ય રીતે નફા અને નુકસાન ખાતે ધ્યાનમાં લેવામાં આવે છે.

ન. આવકને ધ્યાનમાં લેવા બાબત

માપણી અંગેની અથવા ઉધરાણી અંગેની કોઈ નોંધપાત્ર અનિશ્ચિતતા અસ્તિત્વ ધરાવતી ન હોય ત્યારે આવકને ધ્યાનમાં લેવામાં આવે છે. પ્રાપ્ત થયેલા અથવા મળવાપાત્ર અવેજની વાજબી કિંમતે આવકની માપણી કરવામાં આવે છે. આવકમાંથી રિબેટ અને એ પ્રકારનાં અન્ય ભથ્થાં બાદ કરવામાં આવે છે.

પટે આપવામાં આવેલા પ્લોટમાંથી આવક (એટલે કે ઉધરાવવામાં આવેલ પ્રિમિયમ અને ડેવલપમેન્ટ ચાર્જ), માપણી અંગેની અથવા ઉદ્ધારણી અંગેની કોઈ નોંધપાત્ર અનિશ્ચિતતા અસ્તિત્વ ધરાવતી ન હોય ત્યારે અને માલિકી અંગેના તમામ નોંધપાત્ર જોખમો અને પુરસ્કારો ખરીદનારને સમજૂતીની શરતો મુજબ આપી દેવામાં આવ્યા હોય ત્યારે ધ્યાને લેવામાં આવે છે. ગ્રાહકો પાસેથી મળેલી રકમો, જો તે ‘ગ્રાહકો પાસેથી મળેલી પેશગીઓ’ સદર હેઠળ અન્ય ચાલુ જવાબદારીઓ તરીકે હિસાબે લેવામાં આવી હોય તો, આવક તરીકે ધ્યાને લેવાને પાત્ર બનતી નથી. આવક તરીકે ધ્યાનમાં લેવામાં આવેલી રકમો સામે ગ્રાહકો પાસેથી મળવાપાત્ર રકમોને, ‘‘ઘંધા સંબંધી મળવાપાત્ર રકમો’’ સદર હેઠળ ચાલુ મિલકત તરીકે હિસાબે લેવામાં આવે છે. ભારતીય હિસાબી ધોરણ-૧૧૫ મુજબ, જવાબદારી સંતોષકારક રીતે પૂરી કરવામાં આવે ત્યારે આવક તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે. ૭૦૦ મે.વો.નો મેગા પ્રોજેક્ટ રાધાનેસડા અને ૫૦૦૦ મે.વો.નો સોલાર પ્રોજેક્ટ-ધોલેરા શરૂ કરવામાં આવ્યા હતા અને તે અંગેની કામગીરી (કરારગત ફરજો) સંતોષકારકરીતે પૂરી થઈ નથી. તેથી, ભારતીય હિસાબી ધોરણ-૧૧૫ હેઠળ નિયત કરવામાં આવેલી વ્યાખ્યા અને જવાબદારીઓને ધ્યાનમાં લેતાં, આ પ્રોજેક્ટ્સ પૂરા થાય તે વખતે આવક ધ્યાનમાં લેવામાં આવશે.

સેવાઓમાંથી થયેલી આવકને, કરારની શરતોને ધ્યાનમાં લઈને, સેવાઓ જ્યારે પૂરી પાડવામાં આવે ત્યારે ધ્યાનમાં લેવામાં આવે છે વીજ ઉત્પાદમાંથી થયેલી અવાકને, કરારની શરતોને ધ્યાનમાં લઈને ધ્યાને લેવામાં આવે છે. વ્યાજની આવક, બાકી રકમ અને લાગુ પડવાપાત્ર વ્યાજદરને ગણતરીમાં લઈને, સમયના પ્રમાણના આધારે ધ્યાને લેવામાં આવે છે. ચુકવણી મેવવાનો અધિકાર સ્થાપિત થાય ત્યારે ડિવિડન્ડ હિસાબે લેવામાં આવે છે.

પ. ખર્ચ

સંચાલન ખર્ચ અને બાંધકામ અને વિકાસ ખર્ચ, ચારણકા ખાતે સોલારપાર્કના વિસ્તારમાં પ્લોટની ફાળવણીના પ્રમાણમાં આધારે નફા અને નુકસાન ખાતે ઉધારવામાં આવે છે. ૭૦૦ મે.વો.નો મેગા પ્રોજેક્ટ રાધાનેસડા અને ૫૦૦૦ મે.વો.નો સોલાર પ્રોજેક્ટ-ધોલેરા પર કરવામાં આવેલું ખર્ચ, આ પ્રોજેક્ટ હમણાં જ શરૂ થયા હોવાથી, ‘‘ચાલુ કામો’’ ખતે તબદીલ કરવામાં આવ્યું છે.

ફ. કરવેરા

આવકવેરો

આવકવેરાનું ખર્ચ અથવા આ સમયગાળા માટેની કેડીટ એ, કામચલાઉ તફાવતો અને કરવેરા સંબંધી ખોટને કારણે ઊભી થતી કરસંબંધી મિલકતો અને જવાબદારીઓમાં ફેરફારો થકી સમાયોજિત, લાગુ પડતા આવકવેરા દરના આધારે, ચાલુ સમયગાળાની કરપાત્ર આવક પર ચુકવવાપાત્ર કર છે.

ચાલુ આવકવેરાનું ખર્ચ, અહેવાલના સમયગાળાના અંતે ઘડવામાં આવેલા અથવા નોંધપાત્ર રીતે ઘડવામાં આવેલા કર સંબંધી કાયદાના આધારે ગણવામાં આવે છે. ચાલુ આવકવેરા સંબંધી મિલકતો અને જવાબદારીઓ, અહેવાલના સમયગાળાના અંતે ઘડવામાં આવેલા અથવા નોંધપાત્ર રીતે ઘડવામાં આવેલા કરસંબંધી કાયદા અને દરોના આધારે, સત્તામંડળો ચુકવેલા પાસેથી વસૂલ કરવાની અથવા તેમને ચુકવવાની અપેક્ષા હોય એ રકમોના દરે માપવામાં આવે છે. ચાલુ કરસંબંધી બાબતો, અન્ય સર્વગ્રાહી આવક અથવા ઈકિવટીમાં પ્રત્યક્ષ રીતે કરવામાં આવેલી સંબંધિત લેવડદેવડોને અનુરૂપ ધ્યાનમાં લેવામાં આવે છે.

વિલંબિત કરવેરા

મિલકતો અને જવાબદારીઓના કર-આધાર અને સ્ટેન્ડ અલોન નાણાકીય પત્રકોમાં તેમની ચાલુ રકમો વચ્ચે ઊભા થતા કામચલાઉ તફાવત પર વિલંબિત લેવડદેવડોને અનુરૂપ ધ્યાનમાં લેવામાં આવે છે.

વિલંબિત આવકવેરો, અહેવાલના સમયગાળાના અંત સુધીમાં ઘડવામાં આવેલા અથવા મહદંશે ઘડવામાં આવેલા કરવેરાના દર (અને કાયદા)નો ઉપયોગ કરીને નક્કી કરવામાં આવે છે અને જ્યારે સંબંધિત વિલંબિત આવકવેરા મિલકત પ્રાપ્ત થાય અથવા વિલંબિત આવકવેરાની જવાબદારીની પતાવટ થાય ત્યારે તે લાગુ પડવાની અપેક્ષા હોય છે. વિલંબિત કર મિલકતો, તમામ કપાતપાત્ર કામચલાઉ તફાવતો અને ઉપયોગમાં લેવામાં ન આવેલી કરવેરા સંબંધી ખોટ માટે તો જ ધ્યાને લેવામાં આવે છે જો એ સંભવ હોય કે ભાવિ કરપાત્ર રકમો એ કામચલાઉ તફાવતો અને ખોટને ઉપયોગમાં લેવા માટે ઉપલબ્ધ હશે.

વિલંબિત કર મિલકતો અને જવાબદારીઓને ઓફસેટ કરવાનો કાયદેસર અમલપાત્ર અધિકાર હોય ત્યારે અને જ્યારે વિલંબિત કર સિલકો એક જ કર-સત્તામંડળને લગતી હોય ત્યારે વિલંબિત કર મિલકતો અને જવાબદારીઓ ઓફ-સેટ કરવામાં આવે છે. ચાલુ કર મિલકતો અને કર જવાબદારીઓ ઓફસેટ કરવાનો કાયદેસર અમલ પાત્ર અધિકાર હોય ત્યારે અને જ્યારે તેની ચોખ્ખી રકમના આધારે પતાવટ કરવાનો અથવા મિલકત પ્રાપ્ત કરવાની સાથે સાથે જ જવાબદારીની પતાવટ કરવાનો ઈરાદો હોય ત્યારે તેને ઓફસેટ કરવામાં આવે છે.

ચાલુ અને વિલંબિત કરને, તે અન્ય સર્વગ્રાહી આવકમાં અથવા સીધો ઈકિવટીમાં ધ્યાનમાં લેવામાં આવેલી બાબતો સાથે સંબંધ ધરાવતો હોય તેટલા પ્રમાણ સિવાય, નફા અને નુકસાન પત્રકમાં ધ્યાને લેવામાં આવે છે. આ કિસ્સામાં કર અનુક્રમે અન્ય સર્વગ્રાહી આવકમાં અથવા સીધો જ ઈકિવટીમાં પણ ધ્યાને લેવામાં આવે છે. કોઈપણ ઉપલબ્ધ ટેક્સ કેડિટ, ભાવિ કરપાત્ર નફો-જેની સામે ઉપયોગમાં ન લેવાયેલ ટેક્સ કેડિટનો ઉપયોગ થઈ શકે તેમ હોય- જેટલા પ્રમાણમાં ઉપલબ્ધ હોય તેટલા પ્રમાણમાં વિલંબિત કર તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે.

ઉકત મિલકત, નફા અને નુકસાન પત્રક ખાતે કેડિટ દ્વારા ઊભી કરવામાં આવે છે અને વિલંબિત કર મિલકતના સદર હેઠળ દર્શાવવામાં આવે છે.

વિલંબિત કર મિલકતોની ચાલુ રકમની સમીક્ષા દરેક અહેવાલની તારીખે કરવામાં આવે છે અને વિલંબિત કર મિલકતની પૂરેપૂરી અથવા આંશિક રકમનો ઉપયોગ થઈ શકે એટલો પ્રયાત્ન કરપાત્ર નફો ઉપલબ્ધ હોવાની સંભાવના ન રહે એટલા પ્રમાણમાં તે ઘટાડવામાં આવે છે. ધ્યાનમાં લેવામાં ન આવી હોય એવી વિલંબિત કર-મિલકતોની દરેક અહેવાલની તારીખે પુનઃ આકારણી કરવામાં આવે છે અને ભાવિ કરપાત્ર નફા થકી જેટલા પ્રમાણમાં વિલંબિત કર મિલકત વસૂલ થવાની સંભાવના હોય તેટલા પ્રમાણમાં વિલંબિત કર મિલકત વસૂલ થવાની સંભાવના હોય તેટલા પ્રમાણમાં તે ધ્યાને લેવામાં આવે છે.

બ. જોગવાઈઓ, આકસ્મિક જવાબદારીઓ અને આકસ્મિક મિલકતો

કોઈ ભૂતકાળની ઘટનાના પરિણામે કંપની માટે વર્તમાન દાયિત્વ ઊભું થયેલું હોય ત્યારે જોગવાઈઓ વર્તમાન કિંમતે ધ્યાનમાં લેવામાં આવે છે. એ સંભવ છે કે આર્થિક લાભો દર્શાવતા સંસાધનો એ દાયિત્વની પતાવટ માટે ખર્ચવા જરૂરી બને અને તે દાયિત્વની રકમનો વિશ્વસનીય અંદાજ કાઢી શકાય. જોગવાઈને લગતો ખર્ચ, પુનઃભરપાઈ કરવાની કોઈ રકમ હોય તો તેને બાદ કરીને નફા અને નુકસાન ખાતે રજૂ કરવામાં આવે છે.

અંદાજ રોકડ પ્રવાહીનો ઉપયોગ કરીને, દાયિત્વની પતાવટ માટે, અપેક્ષિત ખર્ચની વર્તમાન કિંમતે “ડીકમીશનીંગ કોસ્ટ” પૂરી પાડવામાં આવે છે અને તે પીપીઈની કિંમતના ભાગ તરીકે ધ્યાને લેવામાં આવે છે. રોકડ પ્રવાહો, જે ધ્યાનમાં લેવાનું બંધ કરવામાં આવ્યું હોય તેવી જવાબદારીઓ (ડીકમીશનીંગ લાયેબીલીટી) અંગેના વિશેષ જોખમો દર્શાવતા, કરવેરા પહેલાંના ચાલુ દરોએ રોકડ પ્રવાહો ઘટાડવામાં આવે છે. ઘટાડવામાં આવેલા ડિસ્કાઉન્ટને કરેલ ખર્ચ ગણીને, નાણાકીય ખર્ચ તરીકે નફા અને નુકસાન પત્રકમાં ધ્યાને લેવામાં આવે છે. “ડીકમીશનીંગ”ની અંદાજ ભાવિ કિંમતોની દર વર્ષે સમીક્ષા કરવામાં આવે છે અને તેનું યોગ્ય રીતે સમાયોજન કરવામાં આવે છે. અંદાજ ભાવિ કિંમતો અથવા લાગુ પાડવામાં આવેલા ડિસ્કાઉન્ટ રેટમાં થયેલા ફેરફારો મિલકતની કિંમતમાં ઉમેરવામાં આવે છે અથવા તેમાંથી બાદ કરવામાં આવે છે.

આકસ્મિક જવાબદારીઓ પ્રત્યક્ષ ન હોય તો તેની જોગવાઈ કરવામાં આવતી નથી. તે હિસાબોની નોંધ થકી જાહેર કરવામાં આવે છે. આકસ્મિક મિલકતો નાણાકીય પત્રકોમાં ધ્યાનમાં લેવામાં આવતી નથી. આમ છતાં, આર્થિક લાભ થવાની સંભાવના હોય ત્યાં તે જાહેર કરવામાં આવે છે.

બ. રોકડ અને રોકડ સમાન

રોકડ અને રોકડ સમાન રકમોમાં રોકડ તેમજ બેંકમાં મૂકલી થાપણોનો સમાવેશ થાય છે. ખરીદીની તારીખે જે પાકવાની મુદતમાં ત્રણ મહિના અથવા ઓછો સમય બાકી હોય અને રોકડની જાણીતી રકમોમાં જેને તરત રૂપાંતરિત કરી શકાય તેમ હોય એવાં અતિ પ્રવાહી રોકાણોને કંપની રોકડ-સમાન ગણે છે.

રોકડપ્રવાહોના પત્રકમાં રજૂ કરવાના હેતુ માટે રોકડ અને રોકડ સમાન રકમોમાં હાથ પરની રોકડ, ટૂંકી મુદતના અને જે પાકવાની મુદતમાં ત્રણ મહિના અથવા ઓછો સમય બાકી હોય અને રોકડની જાણીતી રકમોમાં જેને તરત રૂપાંતરિત કરી શકાય તેમ હોય એવાં અતિ પ્રવાહી રોકાણો જેમની કિંમતમાં ફેરફાર થવાનું નજીવું જોખમ હોય તેમનો અને બેંક ઓવર ડ્રાફ્ટ્સનો સમાવેશ થાય છે. બેંક ઓવર ડ્રાફ્ટ્સ, પાકા સરવૈયામાં ચાલુ જવાબદારીઓમાં કરજોની અંદર દર્શાવવામાં આવે છે.

મ. રોકડ પ્રવાહનું પત્રક

રોકડ પ્રવાહો પરોક્ષ પદ્ધતિનો ઉપયોગ કરીને જણાવવામાં આવે છે, જે થકી કરવેરા પહેલાંનો નફો બિન-રોકડ પ્રકારની કોઈપણ લેવડ-દેવડોની અસરો, ભૂતકાળની અથવા ભવિષ્યની કાર્યલક્ષી રોકડ પ્રાપ્તિઓ અથવા ચુકવણીઓના વિલંબ અથવા ઊપાર્જન અને નાણાકીય અથવા રોકાણ સંબંધી રોકડ પ્રવાહો સાથે સંકળાયેલી આવક અથવા ખર્ચની બાબત માટે સમાયોજિત કરવામાં આવે છે. સંચાલન, રોકાણ અને નાણાકીય સંબંધી પ્રવૃત્તિઓમાંથી થતા રોકડ પ્રવાહોને અલગ તારવવામાં આવે છે.

ચ. અહેવાલની તારીખ પછી બનતી ઘટનાઓ

સરવૈયાની તારીખ પછી બનતી સમાયોજનની ઘટનાઓ (જે સરવૈયાની તારીખે અસ્તિત્વ ધરાવતી સ્થિતિનો પુરાવો પૂરો પાડે છે) ને નાણાકીય પત્રકોમાં ધ્યાને લેવામાં આવે છે. સરવૈયાની તારીખ બાદ બનતી પ્રત્યક્ષ બિન સમાયોજનની ઘટનાઓ (જેમાં સરવૈયાની તારીખ પછી ઊભી થયેલી સ્થિતિનો સમાવેશ થાય છે) ઘટનાઓ જે નાણાકીય સ્થિતિને અસર કરતા પ્રત્યક્ષ ફેરફારો અને પ્રતિબદ્ધતાઓ દર્શાવે છે, તે નાણાકીય પત્રકોમાં દર્શાવવામાં આવે છે.

ર. અપવાદરૂપ બાબતો

કંપનીની સામાન્ય પ્રવૃત્તિઓને લગતાં કેટલાંક પ્રસંગો, કંપનીનું કદ, પ્રકાર અથવા આવક અથવા ખર્ચની બાબતની અસર એવાં હોય છે કે તેની જાહેરાત કરવાથી કંપનીની કામગીરી વધુ સારી રીતે સમજી શકાય છે. આવી આવક અથવા ખર્ચને અપવાદરૂપ બાબત તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે અને તદનુસાર તે નાણાકીય પત્રકો સાથેની નોંધોમાં જાહેર કરવામાં આવે છે.

લ. સેગમેન્ટ વિશે જાણ કરવા બાબત (સેગમેન્ટ રિપોર્ટિંગ)

વર્ષ દરમિયાન જીપીસીએલ વીજસંબંધી ઉત્પાદનોના વિકાસ અને વીજ નિર્માણના વ્યાપારમાં રોકાણેલ હતું. તેની પ્રવૃત્તિઓ અને પ્રવૃત્તિઓમાંથી થતી આવક માત્ર ઊર્જા ક્ષેત્ર સાથે જોડાયેલી છે. ઈન્સ્ટીટ્યુટ ઓફ ચર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા ઈસ્યુ કરવામાં આવેલા હિસાબી ધોરણ ૧૦૮ “ઓપ રેટીંગ સેગમેન્ટ મુજબ કંપની માત્ર એક જ જાણ કરવાપાત્ર સેગમેન્ટ ધરાવે છે. જેની વિગતો અન્ય નોંધ-૩૧ (દ) તરીકે રજૂ કરવામાં આવી છે.

વ. સામાન્ય નોંધ

નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે કંપનીના હિસાબો નોંધવાની અને બંધ કરવાની છેલ્લી તારીખ ૩૧/૦૫/૨૦૨૧ ના.વ. ૨૦૨૦-૨૧નાં નાણાકીય પત્રકો મંજૂર કર્યાની તારીખ ૨૮/૧૨/૨૦૨૧ છે.

૨. સંપત્તિ, પ્લાન્ટ અને સાધન સામગ્રી
નોંધ-૨ સંપત્તિ, પ્લાન્ટ અને સાધન સામગ્રી
૨૦૨૦-૨૧ના વર્ષ માટે

વિગતો	એકંદર બ્લોક				
	૧લી એપ્રિલ, ૨૦૨૦ મુજબ	વર્ષ દરમિયાન ઉમેરો	નિકાલ/ સમાયોજન	આઈએનડી એ એસ ટ્રાન્ઝીશન પર અસર	૩૧મી માર્ચ, ૨૦૨૧ મુજબ
જમીન	૬૭,૮૩,૬૬,૮૮૨	૪૬,૪૪,૨૬૬	૪૬,૪૪,૨૬૬	-	૬૭,૮૩,૬૬,૮૮૨
મકાન	૬૬,૪૩,૫૮,૮૨૭	-	૮,૭૩,૨૨,૭૩૪	-	૫૭,૭૦,૩૬,૦૯૩
પ્લાન્ટ અને યંત્ર સામગ્રી	૧૮,૭૫,૦૩,૬૦૧	૩૫,૦૦૦	૩૫,૭૬,૨૩૭	-	૧૮,૩૯,૬૨,૩૬૪
કચેરી સાધન સામગ્રી	૪૩,૭૭,૭૫,૬૫૭	૧૦,૦૮,૨૫૩	૨,૫૦૦	-	૪૩,૮૭,૮૧,૪૧૦
ફર્નિચર અને જડાણો	૩,૧૬,૧૮,૧૮૦	૧૫,૦૦૦	૧,૭૫,૮૮,૩૬૭	-	૧,૪૦,૩૩,૮૧૩
કોમ્પ્યુટર્સ	૧,૮૮,૫૨,૦૨૪	-	-	-	૧,૮૮,૫૨,૦૨૪
વાહનો	૮૨,૬૦,૦૨૬	-	-	-	૮૨,૬૦,૦૨૬
વિન્ડ મીલ	૧,૨૨,૧૮,૦૩,૮૨૮	-	-	-	૧,૨૨,૧૮,૦૩,૮૨૮
સોલારપાર્ક	૧,૨૩,૦૮,૮૭,૩૧૭	-	-	-	૧,૨૩,૦૮,૮૭,૩૧૭
સરવાળો	૪,૪૮,૦૪,૩૬,૫૫૨	૫૭,૦૨,૫૧૯	૧૨,૩૧,૪૫,૧૦૪	-	૪,૩૬,૨૮,૮૩,૮૬૭

૨૦૧૯-૨૦ના વર્ષ માટે

વિગતો	એકંદર બ્લોક				
	૧લી એપ્રિલ, ૨૦૧૯ મુજબ	વર્ષ દરમિયાન ઉમેરો	નિકાલ/ સમાયોજન	આઈ એનડી એ એસ ટ્રાન્ઝીશન પર અસર	૩૧મી માર્ચ, ૨૦૨૦ મુજબ
જમીન	૬૭,૮૩,૬૬,૮૮૨	-	-	-	૬૭,૮૩,૬૬,૮૮૨
મકાન	૬૬,૪૩,૫૮,૮૨૭	-	-	-	૬૬,૪૩,૫૮,૮૨૭
પ્લાન્ટ અને યંત્ર સામગ્રી	૧૮,૭૫,૦૩,૬૦૧	-	-	-	૧૮,૭૫,૦૩,૬૦૧
કચેરી સાધન સામગ્રી	૪૩,૭૭,૭૫,૬૫૭	૬,૩૦,૮૪૭	૧,૬૮,૩૪૪	-	૪૩,૭૭,૭૫,૬૫૭
ફર્નિચર અને જડાણો	૩,૧૬,૦૮,૩૪૨	૮,૮૩૮	-	-	૩,૧૬,૧૮,૧૮૦
કોમ્પ્યુટર્સ	૧,૮૮,૫૨,૦૨૪	૮૮,૮૩૫	-	-	૧,૮૮,૫૨,૦૨૪
વાહનો	૮૨,૬૦,૦૨૬	-	-	-	૮૨,૬૦,૦૨૬
વિન્ડ મીલ	૧,૨૨,૧૮,૦૩,૮૨૮	-	-	-	૧,૨૨,૧૮,૦૩,૮૨૮
સોલારપાર્ક	૧,૨૩,૦૮,૮૭,૩૧૭	-	-	-	૧,૨૩,૦૮,૮૭,૩૧૭
સરવાળો	૪,૪૭,૯૮,૬૬,૨૭૬	૭,૩૯,૬૨૦	૧,૬૮,૩૪૪	-	૪,૪૮,૦૪,૩૬,૫૫૨

(રકમ રૂ. માં)

ઘસારો અને ઋણમુક્તિ					ચોખ્ખો બ્લોક	
૧લી એપ્રિલ ૨૦૨૦ મુજબ	આ વર્ષ માટે	નિકાલ/ સમાયોજન	આઈએનડી એ એસ ટ્રાન્ઝીશન પર અસર	૩૧મી માર્ચ, ૨૦૨૧ મુજબ	૩૧મી માર્ચ, ૨૦૨૧ મુજબ	૩૧મી માર્ચ, ૨૦૨૦ મુજબ
-	-	-	-	-	૬૭,૮૩,૬૬,૮૮૨	૬૭,૮૩,૬૬,૮૮૨
૧૪,૩૩,૮૦,૫૩૮	૮૩,૮૮,૨૮૬	૧,૨૫,૮૪,૩૦૫	-	૧૪,૦૧,૮૫,૫૨૮	૪૨,૬૮,૪૦,૫૬૩	૫૨,૦૮,૬૮,૨૮૮
૫,૭૪,૬૬,૦૩૫	૭૭,૩૦,૭૭૮	૧૮,૫૧,૮૨૫	-	૬,૩૨,૪૪,૮૮૮	૧૨,૦૭,૧૭,૩૭૬	૧૩,૦૦,૩૭,૫૬૬
૧૩,૨૬,૭૪,૪૪૮	૧,૫૦,૦૧,૧૦૭	-	-	૧૪,૭૬,૭૫,૫૫૬	૨૮,૧૧,૦૫,૮૫૪	૩૦,૫૧,૦૧,૨૦૮
૨,૬૮,૨૫,૮૭૪	૧૫,૮૩,૫૨૬	૧,૫૬,૮૭,૩૭૬	-	૧,૨૭,૩૨,૧૨૩	૧૩,૦૧,૬૮૦	૪૭,૮૨,૨૦૬
૧,૮૭,૪૪,૨૪૦	૧,૦૮,૮૧૮	-	-	૧,૮૮,૫૪,૧૫૮	૮,૮૭,૮૬૬	૧૧,૦૭,૭૮૪
૭૪,૭૦,૨૬૫	૩,૧૫,૪૧૫	-	-	૭૭,૮૫,૬૮૦	૪,૭૪,૩૪૬	૭,૮૮,૭૬૧
૪૪,૮૫,૮૫,૮૫૦	૫,૧૫,૧૭,૮૮૦	-	-	૫૦,૧૧,૦૩,૮૩૦	૭૨,૦૭,૦૦,૦૮૮	૭૭,૨૨,૧૮,૦૭૮
૩૨,૪૧,૦૬,૪૩૫	૪,૫૮,૫૭,૨૮૮	-	-	૩૭,૦૦,૬૩,૭૩૩	૮૬,૦૮,૩૩,૫૮૪	૮૦,૬૭,૮૦,૮૮૨
૧,૧૬,૦૨,૬૩,૭૮૭	૧૩,૧૬,૧૫,૩૧૮	૩,૦૨,૨૩,૫૦૭	-	૧,૨૬,૧૬,૫૫,૫૮૮	૩,૧૦,૧૩,૩૮,૩૬૭	૩,૩૨,૦૧,૭૨,૭૬૫

(રકમ રૂ. માં)

ઘસારો અને ઋણમુક્તિ					ચોખ્ખો બ્લોક	
૧લી એપ્રિલ ૨૦૧૯ મુજબ	આ વર્ષ માટે	નિકાલ/ સમાયોજન	આઈ એનડી એ એસ ટ્રાન્ઝીશન પર અસર	૩૧મી માર્ચ, ૨૦૨૦ મુજબ	૩૧મી માર્ચ, ૨૦૨૦ મુજબ	૩૧મી માર્ચ, ૨૦૧૯ મુજબ
-	-	-	-	-	૬૭,૮૩,૬૬,૮૮૨	૬૭,૮૩,૬૬,૮૮૨
૧૩,૩૧,૩૨,૦૧૫	૧,૦૨,૫૮,૫૨૪	-	-	૧૪,૩૩,૮૦,૫૩૯	૫૨,૦૮,૬૮,૨૮૮	૫૩,૧૨,૨૬,૮૧૨
૪,૮૬,૮૦,૩૮૫	૭૭,૭૫,૬૫૦	-	-	૫,૭૪,૬૬,૦૩૫	૧૩,૦૦,૩૭,૫૬૬	૧૩,૭૮,૧૩,૨૧૭
૧૧,૮૦,૩૩,૪૪૩	૧,૪૮,૦૧,૮૮૧	૧,૬૦,૮૭૫	-	૧૩,૨૬,૭૪,૪૪૮	૩૦,૫૧,૦૧,૨૦૮	૩૧,૮૨,૮૦,૬૧૧
૨,૩૮,૬૭,૮૭૮	૨૮,૫૭,૮૮૬	-	-	૨,૬૮,૨૫,૮૭૪	૪૭,૮૨,૨૦૬	૭૬,૪૧,૩૬૪
૧,૮૬,૪૪,૦૭૨	૧,૦૦,૧૬૮	-	-	૧,૮૭,૪૪,૨૪૦	૧૧,૦૭,૭૮૪	૧૧,૦૮,૧૧૭
૭૦,૬૮,૭૩૮	૪,૦૧,૫૨૭	-	-	૭૪,૭૦,૨૬૫	૭,૮૮,૭૬૧	૧૧,૮૧,૨૮૮
૩૮,૭૮,૩૪,૩૮૦	૫,૧૬,૫૧,૪૬૦	-	-	૪૪,૮૫,૮૫,૮૫૦	૭૭,૨૨,૧૮,૦૭૮	૮૨,૩૮,૬૮,૫૩૮
૨૭,૮૦,૨૩,૨૨૭	૪,૬૦,૮૩,૨૦૮	-	-	૩૨,૪૧,૦૬,૪૩૫	૮૦,૬૭,૮૦,૮૮૨	૮૫,૨૮,૭૪,૦૮૦
૧,૦૨,૬૪,૮૪,૨૪૬	૧૩,૩૮,૩૦,૪૧૫	૧,૬૦,૮૭૫	-	૧,૧૬,૦૨,૬૩,૭૮૭	૩,૩૨,૦૧,૭૨,૭૬૫	૩,૪૫,૩૩,૭૨,૦૨૮

નોંધ: (૧) કંપની અધિનિયમ, ૨૦૧૩ ઘડાયા પછી કંપનીએ, ઘસારા/ઋણમુક્તિ અંગેની હિસાબી નીતિમાં જાહેર કર્યા મુજબ અનુસૂચિ-૨માં નિર્દિષ્ટ કરવામાં આવ્યા મુજબ અંદાજિત ઉપયોગી આવરદા લાગુ પાડી છે. તદનુસાર, બિનઋણમુક્ત ચાલુ મૂલ્યનો, સુધારેલી/બાકીની ઉપયોગી આવરદા સુધી ઘસારો ગણવામાં આવે છે.
(૨) એસઈસીએલ સાથે પાવર પર્યંત એગ્રીમેન્ટ અને સીક્યુરીટાઈઝેશન એક્ટ મુજબ, કંપનીની તમામ જવાબદારી અંગે ૧૦ મેવો.ના સોલાર પ્રોજેક્ટને લગતી રૂ. ૬૧,૧૪,૪૬,૫૧૮/-ની અનુમાનિત મિલકત ઉપર પ્રથમ ચાર્જ છે.

નોંધ: ૨
પટાઓ

ક. પટે લેનાર તરીકે પટાની અસર

પટે આપવાની પ્રવૃત્તિઓ, શરતો, પટા તરીકે લેવામાં આવેલ મિલકતનો વર્ગ વગેરે અંગેની પ્રમાણદર્શક મહિતી

૩૧મી માર્ચ, ૨૦૨૧ના રોજ પૂરા થયેલા વર્ષ દરમિયાન મિલકતનો ઉપયોગ કરવાના કંપનીના અધિકારોની ચાલુ કિંમત તથા પટાસંબંધી જવાબદારીઓમાં થયેલી ગતિવિધિઓ નીચે મુજબ છે.

ક. જમીનની મિલકત વાપરવાનો અધિકાર

વિગતો	૨૦૨૦-૨૧ના વર્ષ માટે રકમ (રૂપિયામાં)
એકંદર ચાલુ કિંમત	-
ઉઘડતી સિલક	-
વર્ષ દરમિયાન ઉમેરો ઘટાડો	૧૧,૦૩,૦૨૫
બંધ થતી સિલક (ક)	૧૧,૦૩,૦૨૫
સંચિત ઋણમુક્તિ	-
ઉઘડતી સિલક	-
વર્ષ દરમિયાન ચાર્જ	૫,૦૮,૪૨૨
વર્ષદરમિયાન ઘટાડો/સમાયોજન	-
બંધ થતી સિલક (ખ)	૫,૦૮,૪૨૨
૩૧ માર્ચ, ૨૦૨૧ના રોજ ચોખ્ખી સિલક (ગ=ક - ખ)	૫,૯૩,૬૦૩

ખ. પટા અંગેની જવાબદારી

વિગતો	૨૦૨૦-૨૧ના વર્ષ માટે રકમ (રૂપિયામાં)
ઉઘડતી સિલક	-
વર્ષ દરમિયાન ઉમેરો કરવામાં આવેલ નાણાકીય ખર્ચ	૧૧,૦૩,૦૨૫
પટા અંગેની જવાબદારીનું સમાયોજન	૩,૩૭,૮૬૫
	(૮,૫૬,૮૦૦)
બંધ થતી સિલક	૪,૮૪,૦૮૦
ચાલુ ભાગ	૬૪,૬૮૮
બિન-ચાલુ ભાગ	૪,૧૯,૩૯૨

ગ. નફા અથવા નુકસાનમાં ધ્યાનમાં લેવામાં આવેલી રકમો

વિગતો	૨૦૨૦-૨૧ના વર્ષ માટે રકમ (રૂપિયામાં)
૨૦૨૦-૨૧ - હિસાબી ધોરણ ૧૧૬ હેઠળના પટા	-
મિલકત વાપરવાના અધિકારના ખર્ચોની ઋણમુક્તિ	૫,૦૮,૪૨૨
પટા અંગેની જવાબદારી અંગેનું વ્યાજ ખર્ચ	૩,૩૭,૮૬૫
નફા અને નુકસાનમાં ધ્યાનમાં લેવામાં આવેલ કુલ રકમ	૮,૪૬,૨૮૭

પટા અંગેની જવાબદારી પાકવા અંગેનું વિશ્લેષણ

વિગતો	૩૧ માર્ચ ૨૦૨૧	
	પટા અંગેની ન્યૂનતમ ચુકવણી	એમએલપીની વર્તમાન કિંમત
૧ વર્ષ કરતાં મોડી નહીં	૧,૪૮,૨૦૦	૬૪,૬૮૮
૧ વર્ષ પછી પરંતુ ૫ વર્ષ કરતાં મોડી નહીં	૭,૪૧,૦૦૦	૨,૫૫,૨૮૪
૫ વર્ષ પછી	૭,૦૫,૦૨૦	૧,૬૪,૧૦૮
પટા અંગેની કુલ ન્યૂનતમ ચુકવણી	૧૫,૯૪,૨૨૦	૪,૮૪,૦૮૦
બાદ- નાણાકીય ચાજીસ દર્શાવતી રકમો	-	-
પટા અંગેની કુલ ન્યૂનતમ ચુકવણીની વર્તમાન કિંમત	૧૫,૯૪,૨૨૦	૪,૮૪,૦૮૦

પટા અંગેની ન્યૂનતમ ચુકવણીની કિંમત ગણી કાઢવા માટે કરજે લેવા માટેનો વ્યાજ દર એટલે કે ૮.૪૫ ઉપયોગમાં લેવામાં આવ્યો છે.

નોંધ - ૨ ઉત્પન્ન વિકાસ મિલકત

(રકમ રૂ.માં)

વિગત	૩૧-૦૩-૨૦૨૧ના રોજ મુજબ	૩૧-૦૩-૨૦૨૦ના રોજ મુજબ
પ્રારંભિક વિકાસ ખર્ચ	-	-
ઉઘડતી સિલક	૪૦,૪૭,૮૮,૮૮૧	૪૧,૦૮,૭૭,૧૬૦
વર્ષ દરમિયાન ધ્યાનમાં લેવામાં આવેલ	-	-
વર્ષ દરમિયાન ઋણમુક્તિ	(૮૬,૧૬,૮૫૪)	(૬૧,૭૮,૨૬૮)
બંધ થતી સિલક	૩૯,૫૧,૮૧,૦૨૭	૪૦,૪૭,૮૮,૮૮૧
ઉત્પન્ન બંધ કરવાની જવાબદારી અંગેની મિલકત ★		

★ ગુજરાત સરકારે તેના જુદા જુદા હુકમો અન્વયે, સંબંધિત તારીખોથી ૨૫ વર્ષ માટે ૧૩૫૫ હેક્ટર વિસ્તારને આવરી લેતા લિગ્નાઈટના ઉત્પન્ન પટા મંજૂર કર્યા છે. ઉક્ત પટો, ઉક્ત વિસ્તારમાંથી ઉત્પન્ન કરવામાં આવેલા સમગ્ર લિગ્નાઈટના જથ્થાનો ઉપયોગ બીએલટીપીએસ પાવર પ્લાન્ટ માટે કરવાની જોગવાઈ કરી છે. એટ્રીમેન્ટ મુજબ એમડીઓ લિગ્નાઈટ ઉત્પન્ન ફી હેક્ટર આવરી લેવામાં આવેલ ૩૩.૫૦ એમએમટી લિગ્નાઈટ ખોદવા માટે બંધાયેલું છે. આ સ્તરે, તકનિકી નિષ્ણાતોના મતે, ધોધા સુરકા લિગ્નાઈટ માર્શીંગ પ્રોજેક્ટ બંધ કરવાનો અંદાજ કાઢવા માટે તેના ડિકમીશનીંગ ખર્ચનો અંદાજ કાઢી શકાય તેમ નથી. તે બાબતને ધ્યાનમાં લેતાં ભારતીય હિસાબી ધોરણ ૩૭ “બાણોની આર્થિક આવરદાના અંતે, તેમને ભવિષ્યમાં બંધ કરવા માટે, આકસ્મિક જવાબદારીઓ અને આકસ્મિક મિલકતો અંગેની જોગવાઈ કરી ન શકાય.

નોંધ -૩ ગૌણ અને સહાયક અને સંયુક્ત કંપનીઓમાં રોકાણ (અનકવોટેડ)

(રકમ રૂ.માં)

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૧ મુજબ	૩૧મી માર્ચ ૨૦૨૦ મુજબ
બિન ચાલુ		
ગૌણ, સહાયક અને સંયુક્ત સાહસોના અનકવોટેડ ઇક્વિટી શેર્સમાં રોકાણ		
બૈતરણી વેસ્ટ કોલ કંપની લિમિટેડ (૩૧મી માર્ચ, ૨૦૨૧: ૧,૦૦,૦૦૦; ૩૧મી માર્ચ, ૨૦૨૦ મુજબ : ૧,૦૦,૦૦૦ ઇક્વિટી શેર્સ ઇક્વિટી શેર્સ રૂ. ૧૦૦૦નો એક એવા પૂરેપૂરા ભરપાઈ થયેલા શેર્સ)	૧૦,૦૦,૦૦,૦૦૦	૧૦,૦૦,૦૦,૦૦૦
ટોરેન્ટ પીપાવાવ જનરેશન લિમિટેડ (૩૧મી માર્ચ, ૨૦૨૧ : ૨૫,૦૦,૦૦૦; ૩૧મી માર્ચ, ૨૦૨૦ મુજબ ૨૫,૦૦,૦૦૦ ઇક્વિટી શેર્સ રૂ. ૧૦નો એક એવા પૂરેપૂરા ભરપાઈ થયેલ)	૨,૫૦,૦૦,૦૦૦	૨,૫૦,૦૦,૦૦૦
જી.એસ.પી.સી. પીપાવાવ પાવર કંપની લિમિટેડ (૩૧મી માર્ચ, ૨૦૨૧ : ૨,૧૮,૩૭,૬૨૭; ૩૧મી માર્ચ, ૨૦૨૦ મુજબ ૨,૧૮,૩૭,૬૨૭ ઇક્વિટી શેર્સ એક રૂ. ૧૦નો, પૂરેપૂરા ભરપાઈ થયેલ)	૨૧,૮૩,૭૬,૨૭૦	૨૧,૮૩,૭૬,૨૭૦
ગૌણ, સહાયક અને સંયુક્ત સાહસોમાં કુલ રોકાણ	૩૪,૩૩,૭૬,૨૭૦	૩૪,૩૩,૭૬,૨૭૦
જુઓ નોંધ ૨૮ અને ૩૦- (દ)		

નોંધ-૪ રોકાણો (રકમ રૂ. માં)

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૦ના રોજ
બિન ચાલુ રોકાણો		
(ક) અન્ય કંપનીઓના ક્વોટેડ ઇક્વિટી શેર્સમાં રોકાણ (ઓસીઆઈ મારફત વાજબી કિંમતે ગણેલું) (એફવીટીઓસીઆઈ)		
ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પાવર કંપની લિમિટેડ (૩૧મી માર્ચ, ૨૦૨૧ : ૪૯,૭૭,૪૯૧; ૩૧મી માર્ચ, ૨૦૨૦ : ૪૯,૭૭,૪૯૧ ઇક્વિટી શેર્સ એક રૂ. ૧૦ પૂરેપૂરા ભરપાઈ થયેલ)	૩૭,૭૦,૪૪,૯૪૪	૨૪,૮૩,૭૬,૮૦૨
ગુજરાત ગેસ લિમિટેડ (જીજીએલ) (૩૧મી માર્ચ, ૨૦૨૧ : ૧૩,૩૨,૨૩૫; ઇક્વિટી શેર્સ એક રૂ. ૨ નો એવા પૂરેપૂરા ભરપાઈ થયેલ ૩૧મી માર્ચ, ૨૦૨૦ ૧૩,૩૨,૨૩૫ ઇક્વિટી શેર્સ એક રૂ. ૨નો પૂરેપૂરા ભરપાઈ થયેલ)	૭૩,૧૯,૯૬,૫૨૧	૩૦,૭૫,૪૬,૪૫૦
(ખ) અન્ય કંપનીઓના અનક્વોટેડ ઇક્વિટી શેર્સમાં રોકાણ (ઓસીઆઈ મારફત વાજબી કિંમતે ગણેલું) (એફવીટીઓસીઆઈ)		
ગુજરાત રાજ્ય એનર્જી જનરેશન લિ. (જીએસઈજીએલ) (૩૧મી માર્ચ, ૨૦૨૧ : ૧,૫૮,૧૫,૪૫૪; ઇક્વિટી શેર્સ એક રૂ. ૧૦ પૂરેપૂરા ભરપાઈ થયેલ ૩૧મી માર્ચ, ૨૦૨૦ ૧,૫૮,૧૫,૪૫૪ ઇક્વિટી શેર્સ એક રૂ. ૧૦નો પૂરેપૂરા ભરપાઈ થયેલ)	૧૮,૦૪,૫૪,૩૩૦	૧૭,૦૮,૦૬,૮૦૩
કાલુપુર બેંક (૩૧મી માર્ચ, ૨૦૨૧ : ૪૦૦ ઇક્વિટી શેર્સ; ૩૧મી માર્ચ, ૨૦૨૦ મુજબ ૪૦૦ ઇક્વિટી શેર્સ રૂ. ૨૫નો એક એવા પૂરેપૂરા ભરપાઈ થયેલ)	૧૦,૦૦૦	૧૦,૦૦૦
કુલ બિન ચાલુ રોકાણો	૧,૨૮,૯૫,૦૫,૭૯૫	૭૨,૬૭,૪૦,૧૫૫
જુઓ નોંધ-૨૯- વાજબી કિંમતની માપણી		
ચાલુ રોકાણો		
વિગત	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૦ના રોજ
અન્ય ચાલુ રોકાણો	-	-
સરવાળો ચાલુ રોકાણો	-	-

નોંધ-૫ અન્ય નાણાકીય મિલકતો (રકમ રૂ. માં)

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૦ના રોજ
બિન ચાલુ		
જામીનગીરી અને અન્ય થાપણો	૧,૮૮,૨૮,૧૫૮	૧,૮૮,૨૮,૧૫૮
કુલ બિન ચાલુ નાણાકીય મિલકતો	૧,૮૮,૨૮,૧૫૮	૧,૮૮,૨૮,૧૫૮
ચાલુ		
કોર્પોરેટ સંસ્થાઓ પાસે રહેલી થાપણો	૮,૪૬,૦૫,૨૩,૬૮૧	૬,૦૨,૩૪,૬૨,૪૬૨
કુલ ચાલુ થાપણો	૮,૪૬,૦૫,૨૩,૬૮૧	૬,૦૨,૩૪,૬૨,૪૬૨

નોંધ - ૬ ચાલુ કરવેરા મિલકતો (રકમ રૂ. માં)

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૦ના રોજ
વર્ષ માટેનો અગ્રીમ આવકવેરો	૮,૮૨,૦૦,૦૦૦	૬,૦૮,૦૦,૦૦૦
મળવાપાત્ર ટીડીએસ	૬,૭૮,૩૫,૮૨૯	૬,૮૧,૦૬,૦૮૪
મળવાપાત્ર ટીસીએસ	૧૬,૮૭,૩૫૯	૨૨,૭૯,૨૪૧
વર્ષની આવકવેરા માટેની જોગવાઈ	(૧૦,૦૩,૫૫,૪૫૩)	(૧૨,૮૮,૭૪,૫૬૦)
કુલ ચાલુ કરવેરા મિલકતો (ચોખ્ખી)	૫,૭૩,૬૭,૭૩૫	૩૩,૧૦,૭૬૫

નોંધ -૭ અન્ય મિલકતો (રકમ રૂ. માં)

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૦ના રોજ
બિન ચાલુ		
કેપીટલ એડવાન્સ	૧૭,૬૩,૪૧૧	૩,૩૩,૬૯,૭૭૫
કામગીરી અને નિભાવની મળવાપાત્ર આવક	૯,૨૨,૧૨,૬૨૬	૭,૧૦,૭૮,૮૪૫
અગ્રીમ આવકવેરો (કરવેરાની જોગવાઈ બાદ ચોખ્ખો)	૨૫,૬૬,૩૦,૪૦૩	૨૫,૨૮,૮૭,૫૧૮
એમએટી કેડિટ એન્ટાઈટલમેન્ટ	૧૧,૯૬,૪૫,૯૨૮	૧૮,૪૯,૪૬,૫૮૨
અન્ય	૪૯,૪૮,૯૨૯	૪૯,૪૮,૯૨૯
કુલ અન્ય બિન ચાલુ મિલકતો	૪૭,૫૨,૦૧,૨૯૭	૫૫,૭૨,૩૧,૬૪૮
ચાલુ		
પરિયોજના વિકાસ ખર્ચ	૧૦,૦૪,૧૦,૧૪૬	૧૦,૦૪,૧૦,૧૪૬
નીચેના પર ઉપાર્જિત પરંતુ મળવાપાત્ર ન થયેલું વ્યાજ		
(ક) બેંક થાપણો પર	૭૧,૬૩,૪૨૬	૧,૦૬,૪૫,૯૮૦
(ખ) બોન્ડ પર	૩,૨૮,૮૦૭	૫,૧૬,૪૭૧
(ગ) કોર્પોરેટ સંસ્થાઓ પાસેની થાપણો	૨૩,૦૯,૪૧,૫૦૦	૨૧,૫૨,૪૯,૮૨૩
સંચાલન અને નિભાવની મળવાપાત્ર આવક	૨,૩૩,૬૫,૬૩૦	૨,૩૫,૬૭,૫૨૬
સ્થાયી મિલકતો પેટે મળવાપાત્ર હોય તેવી પાકતી રકમો	૭૦,૦૦,૦૦૦	૭૦,૦૦,૦૦૦
અન્ય		
ઘોઘા સુરખા ખાણ પરિયોજના માટે પેશગી	૮,૫૩,૧૬,૮૫૮	૧૮,૦૧,૨૦,૪૮૭
જીડબલ્યુઆઈએલ પાસેથી વસૂલાતપાત્ર રકમ	૯૯,૬૪,૪૦૫	-
અગાઉથી ચુકવાયેલ ખર્ચ	૭૪,૨૫,૪૭૧	૫૬,૬૧,૦૨૮
મળવાપાત્ર સર્વિસ ટેક્સ	૩,૨૮,૬૨૮	૩,૨૮,૬૨૮
મળવાપાત્ર જીએસટી	૨,૯૪,૫૬,૪૦૮	-
અન્ય	૪,૯૮,૩૧૫	૩૫,૫૫,૦૭૯
કુલ અન્ય ચાલુ મિલકતો	૫૦,૨૧,૯૮,૫૯૫	૫૫,૭૦,૫૫,૧૭૮

નોંધ- ૮ માલસામગ્રી (રકમ રૂ. માં)

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૦ના રોજ
સોલર પાર્ક-૧, ચારણકાનું થયેલું/ ચાલુ કામ	૩૨,૩૫,૩૦,૧૭૦	૩૨,૩૫,૮૦,૧૭૦
૭૦૦ મે.વો. અલ્ટ્રા મેગા પ્રોજેક્ટ રાધાનેસડા પેટે વિકાસ ખર્ચ	૨૮,૮૦,૩૬,૫૮૦	૩,૧૮,૨૪,૦૬૯
૫૦૦૦ મે.વો. સોલાર પ્રોજેક્ટ ધોલેરા પેટે વિકાસ ખર્ચ	૧૯,૭૩,૨૬૫	૧૭,૮૬,૫૩૦
કુલ માલસામગ્રી	૬૧,૩૫,૪૦,૦૨૫	૩૫,૭૨,૦૦,૭૬૯

નોંધ -૯ ધંધાસંબંધી મળવાપાત્ર (રકમ રૂ. માં)

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૦ના રોજ
સારી અને તારણવાળી ગણાતી હોય તેવી મળવાપાત્ર રકમો	૮,૮૭,૨૦,૫૪૧	૬,૮૬,૨૩,૪૮૦
સારી અને તારણ વિનાની ગણાતી હોય તેવી મળવાપાત્ર રકમો	૬૬,૦૫,૪૭,૮૪૪	૧,૭૫,૭૭,૮૧,૩૦૮
જે મળવાનું જોખમ વધુ હોય તેવી મળવાપાત્ર રકમો	-	-
ધંધા સંબંધી મળવાપાત્ર-મળવાનું જોખમ હોય તેવી	૧૧,૬૭,૧૦૦	૧૧,૬૭,૧૦૦
	૭૫,૦૪,૩૫,૪૮૫	૧,૮૨,૭૫,૮૧,૮૮૮
ખરાબ અને શકમંદ દેવાં માટે જોગવાઈ	-૧૧,૬૭,૧૦૦	-૧૧,૬૭,૧૦૦
ધંધા સંબંધી કુલ મળવાપાત્ર	૭૪,૯૨,૬૮,૩૮૫	૧,૮૨,૬૪,૧૪,૭૮૮

નોંધ - ૧૦ રોકડ અને રોકડ સમાન

(રકમ રૂ.માં)

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૦ના રોજ
રોકડ અને અન્ય બેંક બેલેન્સ		
બેંકમાં બેલેન્સ		
ચાલુ ખાતાઓમાં	૭૩,૩૪,૪૦,૩૫૨	૬૩,૮૭,૮૧૬
હાથ પરની રોકડ	૫૧,૧૦૧	૩૬,૪૨૪
કુલ રોકડ અને રોકડ સમાન	૭૩,૩૪,૯૧,૪૫૩	૬૪,૨૪,૨૪૦
અન્ય બેંક બેલેન્સ		
સીમાંત નાણાં થાપણો	૭૧,૩૫,૪૮,૮૭૦	૬૬,૦૩,૬૮,૨૪૮
તરલ થાપણ	૫,૭૬,૪૨,૪૩૪	૫,૩૬,૮૨,૩૨૦
કુલ અન્ય બેંક બેલેન્સ	૭૭,૧૧,૮૨,૩૦૪	૭૧,૪૦,૫૧,૫૬૮

નોંધ- ૧૧ ઇક્વિટી શેર મૂડી

(રકમ રૂ.માં)

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૦ના રોજ
અધિકૃત શેરમૂડી		
રૂ. ૧૦૦નો એક એવા ૬,૦૦,૦૦,૦૦૦ ઇક્વિટી શેર (૩૧ માર્ચ, ૨૦૨૧ : રૂ. ૧૦૦નો એક એવા ૬,૦૦,૦૦,૦૦૦ ઇક્વિટી શેર)	૬,૦૦,૦૦,૦૦,૦૦૦	૬,૦૦,૦૦,૦૦,૦૦૦
કુલ	૬,૦૦,૦૦,૦૦,૦૦૦	૬,૦૦,૦૦,૦૦,૦૦૦
વિગત	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૦ના રોજ
ઇસ્યુ થયેલી સબસ્ક્રાઇબ થયેલી અને ભરપાઈ થયેલી શેર મૂડી		
રૂ. ૧૦૦નો એક એવા ૫,૧૩,૨૨,૫૬૮ ઇક્વિટી શેર (ગત વર્ષે રૂ. ૧૦૦નો એક એવા ૫,૦૫,૦૨,૫૬૮ ઇક્વિટી શેર)	૫,૧૩,૨૨,૫૬૮	૫,૦૫,૦૨,૫૬૮
એક ઇક્વિટી શેરનો અડધો ભાગ દર્શાવતા ફેકશનલ સ્ટીકિંગ/ વોરન્ટ્સ-૧૫	૭૫૦	૭૫૦
કુલ..	૫,૧૩,૨૨,૫૬૮	૫,૦૫,૦૨,૫૬૮
અહેવાલના સમયગાળાના આરંભે અને અંતમાં બાકી હોય એવા શેર્સનો હિસાબમેળ		
વિગત	શેર્સની સંખ્યા	રકમ
૧લી એપ્રિલ, ૨૦૧૮ના રોજ		
વર્ષના આરંભે	૪,૪૦,૪૧,૨૩૮	૪,૪૦,૪૧,૨૩,૦૫૦
વત્તા : વર્ષ દરમિયાન ઇસ્યુ થયેલા શેર્સ	૩૫,૦૦,૦૦૦	૩૫,૦૦,૦૦,૦૦૦
૩૧મી માર્ચ, ૨૦૧૮ના રોજ	૪,૭૫,૪૧,૨૩૮	૪,૭૫,૪૧,૨૩,૦૫૦
વર્ષના આરંભે	૪,૭૫,૪૧,૨૩૮	૪,૭૫,૪૧,૨૩,૦૫૦
વત્તા: વર્ષ દરમિયાન ઇસ્યુ કરવામાં આવેલા શેર્સ	૨૮,૬૧,૩૩૦	૨૮,૬૧,૩૩,૦૦૦
૩૧મી માર્ચ, ૨૦૨૦ના રોજ	૫,૦૫,૦૨,૫૬૮	૫,૦૫,૦૨,૫૬,૦૫૦
વર્ષના આરંભે	૫,૦૫,૦૨,૫૬૮	૫,૦૫,૦૨,૫૬,૦૫૦
વત્તા: વર્ષ દરમિયાન ઇસ્યુ કરવામાં આવેલા શેર્સ	૮,૨૦,૦૦૦	૮,૨૦,૦૦,૦૦૦
૩૧મી માર્ચ, ૨૦૨૧ના રોજ	૫,૧૩,૨૨,૫૬૮	૫,૧૩,૨૨,૫૬,૦૫૦
૫ ટકાથી વધુ ઇક્વિટી શેર્સ ધરાવતા શેર ધારકોની વિગતો		
વિગત	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૦ના રોજ
ઇક્વિટી શેર્સની સંખ્યા		
ગુજરાત સરકાર	૪,૮૩,૮૨,૪૬૨	૪,૮૫,૭૨,૪૬૨
ઇક્વિટી શેર્સમાં હોલડિંગની ટકાવારી		
ગુજરાત સરકાર	૮૬.૨૪%	૮૬.૧૮%

નોંધો

ઇક્વિટી શેર્સ સાથે જોડાયેલી શરતો/ અધિકારો

- (ક) આ કંપની પ્રત્યેક શેર દીઠ રૂ. ૧૦૦ની કિંમત ધરાવતા એક જ પ્રકારના શેર્સ ધરાવે છે. પ્રત્યેક શેર ધારક કોઈ નિયંત્રણ વિના, શેર દીઠ એક મત આપવાનો અધિકાર ધરાવે છે અને જ્યારે પણ ડિવિડન્ડ જાહેર કરવામાં આવે ત્યારે ડિવિડન્ડ મેળવવા હકદાર છે. નિયામક મંડળ દ્વારા કોઈ ડિવિડન્ડ જાહેર કરવામાં આવે તો તે, વચગાળાના ડિવિડન્ડ સિવાય, ત્યાર પછીની વાર્ષિક સભામાં શેર ધારકોની મંજૂરીને અધીન છે. કંપની ફંડમાં જા્ય તેવા કિસ્સામાં તમામ શેર ધારકોને સમાન દરજ્જાના ગણવામાં આવે છે અને તમામ પ્રેફરેન્શ્યલ રકમોના વિતરણ બાદ કંપનીની બાકીની મિલકતો મેળવવા તેઓ હકદાર બને છે.
- (ખ) સરવૈયાની તારીખના તરત પહેલાંના ૫ વર્ષના સમયગાળા દરમિયાન રોકડમાં ચુકવણી પ્રાપ્ત થયા વિના, કરારને અનુસરીને કંપનીએ કોઈ શેર ફાળવ્યા નથી.
- (ગ) સરવૈયાની તારીખના તરત પહેલાંના ૫ વર્ષના સમયગાળા દરમિયાન, કંપનીને કોઈ શેરની પરત ખરીદી કરી નથી.

નોંધ ૧૨ અન્ય ઇક્વિટી

(રકમ રૂ.માં)

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૦ના રોજ
સામાન્ય અનામત	૩૭,૭૫,૮૮૦	૩૭,૭૫,૮૮૦
જાળવી રાખેલી આવક	૬,૦૫,૭૮,૪૪૦	૫,૬૪,૫૪,૩૩,૫૬૩
ફાળવણી બાકી હોય એવા શેર્સના અરજી નાણાં		-
અપ્રાપ્ત નફો/ નુકસાન દર્શાવતી અનામત	૮૮,૦૪,૦૮,૮૦૭	૪૨,૭૭,૨૨,૩૮૦
કુલ અન્ય ઇક્વિટી	૭,૦૫,૨૦,૩૦,૩૮૮	૬,૦૭,૬૮,૩૧,૮૩૩
વિગત	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૦ના રોજ
સામાન્ય અનામત		
ઉઘડતી સિલક	૩૭,૭૫,૮૮૦	૩૭,૭૫,૮૮૦
કુલ સામાન્ય અનામત	૩૭,૭૫,૮૮૦	૩૭,૭૫,૮૮૦
વિગત	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૦ના રોજ
જાળવી રાખેલી આવક		
ઉઘડતી સિલક	૫,૬૪,૫૪,૩૩,૫૬૩	૪,૮૭,૦૮,૫૩,૩૨૫
વત્તા :		
વર્ષ દરમિયાન નફો	૪૧,૨૪,૧૦,૮૩૮	૬૭,૪૫,૮૦,૨૩૮
જાળવી રાખેલી કુલ આવક	૬,૦૫,૭૮,૪૪૦	૫,૬૪,૫૪,૩૩,૫૬૩
વિગત	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૦ના રોજ
ફાળવણી બાકી હોય એવા શેર્સના અરજી નાણાં		
ઉઘડતી સિલક	-	૧૬,૨૮,૦૦,૦૦૦
વત્તા : વર્ષ દરમિયાન ઉમેરો	૮,૨૦,૦૦,૦૦૦	૧૩,૩૩,૩૩,૦૦૦
બાદ : વર્ષ દરમિયાન ઘટાડો	(૮,૨૦,૦૦,૦૦૦)	(૨૮,૬૧,૩૩,૦૦૦)
ફાળવણી બાકી હોય તેવા શેર્સના કુલ શેર અરજી નાણાં	-	-
વિગત	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૦ના રોજ
અપ્રાપ્ત નફો/ નુકસાન દર્શાવતી અનામતો		
એફ.વી.ઓ.સી.આઈ.- ઇક્વિટી રોકાણ		
ઉઘડતી સિલક	૪૨,૭૭,૨૨,૩૭૭	૪૨,૫૮,૦૫,૧૦૧
એફ.વી.ઓ.સી. ઇક્વિટી ખતોની વાજબી કિંમતમાં વધારો/ (ઘટાડો)	૫૬,૨૭,૬૫,૬૪૦	૨૨,૮૨,૩૫૩
નિવૃત્તિ પછીના લાભોની જવાબદારીની પુનઃ ગણતરી	(૧,૧૦,૨૦૫)	(૫,૧૫,૦૬૪)
આ બાબતોને લગતો આવક વેરો	૩૨,૦૮૨	૧,૪૮,૮૮૭
અપ્રાપ્ત નફો/ નુકસાન દર્શાવતી અનામતો	૮૮,૦૪,૦૮,૮૦૪	૪૨,૭૭,૨૨,૩૭૭

નોંધ-૧૩ જોગવાઈઓ

(રકમ રૂ. માં)

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૦ના રોજ
બિન ચાલુ		
ગ્રેચ્યુઈટી માટેની જોગવાઈ	૯,૮૧,૯૬૦	૧,૩૨,૩૨૪
રજના રોકડમાં રૂપાંતર માટેની જોગવાઈ	૧,૩૩,૭૩,૬૪૬	૧,૨૦,૯૨,૮૭૧
એસેટ રીટાયરમેન્ટ ઓબ્લીગેશન-એઆરઓ	૧૨,૮૫,૪૭,૭૯૩	૧૧,૯૦,૨૫,૭૩૪
કુલ બિન ચાલુ જોગવાઈઓ	૧૪,૨૯,૦૩,૩૯૯	૧૩,૧૨,૫૦,૯૨૯
ચાલુ		
ગ્રેચ્યુઈટી માટે જોગવાઈ	૪,૪૪,૯૪૧	૫,૯૨,૪૬૨
ખર્ચ માટે જોગવાઈ	૫૮,૧૯,૨૭૪	૫,૨૯,૧૨૩
કુલ ચાલુ જોગવાઈઓ	૬૨,૬૪,૨૧૫	૧૧,૨૧,૫૮૫

નોંધ : ૧૪ વિલંબિત કરમિલકતો/ (જવાબદારી)

(રકમ રૂ. માં)

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૦ના રોજ
વિલંબિત કર મિલકતો	૪,૩૧,૫૨,૨૮૪	૪,૧૦,૭૬,૧૨૨
સરવાળો...	૪,૩૧,૫૨,૨૮૪	૪,૧૦,૭૬,૧૨૨
વિલંબિત કર જવાબદારી	૪૬,૧૦,૧૩,૮૫૦	૪૬,૯૭,૪૪,૨૦૩
સરવાળો	૪૬,૧૦,૧૩,૮૫૦	૪૬,૯૭,૪૪,૨૦૩
ચોખ્ખી વિલંબિત કર (મિલકતો/ જવાબદારી)	૪૧,૭૯,૬૧,૫૬૬	૪૨,૯૬,૬૮,૦૮૧

નોંધ- ૧૫ અન્ય જવાબદારીઓ

(રકમ રૂ. માં)

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૦ના રોજ
બિન ચાલુ		
ધંધા સંબંધી ચુકવવાપાત્ર		
(ક) સૂક્ષ્મ ઉદ્યોગ સાહસો અને નાના ઉદ્યોગ સાહસો સિવયના લેણદારોનું કુલ બાકી લેણું	૨,૧૮,૭૩,૮૭૧	૨,૧૭,૨૫,૬૭૧
(ખ) સૂક્ષ્મ ઉદ્યોગ સાહસો અને નાના ઉદ્યોગ સાહસોનું કુલ બાકી લેણું	-	-
અન્ય	૫૦,૬૩,૯૨,૭૫૦	૧૮,૫૧,૧૪,૧૩૬
કુલ બિન ચાલુ જવાબદારીઓ	૫૨,૮૨,૬૬,૬૨૧	૨૦,૬૮,૩૯,૮૦૭
ચાલુ		
વૈધાનિક જવાબદારી	૩,૦૫,૨૩,૯૧૭	૨૪,૦૩,૭૯,૭૬૫
ચુકવવાપાત્ર કર્મચારી લાભો	૧,૮૮,૨૦૦	૨૭,૩૨,૩૩૫
ગ્રાહકો પાસેથી પેશગી	૨,૦૯,૫૪,૦૨,૭૨૩	૪૭,૭૬,૯૪,૯૩૭
વપરાશ બાકી હોય એવી ગ્રાન્ટ	૩૬,૦૪,૭૦,૪૬૪	૧૬,૬૨,૪૭,૦૪૩
ગુજરાત સરકારની લોન ઉપર વ્યાજ	-	૬૧,૮૮,૭૯,૩૨૧
ગ્રાન્ટ પર ચુકવવાપાત્ર વ્યાજ	-	૧,૭૬,૧૯,૮૪૬
ગ્રાન્ટ પર જેડાને ચુકવવાપાત્ર વ્યાજ	૧૧,૨૨,૮૭,૦૭૨	-
અર્નેસ્ટ મની ડિપોઝીટ	૨,૨૬,૦૬,૬૮૪	૧,૯૧,૩૦,૯૦૦
ચુકવવાપાત્ર સીએસઆર	૨,૭૨,૧૧,૩૫૮	-
અન્ય	૧,૨૫,૪૭,૫૦,૧૧૯	૧,૩૩,૧૪,૮૯,૦૩૩
કુલ ચાલુ જવાબદારીઓ	૩,૯૦,૩૪,૪૦,૫૩૬	૨,૮૭,૪૧,૭૩,૧૭૯

નોંધ- ૧૬ ધંધા સંબંધી ચુકવવાપાત્ર

(રકમ રૂ. માં)

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૦ના રોજ
સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગો સિવાયના લેણદારોનાં બાકી લેણાં	૩૨,૮૫,૮૫,૮૧૯	૮,૪૫,૬૩,૨૩૦
સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગોનાં કુલ બાકી લેણાં	-	૫૨,૬૨,૮૭૪
ધંધા સંબંધી ચુકવવાપાત્ર કુલ રકમ	૩૨,૮૫,૮૫,૮૧૯	૮,૯૮,૨૬,૧૦૪

* માઈક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ એક્ટ, ૨૦૦૬ હેઠળ ઘણાં સપ્લાયર્સની માહિતી કંપનીને મળી નથી. વધુમાં ૩૧મી માર્ચ, ૨૦૨૧ના રોજ કંપનીના શીરે કોઈ સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગોનું એવું કોઈ લેણું નથી જે ઠપ કરતા વધુ દિવસથી બાકી હોય. ઉક્ત અધિનિયમ હેઠળ જાહેર કરવી જરૂરી છે એવી આ માહિતી, કંપની પાસે ઉપલબ્ધ માહિતીના આધારે પારખવામાં આવેલી આવી પાટીઓ પૂરતી નક્કી કરવામાં આવી છે.

નોંધ- ૧૭ કામગીરીઓમાંથી આવક

(રકમ રૂ. માં)

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૧ અંતિત	૩૧મી માર્ચ ૨૦૨૦ અંતિત
માલસામગ્રીનું વેચાણ :		
લિગ્નાઈટ પ્રોજેક્ટ્સમાંથી આવક*	૨,૨૬,૮૦,૬૫,૦૯૨	૧,૬૮,૯૮,૩૮,૪૫૧
સેવાઓનું વેચાણ		
પટે આપવામાં આવેલા પ્લોટમાંથી આવક	-	૮,૨૦,૮૪,૦૫૧
વીજળીના નિર્માણમાંથી આવક	૨૪,૭૧,૭૮,૮૧૮	૩૦,૬૪,૧૮,૩૦૮
બાદ : વીજળીના વેચાણ પર રિબેટ	(૧,૧૮,૬૪,૧૭૫)	(૧,૪૨,૮૨,૭૩૧)
બાદ : ડીએસએમ ચાજીસ - વિડ મીલ પ્રોજેક્ટ્સ	(૪,૫૯,૬૯૫)	(૯,૫૪,૧૩૭)
બાદ : ડીએસએમ ચાજીસ - સોલાર પાવર પ્રોજેક્ટ્સ	(૧,૭૫,૨૭,૭૮૯)	(૯૯,૩૮,૫૩૭)
બાદ : ગ્રીન ઈન્સેન્ટીવ અંગેનું ખર્ચ	(૩૨,૬૪,૦૬૯)	-
	૨,૪૮,૨૧,૨૮,૧૮૨	૨,૦૫,૩૧,૬૫,૪૦૫
અન્ય કાર્યલક્ષી આવક		
પટા ભાડું	૧,૪૬,૩૪,૪૪૩	૧,૪૬,૦૫,૨૫૮
કામગીરી અને નિભાવ પેટે વસૂલ કરવામાં આવેલ ચારણકા પ્રોજેક્ટ ખર્ચ	૧૯,૨૪,૨૫,૦૧૦	૧૯,૩૭,૧૮,૯૧૪
અન્ય કાર્યલક્ષી આવક	૮૦,૩૬૩	૧,૫૦,૦૦૦
	૨૦,૭૧,૩૯,૮૧૬	૨૦,૮૪,૭૪,૧૭૨
કામગીરીઓમાંથી કુલ આવક	૨,૬૮,૯૨,૬૭,૯૯૮	૨,૨૬,૧૬,૩૯,૫૭૭

* જીપીસીએલ અને જીએસઈસીએલ વચ્ચે ફ્યુઅલ સપ્લાય એગ્રીમેન્ટ (એફએસએ)ની પ્રક્રિયા ચાલુ છે. તેને આખરી રૂપ મળતાં તેનો અમલ કરવામાં આવશે. પરંતુ વચગાળાની વ્યવસ્થારૂપે જીપીસીએલએ ઉત્પન્ન ફી પેટે ચુકવેલી રકમ છૂટી કરવા માટે જીએસઈસીએલને વિનંતી કરેલ છે.

નોંધ - ૧૮ અન્ય આવક

(રકમ રૂ. માં)

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૧ અંતિત	૩૧મી માર્ચ ૨૦૨૦ અંતિત
લાંબા ગાળાના રોકાણો અંગે ડિવિડન્ડ	૧,૬૧,૦૦,૦૧૮	૧,૫૭,૬૬,૯૫૯
લાંબાગાળાના રોકાણો અંગે ડિવિડન્ડ (બેંક)	-	૧,૫૦૦
પ્રાપ્ત થયેલ વીમાનો દાવો	૧૨,૯૦૦	૯૧,૮૦,૮૬૪
ટેન્ડર ફી	૨,૨૬,૦૦૨	૨,૯૫,૧૮૨
પ્રકીર્ણ આવક	૨,૩૬,૪૩,૯૭૬	૨૧,૪૫,૫૫૫
	૩,૯૯,૮૨,૮૯૬	૨,૭૩,૯૦,૦૬૦
કુલ અન્ય આવક	૩,૯૯,૮૨,૮૯૬	૨,૭૩,૯૦,૦૬૦

નોંધ- ૧૯ નાણા સહાયમાંથી આવક
(રકમ રૂ. માં)

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૧ અંતિત	૩૧મી માર્ચ ૨૦૨૦ અંતિત
વ્યાજની આવક		
ઈન્ટર કોર્પોરેટ ડિપોઝીટ અંગેનું વ્યાજ	૪૫,૬૯,૨૭,૪૫૧	૪૧,૫૨,૫૬,૮૫૪
થાપણો અંગેનું વ્યાજ	૩,૬૯,૧૪,૬૫૫	૪,૨૯,૮૩,૧૧૮
અન્ય વ્યાજ	૨,૨૫૦	૪,૦૧૮
કુલ નાણાકીય આવક	૪૯,૩૮,૪૪,૩૫૬	૪૫,૮૨,૪૪,૦૮૯

નોંધ- ૨૦ પ્લોટ્સના બાંધકામ અને વિકાસ અંગેનું ખર્ચ
(રકમ રૂ. માં)

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૧ અંતિત	૩૧મી માર્ચ ૨૦૨૦ અંતિત
સોલાર પાર્ક - ૧		
ઉઘડતી સિલક પ્લોટ્સના બાંધકામ અને વિકાસ અંગેનું ખર્ચ	૩૨,૩૫,૮૦,૧૭૦	૩૭,૨૯,૪૫,૮૩૫
વત્તા : વર્ષ દરમિયાન થયેલ/ તબદીલ થયેલ	-	૧૩,૨૦,૦૦૦
બાદ : વર્ષ દરમિયાન સમાયોજિત	(૬૦,૦૦૦)	(૨૮,૭૯,૩૯૯)
બંધ થતી સિલક	(૩૨,૩૫,૩૦,૧૭૦)	(૩૨,૩૫,૮૦,૧૭૦)
૭૦૦ મે.વો. રાધાનેસડા યુએમએસએસપી		
બાંધકામ ખર્ચ અને પ્લોટના વિકાસની ઉઘડતી સિલક	૩,૧૮,૨૪,૦૬૯	૨,૭૬,૭૪,૧૧૭
વત્તા : વર્ષ દરમિયાન થયેલ/ તબદીલ થયેલ	૨૫,૭૦,૩૮,૧૧૨	૨૧,૦૦,૮૦,૬૦૫
બાદ : વર્ષ દરમિયાન સમાયોજિત	(૮,૨૫,૫૮૦)	(૨૦,૫૯,૪૦,૬૫૩)
બંધ થતી સિલક	(૨૮,૮૦,૩૬,૫૮૦)	(૩,૧૮,૨૪,૦૬૯)
ધોલેરા પ્રોજેક્ટ		
બાંધકામ ખર્ચ અને પ્લોટના વિકાસની ઉઘડતી સિલક	૧૭,૮૬,૫૩૦	-
વત્તા : વર્ષ દરમિયાન થયેલ/ તબદીલ થયેલ	૧,૮૬,૭૩૫	૧૭,૮૬,૫૩૦
બાદ : વર્ષ દરમિયાન સમાયોજિત	-	-
બંધ થતી સિલક	(૧૮,૭૩,૨૬૫)	(૧૭,૮૬,૫૩૦)
બાંધકામ ખર્ચ અને પ્લોટના વિકાસ અંગેનું કુલ ખર્ચ	-	૪,૭૭,૯૬,૨૬૬

નોંધ- ૨૧ ઉત્પન્ન વિકાસ ખર્ચ
(રકમ રૂ. માં)

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૧ અંતિત	૩૧મી માર્ચ ૨૦૨૦ અંતિત
લિગ્નાઈટ ઉત્પન્ન વિકાસ ખર્ચ	૧,૮૮,૦૧,૨૧,૦૭૫	૧,૫૮,૪૧,૩૨,૫૫૦
લિગ્નાઈટ ઉત્પન્ન વિકાસ કુલ ખર્ચ	૧,૮૮,૦૧,૨૧,૦૭૫	૧,૫૮,૪૧,૩૨,૫૫૦

નોંધ - ૨૨ કર્મચારીઓના લાભો અંગેનું ખર્ચ
(રકમ રૂ. માં)

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૧ અંતિત	૩૧મી માર્ચ ૨૦૨૦ અંતિત
પગાર, વેતન અને ભથ્થાં	૨,૪૧,૮૧,૪૮૫	૧,૩૪,૮૭,૭૯૬
ભવિષ્ય નિધિ અને અન્ય ભંડોળમાં ફાળો	૩૦,૨૮,૧૫૬	૨૮,૮૬,૧૨૦
કર્મચારીઓ પૂરા પાડવા અંગેનું ખર્ચ	૪૮,૫૧,૧૨૯	૫૭,૫૬,૬૪૪
કર્મચારીવર્ગના કલ્યાણ માટે ખર્ચ	૮૧,૫૪૩	૪૨,૮૪૦
કર્મચારીઓના લાભો અંગેનું કુલ ખર્ચ	૩,૨૧,૪૨,૩૧૩	૨,૨૧,૮૩,૫૦૦

નોંધ- ૨૩ નાણા વ્યવસ્થા સંબંધી ખર્ચ
(રકમ રૂ. માં)

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૧ અંતિત	૩૧મી માર્ચ ૨૦૨૦ અંતિત
બેંક ગેરંટી ચાર્જ	૧૮,૫૪,૦૫૦	૧૭,૮૯,૫૬૦
અનુદાન પરનું વ્યાજ(*)	૧૨,૧૩,૮૧,૪૨૯	૧,૮૨,૮૮,૨૩૧
પટે ધારણ કરેલી મિલકતો પરનું વ્યાજ	૩,૩૭,૮૬૫	-
એસેટ રીટાયરમેન્ટ ઓબ્લીગેશનની જોગવાઈ અંગે વળતર બાદ કરવું;	૯૫,૨૨,૦૫૯	૮૮,૧૬,૭૨૧
કુલ નાણા વ્યવસ્થાનું કુલ ખર્ચ	૧૩,૩૧,૦૫,૪૦૩	૨,૮૯,૦૪,૫૧૨

(*) જીપીસીએલ સરકાર પાસેથી નાણાકીય સહય મેળવે છે અને તે ગુજરાત સ્ટેટ ફાયનાન્સીયલ સર્વીસીસ લિમિટેડ (જીએસએફએલ લિ.) પાસે આઈસીડીમાં પાર્ક કરવામાં આવે છે. તેના પર જે વ્યાજ મળે છે તે જીપીસીએલએ સરકારને આપવાનું હોય છે. તેથી જીપીસીએલએ તેની આવક અને ખર્ચ ભરતીય હિસાબી ધોરણ ૧ મુજબ નોંધ્યું છે. ઉક્ત લેવડદેવડ નાણાકીય પત્રકોને સારી રીતે સમજી શકાય તે માટે નફા અને નુકસાનના પત્રકથી દર્શાવવામાં આવી છે કરણકે ભરતીય હિસાબી ધોરણ ૧ સ્પષ્ટપણે એમ જણાવે છે કે “ભરતીય હિસાબી ધોરણ હેઠળ જરૂરી હોય અથવા પરવાનગી આપવામાં આવી હોય તે સિવાય, કોઈ સંસ્થા મિલકત અને જવાબદારી અથવા આવક અને ખર્ચ સમસામે વાળશે નહીં”.

નોંધ- ૨૪ અન્ય ખર્ચ
(રકમ રૂ. માં)

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૧ અંતિત	૩૧મી માર્ચ ૨૦૨૦ અંતિત
(ક) મરામત અને નિભાવ		
પ્લાન્ટ અને મશીનરી	૭,૩૪,૫૧,૫૪૮	૭,૮૦,૨૭,૧૭૨
વીમો	૭૫,૭૭,૨૭૮	૩૯,૦૩,૮૨૨
વ્યવસાયિક ફી	૩૮,૨૧,૫૬૫	૯૩,૦૭,૯૬૮
સમયપત્રક અને હિસાબો તૈયાર કરવાની ફી	૮૯,૨૧૮	૭૫,૮૯૪
પ્રવાસ ખર્ચ	૩,૨૦,૪૭૮	૧૦,૦૦,૪૯૨
વોટર ચાર્જીસ	૧૧,૬૭,૭૭,૩૯૮	૭૫,૮૮,૯૮૦
અન્ય મરામત અને નિભાવ	૨૯,૦૫,૭૩૮	૩૪,૦૪,૧૩૦
(ખ) અન્ય	૨૦,૪૯,૪૩,૨૨૨	૧૦,૩૩,૦૮,૪૫૭
પટા ભાડુ	-	૧,૪૮,૨૦૦
ભાડુ	૨,૮૯,૬૧૬	૪,૮૦,૨૮૮
મિલકતોનાં વેચાણ અંગેની ખોટ	૮,૮૨,૭૪,૮૩૨	૪૬૭
દરો અને કરવેરા	૪૯,૦૦૧	૨૨,૦૩,૨૬૭
જાહેરાત અને વેચાણ ખર્ચ	૭૧,૮૨,૯૯૧	૪,૧૮,૩૩૪
વીજ ખર્ચ	૭,૩૬,૨૧૯	૯,૦૩,૦૨૯
કરવેરા પર વ્યાજ	૧૬,૫૭૪	૪,૦૭,૭૪૧
સી.એસ.આર./ડોનેશન (જુઓ નોંધ ૩૧(પ))	૪,૦૫,૬૪,૭૧૩	૫૩,૦૦,૦૦૦
અન્ય ખર્ચ	૧,૬૯,૫૨,૨૯૩	૧,૨૨,૮૦,૭૨૯
(ગ) વૈધાનિક ઓડિટરો તરીકે	૧૫,૪૦,૬૬,૨૩૯	૨,૨૧,૫૨,૦૫૪
	૧,૧૪,૮૦૦	૧,૧૩,૪૮૨
	૧,૧૪,૮૦૦	૧,૧૩,૪૮૨
સરવાળો- અન્ય ખર્ચ (ક + ખ + ગ)	૩૫,૯૧,૨૪,૨૬૦	૧૨,૫૫,૭૩,૯૯૪

નોંધ- ૨૫ શેર દીઠ આવક

વિગત	(રકમ રૂ. માં)	
	૩૧મી માર્ચ ૨૦૨૧ અંતિત	૩૧મી માર્ચ ૨૦૨૦ અંતિત
નીચેના માટે ઈકિવટી ધારકોને આપવાનો નફો		
મૂળભૂત આવક	૪૧,૨૪,૧૦,૯૩૯	૬૭,૪૫,૮૦,૨૩૮
ઘટેલી કિંમતની અસર માટે સમાયોજિત	-	-
નીચેના માટે ઈકિવટી શેર્સની ભારિત સરેરાશ સંખ્યા		
મૂળભૂત શેરદીઠ આવક	૫,૦૬,૦૧,૪૧૭	૪,૯૦,૫૬,૯૯૯
ઘટેલી કિંમતની અસર માટે સમાયોજિત	-	-
શેરદીઠ આવક		
મૂળભૂત	૮.૧૫	૧૩.૭૫
ઘટેલી	૮.૧૫	૧૩.૭૫

૨૨.૧ ગ્રેજ્યુઇટી અને રજા પગારની જોગવાઈ અંગે જાહેરાત
કંપનીએ ભારતીય જીવન વીમા નીગમની રૂપ ગ્રેજ્યુઇટી યોજનામાં ભાગ લીધો છે. ગ્રેજ્યુઇટી લાભો અને રજા પગારને લાભદાયી યોજનાઓ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી હોવાથી અને તેની ચુકવણી ભવિષ્યમાં કરવાની થતી હોવાથી તે સરવૈયાની તારીખે “એક્યુરિયલ” મૂલ્યે નક્કી કરવામાં આવે છે.

ગ્રેજ્યુઇટી અને રજા પગારનું મૂલ્ય નક્કી કરતી વખતે નીચેની ધારણાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

વિગત	૨૦૨૦-૨૧		૨૦૧૯-૨૦	
	ગ્રેજ્યુઇટી	રજા પગાર	ગ્રેજ્યુઇટી	રજા પગાર
આવરદા	ભારતીય નિશ્ચિત આવરદા (૨૦૧૨-૧૪) યુએલટી.		ભારતીય નિશ્ચિત આવરદા (૨૦૧૨-૧૪) યુએલટી.	
ઉપાડનો દર	યુવાન વયે ૫ ટકાના દરે જે ઘટીને વૃદ્ધ થયે ૧ ટકાના દરે		યુવાન વયે ૫ ટકાના દરે જે ઘટીને વૃદ્ધ થયે ૧ ટકાના દરે	
નિવૃત્તિ વય	૫૮ અને ૬૦ વર્ષ		૫૮ અને ૬૦ વર્ષ	
વળતરનો દર	૬.૦૫%	૬.૦૫%	૬.૪૫%	૬.૪૫%
આયોજિત મિલકતો અંગેના મળતરનો દર	૬.૪૫%	૬.૪૫%	૬.૪૫%	૬.૪૫%
પગાર વધારો	૭.૦૦%	૭.૦૦%	૭.૦૦%	૭.૦૦%

નીચેના કોઠામાં, ભારતીય હિસાબી ધોરણ-૧૯ “કર્મચારી લાભ” હેઠળ જરૂરી છે તે મુજબ ગ્રેજ્યુઇટી પ્લાન અને રજા પગારની સંથિતિ નિયત કરવામાં આવી છે. (રકમ રૂ. માં)

વિગત	૨૦૨૦-૨૧		૨૦૧૯-૨૦	
	ગ્રેજ્યુઇટી	રજા પગાર	ગ્રેજ્યુઇટી	રજા પગાર
લાભ સંબંધી જવાબદારીમાં ફેરફાર દર્શાવતો કોઠો				
નિર્ધારિત લાભ સંબંધી જવાબદારીની ઉઘડતી સિલક	૧,૬૨,૦૩,૨૫૫	૧,૨૦,૯૨,૮૭૧	૧,૫૯,૩૫,૨૯૯	૧,૧૧,૭૦,૩૨૫
વ્યાજ ખર્ચ	૧૦,૨૮,૮૪૫	૭,૭૦,૨૦૯	૧૦,૬૦,૬૨૪	૭,૫૧,૪૦૫
ચાલુ સેવા ખર્ચ	૫,૬૪,૨૬૮	૫,૦૦,૮૧૯	૬,૦૫,૧૬૦	૪,૭૦,૩૭૬
ચુકવવામાં આવેલ લાભ	(૧૭,૧૮,૪૪૫)	(૧૧,૨૩,૨૬૦)	(૧૯,૮૭,૯૭૩)	(૧૨,૫૫,૪૯૦)
જવાબદારી અંગેની એક્યુરિયલ ખોટ / (લાભ)	૧,૬૯,૩૮૮	૧૧,૩૩,૦૦૭	૫,૮૦,૧૪૫	૮,૫૬,૨૫૫
ભૂતકાળની સેવાનું ખર્ચ				
આ સમયગાળાના અંતે જવાબદારી	૧,૬૨,૪૭,૩૧૧	૧,૩૩,૭૩,૬૪૬	૧,૬૨,૦૩,૨૫૫	૧,૨૦,૯૨,૮૭૧
આયોજિત મિલકતોની વાજબી કિંમતમાં ફેરફાર દર્શાવતો કોઠો				
આરંભમાં આયોજિત મિલકતોની વાજબી કિંમત	૧,૫૪,૭૮,૪૬૯	-	૧,૪૦,૩૦,૩૨૫	-
ઉઘડતા ભંડોળ સાથે સમાયોજન	-	-	-	-
આયોજિત મિલકતો અંગે અપેક્ષિત મળતર	૫૯,૧૮૩	-	૭૫,૦૮૧	-
ફાળો	-	-	૨૪,૧૧,૯૮૦	-
અનુભવ સંબંધી સમાયોજનને કારણે એક્યુરિયલ ખોટ / (લાભ)	-	-	-	-
વ્યાજ આવક	૧૦,૦૧,૨૦૩	-	૯,૪૯,૦૫૬	-
ચુકવવામાં આવેલ લાભ -	(૧૭,૧૮,૪૪૫)	-	(૧૯,૮૭,૯૭૩)	-
આયોજિત મિલકતો અંગે એક્યુરિયલ લાભ/ (ખોટ)	-	-	-	-
આ સમયગાળાના અંતે આયોજિત મિલકતોની વાજબી કિંમત	૧,૪૮,૨૦,૪૧૦	-	૧,૫૪,૭૮,૪૬૯	-

વિગત	૨૦૨૦-૨૧		૨૦૧૯-૨૦	
	ગ્રેજ્યુઇટી	રજા પગાર	ગ્રેજ્યુઇટી	રજા પગાર
ધ્યાનમાં લેવામાં આવેલ ખરેખર લાભ/નુકસાન				
જવાબદારીઓ અંગે એક્યુરિયલ(લાભ)/ ખોટ	૭,૨૪,૭૮૬	૧૧,૩૩,૦૦૭	૧૯,૦૪,૯૭૪	૮,૫૬,૨૫૫
આયોજિત મિલકતો અંગે એક્યુરિયલ (લાભ)/ ખોટ	૫૯,૧૮૩	-	૭૫,૦૮૧	-
વર્ષ દરમિયાન ધ્યાનમાં લેવામાં આવેલ ચોખ્ખો એક્યુરિયલ (લાભ)/ ખોટ	૭,૮૩,૯૬૯	૧૧,૩૩,૦૦૭	૧૯,૮૦,૦૫૫	૮,૫૬,૨૫૫
સરવૈયામાં ધ્યાનમાં લેવામાં આવેલ રકમ				
આ સમયગાળાના અંતે જવાબદારી	૧,૬૨,૪૭,૩૧૧	૧,૩૩,૭૩,૬૪૬	૧,૬૨,૦૩,૨૫૫	૧,૨૦,૯૨,૮૭૧
આ સમયગાળાના અંતે આયોજિત મિલકતની વાજબી કિંમત	૧,૪૮,૨૦,૪૧૦	-	૧,૫૪,૭૮,૪૬૯	-
સરવૈયામાં ધ્યાનમાં લેવામાં આવેલી ચોખ્ખી રકમ	૧૪,૨૬,૯૦૧	૧,૩૩,૭૩,૬૪૬	૭,૨૪,૭૮૬	૧,૨૦,૯૨,૮૭૧
નફા અને નુકસાન પત્રકમાં ધ્યાનમાં લેવામાં આવેલ ખર્ચ				
ચાલુ સેવા ખર્ચ	૫,૬૪,૨૬૮	૫,૦૦,૮૧૯	૬,૦૫,૧૬૦	૪,૭૦,૩૭૬
વ્યાજ ખર્ચ	૨૭,૬૪૨	૭,૭૦,૨૦૯	૧,૧૧,૫૬૮	૭,૫૧,૪૦૫
આયોજિત મિલકત અંગે અપેક્ષિત મળતર	-	-	-	-
ધ્યાનમાં લેવાની ચોખ્ખી એક્યુરિયલ ખોટ/ (લાભ)	-	૧૧,૩૩,૦૦૭	-	૮,૫૬,૨૫૫
ઉઘડતા ભંડોળ/ અગાઉના સમયના ચાજીઝ સાથે સમાયોજન	-	-	-	-
નફા અને નુકસાન પત્રકમાં ધ્યાનમાં લેવામાં આવેલ ચોખ્ખું ખર્ચ	૫,૯૧,૯૧૦	૨૪,૦૪,૦૩૫	૭,૧૬,૭૨૮	૨૧,૭૮,૦૩૬
અન્ય સર્વગ્રાહી આવકના પત્રકમાં ધ્યાનમાં લેવામાં આવેલ ખર્ચ				
નાણાકીય ધારણામાં ફેરફારને કારણે	૩,૧૨,૧૬૨	૨,૭૬,૫૯૮	૬,૪૬,૮૫૨	(૯,૦૫૮)
વસ્તી સંબંધી ધારણામાં ફેરફારના કારણે	-	-	(૮,૦૫૮)	-
અનુભવ સંબંધી સમાયોજનને કારણે	(૧,૪૨,૭૭૪)	૮,૫૬,૪૦૯	(૪૭,૬૪૯)	૮,૫૬,૨૫૫
વ્યાજ સંબંધી આવકમાં સમાવિષ્ટ રકમને બાદ કરીને આયોજિત મિલકતો અંગે મળતર	(૫૯,૧૮૩)	-	(૭૫,૦૮૧)	-
ઓસીઆઈમાં ધ્યાનમાં લેવામાં આવેલ ચોખ્ખો ખર્ચ	૧,૧૦,૨૦૫	૧૧,૩૩,૦૦૭	૫,૧૫,૦૬૪	૮,૫૬,૨૫૫

સંવેદના વિશ્લેષણ (Sensitivity Analysis)
અહેવાલની તારીખે, અન્ય ધારણાઓને અચળ રાખીને, કોઈ એક સંબંધિત એક્યુરિયલ ધારણામાં આવેલા, નોંધપાત્રીતે સંભવ ફેરફારોએ, નિર્ધારિત લાભસંબંધી જવાબદારીઓ પર નીચે દર્શાવ્યા મુજબ અસર કરી હતી. (રકમ રૂ. માં)

ગ્રેજ્યુઇટી	૨૦૨૦-૨૧		૨૦૧૯-૨૦	
	વધારો	ઘટાડો	વધારો	ઘટાડો
વળતરનો દર ૦.૫ ટકા (અગાઉના વર્ષે ૦.૫ ટકા)	૧,૫૮,૫૮,૪૪૭	૧,૬૬,૪૯,૯૩૮	૧,૫૭,૬૮,૦૬૩	૧,૬૬,૫૪,૮૯૭
પગાર વૃદ્ધિ દર ૦.૫ ટકા (અગાઉના વર્ષે ૦.૫ ટકા)	૧,૬૩,૬૦,૩૯૩	૧,૬૧,૭૩,૫૪૫	૧,૬૩,૫૬,૪૧૭	૧,૬૦,૫૦,૪૮૪
રજા પગાર				
વળતરનો દર ૦.૫ ટકા (અગાઉના વર્ષે ૦.૫ ટકા)	૧,૩૦,૨૯,૨૦૩	૧,૩૭,૩૧,૫૭૬	૧,૧૭,૬૩,૬૫૪	૧,૨૪,૩૪,૯૬૯
વળતરનો દર ૦.૫ ટકા (અગાઉના વર્ષે ૦.૫ ટકા)	૧,૩૭,૨૬,૬૫૭	૧,૩૦,૩૦,૬૩૦	૧,૨૪,૩૧,૫૬૩	૧,૧૭,૬૩,૮૦૫

૨૬. અસરકારક કર ગણતરી અને વિલંબિત કર મિલકતો/ (જવાબદારીઓ) (ચોખ્ખી)

કરસંબંધી ખર્ચ નફા અને નુકસાન પત્રકમાં ધ્યાનમાં લેવામાં આવેલી રકમ (રકમ રૂ.માં)		
વિગતો	૩૧ માર્ચ ૨૦૨૧ના રોજ પૂરા થતા સમયગાળા માટે	૩૧ માર્ચ ૨૦૨૦ના રોજ પૂરા થતા સમયગાળા માટે
ચાલુ આવકવેરો	૧૭,૬૮,૧૭,૮૭૧	૧૭,૪૮,૫૦,૨૪૫
વિલંબિત આવકવેરાની જવાબદારી/(મિલકત) ચોખ્ખી	(૧,૦૭,૭૪,૪૨૨)	(૬,૫૨,૦૮,૬૬૦)
કામચલાઉ તફાવતનો ઉદ્ભવ અને તેનું રિવર્સલ	-	-
અગાઉ ધ્યાનમાં ન લેવામાં આવેલ કરવેરાના નુકસાન ધ્યાનમાં લીધું	-	-
ધ્યાનમાં લેવામાં આવેલ કપાતપાત્ર કામચલાઉ તફાવતોમાં ફેરફાર	-	-
વિલંબિત કર ખર્ચ	(૧,૦૭,૭૪,૪૨૨)	(૬,૫૨,૦૮,૬૬૦)
અગાઉના વર્ષની આવકવેરાની અધિક જોગવાઈ	(૧૬,૮૩,૮૮૪)	૪૨,૪૩,૩૮૮
વર્ષ માટે કુલ કર ખર્ચ	૧૬,૪૪,૪૮,૫૬૫	૧૧,૩૮,૮૩,૮૮૩
અન્ય સર્વાંગ્રહી આવાક મા ધ્યાન લેવામાં આવેલી રકમ		(રકમ રૂ.માં)
વિગતો	૩૧ માર્ચ ૨૦૨૧ના રોજ પૂરા થતા સમયગાળા માટે	૩૧ માર્ચ ૨૦૨૦ના રોજ પૂરા થતા સમયગાળા માટે
નફા અથવા નુકસાન તરીકે પુનઃવર્ગીકૃત નહીં કરવામાં આવે તેવી બાબતો (ક)		
એફવીટીઓસીઆઈ ઈકિવટી ખાતોની વાજબી કિંમતમાં ફેરફાર	(૧,૧૦,૨૦૫)	(૫,૧૫,૦૬૪)
ઈકિવટી ખતોની વાજબી કિંમતમાં ફેરફાર	૫૬,૨૭,૬૫,૬૪૦	૨૨,૮૨,૩૫૩
	૫૬,૨૬,૫૫,૪૩૫	૧૭,૬૭,૨૮૮
નફા અથવા નુકસાન તરીકે પુનઃ વર્ગીકૃત કરવામાં નહીં આવે તેવી આવકવેરાસંબંધી બાબતો (ખ)		
એફવીટીઓસીઆઈ ઈકિવટી ખતોની વાજબી કિંમતમાં ફેરફાર	૩૨,૦૮૨	૧,૪૮,૮૮૭
	૩૨,૦૮૨	૧,૪૮,૮૮૭
અન્ય સર્વગ્રાહી આવકમાં ધ્યાને લેવામાં આવેલ ચોખ્ખી રકમ (ક+ખ)		
નિર્ધારિત નફા-યોજનાઓની માપણી	(૭૮,૧૧૩)	(૩,૬૫,૦૭૭)
અન્ય સર્વગ્રાહી આવક થકી ઈકિવટી ખતો	૫૬,૨૭,૬૫,૬૪૦	૨૨,૮૨,૩૫૩
	૫૬,૨૬,૮૭,૫૨૭	૧૮,૧૭,૨૭૬
અમલીકૃત આવકવેરાના દરનો હિસાબમેળ		(રકમ રૂ.માં)
વિગતો	૩૧ માર્ચ ૨૦૨૧ના રોજ પૂરા થતા સમયગાળા માટે	૩૧ માર્ચ ૨૦૨૦ના પૂરા થતા સમયગાળા માટે
કરવેરા પહેલાંનો નફો	૫૭,૬૮,૬૦,૫૦૪	૭૮,૮૫,૬૪,૨૪૪
કંપનીના ઘરેલુ કરવેરા દરનો ઉપયોગ કરીને કરવેરા ૨૮.૧૨ ટકાના દરે (અગાઉના વર્ષે કરવેરાના દરમાં ઘટાડો)	૧૬,૭૮,૮૧,૭૭૮	૨૨,૮૬,૨૮,૮૦૨
નીચેનાની કર-અસર		
બિન-કપાતપાત્ર કરખર્ચ		
નફો અને નુકસાન ખાતા મુજબ ઘસારો	૪,૧૨,૭૫,૧૮૨	૪,૦૭,૮૮,૬૪૮
સીએસઆર ખર્ચ માટે	૧,૧૮,૧૨,૪૪૪	૧૫,૪૩,૩૬૦
મંજૂર ન રાખવામાં આવેલી અન્ય બાબતો	૨,૫૭,૧૦,૪૫૦	૮૧,૭૮૮
ભારતીય હિસાબી ધોરણને કારણે અસર	(૩૫,૦૨,૮૮૨)	(૪૩,૪૩,૪૦૪)
કલમ-૪૩ ખ હેઠળ મંજૂર ન રાખવામાં આવેલી બાબતો		
ભવિષ્યનિધિ ફાળા અથવા કપાત થકી ચૂકવવાપાત્ર રકમ	૫,૭૭,૪૧૮	(૨,૪૨,૩૫૪)
કપાત		
આવકવેરા અધિનિયમ મુજબ ઘસારો	(૨,૫૮,૮૮,૮૬૧)	(૩,૦૪,૩૮,૬૪૦)
પરવાનગીપાત્ર કપાત-અન્ય		
ડિવિડન્ડની આવક	-	(૪૫,૮૧,૭૭૫)
ઓસીઆઈમાં નોંધાયેલ એક્યુરીયલ ખોટ	(૩૨,૦૮૨)	(૧,૪૮,૮૮૭)
પ્રકરણ-૬-ક હેઠળ કપાત	(૪,૧૦,૦૪,૩૫૭)	(૫,૭૩,૪૮,૨૮૪)
વિલંબિત કરની સ્વીકૃતિ	(૧,૦૭,૭૪,૪૨૩)	(૬,૫૨,૦૮,૬૬૦)
અગાઉના વર્ષ માટે ઓછી (અધિક) જોગવાઈ	(૧૬,૮૩,૮૮૪)	૪૨,૪૩,૩૮૮
નફો અને નુકસાન ખાતે ધ્યાનમાં લેવામાં આવેલ ચોખ્ખું ખર્ચ	૧૬,૪૪,૪૮,૫૬૪	૧૧,૩૮,૮૩,૮૮૩

વિલંબિત કરસંબંધી સિલકોમાં ગતિવિધિ (રકમ રૂ.માં)					
વિગતો	ચોખ્ખી સિલક ૧લી એપ્રિલ, ૨૦૨૦	૩૧મી માર્ચ, ૨૦૨૧			
		નફા અને નુકસાનમાં ધ્યાનમાં લેવાયેલ	ચોખ્ખી	વિલંબિત કર મિલકતો	વિલંબિત કર જવાબદારી
વિલંબિત કર મિલકત/ (જવાબદારીઓ)					
પીપીઈની ચાલુ કિંમત કર આધાર કરતાં વધુ હોવા અંગે	(૪૨,૪૧,૬૨,૦૪૩)	૧,૪૫,૮૫,૮૮૫	(૪૦,૮૫,૬૬,૦૪૮)	-	(૪૦,૮૫,૬૬,૦૪૮)
જવાબદારીઓ બંધ કરવી- જોગવાઈ	૩,૪૬,૬૦,૨૮૪	૨૭,૭૨,૮૨૩	૩,૭૪,૩૩,૧૧૭	૩,૭૪,૩૩,૧૧૭	-
એસેટ રીયાયરમેન્ટ ઓબ્લીગેશન- વિન્ડમીલ	(૧,૨૨,૦૪,૮૪૦)	૮,૧૪,૭૩૧	(૧,૧૩,૯૦,૨૧૦)	-	(૧,૧૩,૯૦,૨૧૦)
નુકસાન આગળ ખેચ્યું	-	-	-	-	-
કામગીરી અને નિભાવની મળવાપાત્ર આવક	(૨,૭૫,૬૧,૦૨૪)	(૬૦,૮૫,૩૬૫)	(૩,૩૬,૫૬,૩૮૦)	-	(૩,૩૬,૫૬,૩૮૦)
રોકાણની વાજબી કિંમત	(૫,૫૫,૮૨૩)	(૫,૫૩,૧૧૮)	(૧૧,૦૮,૦૪૧)	-	(૧૧,૦૮,૦૪૧)
અન્ય બાબતો -	(૫૨,૬૦,૨૭૨)	૦	(૫૨,૬૦,૨૭૧)	-	(૫૨,૬૦,૨૭૧)
દરો અને કરવેરા, રજાનું રોકડમાં રૂપાંતર, શ્રમ ઉપકર અને ગ્રેચ્યુઈટી	૬૪,૧૫,૮૨૮	(૬,૮૬,૬૬૧)	૫૭,૧૮,૧૬૭	૫૭,૧૮,૧૬૭	-
ભારતીય હિસાબી ધોરણ ૧૧૬ને કારણે અસર	-	(૩૧,૮૮૦)	(૩૧,૮૮૦)	-	(૩૧,૮૮૦)
કરવેરા સંબંધી મિલકતો/ (જવાબદારીઓ)	(૪૨,૮૬,૬૮,૦૮૧)	૧,૦૮,૦૬,૫૧૪	(૪૧,૭૮,૬૧,૫૬૭)	૪,૩૧,૫૨,૨૮૪	(૪૬,૧૦,૧૩,૮૫૦)
સેટ-ઓફ કરવામાં આવેલ કર					
ચોખ્ખી કર મિલકતો (જવાબદારીઓ)	(૪૨,૮૬,૬૮,૦૮૧)	૧,૦૮,૦૬,૫૧૪	(૪૧,૭૮,૬૧,૫૬૭)	૪,૩૧,૫૨,૨૮૪	(૪૬,૧૦,૧૩,૮૫૦)
નોંધ	<p>૧. કંપની માત્ર અને માત્ર ચાલુ કર મિલકતો અને ચાલુ કર જવાબદારીઓ સેટ-ઓફ કરવાનો કાયદેસર રીતે લાગુ પાડવાનો અધિકાર ધરાવતી હોય તો જ કર મિલકતો અને જવાબદારીઓ સેટ-ઓફ કરે છે અને ચાલુ કર જવાબદારીઓ અને વિલંબિત કર મિલકતો તથા વિલંબિત કર જવાબદારીઓ, સમાન કર સત્તાધિકારી દ્વારા લેવામાં આવતા આવકવેરાઓ સાથે સંબંધ ધરાવે છે.</p> <p>૨. આવકવેરા, વિલંબિત આવક-વેરા મિલકતો અને જવાબદારીઓ તથા વિલંબિત આવકવેરા મિલકતોની વસૂલાતપાત્રતા માટેની જોગવાઈ નક્કી કરવા માટે વ્યવસ્થાપક મંડળે મહત્વનો નિર્ણય કરવો જરૂરી છે. વિલંબિત આવકવેરા મિલકતોની વસૂલાતપાત્રતા એ પ્રત્યેક ક્ષેત્રાધિકાર (જ્યુરીસડિક્શન)ના કરપાત્ર આવકના અંદાજો પર આધારિત છે. જેમાં સંબંધિત સંસ્થા કામ કરતી હોય અને એ સમયગાળા પર આધારિત છે જે દરમિયાન વિલંબિત આવકવેરા મિલકતોની વસૂલાત કરવાની હોય.</p>				

નોંધ- ૨૭ સંબંધિત પાટીઓ અંગે જાહેરાત

ભારતીય હિસાબી ધોરણ-૨૪ “સંબંધિત પાટીઓ અંગે જાહેરાત” અને કંપની અધિનિયમ, ૨૦૧૩ મુજબ સંબંધિત પાટીઓ સાથેની લેવડદેવડની જાહેરાત નીચે આપવામાં આવી છે.

ક. સંબંધિત પાટીઓ

ક્રમ નં.	વિગતો	સંબંધ
૧.	ભૈતરણી વેસ્ટ કોલ કંપની લિમિટેડ	સહાયક કંપની
૨.	ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ	પ્રમોટર
૩.	સુનયના તોમર, આઈ.એ.એસ.	અધ્યક્ષ (૧૫/૦૬/૨૦૨૧ સુધી)
૪.	મમતા વર્મા, આઈ.એ.એસ.	અધ્યક્ષ (૦૯/૦૭/૨૦૨૧થી)
૫.	શ્રી એસ.બી. પાયલિયા	મેન. ડિરેક્ટર (મુખ્ય વ્યવસ્થાપકીય કર્મચારી વર્ગ) (૩૦/૦૮/૨૦૨૧ સુધી)
૬.	વિકલ્પ ભારદ્વાજ	મેન. ડિરેક્ટર (મુખ્ય વ્યવસ્થાપકીય કર્મચારી વર્ગ) (૨૬/૧૦/૨૦૨૧થી)
૭.	શ્રી પ્રહુલ હરદેવરાય રાણા	નિયામક
૮.	શ્રી રમણભાઈ ગણેશભાઈ દેસાઈ (૦૭/૦૮/૨૦૨૦ સુધી)	નામનિયુક્ત નિયામક
૯.	સુશ્રી દિપલ હરિયલ (૨૩/૧૨/૨૦૨૦થી)	નામનિયુક્ત નિયામક
૧૦.	શ્રીમતી અંજુ શર્મા, આઈ.એ.એસ.	મહિલા નિયામક
૧૧.	શ્રીમેહુલ જે. ડનાયક	મુખ્ય નાણાકીય અધિકારી (મુખ્ય વ્યવસ્થાપકીય કર્મચારીવર્ગ)
૧૨.	સુશ્રી કૃપા જોશી	કંપની સેક્રેટરી (મુખ્ય વ્યવસ્થાપકીય કર્મચારી વર્ગ)

ખ. સંબંધિત પાટીઓ સાથેની લેવડદેવડ

(રકમ રૂ.માં)

ક્રમ નં.	વિગતો	૨૦૨૦-૨૧ રૂ.	૨૦૧૯-૨૦ રૂ.
ક.	વર્ષ દરમિયાન લેવડદેવડ		
	ગુ.ઊ.વિ.નિ.લિ.ને વીજળીનું વેચાણ	૧૩,૨૧,૯૪,૦૮૬	૧૯,૭૬,૯૩,૯૨૯
	નિયામક બેઠક ફી		
	શ્રી પી.એચ.રાણા	૨૭,૦૦૦	૫૧,૦૦૦
	પ્રકાશ શાહ	-	૫૧,૦૦૦
	ભરતકુમાર મોદી	-	૩૯,૦૦૦
	પી.કે.તનેજા	૬,૦૦૦	-
	દિપલ હરિયલ	૩,૦૦૦	-
	અંજુ શર્મા	૬,૦૦૦	-
	આર.જી.દેસાઈ	૬,૦૦૦	-
	સુનયના તોમર	૧૨,૦૦૦	-
	નિયામકોનું ખર્ચ		
	શ્રી પી.એચ.રાણા	૯,૦૦૦	૧૭,૦૦૦
	આર.જી.દેસાઈ	૧,૦૦૦	૧૬,૦૦૦
	પ્રકાશ શાહ	-	૧૭,૦૦૦
	મહેશ સિંઘ	૧,૦૦૦	-
	ભરતકુમાર મોદી	-	૧૩,૦૦૦
	પંકજ જોશી	-	૩,૦૦૦
	પી.કે.તનેજા	૨,૦૦૦	-
	અંજુ શર્મા	૪,૦૦૦	૭,૦૦૦
	સુનયના તોમર	૪,૦૦૦	૧,૦૦૦
	એસ.બી.પાયલિયા	૯,૦૦૦	૩,૦૦૦
	દિપલ હરિયલ	૧,૦૦૦	-
	પગાર અને ભથ્થાં		
	મેહુલ ડનાયક	૧૮,૧૦,૯૩૨	૧૭,૪૫,૬૫૬
	એસ.બી.પાયલિયા	૯૦,૧૩,૭૭૯	૧૭,૬૯,૩૬૦
	સુશ્રી કૃપા જોશી	૯,૨૬,૩૬૦	૮,૮૦,૨૦૦
ક્રમ નં.	વિગતો	૩૧મી માર્ચ, ૨૦૨૧ રૂ.	૩૧મી માર્ચ, ૨૦૨૦ રૂ.
ખ.	બંધ થતી સિલક		
	ગુ.ઊ.વિ.નિ.લિ. પાસેથી વીજળીના વેચાણ પેટે મળવાપાત્ર	૨,૦૫,૪૦,૬૨૫	૨,૯૨,૨૧,૫૩૦

નોંધ- ૨૮

ક. કક્ષાવાર અને તેમની વાજબી કિંમત મુજબ નાણાકીય ખતો

(રકમ રૂ.માં)

૩૧મી માર્ચ, ૨૦૨૧ના રોજ	ચાલુ રકમ				વાજબી કિંમત			
	એક.વી.ટી.પી.એલ.	એક.વી.ટી.ઓ.સી.આઈ.	ઋણ મુક્ત કરેલી રકમ	સરવાળો	સક્રિય બજારમાં લેવલ-૧ ભાવ પાત્રની કિંમત	લેવલ-૨ મહત્વની અવલોકન પાત્ર ઈનપુટ	લેવલ-૩ મહત્વની બિન અવલોકન પાત્ર ઈનપુટ	સરવાળો
નાણાકીય મિલકતો								
રોકાણો								
કવોટ્સ		૧,૧૦,૯૦,૪૧,૪૬૫		૧,૧૦,૯૦,૪૧,૪૬૫	૧,૧૦,૯૦,૪૧,૪૬૫			૧,૧૦,૯૦,૪૧,૪૬૫
અનકવોટ્સ		૧૮,૦૪,૬૪,૩૩૦		૧૮,૦૪,૬૪,૩૩૦			૧૮,૦૪,૬૪,૩૩૦	૧૮,૦૪,૬૪,૩૩૦
અન્ય નાણાકીય મિલકતો								
ચાલુ			૮,૪૬,૦૫,૨૩,૬૮૧	૮,૪૬,૦૫,૨૩,૬૮૧				
ધંધા સંબંધી મળવાપાત્ર			૭૪,૯૨,૬૮,૩૮૫	૭૪,૯૨,૬૮,૩૮૫				
રોકડ અને રોકડ સમાન			૭૩,૩૪,૯૧,૪૫૩	૭૩,૩૪,૯૧,૪૫૩				
અન્ય બેંક સિલક			૭૭,૧૧,૯૨,૩૦૪	૭૭,૧૧,૯૨,૩૦૪				
અન્ય નાણાકીય મિલકતો								
બિન ચાલુ			૧,૮૮,૨૮,૧૫૮	૧,૮૮,૨૮,૧૫૮			૧,૮૮,૨૮,૧૫૮	૧,૮૮,૨૮,૧૫૮
કુલ નાણાકીય મિલકતો		૧,૨૮,૯૫,૦૫,૭૯૫	૧૦,૭૩,૩૩,૦૩,૯૮૧	૧૨,૦૨,૨૮,૦૯,૭૭૬	૧,૧૦,૯૦,૪૧,૪૬૫		૧૯,૯૨,૬૨,૪૮૮	૧,૩૦,૮૩,૩૩,૯૫૩
નાણાકીય જવાબદારીઓ								
કરજ								
બિન ચાલુ								
અન્ય નાણાકીય જવાબદારીઓ								
ચાલુ			૫૨,૮૨,૬૬,૬૨૧	૫૨,૮૨,૬૬,૬૨૧				
બિનચાલુ			૩૨,૮૫,૮૫,૮૧૯	૩૨,૮૫,૮૫,૮૧૯				
ધંધા સંબંધી ચુકવવાપાત્ર								
સરવાળો નાણાકીય જવાબદારીઓ			૮૫,૬૮,૫૨,૪૩૯	૮૫,૬૮,૫૨,૪૩૯				

ઋણમુક્ત કિંમતે માપવામાં આવેલ નાણાકીય મિલકતોની વાજબી કિંમત ઋણમુક્ત કિંમત કરતાં પ્રત્યક્ષ રીતે જુદી નથી. વધુમાં, ચાલુ તરીકે વગીકરણ કરવામાં આવેલા નાણાકીય ખતો માટે નાણાંની સમયલક્ષી કિંમતની અસર વધુ નથી. તદનુસાર, વાજબી કિંમત અલગ રીતે જાહેર કરવામાં આવી નથી.

(રકમ રૂ.માં)

૩૧મી માર્ચ, ૨૦૨૦ના રોજ	ચાલુ રકમ				વાજબી કિંમત			
	એક.વી.ટી.પી.એલ.	એક.વી.ટી.ઓ.સી.આઈ.	ઋણ મુક્ત કરેલી રકમ	સરવાળો	સક્રિય બજારમાં લેવલ-૧ ભાવ પાત્રની કિંમત	લેવલ-૨ મહત્વની અવલોકન પાત્ર ઈનપુટ	લેવલ-૩ મહત્વની બિન અવલોકન પાત્ર ઈનપુટ	સરવાળો
નાણાકીય મિલકતો								
રોકાણો								
કવોટ્સ		૫૫,૫૯,૨૩,૨૫૨		૫૫,૫૯,૨૩,૨૫૨	૫૫,૫૯,૨૩,૨૫૨			૫૫,૫૯,૨૩,૨૫૨
અનકવોટ્સ		૧૭,૦૮,૧૬,૯૦૩		૧૭,૦૮,૧૬,૯૦૩			૧૭,૦૮,૧૬,૯૦૩	૧૭,૦૮,૧૬,૯૦૩
અન્ય નાણાકીય મિલકતો								
ચાલુ			૬,૦૨,૩૪,૬૨,૪૬૨	૬,૦૨,૩૪,૬૨,૪૬૨				
ધંધા સંબંધી મળવાપાત્ર			૧,૮૨,૬૪,૧૪,૭૯૮	૧,૮૨,૬૪,૧૪,૭૯૮				
રોકડ અને રોકડ સમાન			૬૪,૨૪,૨૪૦	૬૪,૨૪,૨૪૦				
અન્ય બેંક સિલક			૭૧,૪૦,૫૧,૫૬૮	૭૧,૪૦,૫૧,૫૬૮				
અન્ય નાણાકીય મિલકતો								
બિન ચાલુ			૧,૮૮,૨૮,૧૫૮	૧,૮૮,૨૮,૧૫૮			૧,૮૮,૨૮,૧૫૮	૧,૮૮,૨૮,૧૫૮
કુલ નાણાકીય મિલકતો		૭૨,૬૭,૪૦,૧૫૫	૮,૫૮,૯૧,૮૧,૨૨૬	૮,૩૧,૫૯,૨૧,૩૮૧	૫૫,૫૯,૨૩,૨૫૨		૧૮,૯૯,૪૫,૦૬૧	૭૪,૫૫,૬૮,૩૧૩
નાણાકીય જવાબદારીઓ								
કરજ								
બિન ચાલુ								
અન્ય નાણાકીય જવાબદારીઓ								
ચાલુ			૩,૯૦,૩૪,૪૦,૫૩૬	૩,૯૦,૩૪,૪૦,૫૩૬				
બિનચાલુ			૨૦,૬૮,૩૯,૮૦૭	૨૦,૬૮,૩૯,૮૦૭				
ધંધા સંબંધી ચુકવવાપાત્ર			૮,૯૯,૨૬,૧૦૪	૮,૯૯,૨૬,૧૦૪				
સરવાળો નાણાકીય જવાબદારીઓ			૪,૨૦,૦૧,૦૬,૪૪૬	૪,૨૦,૦૧,૦૬,૪૪૬				

ઋણમુક્ત કિંમતે માપવામાં આવેલ નાણાકીય મિલકતોની વાજબી કિંમત ઋણમુક્ત કિંમત કરતાં પ્રત્યક્ષ રીતે જુદી નથી. વધુમાં, ચાલુ તરીકે વગીકરણ કરવામાં આવેલા નાણાકીય ખતો માટે નાણાંની સમયલક્ષી કિંમતની અસર વધુ નથી. તદનુસાર, વાજબી કિંમત અલગ રીતે જાહેર કરવામાં આવી નથી.

ઈનપુટના પ્રકારો નીચે મુજબ છે.

ઈનપુટ લેવલ-૧ (પ્રત્યક્ષ જોઈ શકાય તેવું) જેમાં સમાન પ્રકારની મિલકતો માટે સક્રિય બજારમાં કવોટ કરવામાં આવેલી કિંમતોનો સમાવેશ થાય છે, જેમકે સીક્યુરીટી એક્સ્ચેન્જ અંગેની કોઈ ઈકિવટી સીક્યુરીટી માટે દર્શાવવામાં આવેલી કિંમત.

ઈનપુટ-૨ (પરોક્ષ રીતે જોઈ શકાય તેવું) જેમાં સમાન પ્રકારની મિલકતો માટે સક્રિય બજારમાં ચાલતી કિંમતોનો સમાવેશ થાય છે, જેમ કે સક્રિય બજારમાં સમાન મિલકતો માટેની ‘કવોટ્સ’ કિંમતો, સમાન પ્રકારના ધંધામાં થયેલી લેવડ દેવડમાં કિંમતોમાંથી તારવવામાં આવેલ ‘વેલ્યુએશન મલ્ટિપલ’.

ઈનપુટ લેવલ-૩ (પરોક્ષ રીતે જોઈ ન શકાય તેવું) જેમાં કોઈ વાજબી કિંમતે આવવા માટે વ્યવસ્થાપક મંડળે પોતે કરેલી ધારણાઓનો સમાવેશ થાય છે, જેમ કે કોઈ ધંધાનું મૂલ્ય નક્કી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ પ્રક્ષેપિત (પ્રોજેક્ટ) કેશ ફ્લોઝ.

ખ. વાજબી કિંમતની માપણી

મૂલ્ય નિર્ધારણની ટેકનિક અને જોઈ ન શકાય તેવા મહત્વના ઇનપુટ

નીચેના કોઠાઓમાં લેવલ-૨ અને લેવલ-૩ની તેમજ જોઈ ન શકાય તેવા મહત્વના ઇનપુટ માપણીમાં ઉપયોગમાં લેવામાં આવેલી મૂલ્ય નિર્ધારણની ટેકનિકો દર્શાવવામાં આવી છે.

વાજબી કિંમતે માપવામાં આવેલ નાણાકીય ખતો

અનકવોટેડ ઇકિવટી શેર્સમાં એફ.વી.ટી.ઓ. સી.આઈ.	તબ્દીલી (ટ્રાન્ઝીશન)ની તારીખે ગોણ સંસ્થાઓ અને ઇકિવટી ખાતાં ધરાવતી સંસ્થાઓમાં ઇકિવટી શેર્સમાં રોકાણો :
	જીએસઈજી- તબ્દીલીની તારીખે જીએસઈજીનું ઇકિવટી મૂલ્ય નિર્ધારણ ડિસ્કાઉન્ટેડ કેશ ફ્લો (ડીસીએફ) પદ્ધતિનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું છે. ઇકિવટીમાં બી-કેશ ફ્લો (એફ.સી.એફ.ઈ.)માં ઇકિવટીની કિંમતના ૧૪ ટકા ઘટાડો ઇકિવટી મૂલ્ય નિર્ધારણ માટે કરવામાં આવ્યો છે.
	અન્ય સંસ્થાઓના ઇકિવટી શેર્સમાં રોકાણો :

લેવલ-૧ અને લેવલ-૨ વચ્ચે ટ્રાન્સફર

અહેવાલના સમયગાળાઓ દરમિયાન લેવલ-૧ અને લેવલ-૨ વચ્ચે કોઈ ટ્રાન્સફર નથી.

લેવલ-૩ વાજબી કિંમત

૩૧મી માર્ચ, ૨૦૨૧ના રોજ પૂરા થતા સમયગાળાઓ માટેના ઉનકવોટેડ ઇકિવટી ખતોના મૂલ્યમાં તફાવત નીચે મુજબ છે. (૨કમ રૂ.માં)

વિગતો	રકમ
૧લી એપ્રિલ ૨૦૨૦ના રોજ	૧૭,૦૮,૧૬,૮૦૩
અન્ય સર્વગ્રાહી આવકમાં ધ્યાનમાં લેવામાં આવેલ નફો/ નુકશાન	૮૬,૪૭,૪૨૭
૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ	૧૮,૦૪,૬૪,૩૩૦

લેવલ-૩માંથી ટ્રાન્સફર

૨૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧નાં વર્ષો દરમિયાન લેવલ-૩માંથી કોઈ ટ્રાન્સફર ન હતી.

ખ. નાણાકીય જોખમ વ્યવસ્થાપન

કંપનીની મુખ્ય નાણાકીય જવાબદારીઓમાં લોન અને કરજો તથા ધંધા સંબંધી અને અન્ય ચુકવવાપાત્ર રકમોનો સમાવેશ થાય છે. આ નાણાકીય જવાબદારીઓનો મુખ્ય હેતુ કંપનીની કામગીરીઓ માટે નાણા વ્યવસ્થા કરવાનો અને તેની કામગીરીઓની સહાય માટે ગેરંટી પૂરી પાડવાનો છે. કંપનીની મુખ્ય નાણાકીય મિલકતોમાં ધંધા સંબંધી તેમજ અન્ય મળવાપાત્ર રકમો, રોકડ અને રોકડ સમાન રકમો તેમજ કંપનીની કામગીરીઓમાંથી પ્રત્યક્ષ રીતે મેળવવામાં આવેલાં રોકાણોનો સમાવેશ થાય છે. કંપની નાણાકીય ખતોમાંથી ઊભાં થતાં નીચે મુજબના જોખમોની સંભાવના ધરાવે છે

૧. ધિરાણ સંબંધી જોખમ

૨. તરલતા સંબંધી જોખમ

૩. બજાર સંબંધી જોખમ

(૧) ધિરાણ સંબંધી જોખમ

ધિરાણ સંબંધી જોખમ એટલે એવું જોખમ જેમાં ગ્રાહકો અથવા નાણાકીય ખતમાં સામેનો પક્ષ તેની પાસેથી લેણી નીકળતી રકમ ચૂકવી ન શકે અને પરિણામે કંપનીને નાણાકીય ખોટ થાય. ધિરાણ સંબંધી જોખમ ઊભું થાય એવી સંભવિત પ્રવૃત્તિઓમાં રોકડ અને રોકડ સમાન રકમો, નાણાકીય સંસ્થાઓ પાસેના ડેરીવેટીવ ફાઈનાન્સીયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને થાપણો અને મુખ્યત્વે ગ્રાહકો પાસેથી ધિરાણ બાદ લેણી નીકળતી બાકી રકમોનો સમાવેશ થાય છે.

ધંધા સંબંધી મળવાપાત્ર

સંબંધિત અહેવાલની તારીખે ધંધા સંબંધી મળવાપાત્ર રકમોના મહત્વના હિસ્સામાં જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને નોંધપાત્ર સરકારી પ્રભાવ ધરાવતી સંસ્થાઓનો સમાવેશ થાય છે. વધુમાં, આ અંગે વ્યવસ્થાપક મંડળને ધિરાણ સંબંધી કોઈ જોખમની અપેક્ષા નથી.

અન્ય નાણાકીય મિલકતો

અન્ય નાણાકીય મિલકતોમાં રોકડ અને રોકડ સમાન રકમો, કર્મચારીઓને આપવામાં આવેલી લોન અને ગોણ, સહાયક તથા સંયુક્ત સાહસો સિવાયની કંપનીઓના ઇકિવટી શેર્સમાં કરવામાં આવેલા રોકાણોનો સમાવેશ થાય છે. - રોકડ અને રોકડ સમાન રકમો તથા બેંક થાપણો સારી સાખ તેમજ પર્યાપ્ત કેડિટ રેટીંગ ધરાવતી બેંકોમાં મૂકવામાં આવે છે. કંપની તેમની ધિરાણ-યથાર્થતાનું નિયમિત સમયાંતરે પુનર્વિલોકન કરે છે. - રોકાણો ધિરાણ-યથાર્થ કંપનીઓમાં કરવામાં આવે છે.

(૨) તરલતા સંબંધી જોખમ

તરલતા સંબંધી જોખમ એટલે એવું જોખમ જેમાં કંપની, રોકડ અથવા અન્ય નાણાકીય મિલકત આપીને જેની પતાવટ કરવાની હોય એવી, તેની નાણાકીય જવાબદારીઓ સાથે જોડાયેલી જવાદારીઓને પહોંચી વળવામાં મુશ્કેલી અનુભવવાની હોય. કંપનીના નાણાકીય આયોજને શક્ય હોય ત્યાં સુધી એ સુનિશ્ચિત કર્યું છે કે જ્યારે પણ આવી જવાબદારી ઊભી થાય ત્યારે તેને પહોંચી વળવા માટે પૂરતી તરલતા સામાન્ય અને તંગ સંથિતિઓમાં પણ, કંપની માટે અસ્વીકાર્ય નુકસાન અથવા જોખમ નોતર્યા વિના ઉપલબ્ધ હોય.

તરલતાસંબંધી જોખમની સંભાવના

અહેવાલની તારીખે નાણાકીય જવાબદારીઓના બાકીના પાકતા કરારો નીચે મુજબ છે. આ રકમો એકંદર/ ઘટાડ્યા વિનાની કિંમતો છે અને તેમાં અંદાજિત વ્યાજની ચુકવણીઓનો સમાવેશ થાય છે, 'નેટીંગ એગ્રીમેન્ટ'ની અસરોનો સમાવેશ થતો નથી.

(૨કમ રૂ.માં)

૩૧મી માર્ચ, ૨૦૨૧	પાકતા કરારો પર આધારિત કેશ-ફ્લો			
	ચાલુ રકમ	સરવાળો	૧૨ મહિનાથી ઓછી	૧૨ મહિનાથી વધુ
નોન-ડેરીવેટીવ નાણાકીય જવાબદારી				
બિન ચાલુ કરજો	-	-	-	-
ચાલુ કરજો	-	-	-	-
બિન ચાલુ નાણાકીય જવાબદારીઓ	૫૨,૮૨,૬૬,૬૨૧	૫૨,૮૨,૬૬,૬૨૧	-	૫૨,૮૨,૬૬,૬૨૧
ચાલુ નાણાકીય જવાબદારીઓ	૩,૮૦,૩૪,૪૦,૫૩૬	૩,૮૦,૩૪,૪૦,૫૩૬	૩,૮૦,૩૪,૪૦,૫૩૬	-
ધંધા સંબંધી અને અન્ય ચુકવવાપાત્ર રકમો	૩૨,૮૫,૮૫,૮૧૮	૩૨,૮૫,૮૫,૮૧૮	૩૨,૮૫,૮૫,૮૧૮	-
સરવાળો.	૪,૭૬,૦૨,૮૨,૮૭૬	૪,૭૬,૦૨,૮૨,૮૭૬	૪,૨૩,૨૦,૨૬,૩૫૫	૫૨,૮૨,૬૬,૬૨૧

(૨કમ રૂ.માં)

૩૧મી માર્ચ, ૨૦૨૦	પાકતા કરારો પર આધારિત કેશ-ફ્લો			
	ચાલુ રકમ	સરવાળો	૧૨ મહિનાથી ઓછી	૧૨ મહિનાથી વધુ
નોન-ડેરીવેટીવ નાણાકીય જવાબદારી				
બિન ચાલુ કરજો	-	-	-	-
ચાલુ કરજો	-	-	-	-
બિન ચાલુ નાણાકીય જવાબદારીઓ	૨૦,૬૮,૩૮,૮૦૭	૨૦,૬૮,૩૮,૮૦૭	-	૨૦,૬૮,૩૮,૮૦૭
ચાલુ નાણાકીય જવાબદારીઓ	૨,૮૭,૪૧,૭૩,૧૭૮	૨,૮૭,૪૧,૭૩,૧૭૮	૨,૮૭,૪૧,૭૩,૧૭૮	-
ધંધા સંબંધી અને અન્ય ચુકવવાપાત્ર રકમો	૮,૮૮,૨૬,૧૦૪	૮,૮૮,૨૬,૧૦૪	૮,૮૮,૨૬,૧૦૪	-
સરવાળો.	૩,૧૭,૦૮,૩૮,૦૮૦	૩,૧૭,૦૮,૩૮,૦૮૦	૨,૮૬,૩૮,૮૮,૨૮૩	૨૦,૬૮,૩૮,૮૦૭

(૩) બજાર સંબંધી જોખમ

બજાર સંબંધી જોખમ એટલે એવું જોખમ જેમાં બજાર કિંમતમાં સંભવિત ફેરફારો અને ધંધા પર તેની પડનારી વર્તમાન/ ભાવિ અસરોમાંથી જોખમ અથવા અનિશ્ચિતતા ઊભી થતી હોય. બજાર સંબંધી જોખમોમાં કિંમતલક્ષી જોખમ, ચલણલક્ષી જોખમ અને વ્યાજ-દર સંબંધી જોખમનો સમાવેશ થાય છે. કંપની માટે મુખ્ય કિંમતલક્ષી જોખમ વસ્તુઓની કિંમતોને લગતું એટલે કે કંપનીની નાણાકીય મિલકતો, જવાબદારીઓ અથવા અપેક્ષિત ભાવિ રોકડ પ્રવાહના મૂલ્યને વિપરિત અસર કરી શકે એવું કિંમતલક્ષી જોખમ છે.

ઇકિવટીની કિંમત સંબંધી જોખમ

નીચેના કોઠામાં, આ સમયગાળા માટેની કંપનીની અન્ય સર્વગ્રાહી આવકના ઇન્ડેક્સમાં વધારા/ઘટાડાની અસરોનો સારાંશ આપવામાં આવ્યો છે. આ વિશ્લેષણ એ ધારણા પર આધારિત છે કે સંબંધિત સમયગાળાઓ માટે રોકાણો તરીકે ધારણ કરવામાં આવેલા ઇકિવટી શેર્સની કવોટેડ કિંમતની સરેરાશ વધ-ઘટ (મુવમેન્ટ)ના ઇન્ડેક્સમાં વધારો થયો છે. અન્ય તમામ વધ-ઘટ અચળ રહી છે.

સંવેદનશીલતા (સેન્સીટીવીટી)

નીચેના કોઠામાં, આ સમયગાળા માટેની કંપનીની અન્ય સર્વગ્રાહી આવકના ઇન્ડેક્સમાં વધારા/ઘટાડાની અસરોનો સારાંશ આપવામાં આવ્યો છે. આ વિશ્લેષણ એ ધારણા પર આધારિત છે કે સંબંધિત સમયગાળાઓ માટે રોકાણો તરીકે ધારણ કરવામાં આવેલા ઇકિવટી શેર્સની કવોટેડ કિંમતની સરેરાશ વધ-ઘટ (મુવમેન્ટ)ના ઇન્ડેક્સમાં વધારો થયો છે. અન્ય તમામ વધ-ઘટ અચળ રહી છે.

વિગતો	અન્ય સર્વગ્રાહી આવક પર અસર		
	૩૧મી માર્ચ, ૨૦૨૧ ના રોજ	૩૧મી માર્ચ, ૨૦૨૦ ના રોજ	૩૧મી માર્ચ, ૨૦૧૯ ના રોજ
એનએસઈ નિફ્ટી-૫૦-૩૦ ટકા વધારો (૩૧મી માર્ચ, ૨૦૨૦- ૨૦ ટકા)	૩૩,૨૭,૧૨,૪૪૦	૧૧,૧૧,૮૪,૬૫૦	૧૧,૦૩,૮૦,૨૪૦
એનએસઈ નિફ્ટી-૫૦-૩૦ ટકા ઘટાડો (૩૧મી માર્ચ, ૨૦૨૦- ૨૦ ટકા)	(૩૩,૨૭,૧૨,૪૪૦)	(૧૧,૧૧,૮૪,૬૫૦)	(૧૧,૦૩,૮૦,૨૪૦)

વ્યાજદર જોખમ

વ્યાજદર જોખમ એ કાંતો વ્યાજબી કિંમત વ્યાજ દર જોખમ હોઈ શકે અથવા કેશ-ફ્લો વ્યાજ દર જોખમ હોઈ શકે. વાજબી કિંમત વ્યાજદર જોખમ એ વ્યાજ-દરોમાં વધ-ઘટ થવાને કારણે નિયત વ્યાજ ધરાવતાં રોકાણોની વાજબી કિંમતોમાં થતા ફેરફારનું જોખમ છે. કેશફ્લો વ્યાજ દર જોખમ એ વ્યાજના દરોમાં વધ-ઘટ થવાને કારણે ફ્લોટિંગ (અનિયત) વ્યાજ ધરાવતાં રોકાણો વાજબી કિંમતોમાં થતા ફેરફારનું જોખમ છે. કંપની વ્યાજના બદલાતા દરોએ કોઈ ન ઉપાડેલું કે બાકી કરજ ધરાવતી નથી અને તેથી તે વ્યાજદર સંબંધી કોઈ જોખમ ધરાવતી નથી.

ઘ. મૂડી વ્યાવસ્થાપન

મૂડીનું વ્યવસ્થાપન કરતી વખતે કંપનીના ઉદ્દેશ્યો નીચે મુજબના રહે છે. - ચાલુ ધંધા તરીકેની કામગીરી કરવાની ક્ષમતાને સુરક્ષિત કરવી જેથી શેરધારકો માટે મળતર અને અન્ય હિતધારકો માટે લાભો પૂરા પાડી શકાય; અને - મૂડીનું ખર્ચ ઘટાડવા માટે શ્રેષ્ઠતમ મૂડી-માળખું જાળવી રાખવું. કંપની ‘સમાયોજિત ચોખ્ખા દેવા’ના પ્રમાણમાં ‘સમાયોજિત ઇકિવટી’ના ગુણોત્તરનો ઉપયોગ કરીને મૂડી પર દેખરેખ રાખે છે. આ હેતુ માટે સમાયોજિત ચોખ્ખા દેવાને કુલ બિન ચાલુ જવાબદારીઓમાંથી બાદ કરવામાં આવેલી રોકડ અને રોકડ સમાન રકમ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.

૩૧મી માર્ચ, ૨૦૨૧ના રોજ સમાયોજિત ચોખ્ખા દેવાની તુલનામાં ઇકિવટીનું પ્રમાણ નીચે મુજબ હતું. (રકમ રૂ.માં)

વિગતો	૩૧મી માર્ચ, ૨૦૨૧ના રોજ	૩૧મી માર્ચ, ૨૦૨૦ના રોજ	૩૧મી માર્ચ, ૨૦૧૯ના રોજ
કુલ બિન ચાલુ જવાબદારીઓ	૧,૦૮,૮૦,૩૧,૫૮૬	૭૬,૬૭,૫૮,૮૧૭	૭૫,૭૮,૬૫,૩૫૦
બાદ : રોકડ અને બેંક સિલકો	૧,૫૦,૪૬,૮૩,૭૫૭	૭૨,૦૪,૭૫,૮૦૮	૬૩,૮૧,૩૮,૨૭૮
સમાયોજિત ચોખ્ખું દેવું	(૪૧,૫૬,૫૨,૧૭૧)	૪,૬૨,૮૩,૦૦૮	૧૧,૮૮,૨૬,૦૭૧
કુલ ઇકિવટી	૧૨,૧૮,૪૨,૮૬,૪૪૮	૧૧,૧૨,૭૧,૮૭,૮૮૩	૧૦,૩૧,૭૩,૫૭,૪૭૦
સમાયોજિત ચોખ્ખા દેવાની તુલનામાં સમાયોજિત ઇકિવટીનું પ્રમાણ	-૦.૦૩૪:૧ વખત	૦.૦૦૪:૧ વખત	૦.૦૧:૧ વખત

નોંધ : ૨૯

કંપનીએ સંયુક્ત નિયંત્રણ ધરાવતી સંસ્થાઓમાં કરેલાં રોકાણોની વિગતો

ક્રમ નં.	સંસ્થાનું નામ	સંસ્થા જ્યાં સ્થાપવામાં આવી હોય તે દેશ	માલિકીમાં હિસ્સાનું પ્રમાણ	માલિકીમાં હિસ્સા હિસ્સાનું પ્રમાણ	અન્ય ભાગીદારોનાં નામ	મૂખ્ય પ્રવૃત્તિઓ
૧	ટોરન્ટ પીપાવાવ જનરેશન લિમિટેડ	ભારત	૫%	૮૫%	ટોરન્ટ પાવર લિમિટેડ	કોલસા આધારિત વીજ પ્લાન્ટ
૨	બૈતરણી વેસ્ટ કોલ કંપની લિમિટેડ	ભારત	૩૩.૩૩%	૩૩.૩૩%	કેરાલા સ્ટેટ ઇલેક્ટ્રીસિટી બોર્ડ	આ કંપનીની ફાળવણી રદ અકરવામાં આવી છે. આ બાબત ઓરિસ્સાની નમદાર હાઇકોર્ટમાં નિર્ણયાયેલ છે.
૩	જીએસપીસી પીપાવાવ પાવર કંપની લિમિટેડ	ભારત	૨.૫૩%	૮૭.૪૬%	ઔરિસા હાઇડ્રો પાવર કોર્પો. લિમિટેડ	ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન

નોંધ- ૩૦

- (ક) જીપીસીએલએ, કલેક્ટર, બનાસકાંઠા, પાલનપુરના તા.૨૦-૧-૨૦૧૬ના પત્ર મુજબ, ૭૦૦ મે.વો.ના અલ્ટ્રામેગા સોલાર પાવર પ્રોજેક્ટ માટે, વાવ તાલુકાના રાધાનાનેસના ગામ ખાતે ૧૪૦૭-૦૬-૮૮ ચો.મી.ની સરકારી જમીનનો અગ્રીમ કબજો મેળવી લીધો છે. આ જમીન જીપીસીએલને નવી સૌર નીતિની શરતોની જોગવાઈઓના આધારે સરકારને ચુકવણી કરવાની શરતને અધીન રહીને આપવામાં આવી છે. સરકારે જમીનની કિંમત નક્કી ન કરી હોવાથી તે હિસાબે લેવામાં આવી નથી.
- (ખ) જીપીસીએલએ સોલાર પાર્ક માટે તા. ૩૦-૦૮-૨૦૧૧ના રોજ બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના હડસદ ગામ ખાતે ૫૧૦.૩૧.૩૧ હેક્ટરની સરકારી પડતર જમીનનો અગ્રીમ કબજો મેળવી લીધો છે. સરકારે જમીનની કિંમત નક્કી ન કરી હોવાથી તે હિસાબે લેવામાં આવી નથી.
- (ગ) જીપીસીએલએ સોલાર પાર્ક માટે તા. ૩૦-૦૮-૨૦૧૧ના રોજ બનાસકાંઠા જિલ્લાના, સુઈગામ તાલુકાના દુંગડા ગામ ખાતે ૮૧.૭૫.૩૮ હેક્ટરની સરકારી પડતર જમીનનો અગ્રીમ કબજો મેળવી લીધો છે. સરકારે જમીનની કિંમત નક્કી ન કરી હોવાથી તે હિસાબે લેવામાં આવી નથી.
- (ઘ) અગાઉના વર્ષના આંકડા, આ વર્ષના વગીકરણ સાથે સુસંગત બનાવવા માટે જ્યાં જરૂરી જણાયું છે ત્યાં પુનઃ ગોઠવવામાં આવ્યા છે.
- (ચ) જીપીસીએલને એસએસએનએનએલ તરફથી ચારણકા સોલાર પાર્ક-૧ પ્રોજેક્ટ માટેના તેના ૪.૫ એમએલડી પાણી પુરવઠાના દાવા મુજબ, ૨૦૧૧-૧૨ થી ૨૦૧૫-૧૬ સુધીના સમયગાળા માટેની પાણીના ચાર્જીસની રૂ. ૧૪.૬૩ કરોડની કુલ ડિમાન્ડ (રૂ. ૨.૮૫ કરોડના વ્યાજ સહિત) પ્રાપ્ત થઈ છે.. બોર્ડના સભ્યોએ નિર્દેશ કર્યો છે કે એસએસએનએનએલને માત્ર મુદ્દલ રકમ આપીને તેની પતાવટ કરવાનો પ્રયાસ કરવામાં આવે. તદ્દનુસાર, હિસાબના ચોપડે પાણીના ચાર્જીસ અંગેની જોગવાઈ કરવામાં આવી છે અને વ્યાજની રકમ આકસ્મિક જવાબદારી તરીકે દર્શાવવામાં આવી છે.
- (છ) ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડે, સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એસ.ઈ.સી.આઈ.) સાથે તેના ૧૦ મે.વો. ના સોલાર પાવર પ્રોજેક્ટ માટે રૂ. ૧,૭૫,૦૦,૦૦૦/-ની વીજીએફ સહાય મેળવવા માટે ૨૦૧૪માં વાયેબીલીટી ગેપ ફંડીંગ સીક્યુરિટીઝેશન એગ્રીમેન્ટ કર્યા છે. તા. ૨૭/૦૩/૨૦૧૪ના

વીજીએફ સીક્યુરિટીઝેશન એગ્રીમેન્ટના ખંડ ૨.૧(ક) મુજબ, એગ્રીમેન્ટના આર્ટિકલ ૨.૨માં જણાવવામાં આવેલી શરતોના અનુપાલનને અધીન રહીને, જીપીસીએલ રૂ. ૧,૭૫,૦૦,૦૦૦/-ની વીજીએફ સહાય મેળવવાને પાત્ર છે. ઉપર જણાવેલા એગ્રીમેન્ટના ખંડ ૨.૧(ખ) મુજબ, રૂ. ૧,૭૫,૦૦,૦૦૦/-નું વીજીએફ છ હપતામાં છૂટું કરવામાં આવશે. ૫૦%નો પ્રથમ હપતો સંપૂર્ણ પરિયોજના ક્ષમતા સફળતાપૂર્વક શરૂ કર્યેથી છૂટો કરવામાં આવશે. બાકીના ૫૦% વીજીએફ ૧૦%ના સમાન પાંચ હપતામાં આગામી પાંચ વર્ષોમાં ક્રમશઃ રીતે, અન્ય શરતો તેમજ વીજનિર્માણની અન્ય જરૂરિયાતો પ્લાન્ટ દ્વારા સંતોષાય તે મુજબ છૂટું કરવામાં આવશે. પરિયોજના માર્ચ, ૨૦૧૫માં સફળતાપૂર્વક શરૂ કરવામાં આવી હતી. તેની વાણિજ્યિક કામગીરીની તરીકે મિલકતની કીમત નક્કી કરવી અનિવાર્ય છે અને વાણિજ્યિક કામગીરી શરૂ કરવામાં આવે તે વર્ષે એટલે કે વર્ષ ૨૦૧૪-૧૫માં તેની કિંમતમાંથી, મળવાપાત્ર કુલ વીજીએફ એટલે કે રૂ. ૧.૭૫ કરોડની રકમ બાદ કરવી અનિવાર્ય છે. તદ્દનુસાર, નાણાકીય વર્ષ ૨૦૧૪-૧૫માં જીપીસીએલએ તેના ઓડિટ થયેલા હિસાબના ચોપડાઓમાં, મળવાપાત્ર વાયેબીલીટી ગેપ ફંડીંગ ખાતાઓમાંથી રૂ. ૧,૭૫,૦૦,૦૦૦/-ની રકમ બાદ કરતી અને તેટલીજ રકમ ૧૦ મે.વો.ના સોલાર પાવર પ્રોજેક્ટના ખાતામાં જમા કરતી ઓર્ડર કરી હતી. નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં એસઈસીઆઈએ જીપીસીએલને પ્રથમ હપતા પેટે રૂ. ૮૭,૫૦,૦૦૦/-અને બીજા હપતા પેટે રૂ. ૧૭,૫૦,૦૦૦/-ની રકમ છૂટી કરી હતી. એસઈસીઆઈ તરફથી ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો હપતો છૂટો થવાની પ્રતીક્ષા છે. તેથી, એગ્રીમેન્ટ મુજબ પ્લાન્ટ દ્વારા વીજનિર્માણની અન્ય જરૂરિયાતો તેમજ અન્ય શરતો સંતોષાવાની બાબતને અધીન રહીને, દરેક વર્ષના અંતે (માર્ચ-૨૦૨૦) અને વાર્ષિક રૂ. ૧૭.૫૦લાખના દરે રકમ છૂટી કરવાની થાય છે. એગ્રીમેન્ટ મુજબ અને વ્યવસ્થાપક મંડળના અભિપ્રાય પ્રમાણે આ રકમો એસઈસીઆઈ તરફથી મળવાપાત્ર છે અને તદ્દનુસાર તે રકમોને એસઈસીઆઈ તરફથી મળવાપાત્ર રકમ તરીકે ૩૧મી માર્ચ, ૨૦૧૫ના રોજ હિસાબે લીધી છે અને મિલકત, પ્લાન્ટ અને સાધનસામગ્રીમાંથી તે રકમ બાદ કરી છે.

- (જ) જીપીસીએલએ તેના ૧૦૦૦ મે.વો. પીપાવાવ પાવર પ્રોજેક્ટ માટે ખરેખર પરામર્શન ફી પેટે લગભગ રૂ. ૧.૨૭ કરોડ ખર્ચ્યા છે. ગુજરાત સરકારે માત્ર જમીન સંપાદન માટે કંપનીએ કરેલ ખર્ચનું વળતર આપવાનું સ્વીકાર્યું છે અને પરામર્શન ફી સહિત પ્રોજેક્ટ અંગે કરેલું અન્ય કોઈપણ ખર્ચ ચૂકવવાનો ઈન્કાર કર્યો છે. આમ છતાં બોર્ડે નિર્દેશ કર્યો છે કે જીપીસીએલએ ખરેખર પરામર્શન ફી પેટે ખર્ચેલા રૂ. ૧.૨૭ કરોડ સહિત કરેલા કુલ ખર્ચનું વળતર ચૂકવવા માટે ગુજરાત સરકારને વિનંતી કરવી. પરંતુ આ બાબતમાં ગુજરાત સરકાર તરફથી કોઈ પ્રતિભાવ મળ્યો નથી. જીઆઈડીસીના તા. ૨૧/૦૮/૨૦૨૧ના પત્રને ધ્યાનમાં લેતાં, આ કંપનીના મતે આ દાવાની રકમ જીઆઈડીસી પાસેથી મેળવી શકાય તેમ હોઈ, જીપીસીએલએ તેના ૧૦૦૦ મે.વો. પીપાવાવ પાવર પ્રોજેક્ટ માટે ખરેખર પરામર્શન ફી પેટે ખર્ચેલા રૂ. ૧.૨૭ કરોડના સંદર્ભમાં ચલુ વર્ષે જોગવાઈ ઊભી કરી નથી.
- (ઝ) કંપની જે અંગે નજીકના ભવિષ્યમાં પ્રત્યક્ષ નુકસાન ઊભું થાય એવા ડેરિવેટિવ્સ કોન્ટ્રાક્ટ સહિત કોઈ લાંબાગાળાના કોન્ટ્રાક્ટ ધરાવતી નથી.
- (ત) વ્યવસ્થાપક મંડળના મતે સ્થાયી મિલકતો અને બિન-ચાલુ રોકાણો સિવાયની મિલકતોનું મૂલ્ય સામાન્ય કામકાજ દરમિયાન સરવૈયામાં તે દર્શાવવામાં આવ્યું છે તેનાથી ઓછું ઉપજશે નહીં.
- (થ) સિલકનું સમર્થન ન થવાને કારણે ૩૧/૦૩/૨૦૨૧ના રોજ પ્રાપ્ત થવા અને ચૂકવવાપાત્ર સિલકો, હિસાબ મેળવવાવડને કારણે કોઈ સમાયોજન કરવાનું થાય તો તેને અધીન રહેશે.
- (દ) જીપીસીએલ એ ટોરન્ટ પીપાવાવ જનરેશન લિમિટેડ અને બૈતરણી વેસ્ટ કોલ કંપનીમાં રોકાણ કર્યું છે (જુઓ નોંધ-૩ “ગૌણ, સહયોગી અને સંયુક્ત સાહસોમાં રોકાણ”). ઘટાડાનું પરીક્ષણ, ઘટાડાની જરૂરિયાત સૂચવતી હોય એવી પરિસ્થિતિઓના અસ્તિત્વના આધારે કરવામાં આવે છે. જીઆઈડીસીના તારીખ ૨૧/૦૮/૨૦૨૧ના પત્ર મુજબ આ પ્રોજેક્ટ માટે કરવામાં આવેલ તમામ ખર્ચ જીઆઈડીસી પાસેથી વસૂલ કરવાનું રહેશે અને તેથી વ્યવસ્થાપક મંડળનો અભિપ્રાય છે કે નુકસાન અંગે હાલમાં કોઈ નક્કર સંકેતો ન હોવાની બાબતને ધ્યાનમાં લઈને નુકસાન અંગેની જોગવાઈ કરવાની કોઈ જરૂર નથી. બૈતરણી વેસ્ટ કોલ કંપની લિમિટેડની તા. ૨૪/૦૩/૨૦૨૧ના રોજ મળેલી બોર્ડ મિટિંગમાં, બૈતરણી વેસ્ટ કોલ કંપની લિમિટેડના નિયામકમંડળે આ બાબત અંગે વિચારવિમર્શ કર્યો હતો અને ત્યારબાદ ૨૩મી સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ મળેલી બેઠકમાં પણ આ બાબત હાથ ધરવામાં આવી હતી પરંતુ તે અંગે આગળ શું નિર્ણય લેવો તે નક્કી થઈ શક્યું ન હતું. આને કારણે, વસુલાતપાત્ર કિંમત ચોક્કસ રીતે નક્કી કરી શકાઈ ન હોવાને કારણે હિસાબી ધોરણ ઉપ મુજબ નુકસાનની અસર ચાલુ વર્ષે નક્કી કરી શકાઈ નથી.
- (ધ) કંપની દ્વારા ફ્યુઅલ સપ્લાય એગ્રીમેન્ટના મુસદ્દાને આખરી રૂપ આપવામાં આવ્યું ન હોવાથી વ્યવસ્થાપક મંડળે, તેની મંજૂરી મળ્યા પછી, રૂ. ૨૨૬.૮૧ કરોડની રકમના લિગનાઈટના પુરવઠા માટે કામચલાઉ ધોરણે વચગાળાનું ઈનવોઈસ ઉગવવાનું નક્કી કર્યું હતું. સપ્લાય એગ્રીમેન્ટના મુસદ્દાને આખરી રૂપ આપવામાં થોડો વધુ સમય લાગશે એ હકીકતને ધ્યાનમાં લઈને આ રકમ ચાલુ વર્ષ માટે કામગીરીમાંથી આવક નોંધ-૧૭માં સમાવવામાં આવી છે.
- (ન) હિસાબી ધોરણ-૧૧૫ મુજબ કામગીરીસંબંધી જવાબદારીઓ સંતોષકારક રીતે પૂરી થયેથી આવક ધ્યાનમાં લેવામાં આવે છે. ૭૦૦ મે.વો. અલ્ટ્રા મેગા પ્રોજેક્ટ - રાધાનેસડા અને ૫૦૦૦ મે.વો. સોલાર પ્રોજેક્ટ - ધોલેરા શરૂ કરવામાં આવ્યા હતા અને તેમના અંગેની કામગીરીસંબંધી જવાબદારીઓ (કરારગત ફરજો) સંતોષકારક રીતે પૂરી કરવામાં આવી ન હતી. તેથી, ભારતીય હિસાબી ધોરણ-૧૧૫ હેઠળ નિયત કરવામાં આવેલી શરતો અને જરૂરિયાતોને ધ્યાનમાં લેતાં, આ પ્રોજેક્ટ પૂરા થશે ત્યારે આવક ધ્યાનમાં લેવામાં આવશે. તેથી નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં આ બંને પ્રોજેક્ટ અંગેની આવક ધ્યાનમાં લેવામાં આવી નથી. ગ્રાહકો પાસેથી પ્રાપ્ત થયેલી રકમ નાણાકીય પત્રકોમાં ચાલુ જવાબદારીઓ રૂપે “ગ્રાહકો પાસેથી પેશગી” તરીકે દર્શાવવામાં આવી છે. વધુમાં, તા. ૧૦/૦૬/૨૦૨૧ના પત્ર મુજબ શરતો પૂરી કરવાની બાબતને અધીન રહીને, રાધાનેસડા અને ધોલેરા સોલર પાર્ક માટેની સમયરેખા ૩૧/૧૨/૨૦૨૧ સુધી લંબાવવા માટે સક્ષમ સત્તામંડળ દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને તેથી આવક ધ્યાનમાં લેવાની બાબતમાં વિલંબ થયો છે.
- (પ) ગુજરાત રાજ્ય માટે વીજ ક્ષેત્રમાં ટેકનીકલ માનવ સંસાધન ઊભું કરવાના વિચાર સાથે ગુજરાત પાવર એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ (જીપીઈઆરઆઈ) ઊભી કરવાના માટે જીપીઈઆરએફની રચના જાહેર ખાનગી ભાગીદારી હેઠળ કરવામાં આવી હતી. જીપીઈઆરએફના પ્રમોટર ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ (જીપીસીએલ) છે, જે ગુજરાત સરકાર દ્વારા પ્રાયોજિત કંપની છે. જીટીયુ દ્વારા ૧૮ મી માર્ચ ૨૦૨૦ના રોજ યોજવામાં આવેલી બેઠકમાં, જીપીઈઆરએફના સ્ટાફ અને જવાબદારીઓ સિવાયની તમામ મિલકતો સાથે ઉક્ત સંસ્થાને ઘટક કોલેજ તરીકે પોતાને હસ્તક લઈ લેવા માટે જીટીયુ તૈયાર થઈ હતી. જીપીઈઆરએફને જુદી જુદી મિલકતો પૂરી પાડવા માટે જીપીસીએલએ લગભગ રૂ. ૧૧.૮૫ કરોડ ખર્ચ્યા છે. ઉપરની

બાબતને અનુસરીને, જીપીઈઆરએફએ તમામ સ્થાવર અને જંગમ મિલકતો સાથે જીપીઈઆરઆઈ તા. ૧૧/૦૮/૨૦૨૦થી જીટીયુને સોંપી દીધી છે. આ મિલકતો પર જીપીસીએલ ઘસારો ચાર્જ કરી રહ્યું છે. ઉપર જણાવેલી બાબતમાં લેવામાં આવેલા નિર્ણયને ધ્યાનમાં લઈને, કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં તા. ૧૦/૦૮/૨૦૨૦ સુધી ઘસારો ચાર્જ કર્યો છે અને હિસાબના ચોપડાઓમાં, ૩૧/૦૩/૨૦૨૧ના રોજ મુજબ રૂ. ૮,૮૨,૭૪,૮૩૨/- ની રાઈટ ડાઉન કરવામાં આવેલી કિંમત, નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં આ મિલકતોની તબદીલી અંગેના નુકસાન તરીકે પી અને એલ ખાતામાં ઉધારવામાં આવી છે.

(ક) સેગમેન્ટ રિપોર્ટિંગ નીતિને ધ્યાનમાં લઈને, નાણાકીય પત્રકોમાંથી બાબતવાર જાહેરાત નીચે આપવામાં આવી છે.

વિગતો:	રકમ:
ઉત્પાદનો અને સેવાઓ વિશેની માહિતી:	
બહારના ગ્રાહકો પાસેથી આવક	૨,૬૮,૮૨,૬૭,૮૮૮
ભૌગોલિક વિસ્તારો વિશે માહિતી:	
બિન ચાલુ મિલકતો: (મૂળ દેશમાં)	
મિલકત, પ્લાન્ટ અને સાધનસામગ્રી	૩,૧૦,૧૮,૩૧,૮૭૦
ઉત્પાદન વિકાસ મિલકત	૩૮,૫૧,૮૧,૮૩૭
ગૌણ, સહાયક અને સંયુક્ત સાહસમાં રોકાણ	૩૪,૩૩,૭૬,૨૭૦
અન્ય બીન ચાલુ મિલકતો	૪૭,૫૨,૦૧,૨૮૭
મુખ્ય ગ્રાહકો વિશેની માહિતી:	
કંપનીના એક ગ્રાહક પાસેથી લિગ્નાઈટના પુરવઠામાંથી થયેલી આવક લગભગ રૂ. ૨૨૬.૮૧ કરોડની (કંપનીની કુલ આવકના ૮૪.૩૪%)	

(બ) સીએસઆર માટે આ નાણાકીય વર્ષ દરમિયાન નીચે મુજબ ખર્ચ કરવામાં આવ્યું છે.

ક) ચાલુ વર્ષ (ના.વ. ૨૦૨૦-૨૧) કંપનીએ સીએસઆર માટે ખર્ચવી જરૂરી રકમ રૂ. ૧,૩૫,૫૧,૦૮૧/- છે અને ગત વર્ષ (ના.વ. ૨૦૧૯-૨૦)ની આગાળ ખર્ચવામાં આવેલ વણવપરાયેલ રકમ રૂ. ૧,૪૦,૨૩,૨૪૪/- છે. અને એ રીતે એકંદર રકમ રૂ. ૨,૭૫,૭૪,૩૨૫/- છે. તે પૈકી, ચાલુ વર્ષ (નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧), પાછલા વર્ષના ફંડમાંથી ખર્ચ કરવામાં આવેલી રકમ રૂ. ૧,૨૮,૮૫,૦૦૦/- છે અને ચાલુ વર્ષના ફંડમાંથી ખર્ચ કરવામાં આવેલી રકમ રૂ. ૩,૬૮,૩૫૫/- છે. અને તેથી બાકી રહેલી વણવપરાયેલી રૂ. ૧,૪૨,૨૦,૮૭૦/- ની રકમ માટે હિસાબના ચોપડાઓમાં જોગવાઈ કરવામાં આવી છે.

ખ) તા. ૨૪/૧૨/૨૦૧૪ની પર્યાવરણ સંબંધી મંજૂરી (ખંડ ક્રમાંક-૨૬) મુજબ, પ્રોજેક્ટ શરૂ કરનાર મુખ્ય કંપની જીપીસીએલ હોવાથી, ઉત્પાદનથી અસરગ્રસ્ત વિસ્તારોમાં તેણે સ્થાનિક સત્તામંડળો અને ગામો સાથે પરામર્શ કરીને, ખોદવામાં આવેલા લિગ્નાઈટના પ્રત્યેક ટન દીઠ રૂ. ૫ના દરે સીએસઆર પ્રવૃત્તિઓ કરવાની રહેશે, જે વાર્ષિક કુગાવાને અધીન રહેશે. નાણાકીય વર્ષ ૧૮-૧૯ માટે જીપીસીએલએ ૫,૦૮,૧૮૪.૮૩ મે.ટ. લિગ્નાઈટનું ઉત્પાદન કર્યું હતું અને એ રીતે તે ૨૦૧૯-૨૦ના નાણાકીય વર્ષમાં લગભગ રૂ. ૨૫,૪૫,૮૭૪.૧૫/-ની રકમ જેટલી સીએસઆર પ્રવૃત્તિઓ કરવા માટે જવાબદાર છે. વધુમાં, નાણાકીય વર્ષ ૧૯-૨૦ માટે જીપીસીએલએ ૮,૧૭,૦૬૨.૧૮ મે.ટ. લિગ્નાઈટનું ઉત્પાદન કર્યું હતું અને એ રીતે તે ૨૦૨૦-૨૧ના નાણાકીય વર્ષમાં લગભગ રૂ. ૪૦,૮૫,૩૧૦.૮૫/-ની રકમ જેટલી સીએસઆર પ્રવૃત્તિઓ કરવા માટે જવાબદાર છે. વધુમાં, નાણાકીય વર્ષ ૨૦-૨૧ માટે જીપીસીએલએ ૧૨,૭૧,૮૨૦.૫ મે.ટ. લિગ્નાઈટનું ઉત્પાદન કર્યું હતું અને એ રીતે તે ૨૦૨૧-૨૨ના નાણાકીય વર્ષમાં લગભગ રૂ. ૬૩,૫૮,૧૦૨.૫૦/-ની રકમ જેટલી સીએસઆર પ્રવૃત્તિઓ કરવા માટે જવાબદાર છે. તદ્દનુસાર, જીપીસીએલએ નાણાકીય વર્ષ ૨૦-૨૧માં સીએસઆર માટે રૂ. ૧,૨૮,૮૦,૩૮૮/-ની જોગવાઈ ઊભી કરી છે.

ગ) વર્ષ દરમિયાન નીચે મુજબ રકમ ખર્ચવામાં આવી છે. (રકમ રુ.માં)

ક્રમ નં.	વિગતો:	સરવાળો
૧	કોઈ પણ મિલકતનું બાંધકામ/સંપાદન	-
૨	ઉપર (૧) સિવાયના અન્ય હેતુ માટે	૧,૩૩,૫૩,૩૫૫
	સરવાળો...	૧,૩૩,૫૩,૩૫૫

આકસ્મિક જવાબદારીઓ

(૩. લાખમાં)

વિગતો	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૦ના રોજ
બેંક ગેરંટી અને સિમાંત નાણાં	૭,૪૩૧.૮૩	૭૪૧૧.૭૭
જુદાં જુદાં આકારણી વર્ષો માટે આવક વેરાની વિવાદિત માંગણી	૧૧,૬૦૧.૧૬	૧૧૭૦૮.૮૧
તા. ૧૨-૧૧-૨૦૧૮ના રોજ મુજબ વિવાદિત સર્વિસ ટેકસની માંગણી	૨,૮૫૩.૬૫	૨૮૪૪.૮૮
અસલમાં મૂકવાના અને જેના માટેની જોગવાઈ કરવામાં આવી નથી એવા કરારોની અંદાજિત રકમ	૫,૪૭૧.૦૦	૩૮૫૩.૦૧
એસએસએનએનએલના અકારવામાં આવ્યા મુજબના પાણી ખર્ચના વિવાદિત હકદાવા	૨૮૫.૩૭	૧૮૧૪.૬૪
એસઈસીઆઈ સાથેનો વિવાદિત હકદાવો	૨૪૧.૦૮	૨૪૧.૦૮
ઓર્ડર ૨૬ થવાના કારણે ગ્રાહક સાથે વિવાદિત હકદાવો	૨૮૩.૩૫	૦.૦૦
સરવાળો	૨૮૨૮૭.૫૩	૨૮૧૭૫.૪૦

અનિલ એન. શાહ એન્ડ કું.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એફ. આર. એન. નં. ૧૧૪૧૩૧W
વતી
જહા એચ. શાહ
ભાગીદાર સભ્ય નં. ૧૪૧૮૨૫
યુડીઆઈએન: ૨૨૧૪૧૮૨૫એએએડી૧૦૮૮
તારીખ: ૨૮/૧૨/૨૦૨૧
સ્થળ: અમદાવાદ

મેહુલ જે. ડનાયક
ચીફ ફાઇનાન્સીયલ ઓફીસર
કૃપા એન. જોશી
કંપની સેક્રેટરી

વ્યવસ્થાપક મંડળના નામે અને તેમના વતી
(સીઆઈએન : યુ ૪૦૧૦૦ જીજે ૧૮૮૦ એસજીસી ૦૧૩૮૬૧)
મમતા વર્મા
અધ્યક્ષ
ડીઆઈએન : ૦૧૮૫૪૩૧૫
વિકલ્પ ભરદ્વાજ
મેનેજિંગ ડિરેક્ટર
ડીઆઈએન: ૦૮૩૮૬૨૨૨
તારીખ : ૨૮/૧૨/૨૦૨૧
સ્થળ : ગાંધીનગર

Government Report under section 143(6)(B) of the Companies Act with regard to the performance of Gujarat Power Corporation Limited (GPCL) for the year ending on 31/03/2021

The 31ST Annual Report of GPCL has been received by Government on 02/03/2022. The corporation has attained remarkable achievements during the year under report. GPCL was engaged in various activities involving planning of different energy related projects and their stages of implementation during 2020-2021. The corporation has generated income of ₹ 322.31 crore during the year 2020-2021 compared to ₹ 274.72 crore during the year 2019-2020 and recorded profit of ₹ 57.69 crore compared to the profit of ₹ 78.85 crore in the year 2019-2020.

Considering the requirement of fund for upcoming project, it has been decided to retain the profit in the current year. Therefore, no dividend has been announced during the year under report. As the State Government has an investment of more than 51% in this corporation, GPCL is a government company. As on 31/03/2021, the paid up share capital of the company is ₹ 513.22 crore against the authorised share capital of ₹ 600 crore.

The company has been playing the role of a developmental catalyst in the field of energy in the state. The company identifies energy projects based on different kinds of fuel, identifies private/joint venture partners and implements the projects collectively with the identified partners. Once the projects are identified, the corporation undertakes the task of obtaining various statutory and administrative approvals such as approval with regard to water and air pollution, environmental and forest approval, approval with regard to civil aviation. The company completes the formalities to acquire land under the Land Acquisition Act and integrates energy projects with fuel. In several cases, the company implements the projects under memorandum of understanding executed with public enterprises.

During 2020-2021 following projects were in operation or under implementation.

1. GPCL Power Project (Windmill/Solar in operation)

- (A) 6MW windmill power project at villages Manaba and Pethapur , Taluka Rapar, District Kutch
- (B) 10.5 MW windmill power project at Jamanwada, District Kutch
- (C) 4.2 MW windmill power project under the concept of hybridization at Charanka Solar Park, District Patan
- (D) 5 MW solar power project at Gujarat Solar Park, village Charanka, Taluka Santalpur, District Patan

(E) 10 MW solar power project at Gujarat Solar Park, village Charanka, Taluka Santalpur, District Patan

(F) 1 MW Rooftop Solar Project.

2. Gujarat Solar Park, District Patan (in operation)

Gujarat Power Corporation Limited is the nodal agency for developing Charanka solar park at village Charanka, Taluka Santalpur, District Patan

Till date, 730 MW Solar Projects by about 36 developers are commenced.

3. 700 MW gas based Pipavav Power Project, District Amreli

GSPC, Pipavav Power Company Limited is a joint venture between Gujarat State Petroleum Corporation Limited and Gujarat Power Corporation Limited. This project is under commercial operation.

4. 700+ MW Raghnesda Ultra Mega Solar Park

Gujarat Power Corporation Limited has been made the nodal agency for developing 700+ Ultra Mega Solar Park at village Raghnesda, Taluka Vav, District Banaskantha. Currently, the various infrastructure activities like road, water supply system, power evaluation are almost completed. Projects developers for 700 MW capacity are finalized, out of 700 MW capacity, 400 MW solar projects will be commissioned in August – 2021, 200 MW solar projects will be commissioning by June – 2022.

5. Mining Projects


- Bhavnagar Lignite Mining Projects - in operation






Mamta Verma
Principal Secretary
Energy and Petrochemicals Department



Address : Block No. 8, Sixth Floor,
Udhyog Bhavan, Sector 11,
Gandhinagar - 382 011
Phone : 079 - 23251255-60
Fax : 91-79-23251254
www.gpcl.gujarat.gov.in
CIN:U40100GJ1990SGC013961



ANNUAL REPORT 2020-2021



31ST ANNUAL REPORT 2020-21

GUJARAT POWER CORPORATION LIMITED

[CIN: CIN: U40100GJ1990SGC013961;

Registered Office: 6th Floor, Block Nos. 6 & 8 Udhog Bhavan, Sector – 11, Gandhinagar – 382 011

E-mail: cosecgpcl@yahoo.co.in; website: www. gpcl.gujarat.gov.in

Tel. No.: 079 – 23251255-60; Fax: 079-23251254]

Board of Directors:

Smt. Sunaina Tomar, IAS	:	Chairman (from 10.01.2020 to 15.06.2021)
Smt. Mamta Verma, IAS	:	Chairman (w.e.f. 09.07.2021)
Shri S. B. Khyalia	:	Managing Director (upto 01.10.2021)
Shri Vikalp Bharadwaj	:	Managing Director (w.e.f. 11.11.2021)
Smt. Anju Sharma, IAS	:	Woman Director (upto 28.07.2021)
Shri Praful H. Rana	:	Director
Shri R. G. Desai	:	Director (Nominee of FD, GoG) upto 07.08.2020
Ms. Dipal Hadiyal	:	Director (Nominee of FD, GoG) w.e.f. 23.12.2020

Independent Directors:

Shri P. K. Taneja, IAS (Retd.)	:	Independent Director (w.e.f. 26.11.2020)
--------------------------------	---	--

Key Managerial Personnel (KMP) :

Shri Mehul J. Danayak	Chief Financial Officer
Ms. Krupa N. Joshi	Company Secretary

Auditors:

Statutory Auditors M/s. Anil N. Shah & Co. Chartered Accountants, Ahmedabad.

Secretarial Auditors M/s. Dhara Patel, Company Secretaries,
Practicing Company Secretary, Ahmedabad

Cost Auditors M/s. P. H. Desai & Co., Cost Accountants, Ahmedabad

Bankers: Axis Bank Ltd.
State Bank of India
HDFC Bank Ltd

Registered Office : 6th Floor, Block Nos. 6 & 8
Udhog Bhavan, Sector – 11,
Gandhinagar – 382 011, Gujarat.

Corporate Identity Number (CIN) : U40100GJ1990SGC013961

INDEX

Sr. No.	Particulars	Page No.
1	Directors' Report	01
2	Comments of the Comptroller and Auditor General of India under Section 143 (6) (b) of the Companies Act, 2013 on the Financial Statements of Gujarat Power Corporation Limited for the year ended 31st March, 2021.	19
3	Auditors' Report	20
4	Balance Sheet	31
5	Statement of Profit & Loss	32
6	Cash Flow Statement	33
7	Statement of Changes in Equity	35
8	Notes to Financial Statements 1 to 30	37

DIRECTORS' REPORT

To,
The
Members,
Gujarat Power Corporation Ltd. (GPCL).
Gandhinagar.

Your Directors are pleased to present the 31st Annual Report and Audited Statement of Accounts of the Company for the year ended on 31/03/2021 as below:

1. FINANCIAL RESULTS:

(Rs. In Crores)

Sr. No.	Particulars	2020-21	2019-20
1.	Total Revenue	322.31	274.72
2.	Total Expenditure	264.62	195.87
3.	Profit before tax	57.69	78.85
4.	Tax including deferred tax	(16.44)	(11.40)
5.	Profit/ (Loss) after tax	41.25	67.45
6.	Other comprehensive income (OCI)	56.26	00.19
7.	Total comprehensive income for the period	97.51	67.64

2. DIVIDEND

During the year under review, the Company has earned profits but due to upcoming projects, your Directors do not recommend any dividend for FY 2020-21.

3. TRANSFER TO RESERVES

The Profit is carried to reserves.

4. TRANSFER OF UNCLAIMED DIVIDEND TO INVESTOR EDUCATION AND PROTECTION FUND (IEPF):

The provisions of Section 125(2) of the Companies Act, 2013 do not apply to the Company as there are no unclaimed / unpaid dividends which are to be transferred to IEPF.

5. DEPOSITS

During the year ended March 31, 2021, the Company has not accepted any deposits from the public within the meaning of "Deposits" as defined under The Companies (Acceptance of Deposits) Rules, 2014. As such, Rule 8 (5)(v)&(vi) of the Companies (Accounts) Rules, 2014 read with Rule 3 (ii) of The Companies (Acceptance of Deposits) Rules, 2014, and section 73 of the Companies Act, 2013, are not applicable to the Company.

6. STATUS OF PROJECTS UNDERTAKEN:

A) POWER PROJECTS

1) 500MW Bhavnagar Lignite Based Power Project:

The project has been commissioned.

2) GPCL OWN POWER PROJECT (WIND / SOLAR):

A) 6 MW Wind Mill Power Project at Shikarpur:

GPCL has set up a 6 MW Wind Mill Project at villages Manaba & Pethapar, Taluka Rapar, District Kutch during the FY 2010-11. The Project is fully operational. In year 2020-2021, the project has generated 6.15 MUs of electricity and approx earned revenue of Rs. 2.16 Crores.

B) 10.5 MW Wind Mill Power Project at Jamanwada.

GPCL has set up a 6.3 MW Wind Mill Project at Jamanwada in District Kutch during the FY 2011-12 and 4.2 MW Wind Mill Project at Jamanwada in F.Y. 2012-13. The Project is fully operational. In year 2020-2021, the Project has generated 11.13 MUs of electricity and approx earned revenue of Rs. 4.20 Crores.

C) 4.2 MW Wind Mill Power Project at Charanka under Hybridization concept:

GPCL has set up a 4.2 MW Wind Mill Project at Charanka to experiment hybridization concept at Charanka during the FY 2012-13. The Project is fully operational. In year 2020-2021, the Project has generated 2.69 MUs of electricity and approx earned revenue of Rs. 0.95 Crores.

D) 5 MW Solar Project at Charanka:

GPCL has set up a 5 MW Solar Power Project at Charanka during the FY 2011-12. The project is operational. In year 2020-2021, the Project has generated 4.14 MUs of electricity and approx earned revenue of Rs. 6.01 Crores.

E) Solarisation of Modhera Sun Temple & Town:

Government of Gujarat and Government of India jointly is setting up first-of-its-kind demonstration project - Solarisation of Modhera Sun Temple & Town. The main aim of this project is to provide round the clock the solar power supply to Modhera Sun Temple & Town. Government of Gujarat has declared GPCL as an implementing agency for this project. GPCL through reverse auction bidding has selected Mahindra Susten Pvt Ltd as EPC agency for this project. The agency has started the work for this project from 05.08.2020. The estimated project cost is Rs. 69 Crores. The entire funding is provided by GoG & Gol. Though the project is greatly affected by COVID-19 pandemic. The project is expected to complete in near future.

3) Gujarat Solar Park.

Gujarat Solar Park is located at Charanka village, Santalpur, Taluka of Patan District. The integrated "Solar Park" has state of art infrastructure with provision to harness rain water besides power evacuation at the door steps. Installed capacity of 730 MW Solar Project has been commissioned by 36 developers.

4) 10MW Solar Power Project under JNNSM Phase II Scheme.

GPCL has commissioned another 10 MW Solar Power Project under JNNSM phase II Batch I scheme with an EPC cost of Rs. 62 Crs. The project was commissioned on 20.03.2015. In year 2020-2021, the project has generated 20.96 MUs and earned revenue of 9.49 Crores.

5) GPCL's Own 1-MW Solar Rooftop Project

GPCL has signed "Power Purchase Agreement (PPA)" with Torrent Power Ltd for its aggregate 1-MW Solar Rooftop Project set up on various Government Buildings located in Gandhinagar and Ahmedabad. GPCL has successfully commissioned 983.99 KW in F.Y. 2013-14. In year 2020-2021, the project has earned revenue of Rs. 95.42 Lakhs.

6) 700 + MW Raghanesda Ultra Mega Solar Park

The park is in operation with 400 MW Solar power generation, 200 MW capacity is under execution where as plot for 100 MW capacity is yet to be allotted. The construction of road is completed. The infrastructure works like bund, water supply, storm water drains at the said park are above to complete.

7) 500 MW Harshad Solar Park

Government of Gujarat and Government of India have given "In Principle" approval to set up 500 MW Solar Power Park on waste land having area of about 1000 hectares. Government of Gujarat has already given advance possession of 698 hector land in Village- Harshad, Suigam, Dist. Banaskantha. At present, GPCL has requested to Government of Gujarat to decide upon implementation modalities of this park.

8) 1000 MW (Phase-1) Dholera Ultra Mega Solar Park

Government of Gujarat has approved to set up 1000 MW Dholera Ultra Mega Solar Power Park. In this project, Dholera Special Investment Region has agreed "In princilpe" to provide land on long term lease basis. GUVNL had initial invited tenders for procurement of solar power from this park. Out of which, 300 MW capacity is tied up by GUVNL. This capacity is being developed by Tata Power Renewable Energy Ltd which is under execution. GPCL is providing necessary infrastructure for development of this park.

9) Tidal based Power Project.

GPCL has been appointed as nodal agency for implementing the Tidal Power Project.

(B) MINING PROJECTS:
1.) Bhavnagar Lignite Mining Projects.

GPCL has identified three lignite blocks/ mining leases in Bhavnagar District for mining of lignite:

- (i.) Ghogha Surka Mining Project (1355 hectares)
- (ii.) Khadsaliya-I Mining Project (712 hectares); (This project is yet to be commissioned)
- (iii.) Khadsaliya-II Mining Project (914 hectares); (This project is yet to be commissioned)
- (i) Ghogha Surka Mining Project.

Out of Mining Lease over an area of 1355 hectares having the rated capacity of 2.25 MMT/year, about 1,069 hectares of Private Land has been acquired through the consent award. All the necessary permissions, approvals/ agreements have been obtained / executed, as are necessary for commissioning Mining activities. The mining activity at Ghogha Surka Lignite Mine commenced from 01.04.2018 and supply of lignite to Bhavnagar Thermal Power Station (BLTPS) started from 08.08.2018 onwards. About 25,98,077.52 Tons of lignite have been supplied to BLTPS upto 31.03.2021.

2.) Baitarni West Coal Block

The matter pertaining to de-allocation of coal block is sub-judice in the Hon'ble High Court of Odisha. BWCCCL has received compensation towards cost of Geological Report and cost of Consent from Ministry of Coal, GOI and has given GPCL its 1/3rd share of cost of consent. BWCCCL has assured GPCL that the matter pending before the Hon'ble. High Court of Cuttak, Odisha will be expedited by them to release the Bank Guarantee of Rs. 75 Crores.

7. SUBSIDIARY/ ASSOCIATE/ JOINT VENTURE COMPANIES

The Company has no Subsidiaries as on 31.03.2021.

The Company has one Associate Company viz; Baitarni West Coal Company Limited (BWCCCL) and three other jointly controlled entities with investment of less than 10%. The financial statement pertaining to the associates/ joint ventures of the Company as required under first proviso to subsection – 3 of section 129 of the Companies Act, 2013 in the prescribed form AOC – 1 contained in Rule 5 of The Companies (Accounts) Rules, 2014 is attached to this Report as – "Annexure – 1". The financial statements of BWCCCL are not consolidated with the Company as the coal block allotted to BWCCCL is de-allocated by the Ministry of Coal, Gol and the matter is sub-judice in the Hon'ble High Court of Orissa.

8. DIRECTORS AND KEY MANAGERIAL PERSONNEL (KMP)
a.) Chairman, Managing Director

During the year, Smt. Sunaina Tomar, IAS was the Chairman of the Company and Shri S. B. Khyalia, was Managing Director of the Company. However, as on the date of this Report, Smt. Sunaina Tomar, IAS has resigned from the office of Chairman of the Company on 15.06.2021 and Smt. Mamta Verma, IAS, has been appointed as Chairman of the Company w.e.f. 09.07.2021.

As on the date of this Report, Shri S. B. Khyalia has resigned from the office of Managing Director on 01.10.2021 and Shri Vikalp Bharadwaj, IAS has been appointed as Managing Director w.e.f. 11.11.2021.

b.) Independent Directors:

In terms of the definition of 'Independence' of Directors as prescribed under Section 149(6) of the Companies Act, 2013, Shri P. K. Taneja, IAS (Retd.) is the Non –executive Independent Director on the Board of the Company and appointment of another Independent Director is under process. The Independent Director has given necessary declaration as required under section 149 of the Companies Act, 2013. All the Directors have given declaration towards compliance of code of conduct.

c.) Woman Director:

In terms of the provisions of Section 149 of the Companies Act, 2013, Smt. Anju Sharma, IAS was the Woman Director on the Board of the Company during the financial year 2020-21. However, as on the date of this Report Smt. Mamta Verma, IAS and Ms. Dipal Hadiyal are the Women Directors on the Board.

d.) Key Managerial Personnel:

During the FY 2020-21, Ms. Krupa Joshi, is the Company Secretary of the Company and also a KMP u/s 203 of the Companies Act, 2013. Shri Mehul J. Danayak is the Chief Financial Officer of the Company and also a KMP u/s 203 of the Companies Act, 2013.

9. NUMBER OF MEETINGS OF THE BOARD:

During the financial year under review, Four Board Meetings were held on 19.06.2020, 28.09.2020, 23.12.2020 and 04.02.2021. The intervening gap between any two Meetings was within the period prescribed under the Companies Act, 2013.

10. COMMITTEES OF THE BOARD

During the year under review, the Company has “Corporate Social Responsibility Committee” in compliance with the requirements of the relevant provisions of the Companies Act, 2013 and Rules thereunder and “Share Offer & Allotment Committee” to look after the matters pertaining to allotment of Equity Shares from time to time.

a.) CSR COMMITTEE:

The Company has constituted the CSR Committee in compliance with the provisions of Section 135 of the Companies Act, 2013. The constitution of CSR Committee as on 31.03.2021 is as follows:

- i.) Smt. Anju Sharma, IAS – Chairman of Committee
- ii.) Shri S. B. Khyalia - Member
- iii.) Shri P. H. Rana – Member

The detailed report of the activities is placed at “Annexure - 2”.

11. VIGIL MECHANISM/ WHISTLE BLOWER POLICY

The Company has implemented a Vigil mechanism pursuant to which Whistle Blowers can raise concerns against unacceptable work behaviour, management/ business practices, physiologically adverse work conditions, actual or suspected fraud or violation of the Codes of conduct or violation of legal or regulatory requirements, incorrect or misrepresentation of any financial statements and reports and such other activities of reasonably negative nature which may be seen to tarnish the image of the Company, employee morale and safety at the workplace etc. Whistle Blower has direct access to the Chairman of Audit Committee in exceptional cases to report genuine concerns or grievances.

12. PARTICULARS OF LOANS, GUARANTEES OR INVESTMENTS MADE UNDER SECTION 186 OF THE COMPANIES ACT, 2013:

The investments made by the Company during the period under review are contained in Note 3 and 4 and loans given are mentioned at Note – 5 to the Financial Statement for FY 2020-21.

13. PARTICULARS OF CONTRACTS OR ARRANGEMENTS MADE WITH RELATED PARTIES:

All transactions entered by the Company during the financial year with related parties were in the ordinary course of business and on an arm's length basis and that the provisions of Section 188 of the Companies, Act, 2013 are not attracted. Further there are no material related party transactions during the year under review with the promoters, Directors or Key Managerial Personnel which may have a potential conflict with the interest of the Company. Your Directors draw attention to Note 27 of the financial statement for FY 2020-21 containing related party disclosures. Moreover, in case of holding company/ associated company is a state controlled entity; there is no need to make such disclosure.

14. EXTRACTS OF ANNUAL RETURN

Pursuant to section 134 (3) (a) section 92 (3) of the Companies Act 2013, read with Rule 12 of the Companies (Management and Administration) Rules, 2014 the extracts of the Annual Return as at 31st March, 2021, in the prescribed form MGT - 9 forms part of this report as “Annexure - 3”.

15. AUDITORS & AUDIT OBSERVATIONS:
a.) STATUTORY AUDITORS:

As per the provisions of section 139 of the Companies Act, 2013 read with Rules made there under, the office of the Comptroller and Auditor General of India, New Delhi had appointed M/s. Anil N. Shah & Company, Chartered Accountants, Ahmedabad as Statutory Auditors of the Company for the financial year 2020-21 who shall hold the office as such till the date of ensuing Annual General Meeting.

b.) COST AUDITORS:

The Company is required to maintain cost records as specified by the Central Govt. under Section 148 (1) of the Companies Act, 2013. Accordingly, the Company is maintaining requisite Cost records and accounts. As per Companies (cost records and audit) Rules, 2014, M/s. P.H. Desai & Co., Cost Accountants, Ahmedabad were appointed as Cost Auditors of the Company for FY 2020-21 for undertaking the cost audit of the Company.

c.) INTERNAL AUDITORS:

In accordance with the provisions of section 138 of the Companies Act, 2013, read with Rules made there under, the Board appointed M/s. Sandip Desai & Co., Chartered Accountants, Ahmedabad as Internal Auditors of the Company for the FY 2020-21 to carry out the work of Internal Audit. The observations and recommendations of the Internal Auditors are reported to the Audit Committee for appropriate action on the same.

d.) SECRETARIAL AUDITORS:

Pursuant to the provisions of Section 204 read with Rules made there under, the Company appointed M/s. Dhara Patel, Company Secretaries, Practising Company Secretary, Ahmedabad as the Secretarial Auditor for the Financial Year 2020-21 The Report on Secretarial Audit carried out is annexed herewith as “Annexure – 4”.

e.) Explanations or comments by the Board on every qualification/ reservation/ adverse remark or disclaimer made by the Statutory Auditor in his Audit Report and by the Secretarial Auditor in his Secretarial Audit Report

The Statutory Auditors have not given any qualification, reservation or made any adverse remarks or disclaimer in their Audit Report. The observations of Secretarial Auditors are self explanatory since due to the effects of the Covid -19 pandemic, the mentioned delay in compliances was made.

16. MATERIAL CHANGES AND COMMITMENT AFFECTING FINANCIAL POSITION OF THE COMPANY:

There are no material changes and commitments, affecting adversely the financial position of the Company which has occurred between the end of the financial year of the Company i.e. 31st March, 2021 and the date of the Directors' Report other than routine business dealings. There has been no change in the nature of business of the Company. No significant or material Orders have been passed by the regulators or Courts or Tribunals impacting the going concern status of the Company and/ or the Company's operations in future.

17. PARTICULARS OF EMPLOYEES:

As per MCA notification dated 05.06.2015 section 197 is not applicable to the Company as the Company is a government company.

18. SHARE CAPITAL:

The Company has only one class of shares viz; Equity Shares. The Authorised Share Capital of the Company as on 31.03.2021 is Rs. 600 Crores divided into 6 Crore Equity Shares of Rs. 100/- each. The issued, subscribed and paid-up capital of the Company as on 31.03.2021 stood at Rs. 513,22,56,050/-. Other details w.r.t. Capital are:

a.) BUY BACK OF SECURITIES-

The Company has not bought back any of its securities during the year under review.

b.) SWEAT EQUITY-

The Company has not issued any Sweat Equity Shares during the year under review.

c.) BONUS SHARES-

No Bonus Shares were issued during the year under review.

d.) EMPLOYEES STOCK OPTION PLAN-

The Company has not provided any Stock Option Scheme to the employees.

19. CONSERVATION OF ENERGY, TECHNOLOGY ABSORPTION, FOREIGN EXCHANGE EARNINGS AND OUTGO

(a) Conservation of Energy: During the period under review, there is no consumption of energy requiring disclosure.

(b) Technology Absorption: During the period under review your Company has not imported any technology.

(C) Foreign Exchange Earnings & Outgo: Nil

20. RISK MANAGEMENT:

The Company's property and assets have been adequately insured. However, it is yet to form and implement a Risk Management Policy covering the elements of risk which may be detrimental to the Company.

21. INTERNAL AUDIT & CONTROL SYSTEMS:

The Company has put in place proper internal control systems and processes commensurate with its size and scale of operations, ensuring adherence to policies and system facilitating mitigation of the operations risks perceived for each area under audit. Please refer Annexure – II to the Independent Auditors’ Report of even date on the Standalone IND AS Financial Statements of the Company.

22. DISCLOSURE UNDER THE SEXUAL HARASSMENT OF WOMEN AT WORKPLACE (PREVENTION, PROHIBITION & REDRESSAL) ACT, 2013:

During the year under review, the Company had received Nil complaint w.r.t. sexual harassment of women employees. The requisite Internal Complaints Committee under the provisions of the Sexual Harassment of Women at Workplace (Prevention, Prohibition & Redressal) Act, 2013, is yet to be formed

23. BOARD EVALUATION:

The Company being a Government Company, the provisions of Section 134(3)(p) of the Companies Act, 2013 are not applicable in view of the Notification No. GSR-163(E) dated 05-Jun-2015 issued by the Ministry of Corporate Affairs, Govt. of India.

24. DIRECTORS’ RESPONSIBILITY STATEMENT:

In accordance with the provisions of Section 134(5) of the Companies Act, 2013 the Board hereby submits its responsibility Statement that:—

- a) in the preparation of the annual accounts, the applicable accounting standards had been followed along with proper explanation relating to material departures;
- b) the directors had selected such accounting policies and applied them consistently and made judgments and estimates that are reasonable and prudent so as to give a true and fair view of the state of affairs of the company at the end of the financial year and of the profit and loss of the company for that period;
- c) the directors had taken proper and sufficient care for the maintenance of adequate accounting records in accordance with the provisions of this Act for safeguarding the assets of the company and for preventing and detecting fraud and other irregularities;
- d) the directors had prepared the annual accounts on a going concern basis; and
- e) (Not Applicable since the company is not a listed Company)
- f) the directors had devised proper systems to ensure compliance with the provisions of all applicable laws and that such systems were adequate and operating effectively.

25. OTHER DISCLOSURES:

- a.) There was no change in the nature of business of the Company during the year.
- b.) There were no instances of frauds identified or reported by the Statutory Auditors during the course of their audit pursuant to Section 143(12) of the Companies Act, 2013.
- c.) No Significant or material orders were passed by the Regulators or Courts or Tribunals which impact the going concern status and the Company’s operations in future except as stated elsewhere in this report.
- d.) The Company has complied with the applicable Secretarial Standards.

26. ACKNOWLEDGEMENT

Your Directors take this opportunity to express their gratitude to all employees for the continuous assistance, dedication and loyalty towards the Company. The Directors also place on record their sincere appreciation for co-operation and continued support extended by various departments of Government of Gujarat specifically Energy and Petrochemical Dept., the Clients, Bankers and other Regulatory authorities during the year.

For and on behalf of the Board of Directors
Sd/-

(Smt. Mamta Verma, IAS)

Chairperson

DIN: 01854315

Place: Gandhinagar

Date: 29.12.2021

“Annexure – 1”

Form AOC-1

(Pursuant to first proviso to sub-section (3) of section 129 read with rule 5 of Companies (Accounts) Rules, 2014)
Statement containing salient features of the financial statement of subsidiaries/associate companies/joint ventures

Part “A”: Subsidiaries – N.A. (The Company does not have any subsidiary)

Part “B”: Associates and Joint Venture

Statement pursuant to Section 129 (3) of the Companies Act, 2013 related to Associate Companies:

Name of associates	Baitarni West Coal Company Limited (“BWCCL”)
1. Latest audited Balance Sheet Date	31.03.2021
2. Shares of Associate held by the company on the year end	
No.	100000 Equity Shares of Rs. 1000/- each
Amount of Investment in Associates/ Joint Venture	Rs. 10,00,00,000/-
Extent of Holding%	33.33%
3. Description of how there is significant influence	It is a Joint Venture Company of Gujarat Government (represented by Gujarat Power Corporation Limited), Orissa Government and Kerala Government wherein each of the Governments have the stake of 33.33%.
4. Reason why the associate/joint venture is not consolidated	The coal block allotted to BWCCL is de-allocated by the Ministry of Coal, Gol and the matter is sub-judice in the Hon’ble High Court of Orissa, hence the financial statements are not consolidated with the Company.
5. Net worth attributable to shareholding as per latest audited Balance Sheet	*Total Net worth of BWCCL: Rs. 32,95,91,609/- *Attributable to GPCL (33.33%): Rs. 10,98,52,883/-
6. Profit/Loss for the year	*Net Profit of Rs. 8,551,767/- *Attributable to GPCL Rs. 2850304/-
i. Considered in Consolidation	Nil
ii. Not Considered in Consolidation	Rs. 2850304/- as N.A.

- 1. Names of associates or joint ventures which are yet to commence operations.
- 2. Names of associates or joint ventures which have been liquidated or sold during the year.

Note: This Form is to be certified in the same manner in which the Balance Sheet is to be certified.

For & on behalf of the Board of Directors

Sd/-

Chairperson

DIN:01854315

Date: 29.12.2021

Place: Gandhinagar

Sd/-

Managing Director

DIN: 09396222

Sd/-
Chief Financial Officer

Sd/-
Company Secretary

ANNUAL REPORT ON CORPORATE SOCIAL RESPONSIBILITY (CSR) ACTIVITIES

- The brief outline of the company’s CSR Policy, including overview of projects or programs proposed to be undertaken and a reference to the web-link to the CSR Policy and projects or programs:

The Company understands that being part of this society it is its moral responsibility to aid and serve the society to the maximum possible extent. The Objective of this CSR Policy through its CSR initiatives is to focus on holistic development of host communities and create social, environmental and economic value to the society

The Corporate Social Responsibility Policy of the Company is available on the website of the Company viz. www.gpcl.gujarat.gov.in

- Composition of the CSR Committee:

Smt. Anju Sharma, IAS - Chairman (upto 28.07.2021)
 Shri S. B. Khyalia - Member (upto 01.10.2021)
 Shri P. H. Rana - Member

- Average Net Profit of the Company for last three Financial Years:

Average Net Profit (2017 – 2018 to 2019 – 20): Rs. 67,75,54,027/-

- Prescribed CSR Expenditure (two percent of the amount as in item 3 above.):

Rs. 1,35,51,081/- towards CSR.

- Details of CSR spent during the financial year:

(a) Total amount spent for the financial year: Rs. 27,50,000/- (approved during FY 2020-2021 but spent in FY 2021-2022)

- (b) Amount unspent, if any: Rs. 1,35,51,081/- (approved during FY 2020-2021 but spent in FY 2021-2022)

- (c) Manner in which the amount spent during the financial year is detailed below:

Sr. No	CSR project or activity identified.	Sector in which the Project is covered.	Projects or programs (1) Local area or other (2) Specify the State and district where projects or programs was undertaken.	Amount outlay (budget) project or programs wise	Amount spent on the projects or programs Sub-heads: (1) Direct expenditure on projects or programs. (2) Overheads:	Cumulative expenditure upto the reporting period.	Amount spent: Direct or through *implementing agency
*1.	Government Arts & Commerce College, Bhavnagar	Promoting Education and health care	Bhavnagar, Gujarat	Rs. 8,50,000/-	Direct Expenditure Rs. 8,50,000/-	Rs. 4,93,379/-	Direct
**2	The Akshay Patra Foundation, Gujarat	Eradicating malnutrition and Promoting Healthcare	Bhavnagar, Gujarat	Rs. 9,00,000/-	Direct Expenditure Rs. 9,00,000/-	Rs. 9,00,000/-	Direct
*&** Please see notes below							

Notes:

* 1. Total CSR contribution of Rs. 8,50,000/- has been carried forward from F.Y.2019-20 and out of that Rs. 4,93,379/- has been spent in F.Y. 2020-21. Remaining amount has been transferred to Unspent Corporate Social Responsibility Account being the amount towards ongoing project.

** 2. The said contribution of Rs. 9,00,000/- has been carried forward from F.Y.2019-20 and entire amount has been spent in F.Y. 2020-21.

3. Further, from the total CSR expenditure amounting to Rs. 1,35,51,081/- to be spent during FY 2020-21, Rs. 27,50,000/- were approved to be contributed to The Akshay Patra Foundation towards distribution of Happiness Kit during FY 2020-21, but due to effects of Covid-19, the same were spent in FY 2021-22. Remaining amount of Rs. 1,07,05,970/- were transferred to PM (CARES) Fund as per the CSR amendment notification dated 22.01.2021.

6. In case the Company has failed to spend two per cent of the average net profit of the last three financial years or any part thereof, the Company shall provide the reasons for not spending the amount in its Board report:

Please see notes above.

7. The CSR Committee of the Company hereby confirms that the implementation and monitoring of CSR Policy, is in compliance with CSR objectives and Policy of the Company.

The CSR Committee confirms that the implementation and monitoring of CSR Policy, is in compliance with CSR objectives and Policy of the Company.

Sd/-
Chairman – (CSR Committee)
DIN: 00010589

Sd/-
Managing Director
DIN: 09396222

FORM NO. MGT.9
EXTRACT OF ANNUAL RETURN

as on the financial year ended on 31st March, 2021

[Pursuant to section 92(3) of the Companies Act, 2013 and rule 12(1) of the Companies (Management and Administration) Rules, 2014]

I. REGISTRATION AND OTHER DETAILS:

- i) CIN: U40100GJ1990SGC013961
- ii) Registration Date: 28th June, 1990
- iii) Name of the Company: Gujarat Power Corporation Limited
- iv) Category / Sub-Category of the Company: Company having share capital / State Government Company.
- v) Address of the Registered office and contact details: Block Nos. 6 & 8, 6th Floor, Udhog Bhavan, Sector 11, Gandhinagar – 382010.
Phone No.: 079-2321255-60 Fax. 079-23221254
Email: cosecgpcl@yahoo.co.in
Website: www.gpcl.gujarat.gov.in
- vi) Whether listed company: ~~Yes~~/ No
- vii) Name, Address and Contact details of Registrar and Transfer Agent, if any- NA

II. PRINCIPAL BUSINESS ACTIVITIES OF THE COMPANY

All the business activities contributing 10 % or more of the total turnover of the Company shall be stated:

Sl. No.	Name and Description of main products/ services	NIC Code of the Product/ service	% to total turnover of the company
1.	Generation of solar energy	40106	More than 10%
	Generation of electricity from other non-conventional sources		
	Site preparation other than in connection with mining (Development of Solar Park)	40108 45102	

III. PARTICULARS OF HOLDING, SUBSIDIARY AND ASSOCIATE COMPANIES

S. No	Name and address of the Company	CIN/GLN	Holding/ subsidiary/ associate	% of shares held	Applicable Section
1	Baitarni West Coal Company Limited, 3rd Floor, Setu Bhavan, (Orissa Bridge & Construction Corporation Building), Plot No. 3 (D), Nayapally, BBSR -751012	U401020R2008SGC009955	Associate Company	33.33%	2(6)

IV. SHARE HOLDING PATTERN (Equity Share Capital Breakup as percentage of Total Equity)

i) Category-wise Share Holding

Category of Shareholders	No. of Shares held at the beginning of the year				No. of Shares held at the end of the year				% change during the year
	Demat	Physical	Total	% of Total Shares	Demat	Physical	Total	% of Total Shares	
A.Promoters									
(1.) Indian									
a.) Individual/ HUF	-	85.5	85.5	0.00	-	85.5	85.5	0.00	-
b.) Central Govt.	-	-	-	-	-	-	-	-	-
c.) State Govt. (s)	-	48572462	48572462	96.18	-	49392462	49392462	96.24	(+)0.06%
d.) Bodies Corporate		1930013	1930013	03.82		1930013	1930013	03.76	(-)0.06%
e.) Banks/ FI	-	-	-	-	-	-	-	-	-
f.) Any Other	-	-	-	-	-	-	-	-	-
Sub-Total(A)(1):		50502560.5	50502560.5	100		51322560.5	51322560.5	100	
(2) Foreign Sub-total (A) (2):-	-	-	-	-	-	-	-	-	-
Total shareholding of Promoter (A)= (A)(1)+(A)(2)	-	50502560.5	50502560.5	100		51322560.5	51322560.5	100	
B. Public Shareholding	-	-	-	-	-	-	-	-	-
Total Public Shareholding (B) = (B)(1) + (B)(2)	-	-	-	-	-	-	-	-	-
C. Shares held by Custodian for GDRs & ADRs	-	-	-	-	-	-	-	-	-
Grand Total (A+B+C)		50502560.5	50502560.5	100		51322560.5	51322560.5	100	

ii) Shareholding of Promoters

Sr.	Shareholder's Name	Shareholding at the beginning of the year			Share holding at the end of the year			% change in share holding during the year
		No. of Shares	% of total Shares of the company	% of Shares Pledged/ encumbered to total shares	No. of Shares	% of total Shares of the company	% of Shares Pledged/ encumbered to total shares	
1	Governor of Gujarat	48572462	96.18	-----	49392462	96.24	-----	(+)0.06
2	Gujarat Urja Vikas Nigam Ltd.	1930013	03.82	-----	1930013	03.76	-----	(-)0.04
3	*Other	85.5	0.00	-----	85.5	0.00	-----	--
	Total	50502560.5	100		51322560.5	100		

* Other includes Nominees of Government of Gujarat as well as Gujarat Urja Vikas Nigam Ltd.

(iii) Change in Promoters' Shareholding (please specify, if there is no change): **

	Shareholding at the beginning of the year		Cumulative Shareholding during the year	
	No. of shares	% of total shares of the company	No. of shares	% of total shares of the company
At the beginning of the year	48572462	96.18	48572462	96.18
Governor of Gujarat				
(a.) 333330 Equity Shares of Rs.100 each allotted to Governor of Gujarat on rights basis On 23.10.2020	333330		333330	
(b.) 486670 Equity Shares of Rs.100 each allotted to Governor of Gujarat on rights basis On 12.10.2020	486670		486670	
At the End of the year			49392462	96.24

** There is no Change in Gujarat Urja Vikas Nigam Ltd. and Others which fall in the category of Promoters.

(iv.) Shareholding Pattern of top ten Shareholders (other than Directors, Promoters and Holders of GDRs and ADRs):

Sl. No	For Each of the Top 10 Shareholders	Shareholding at the beginning of the year		Cumulative Shareholding during the year	
		No. of shares	% of total shares of the company	No. of shares	% of total shares of the company
	At the beginning of the year	NA	NA	NA	NA
	Dt. wise Increase/ Decrease in Share holding during year specifying the reasons for increase/ decrease (e.g. allotment/ transfer/ bonus/ sweat equity etc):	NA	NA	NA	NA
	At the End of the year (or on the date of separation, if separated during the year)	NA	NA	NA	NA
	TOTAL				

(v) Shareholding of Directors and Key Managerial Personnel:

Sl. No.	Name of Director/ Key Managerial Personnel	Shareholding at the beginning of the year		Cumulative Shareholding during the year	
		No. of shares	% of total shares	No. of shares	% of total shares
	At the beginning of the year	NA	NA	NA	NA
	Date wise Increase / Decrease in Share holding during the year	NA	NA	NA	NA
	At the End of the year	NA	NA	NA	NA

Note: None of the Directors/ KMP holds any shares in the Company.

V. INDEBTEDNESS

Indebtedness of the Company including interest outstanding/accrued but not due for payment

(Rs. In Lacs)

	Secured Loans Excluding deposits	Unsecured Loans	Deposits	Total Indebtedness
Indebtedness at the beginning of the FY year				
i) Principal Amount	Nil	Nil	Nil	Nil
ii) Interest due but not paid	Nil	6188.79	Nil	6188.79
iii) Interest accrued but not due (1st April)	Nil	Nil	Nil	Nil
Total (i+ii+iii)	Nil	6188.79	Nil	6188.79
Change in Indebtedness during the FY				
• Addition	Nil	Nil	Nil	Nil
• Reduction		6188.79		6188.79
Net Change	Nil	6188.79	Nil	6188.79
Indebtedness at the end of the financial year				
i) Principal Amount	Nil	Nil	Nil	Nil
ii) Interest due but not paid	Nil	Nil	Nil	Nil
iii) Interest accrued but not due (1st April)	Nil	Nil	Nil	Nil
Total (i+ii+iii)	Nil	Nil	Nil	Nil

VI. REMUNERATION OF DIRECTORS AND KEY MANAGERIAL PERSONNEL
A. REMUNERATION TO MANAGING DIRECTOR, WHOLE-TIME DIRECTORS AND/OR MANAGER:

Sl. no.	Particulars of Remuneration	Name of MD	Total Amount
		Shri S. B. Khyalia	
1.	Gross salary	38,36,266/-	38,36,266/-
	(a) Salary as per provisions contained in section 17(1) of the Income-tax Act, 1961	3,80,466/-	3,80,466/-
	(b) Value of perquisites u/s 17(2) Income-tax Act, 1961	----	----
	(c) Profits in lieu of salary under section 17(3) Income- tax Act, 1961	----	----
2.	Stock Option	----	----
3.	Sweat Equity	----	----
	Commission		
	- as % of profit	----	----
4.	- others, specify.		
5.	Others, please specify*	9,000/-	9,000/-
	Total	42,25,732	42,25,732
	Ceiling as per the Act		Not Applicable

B. REMUNERATION TO OTHER DIRECTORS.

Category	Particulars of remuneration			Total
	Sitting fees for Board & Committee meetings	Comm-ission	Other (Incidental Charges for attending Board/ Committee Meetings)	
Chairman - Smt. Sunaina Tomar	***	---	4000	4000
Independent Directors				
Shri P. K. Taneja, IAS (Retd.)	5400	---	2000	7400
Total A	5400	---	6000	11400
Other Non- Executive Directors				
Smt. Anju Sharma, IAS ***	---	---	4000	4000
Shri P. H. Rana	24300	---	9000	33300
Ms. Dipal Hadiyal	---	---	1000	1000
Shri R. G. Desai			1000	1000
Total B	24300		15000	39300
Total Managerial Remuneration (A+B)	29700	---	21000	50700
Overall Ceiling as per the Act	-----	-----	-----	

***Sitting fee @ Rs.3000/- per meeting in respect of serving IAS Officers or GoG Nominees has been directly deposited in government treasury while incidental expense @Rs.1000/- (10% TDS) per meeting was directly paid to the concerned director/s.

C. REMUNERATION TO KEY MANAGERIAL PERSONNEL OTHER THAN MD/ MANAGER/ WTD:

Sr.	Particulars of Remuneration	Key Managerial Personnel		
		CEO	CS	CFO
	Gross salary			
	(a) Salary as per provisions contained in section 17(1) of the Income-tax Act, 1961			
	(b) Value of perquisites u/s 17(2) Income-tax Act, 1961	-----	9,26,360/-	18,10,932/-
	(c) Profits in lieu of salary under section 17(3) Income-tax Act, 1956			
1.				
2.	Stock Option	-----	-----	-----
3.	Sweat Equity	-----	-----	-----
	Commission			
	- as % of profit	-----	-----	-----
4.	- others, specify			
5.	Others, please specify	-----	-----	-----
	Total	-----	Rs. 9.26 Lacs	Rs. 18.10 Lacs

VII. PENALTIES/PUNISHMENT/COMPOUNDING OF OFFENCES:

Type	Brief Description	Details of			Authority [RD/ NCLT/ COURT]	Appeal made, if any (give Details)
		Penalty	Punishment	Compounding fee imposed		
A. COMPANY			NA.		NA.	NA.
B. DIRECTORS			NA		NA	NA
C. OTHER OFFICERS IN DEFAULT			NA		NA	NA

For & on behalf of the Board of Directors

Date: 29.12.2021

Place: Gandhinagar

Sd/-
Chairperson
DIN: 01854315

Sd/-
Managing Director
DIN: 09396222

SECRETARIAL AUDIT REPORT

FOR THE FINANCIAL YEAR ENDED ON 31st March, 2021

[Pursuant to section 204(1) of the Companies Act, 2013 and rule No.9 of the Companies (Appointment and Remuneration Personnel) Rules, 2014]

To,
The Members,
Gujarat Power Corporation Limited
6th Floor, Block No. 6&8
UdyogBhavan Sector 11, Gandhinagar-382011

We have conducted the secretarial audit of the compliance of applicable statutory provisions and the adherence to good corporate practices by Gujarat Power Corporation Limited. The secretarial audit was conducted in a manner that provided us a reasonable basis for evaluating the corporate conducts/statutory compliances and expressing my opinion thereon. Based on our verification of the Company's books, papers, minute books, forms and returns filed and other records maintained by the Company and also the information provided by the Company, its officers, agents and authorized representatives during the conduct of secretarial audit, we hereby report that in our opinion, the Company has, during the audit period covering the financial year ended on 31st March, 2021 complied with the statutory provisions listed hereunder and also that the Company has proper Board-processes and compliance-mechanism in place to the extent, in the manner and subject to the reporting made hereinafter:

We have examined the books, papers, minute books, forms and returns filed and other records maintained by the Company for the financial year ended on 31st March, 2021 according to the provisions of:

- (i) The Companies Act, 2013 (the Act) and the rules made there-under;
- (ii) The Securities Contracts (Regulation) Act, 1956 ('SCRA') and the rules made there-under to the extent applicable;
- (iii) The Depositories Act, 1996 and the Regulations and Bye-laws framed there-under are not applicable to the Company as the government companies are exempted from the compulsory dematerialization of shares vide MCA Notification No. 43(E) dated 22nd January, 2019.
- (iv) Foreign Exchange Management Act, 1999 and the rules and regulations made thereunder to the extent of Foreign Direct Investment, Overseas Direct Investment and External Commercial Borrowings are not applicable to the Company during the period under review.
- (v) The following Regulations and Guidelines prescribed under the Securities and Exchange Board of India Act, 1992 ('SEBI Act') are not applicable to the Company as the Company is an unlisted Company during the period under review.
 - (a) The Securities and Exchange Board of India (Substantial Acquisition of Shares and Takeovers) Regulations, 2011;
 - (b) The Securities and Exchange Board of India (Prohibition of Insider Trading) Regulations, 1992;
 - (c) The Securities and Exchange Board of India (Issue of Capital and Disclosure Requirements) Regulations, 2009;
 - (d) The Securities and Exchange Board of India (Employee Stock Option Scheme and Employee Stock Purchase Scheme) Guidelines, 1999;
 - (e) The Securities and Exchange Board of India (Issue and Listing of Debt Securities) Regulations, 2008;
 - (f) The Securities and Exchange Board of India (Registrars to an Issue and Share Transfer Agents) Regulations, 1993 regarding the Companies Act and dealing with client;
 - (g) The Securities and Exchange Board of India (Delisting of Equity Shares) Regulations, 2009; and
 - (h) The Securities and Exchange Board of India (Buyback of Securities) Regulations, 1998;

I further report that, having regard to the compliance system prevailing in the Company and on examination of the relevant documents and records in pursuance thereof, on test-check basis, the Company has complied with the following laws applicable specifically to the Company:

- (i) The Electricity Act, 2003
- (ii) Mines Act, 1952
- (iii) The Environment (Protection) Act, 1986.

I have also examined compliance with the applicable clauses of the following:

- (i) Secretarial Standards issued by The Institute of Company Secretaries of India.
- (ii) The Company being unlisted is not required to comply with the Listing Agreements of Stock Exchange(s).

During the period under review, the Company has generally complied with the provisions of the Act, Rules, Regulations, Guidelines, Standards, etc. mentioned above subject to our following observations:

1. Due to expiration of term of appointment of two Independent Directors i.e. Shri Prakash Shah, IAS (Retd.) and Shri Bharatkumar Modi as on 31.03.2020, the Company filled the position of one Independent Director on 26.11.2020 and the appointment of one more Independent Director is yet to be made and accordingly constitution of committees are to be made as per the requirement under Companies Act, 2013.
2. The Annual General Meeting of the Company was held on 28.12.2020. However, the AGM was adjourned and the Audited Accounts are adopted at the adjourned Annual General Meeting (AGM) of the Company held on 24th February, 2021 i.e. after the due date for convening the AGM (including the extended time of AGM granted upto 31.12.2020).

We further report that

The Board of Directors of the Company is duly constituted with proper balance of Executive Directors and Non-Executive Directors as on 31.03.2020 subject to our above observation at point no. 1 above. The changes in the composition of the Board of Directors that took place during the period under review were carried out in compliance with the provisions of the Act.

Adequate notice is given to all directors to schedule the Board Meetings, agenda and detailed notes on agenda were sent at least seven days in advance & in case of shorter notice required compliance as per Companies Act, 2013 has been ensured and a system exists for seeking and obtaining further information and clarifications on the agenda items before the meeting and for meaningful participation at the meeting.

Generally, all decisions at the Board and Committee meetings are carried out unanimously as recorded in the minutes of the meeting of the Board of Directors and Committee of the Board as the case may be.

We further report that

There are adequate systems and processes in the company commensurate with the size and operations of the company to monitor and ensure compliance with applicable laws, rules, regulations and guidelines.

We further report that

1. During the audit period the Company has allotted:-
 - (i) 3,33,330 Equity Shares of Rs.100 each on 23.10.2020 aggregating to Rs.3,33,33,000/- on right basis to the Governor of Gujarat.
 - (ii) 4,86,670 Equity Shares of Rs.100 each on 09.11.2020 aggregating to Rs. 4,86,67,000/- on right basis to the Governor of Gujarat

For, CS Dhara Patel

Sd/-

Proprietor

(CS Dhara Patel)

ACS No. 28198, CP No. 10979

UDIN: U40100GJ1990SGC013961

Date: 29.12.2021

Place: Gandhinagar

(This report is to be read with our letter of even date which is annexed as **Annexure A** and forms an integral part of this report.)

'Annexure A'

To,

The Members,

Gujarat Power Corporation Limited

6th Floor, Block No. 6&8

Udyog Bhavan, Sector 11, Gandhinagar- 382011

Our report of even date is to be read along with this letter.

1. Maintenance of secretarial record is the responsibility of the management of the Company. Our responsibility is to express an opinion on these secretarial records based on our audit.
2. We have followed the audit practices and processes as were appropriate to obtain reasonable assurance about the correctness of the contents of the Secretarial records. The verification was done on test basis to ensure that correct facts are reflected in secretarial records. We believe that the processes and practices, we followed provide a reasonable basis for our opinion.
3. We have not verified the correctness and appropriateness of financial Statements of the company.
4. The compliance of the provisions of Corporate and other applicable laws, rules, regulations, standards is the responsibility of management. Our examination was limited to the verification of procedures on test basis.
5. The Secretarial Audit report is not an assurance as to the future viability of the Company.
6. Due to Covid-19, the secretarial audit is carried out with limited review as physical verification of records was not possible.

For, CS Dhara Patel

Sd/-

Proprietor

(CS Dhara Patel)

ACS No. 28198, CP No. 10979

Date: 29.12.2021

Place: Gandhinagar

COMMENTS OF THE COMPTROLLER AND AUDITOR GENERAL OF INDIA UNDER SECTION 143(6)(b) OF THE COMPANIES ACT, 2013 ON THE FINANCIAL STATEMENTS OF GUJARAT POWER CORPORATION LIMITED FOR THE YEAR ENDED 31 MARCH 2021.

The preparation of financial statements of Gujarat Power Corporation Limited for the year ended 31 March 2021 in accordance with the financial reporting framework prescribed under the Companies Act, 2013 (Act) is the responsibility of the Management of the Company. The Statutory Auditors appointed by the Comptroller and Auditor General of India under Section 139(5) of the Act are responsible for expressing opinion on the financial statements under Section 143 of the Act based on independent audit in accordance with the Standards on Auditing prescribed under Section 143 (10) of the Act. This is stated to have been done by them vide their Audit Report dated 29 December 2021.

I, on behalf of the Comptroller and Auditor General of India, have conducted a supplementary audit of the financial statements of Gujarat Power Corporation Limited for the year ended 31 March 2021 under Section 143(6) (a) of the Act. This supplementary audit has been carried out independently without access to the working papers of the Statutory Auditors and is limited primarily to inquiries of the Statutory Auditors and Company personnel and a selective examination of some of the accounting records.

On the basis of my supplementary audit nothing significant has come to my knowledge which would give rise to any comment upon or supplement to Statutory Auditors' Report under Section 143(6)(b) of the Act.

For and on behalf of the

Comptroller and Auditor General of India

Sd/-

(H.K. Dharmadarshi)

Principal Accountant General (Audit - II), Gujarat

Place: Ahmedabad

Date: 23/2/22

INDEPENDENT AUDITOR'S REPORT

To the Members of Gujarat Power Corporation Ltd.

Report on the Ind AS Financial Statements

Opinion

We have audited the accompanying Ind AS financial statements of Gujarat Power Corporation Ltd. ("the Company"), which comprises the Balance Sheet as at March 31, 2021, the Statement of Profit and Loss (including other Comprehensive income), the statement of Cash Flow and the statement of changes in equity for the year then ended, and a summary of significant accounting policies and other explanatory information. (herewith after referred to as "Ind AS financial statements")

In our opinion and to the best of our information and according to the explanations given to us, the aforesaid financial statements give the information required by the Companies Act, 2013 ("the Act") in the manner so required and give a true and fair view in conformity with the Indian Accounting Standards prescribed under section 133 of the Act read with the Companies (Indian Accounting Standards) Rules, 2015, as amended, ("Ind AS") and other accounting principles generally accepted in India, of the state of affairs of the Company as at March 31, 2021, the profit and total comprehensive income, changes in equity and its cash flows for the year ended on that date.

Basis for Opinion

We conducted our audit of the financial statements in accordance with the Standards on Auditing specified under section 143(10) of the Act (SAs). Our responsibilities under those Standards are further described in the Auditor's Responsibilities for the Audit of the Financial Statements section of our report. We are independent of the Company in accordance with the Code of Ethics issued by the Institute of Chartered Accountants of India (ICAI) together with the independence requirements that are relevant to our audit of the financial statements under the provisions of the Act and the Rules made thereunder, and we have fulfilled our other ethical responsibilities in accordance with these requirements and the ICAI's Code of Ethics. We believe that the audit evidence we have obtained is sufficient and appropriate to provide a basis for our audit opinion on the financial statements.

Emphasis of Matters

We draw attention to Note 17 to the financial statements, regarding Fuel Supply Agreement (FSA) between the Company and Gujarat State Electricity Corporation Limited (GSECL) is under process. Pending execution of FSA, the company has accounted revenue from Lignite Project of Rs. 226,80,65,092/- based on interim arrangement with GSECL.

Our opinion on the financial statements and our report on Other Legal and Regulatory Requirements below is not modified in respect of this matter.

Information Other than the Financial Statements and Auditor's Report Thereon

The Company's Board of Directors is responsible for the other information. The other information comprises the Directors' Report including Annexures to the Directors' Report but does not include the financial statements and our auditor's report thereon. The other information is expected to be made available to us after the date of this auditor's report.

Our opinion on the financial statements does not cover the other information and we will not express any form of assurance conclusion thereon.

In connection with our audit of the financial statements, our responsibility is to read the other information identified above when it becomes available and, in doing so, consider whether the other information is materially inconsistent with the financial statements or our knowledge obtained during the course of our audit or otherwise appears to be materially misstated.

When we read the other Information, if we conclude that there is a material misstatement therein, we are required to communicate the matter to those charged with governance as required under SA 720 'The Auditor's responsibilities Relating to Other Information'.

Management's Responsibility for the Ind AS Financial Statements

The Company's Board of Directors is responsible for the matters stated in section 134(5) of the Act with respect to the preparation of these financial statements that give a true and fair view of the financial position, financial performance, total comprehensive income, changes in equity and cash flows of the Company in accordance with the Ind AS and other accounting principles generally accepted in India. This responsibility also includes maintenance of adequate accounting records in accordance with the provisions of the Act for safeguarding the assets of the Company and for preventing and detecting frauds and other irregularities; selection and application of appropriate accounting policies; making judgments and estimates that are reasonable and prudent; and design, implementation and maintenance of adequate internal financial controls, that were operating effectively for ensuring the accuracy and completeness of the accounting records, relevant to the preparation and presentation of the financial statements that give a true and fair view and are free from material misstatement, whether due to fraud or error.

In preparing the financial statements, management is responsible for assessing the Company's ability to continue as a going concern, disclosing, as applicable, matters related to going concern and using the going concern basis of accounting unless management either intends to liquidate the Company or to cease operations, or has no realistic alternative but to do so.

The Board of Directors are also responsible for overseeing the Company's financial reporting process.

Auditor's Responsibilities for the Audit of the Financial Statements

Our objectives are to obtain reasonable assurance about whether the financial statements as a whole are free from material misstatement, whether due to fraud or error, and to issue an auditor's report that includes our opinion. Reasonable assurance is a high level of assurance, but is not a guarantee that an audit conducted in accordance with SAs will always detect a material misstatement when it exists. Misstatements can arise from fraud or error and are considered material if, individually or in the aggregate, they could reasonably be expected to influence the economic decisions of users taken on the basis of these financial statements.

As part of an audit in accordance with SAs, we exercise professional judgment and maintain professional skepticism throughout the audit. We also:

- Identify and assess the risks of material misstatement of the financial statements, whether due to fraud or error, design and perform audit procedures responsive to those risks, and obtain audit evidence that is sufficient and appropriate to provide a basis for our opinion. The risk of not detecting a material misstatement resulting from fraud is higher than for one resulting from error, as fraud may involve collusion, forgery, intentional omissions, misrepresentations, or the override of internal control.
- Obtain an understanding of internal financial controls relevant to the audit in order to design audit procedures that are appropriate in the circumstances. Under section 143(3)(i) of the Act, we are also responsible for expressing our opinion on whether the Company has adequate internal financial controls system in place and the operating effectiveness of such controls.
- Evaluate the appropriateness of accounting policies used and the reasonableness of accounting estimates and related disclosures made by management.
- Conclude on the appropriateness of management's use of the going concern basis of accounting and, based on the audit evidence obtained, whether a material uncertainty exists related to events or conditions that may cast significant doubt on the Company's ability to continue as a going concern. If we conclude that a material uncertainty exists, we are required to draw attention in our auditor's report to the related disclosures in the financial statements or, if such disclosures are inadequate, to modify our opinion. Our conclusions are based on the audit evidence obtained up to the date of our auditor's report. However, future events or conditions may cause the Company to cease to continue as a going concern.

- Evaluate the overall presentation, structure and content of the financial statements, including the disclosures, and whether the financial statements represent the underlying transactions and events in a manner that achieves fair presentation.

We communicate with those charged with governance regarding, among other matters, the planned scope and timing of the audit and significant audit findings, including any significant deficiencies in internal control that we identify during our audit.

We also provide those charged with governance with a statement that we have complied with relevant ethical requirements regarding independence, and to communicate with them all relationships and other matters that may reasonably be thought to bear on our independence, and where applicable, related safeguards.

From the matters communicated with those charged with governance, we determine those matters that were of most significance in the audit of the financial statements of the current period and are therefore the key audit matters. We describe these matters in our auditor's report unless law or regulation precludes public disclosure about the matter or when, in extremely rare circumstances, we determine that a matter should not be communicated in our report because the adverse consequences of doing so would reasonably be expected to outweigh the public interest benefits of such communication.

Report on Other Legal and Regulatory Requirements

1. As required by the Companies (Auditor's Report) Order, 2016 ("the Order") issued by the Central Government of India in terms of sub-section (11) of section 143 of the Act, we give in the "Annexure-I" a statement on the matters specified in the paragraph 3 and 4 of the Order, to the extent applicable.
2. We are enclosing our report in terms of Section 143 (5) of the Act, on the basis of such checks of the books and records of the Company as we considered appropriate and according to the information and explanations given to us, in the "Annexure II" on the directions and sub-directions issued by Comptroller and Auditor General of India.
3. As required by section 143(3) of the act we report that:
 - a. We have sought and obtained all the information and explanations which to the best of our knowledge and belief necessary for the purpose of our audit.
 - b. In our opinion proper books of account as required by law have been kept by the company so far as it appears from our examination of those books.
 - c. The Balance Sheet, Statement of Profit and Loss, the statement of Cash Flow and the statement of changes in equity dealt with by this Report are in agreement with the books of account.
 - d. In our opinion, the aforesaid Ind AS financial statements comply with the Indian Accounting Standards specified under Section 133 of the Act, read with the Companies (Indian Accounting Standards) Rules, 2015;
 - e. On the basis of the written representations received from the directors as on 31 March, 2021 taken on record by the Board of Directors, none of the directors is disqualified as on 31 March, 2021 from being appointed as a director in terms of Section 164 (2) of the Act; and
 - f. With respect to the adequacy of the internal financial controls over financial reporting of the Company and the operating effectiveness of such controls, refer to our separate Report in "Annexure III". Our report expresses an unmodified opinion on the adequacy and operating effectiveness of the Company's internal financial controls over financial reporting.
 - g. With respect to the other matters to be included in the Auditor's Report in accordance with the requirements of section 197(16) of the Act, as amended:

In our opinion and to the best of our information and according to the explanations given to us, the Managerial remuneration has been paid or provided in accordance with the provisions of section 197 of the Companies Act, 2013.

- h. with respect to the other matters to be included in the Auditor's Report in accordance with Rule 11 of the Companies (Audit and Auditors) Rules, 2014, in our opinion and to the best of our information and according to the explanations given to us:
 - i. The Company has disclosed the impact of pending litigations on its financial position in its financial statements (Refer Note No.: 31(Q)).
 - ii. The Company did not have any long-term contracts including derivative contracts as at March 31,2021 for which there were any material foreseeable losses and
 - iii. There were no amounts which were required to be transferred to the Investors Education and Protection fund by the company.

For, Anil N. Shah & Co.
Chartered Accountants
FRN. 114131W
Sd/-
Jigna H. Shah
Partner
Membership No. 141825

Place: Ahmedabad

Date: 29/12/2021

UDIN: 22141825AAAAAD1089

**“ANNEXURE I” TO INDEPENDENT AUDITOR’S REPORT
(Referred to in paragraph 1 under ‘Report on Other Legal and Regulatory Requirements’ section of our report of even date)**

The “Annexure-I” referred to in our Independent Auditor’s Report to the members of the Company on the Ind AS financial statements for the year ended 31 March 2021, we report that:

- 1) In respect of Fixed Assets
 - a) The company has maintained proper records showing full particulars including quantitative details and situation of fixed assets.
 - b) The fixed assets (Property, Plant & Equipment) of the Company are physically verified by the management according to a phased programme, which in our opinion, is reasonable having regard to the size of the Company and the nature of its assets. Pursuant to the programme, a portion of the fixed assets (Property, Plant & Equipment) has been physically verified by the management during the year and no material discrepancies have been noticed on such verification.
 - c) As per the information and explanations given to us, during the course of audit, the company has all title deeds of immovable properties on its name as at balance sheet date. In respect of immovable properties of Land and building that have been taken on lease and disclosed as fixed assets in the financial statements, the lease agreements are in the name of company.
- 2) In our opinion, the inventories have been physically verified by the management at reasonable interval during the year. In our opinion and according to the information and explanations given to us, discrepancies noticed on physical verification of inventories were not material and have been properly dealt with in the books of accounts.
- 3) According to the information and explanations given to us, the Company has not granted any loans, secured or unsecured, to Companies, Firms, Limited Liability Partnerships or other parties covered in the register maintained under Section 189 of the Companies Act, 2013. Consequently, reporting requirements under clause 3 (iii) (a), (b) & (c) of CARO are not applicable to the Company.
- 4) The Company has not given any loan or guarantee or security under section 185 of the Act. In our opinion and according to the information and explanation given to us, the Company has complied with the provisions of section 186 of the Act in respect of the Investments made.
- 5) According to the information and explanations given to us, the Company has not accepted any deposits during the year from the public within the meaning of provisions of section 73 to 76 of the Act and the rules framed thereunder or under the directives issued by the Reserve Bank of India and therefore, reporting under clause 3(v) of the Order is not applicable to the Company.
- 6) We have broadly reviewed the books of accounts and records maintained by the Company as prescribed by the Central Government under sub-section (1) of section 148 of the Companies Act, 2013 and are of the opinion that prima-facie, the prescribed accounts and cost records have been maintained. We have however, not made a detailed examination of the cost records with a view to determine whether they are accurate or complete.
- 7) (a) According to the information and explanations given to us and on the basis of our examination of the records of the Company, in our opinion, the Company is generally regular in depositing the undisputed statutory dues including Provident Fund, Employees’ State Insurance, Income Tax, Goods and Service Tax, Custom Duty, Value Added Tax, Cess and other material statutory dues as applicable with the appropriate authorities. According to the information and explanations given to us there were no undisputed amounts payable in respect of same were in arrears as at March 31, 2021 for a period of more than six months from the date they became payable.
(b) According to the information and explanations given to us and on the basis of our examination of the records of the Company, there are no disputed dues in respect of value added tax, goods and service tax, excise duty and duty of customs which have not been deposited. The following are the particulars of income tax and service tax as at March 31, 2021 which have not been deposited on account of dispute:

Name of statute	Nature of Dues	Outstanding Disputed (Rs. In lacs)	Financial year to which the amount relates	Forums where the dispute is pending
Income Tax Act, 1961	Income Tax	15.06	1991-92	High court has passed order on 26-06-12
Income Tax Act, 1961	Income Tax	51.9	1992-93	High court has passed order on 17-10-14
Income Tax Act, 1961	Income Tax	9577.03	2001-02	High court has passed order on 30-07-12 in favour of GPCL. Appeal before Supreme court is pending.
Income Tax Act, 1961	Income Tax	410.65	2002-03	ITAT has passed order dated 31-07-2019. Appeal is filed before High Court & hearing is pending.
Income Tax Act, 1961	Income Tax	8.05	2003-04	ITAT has passed order dated 31-07-2019. Appeal is filed before High Court & hearing is pending.
Income Tax Act, 1961	Income Tax	460.79	2004-05	ITAT has passed order dated 31-07-2019. Appeal is filed before High Court & hearing is pending.
Income Tax Act, 1961	Income Tax	30.72	2006-07	ITAT has passed order dated 31-07-2019. Appeal is filed before High Court & hearing is pending.
Income Tax Act, 1961	Income Tax	55.16	2007-08	ITAT has passed order dated 31-07-2019. Appeal is filed before High Court & hearing is pending.
Income Tax Act, 1961	Income Tax	55.81	2008-09	ITAT has passed order dated 31-07-2019. Appeal is filed before High Court & hearing is pending.
Income Tax Act, 1961	Income Tax	59.6	2002-03	Matter is pending with ITAT
Income Tax Act, 1961	Income Tax	81.13	2003-04	Matter is pending with ITAT
Income Tax Act, 1961	Income Tax	137.52	2004-05	Matter is pending with ITAT
Income Tax Act, 1961	Income Tax	109.79	2005-06	Matter is pending with ITAT
Income Tax Act, 1961	Income Tax	23.05	2009-10	CIT(A) has passed order on 22-08-13
Income Tax Act, 1961	Income Tax	436.46	2010-11	ITAT has passed order dated 10-07-2019. Caveat is filed before High Court
Income Tax Act, 1961	Income Tax	28.53	2011-12	ITAT has passed order dated 10-07-2019. Caveat is filed before High Court
Income Tax Act, 1961	Income Tax	11.28	2012-13	ITAT has passed order dated 19-09-2019. Caveat is filed before High Court
Income Tax Act, 1961	Income Tax	48.63	2013-14	ITAT has passed order dated 20-09-2019. Caveat is filed before High Court
Service Tax Act	Service Tax	2945	April 2009 to December 2012	Matter is pending with CESTAT.
Service Tax Act	Service Tax	8.66	April 2016 to June 2017	Matter is pending with Commissioners (Appeals) of GST.

- 8) In our opinion and according to the information given to us, the Company has not taken loans during the year.
- 9) In our opinion and according to the information and explanations given to us, the company. has not raised any money by way of initial public offer or further public offer (including debt instruments) during the year. Accordingly, paragraph 3(ix) of the order is not applicable.
- 10) To the best of our knowledge and according to information and explanations given to us, no fraud by the Company or on the Company by its officers or employees has been noticed or reported during the year.
- 11) As per notification No. GSR 463(E) dtd. 05/06/2015 issued by the Ministry of Corporate affairs, Government of India, Section 197 of the companies Act, 2013 is not applicable to the Government companies. Accordingly, paragraph 3(xi) of the order is not applicable.
- 12) The Company is not a Nidhi Company. Hence, reporting requirements as mentioned under clause 3(xii) are not applicable to the Company.
- 13) In our opinion and according to the information and explanations given to us by the management; all transactions with the related parties are in compliance with sections 177 and 188 of Companies Act, 2013 where applicable and the details have been disclosed in the Ind AS Financial Statements, as required by the Indian accounting standards 24 "Related Party Disclosures".
- 14) As per the information and explanations given to us and on examination of the records, the Company has not made any preferential allotment or private placement of shares or fully or partly convertible debentures during the year under review. Hence, the reporting requirements of clause 3(xiv) are not applicable to the Company.
- 15) In our examination of records and books and as per the information and explanation provided to us, the Company has not entered into any non-cash transactions with directors or persons connected with them. Hence, the clause 3(xv) is not applicable to the company.
- 16) According to the information and explanations given to us, the Company is not required to be registered under section 45-IA of the Reserve bank of India Act, 1934.

For, Anil N. Shah & Co.
Chartered Accountants
FRN. 114131W
Sd/-
Jigna H. Shah
Partner
Membership No. 141825

Place: Ahmedabad

Date: 29/12/2021

UDIN: 22141825AAAAAD1089

**“ANNEXURE II” TO INDEPENDENT AUDITOR’S REPORT
(Referred to in paragraph 2 under ‘Report on Other Legal and Regulatory Requirements’ section of our report of even date)**

Gujarat Power Corporation Ltd.

Report under Section 143 (5) of the Companies Act, 2013

For The Financial Year 2020-21

1. Main Direction

Sr. No.	Questionnaires	Response / Remedial Measure
1	Whether the Company has system in place to process all the accounting transactions through IT System ?If yes, the implications of processing of accounting transactions outside IT system on the integrity of the accounts along with the financial implications, if any, may be stated.	Yes, the Company has system in place to process all the accounting transactions through IT System only. Since , no transaction is processed outside the IT system, there will be no implication of the same on the integrity of the accounts and there will be no financial implication of the same.
2	Whether there is any restructuring of an existing loan or cases of waiver/write off of debts/loans/internet etc. made by a lender to the Company due to the Company's inability to repay the loan ? If yes, the financial impact may be stated.	Not Applicable
3	Whether funds received / receivable for specific schemes from central/state agencies were properly accounted for /utilized as per its terms and conditions ? List the cases of deviation.	Not Applicable

2 Sub-Directions under section 143(5) of the companies Act, 2013 applicable for the year 2020-21 (Infrastructure Sector)

Sr.No.	Particulars	Remark
1.	Whether the Company has taken adequate measures to prevent encroachment of idle land owned by it. Whether any land of the Company is encroached under litigation, not put to use or declared surplus? Details may be provided	Yes No
2	Whether the system in vogue for identification of projects to be taken up under Public Private Partnership is in line with the guidelines/policies of the Government? Comment on deviation if any.	Not Applicable
3	Whether system for monitoring the execution of works vis-a-vis the milestones stipulated in the agreement is in existence and the impact of cost escalation, if any, revenue/losses from contracts, etc. have been properly accounted for in the books.	Yes
4	Whether funds received/receivable for specific schemes from central/state agencies were properly accounted for/utilized? List the cases of deviations.	Yes
5	Whether bank guarantees have been revalidated in time?	Yes

6	Comment on the confirmation of balances of a) trade receivables, trade payables, b) term deposits, bank accounts & cash obtained.	No Yes
7	The cost incurred on abandoned projects may be Quantified and the amount actually written-off shall be mentioned.	Not Applicable

3 Power Sector

Sr. No	Particulars	Remarks
1.	Adequacy of steps to prevent encroachment of idle land owned by Company may be examined In case of the Company is encroached , under litigation, not put to use or declared surplus, details may be provided.	Yes Not Applicable
2	Where land acquisition is involved in setting up new projects, report whether settlement of due done expeditiously and in a transparent manner in all cases. The case of deviation may please be detailed.	Yes
3	Whether the Company has an effective system of recovery of revenue as per contractual terms and the revenue is properly accounted for in the books of accounts in compliance with the applicable Accounting Standards.	Yes
4	How much cost has been incurred on abandoned projects and out of this how much cost has been written off?	Not Applicable

4 Generation

Sr. No	Particulars	Remarks
1.	In case of Thermal Power Projects, compliance of the various Pollution Control Acts and the impact thereof including utilisation and disposal of ash and the policy of the company in this regard, may be checked and commented upon.	Not Applicable
2	Has the company entered into revenue sharing agreements with private parties for extraction of coal at pitheads and adequately protects the financial interest of the company?	Not Applicable
3	Does the company have a proper system for reconciliation of quality/quantity of coal ordered and received and whether grade of coal moisture and demurrage etc are properly recorded in the books of accounts?	Not Applicable
4	How much share of free power was due to the State Government and whether the same was calculated as per the agreed terms and depicted in the accounts as per accepted accounting norms?	Not Applicable
5	In the case of Hydroelectric Projects the water discharge is as per policy/ guidelines issued by the State Government to maintain biodiversity. For not maintaining it penalty paid/payable may be reported.	Not Applicable

For, Anil N. Shah & Co.

Chartered Accountants

FRN. 114131W

Sd/-

Jigna H. Shah

Partner

Membership No. 141825

Place: Ahmedabad

Date: 29/12/2021

UDIN: 22141825AAAAAD1089

ANNEXURE III” TO INDEPENDENT AUDITOR’S REPORT

(Referred to in clause (f) paragraph 3 under ‘Report on Other Legal and Regulatory Requirements’ section of our report of even date)

Report on the Internal Financial Controls Over Financial Reporting under Clause (i) of Sub-section 3 of Section 143 of the Companies Act, 2013 (“the Act”)

The “Annexure III” referred to in our Independent Auditor’s Report to the members of the Company on the Ind AS financial statements for the year ended 31 March 2021, we report that we have audited the internal financial controls over financial reporting of Gujarat Power Corporation Ltd. (“the Company”) as of March 31, 2021 in conjunction with our audit of the financial statements of the Company for the year ended on that date.

Management’s Responsibility for Internal Financial Controls

The Company’s management is responsible for establishing and maintaining internal financial controls based on the internal control over financial reporting criteria established by the Company considering the essential components of internal control stated in the Guidance Note on Audit of Internal Financial Controls Over Financial Reporting issued by the Institute of Chartered Accountants of India. These responsibilities include the design, implementation and maintenance of adequate internal financial controls that were operating effectively for ensuring the orderly and efficient conduct of its business, including adherence to company’s policies, the safeguarding of its assets, the prevention and detection of frauds and errors, the accuracy and completeness of the accounting records, and the timely preparation of reliable financial information, as required under the Companies Act, 2013.

Auditors’ Responsibility

Our responsibility is to express an opinion on the Company’s internal financial controls over financial reporting based on our audit. We conducted our audit in accordance with the Guidance Note on Audit of Internal Financial Controls Over Financial Reporting (the “Guidance Note”) and the Standards on Auditing, issued by ICAI and deemed to be prescribed under section 143(10) of the Companies Act, 2013, to the extent applicable to an audit of internal financial controls, both applicable to an audit of Internal Financial Controls and, both issued by the Institute of Chartered Accountants of India. Those Standards and the Guidance Note require that we comply with ethical requirements and plan and perform the audit to obtain reasonable assurance about whether adequate internal financial controls over financial reporting was established and maintained and if such controls operated effectively in all material respects.

Our audit involves performing procedures to obtain audit evidence about the adequacy of the internal financial controls system over financial reporting and their operating effectiveness. Our audit of internal financial controls over financial reporting included obtaining an understanding of internal financial controls over financial reporting, assessing the risk that a material weakness exists, and testing and evaluating the design and operating effectiveness of internal control based on the assessed risk. The procedures selected depend on the auditor’s judgement, including the assessment of the risks of material misstatement of the Ind AS financial statements, whether due to fraud or error.

We believe that the audit evidence we have obtained is sufficient and appropriate to provide a basis for our audit opinion on the Company’s internal financial controls system over financial reporting.

Meaning of Internal Financial Controls Over Financial Reporting

A company’s internal financial control over financial reporting is a process designed to provide reasonable assurance regarding the reliability of financial reporting and the preparation of the Ind AS financial statements for external purposes in accordance with generally accepted accounting principles. A company’s internal financial control over financial reporting includes those policies and procedures that

- (1) pertains to the maintenance of records that, in reasonable detail, accurately and fairly reflect the transactions and dispositions of the assets of the company;
- (2) provides reasonable assurance that transactions are recorded as necessary to permit preparation of the Ind AS financial statements in accordance with generally accepted accounting principles, and that receipts and expenditures of the company are being made only in accordance with authorisations of management and directors of the company; and

(3) provides reasonable assurance regarding prevention or timely detection of unauthorised acquisition, use, or disposition of the company's assets that could have a material effect on the Ind AS financial statements.

Inherent Limitations of Internal Financial Controls Over Financial Reporting

Because of the inherent limitations of internal financial controls over financial reporting, including the possibility of collusion or improper management override of controls, material misstatements due to error or fraud may occur and not be detected. Also, projections of any evaluation of the internal financial controls over financial reporting to future periods are subject to the risk that the internal financial control over financial reporting may become inadequate because of changes in conditions, or that the degree of compliance with the policies or procedures may deteriorate.

Opinion

In our opinion, the Company has maintained, in all material respects, an adequate internal financial controls over financial reporting and such internal financial controls over financial reporting were operating effectively as at March 31, 2021, based on the internal control over financial reporting criteria established by the Company considering the essential components of internal control stated in the Guidance Note on Audit of Internal Financial Controls Over Financial Reporting issued by the Institute of Chartered Accountants of India.

For, Anil N. Shah & Co.

Chartered Accountants

FRN. 114131W

Sd/-

Jigna H. Shah

Partner

Membership No. 141825

Place: Ahmedabad

Date: 29/12/2021

UDIN: 22141825AAAAAD1089

GUJARAT POWER CORPORATION LIMITED

Reg Off.: 6TH FLOOR, Block no. 6 & 8, Udyog Bhavan, Sector- 11, Gandhinagar - 11

CIN: U40100GJ1990SGC013961

Balance Sheet as at 31st March, 2021

(Amount in ₹)

Particulars	Notes	As at 31st March, 2021	As at 31st March, 2020
ASSETS			
Non-current assets			
Property, plant and equipment	2	3,10,19,31,970	3,32,01,72,765
Mining Development Asset	2	39,51,81,937	40,47,98,891
Investment in subsidiary, associate and joint venture	3	34,33,76,270	34,33,76,270
Financial assets			
Investments	4	1,28,95,05,795	72,67,40,155
Other financial assets	5	1,88,28,158	1,88,28,158
Other non-current assets	7	47,52,01,297	55,72,31,649
Total non-current assets		5,62,40,25,427	5,37,11,47,888
Current assets			
Inventories	8	61,35,40,025	35,72,00,769
Financial assets			
Trade receivables	9	74,92,68,385	1,82,64,14,798
Cash and cash equivalents	10	73,34,91,453	64,24,240
Other bank balances	10	77,11,92,304	71,40,51,568
Other financial assets	5	8,46,05,23,681	6,02,34,62,462
Current tax assets	6	5,73,67,734	33,10,765
Other current assets	7	50,21,99,595	55,70,55,178
Total current assets		11,88,75,83,177	9,48,79,19,779
TOTAL ASSETS		17,51,16,08,604	14,85,90,67,668
EQUITY AND LIABILITIES			
Equity			
Equity share capital	11	5,13,22,56,050	5,05,02,56,050
Other equity	12	7,05,20,30,398	6,07,69,31,933
Total Equity		12,18,42,86,448	11,12,71,87,983
Liabilities			
Non-current liabilities			
Financial liabilities			
Provisions	13	14,29,03,399	13,12,50,929
Deferred tax liabilities (Net)	14	41,78,61,566	42,86,68,081
Other non-current liabilities	15	52,82,66,621	20,68,39,807
Total non-current liabilities		1,08,90,31,586	76,67,58,817
Current Liabilities			
Financial liabilities			
Trade payables	16	32,85,85,819	8,98,26,104
Provisions	13	62,64,215	11,21,585
Other current liabilities	15	3,90,34,40,536	2,87,41,73,179
Total current liabilities		4,23,82,90,570	2,96,51,20,868
Total Liabilities		5,32,73,22,156	3,73,18,79,685
TOTAL EQUITY AND LIABILITIES		17,51,16,08,604	14,85,90,67,668

Significant Accounting Policies
The accompanying notes are integral part of the financial statements.
As per our report of even date attached

1

For Anil N Shah & Co.
Chartered Accountants
FRN No.: 114131W

Sd/-
Jigna H. Shah
Partner
M.No. 141825

Date : 29/12/2021
Place : Ahmedabad
UDIN: 22141825AAAAAD1089

For and on behalf of the Board of Directors
(CIN : U40100GJ1990SGC013961)

Sd/-
Mehul J. Danayak
Chief Financial Officer

Sd/-
Krupa N. Joshi
Company Secretary

Sd/-
Mamta Verma
Chairman
DIN: 01854315

Sd/-
Vikalp Bharadwaj
Managing Director
DIN: 09396222
Date : 29/12/2021
Place : Gandhinagar

GUJARAT POWER CORPORATION LIMITED

Reg Off.: 6TH FLOOR, Block no. 6 & 8, Udyog Bhavan, Sector- 11, Gandhinagar - 11

CIN: U40100GJ1990SGC013961

Statement of profit and loss for the year ended 31st March, 2021

(Amount in ₹)

Particulars	Notes	For the year ended 31st March, 2021	For the year ended 31st March, 2020
INCOME			
Revenue from operations	17	2,68,92,67,998	2,26,16,39,577
Other income	18	3,99,82,896	2,73,90,060
Finance income	19	49,38,44,356	45,82,44,091
TOTAL INCOME (A)		3,22,30,95,250	2,74,72,73,728
EXPENSES			
Cost of construction and development of plots	20	--	4,77,96,266
Mining Development Expense	21	1,98,01,21,075	1,59,41,32,550
Employee benefits expenses	22	3,21,42,313	2,21,93,500
Finance costs	23	13,31,05,403	2,89,04,512
Depreciation expenses	2	13,16,15,319	13,39,30,415
Amortisation expenses	2	1,01,26,376	61,78,269
Other expenses	24	35,91,24,260	12,55,73,994
TOTAL EXPENSES (B)		2,64,62,34,746	1,95,87,09,507
Profit/ (loss) before exceptional items and tax (A-B)		57,68,60,504	78,85,64,221
Exceptional Items		--	--
Profit/ (loss) before tax		57,68,60,504	78,85,64,221
Tax expense			
Current Tax		(17,69,17,971)	(17,49,50,245)
Short / Excess Provision for Tax		16,93,984	34,920
Deferred Tax	26	1,07,74,422	6,52,09,660
MAT credit entitlement		--	(42,78,318)
Profit/ (loss) after tax for the period (C)		41,24,10,939	67,45,80,238
Other comprehensive income			
Items that will not be reclassified to profit or loss			
Changes in fair value of FVTOCI equity instruments		56,27,65,640	22,82,353
Remeasurement of post-employment benefit obligations		(1,10,205)	(5,15,064)
Income tax relating to these items		32,092	1,49,987
Other comprehensive income for the period, net of tax (D)		56,26,87,527	19,17,276
Total Comprehensive Income for the Period (C+D)		97,50,98,466	67,64,97,514
Earning per equity share (EPS) for profit for the period (face value of Rs.100/-)	25		
Basic (Rs.)		8.15	13.75
Diluted (Rs.)		8.15	13.75

 Significant Accounting Policies
 The accompanying notes are integral part of the financial statements.
 As per our report of even date attached

1

 For and on behalf of the Board of Directors
 (CIN : U40100GJ1990SGC013961)

 Sd/-
Mehul J. Danayak
 Chief Financial Officer

 Sd/-
Mamta Verma
 Chairman
 DIN: 01854315

 For Anil N Shah & Co.
 Chartered Accountants
 FRN No.: 114131W

 Sd/-
Jigna H. Shah
 Partner
 M.No. 141825

 Sd/-
Krupa N. Joshi
 Company Secretary

 Sd/-
Vikalp Bharadwaj
 Managing Director
 DIN: 09396222
 Date : 29/12/2021
 Place : Gandhinagar

 Date : 29/12/2021
 Place : Ahmedabad
 UDIN: 22141825AAAAAD1089

GUJARAT POWER CORPORATION LIMITED

Reg Off.: 6TH FLOOR, Block no. 6 & 8, Udyog Bhavan, Sector- 11, Gandhinagar - 11

CIN: U40100GJ1990SGC013961

Cash flow statement for the year ended 31st March, 2021

(Amount in ₹)

Particulars	For the year ended 31st March, 2021	For the year ended 31st March, 2020
CASH FLOW FROM OPERATING ACTIVITIES		
Net Profit before tax as per statement of profit and loss	57,68,60,504	78,85,64,221
Adjustments for:		
Depreciation, Amortisation, Depletion & Impairment	14,17,41,695	14,01,08,684
Remeasurement of employee benefits	(1,10,205)	(5,15,064)
Finance cost	13,31,05,403	2,89,04,512
Loss on sale of asset	8,82,74,832	467
Dividend income	(1,61,00,018)	(1,57,66,959)
Interest from inter corporate deposit	(49,38,44,356)	(45,82,44,091)
Short / Excess Provision for Tax	16,93,984	34,920
Operating Profit before working capital changes	43,16,21,839	48,30,86,691
Adjustments for changes in Working Capital		
Inventories	(25,63,39,256)	1,57,45,066
Trade Receivables	1,07,71,46,413	(81,33,83,201)
Other Financial assets	(2,43,70,61,219)	(38,70,70,532)
Other Current Assets	7,01,87,797	25,80,86,107
Provisions	1,67,95,100	(7,00,27,921)
Other Current Liabilities	1,02,92,67,357	24,56,97,216
Trade payables	23,87,59,715	(13,51,86,931)
Other Bank Balances	(5,71,40,736)	(15,46,39,143)
Cash Generated from Operations	11,32,37,009	(55,76,92,647)
Taxes (paid)/ refund	(15,77,23,187)	(4,23,08,753)
Net Cash Flow from Operating Activities (A)	(4,44,86,178)	(60,00,01,400)
CASH FLOW FROM INVESTING ACTIVITIES		
Purchase of Fixed Assets	(21,61,278)	(7,39,620)
Dividend on Long-Term Investments	1,61,00,018	1,57,66,959
Interest from inter corporate deposit	48,18,22,907	45,09,11,934
Other Non-Current Assets	54,67,834	(10,91,52,645)
Sale of Fixed Assets	2,499	8,002
Sale of Investment	--	10
Net Cash Flow from Investing Activities (B)	50,12,31,980	35,67,94,640
CASH FLOW FROM FINANCING ACTIVITIES		
Proceed from Equity Share issue	8,20,00,000	29,61,33,000
Share Application Money pending allotment	--	(16,28,00,000)

Finance cost	(1,17,13,974)	(1,06,16,281)
Interest on grant	(12,13,91,429)	(1,82,88,231)
Availment/(Repayment) of Non-current liability	32,14,26,814	6,54,75,661
Net Cash Flow from Financing Activities (C)	27,03,21,412	16,99,04,149
Net Increase/(Decrease) in Cash and Cash equivalents (D) (A+B+C)	72,70,67,214	(7,33,02,612)
Cash and Cash equivalents at the Beginning of the Year		
Cash on hand	36,424	10,420
Bank Balances	63,87,816	7,97,16,433
	64,24,240	7,97,26,854
Cash and Cash equivalents at the End of the Year		
Cash on hand	51,101	36,424
Bank Balances	73,34,40,352	63,87,816
	73,34,91,453	64,24,240

For and on behalf of the Board of Directors
(CIN : U40100GJ1990SGC013961)

For Anil N Shah & Co.
Chartered Accountants
FRN No.: 114131W

Sd/-
Mehul J. Danayak
Chief Financial Officer

Sd/-
Mamta Verma
Chairman
DIN: 01854315

Sd/-
Jigna H. Shah
Partner
M.No. 141825

Sd/-
Krupa N. Joshi
Company Secretary

Sd/-
Vikalp Bharadwaj
Managing Director
DIN: 09396222

Date : 29/12/2021
Place : Ahmedabad
UDIN: 22141825AAAAAD1089

Date : 29/12/2021
Place : Gandhinagar

GUJARAT POWER CORPORATION LIMITED

Reg Off.: 6TH FLOOR, Block no. 6 & 8, Udyog Bhavan, Sector- 11, Gandhinagar - 11
CIN: U40100GJ1990SGC013961

Statement of changes in equity (SOCIE) for the period ended on 31st March 2021

A. Equity Share Capital

Particulars	No. of Shares	Amount
Issued, subscribed and paid up share capital		
Equity Shares of Rs. 100/- each fully paid up		
As at 31st March 2018	4,40,41,238	4,40,41,23,050
Changes in equity share capital	35,00,000	35,00,00,000
As at 31st March 2019	4,75,41,238	4,75,41,23,050
Changes in equity share capital	29,61,330	29,61,33,000
As at 31st March 2020	5,05,02,568	5,05,02,56,050
Changes in equity share capital	8,20,000	8,20,00,000
As at 31st March 2021	5,13,22,568	5,13,22,56,050

B. Other equity

(Amount in ₹)

Particulars	Reserves & Surplus			Share Pending money Allotment	Equity Instruments through Other Comprehensive Income	Total Equity
	Capital reserve	General reserve	Retained earnings			
Balance as at April 1, 2018	-	37,75,990	5,34,61,82,967	5,00,00,000	57,55,30,028	5,97,54,88,985
Changes in accounting policy / prior period errors	-	-	-	-	-	-
Restated balance at the beginning of the reporting period	-	37,75,990	5,34,61,82,967	5,00,00,000	57,55,30,028	5,97,54,88,985
Profit for the year	-	-	(37,53,29,642)	-	-	(37,53,29,642)
Other comprehensive income for the year	-	-	-	-	(14,97,24,923)	(14,97,24,923)
Total comprehensive income for the year	-	37,75,990	4,97,08,53,325	5,00,00,000	42,58,05,105	5,45,04,34,420
Issue of Equity Shares	-	-	-	(5,00,00,000)	-	(5,00,00,000)
Utilisation during the year	-	-	-	-	-	-
Proceeds for Share Allotment	-	-	-	16,28,00,000	-	16,28,00,000
Balance as at March 31, 2019	-	37,75,990	4,97,08,53,325	16,28,00,000	42,58,05,105	5,56,32,34,420
Restated balance at the beginning of the reporting period	-	37,75,990	4,97,08,53,325	16,28,00,000	42,58,05,105	5,56,32,34,420
Profit for the year	-	-	67,45,80,238	-	-	67,45,80,238
Other comprehensive income for the year	-	-	-	-	19,17,276	19,17,276
Total comprehensive income for the year	-	37,75,990	5,64,54,33,563	16,28,00,000	42,77,22,380	6,23,97,31,933
Add: Contribution towards share capital				13,33,33,000		13,33,33,000
Issue of Equity Shares	-	-	-	(29,61,33,000)	-	(29,61,33,000)
Utilisation during the year	-	-	-	-	-	-
Balance as at March 31, 2020	-	37,75,990	5,64,54,33,563	-	42,77,22,380	6,07,69,31,933

Restated balance at the beginning of the reporting period	-	37,75,990	5,64,54,33,563	-	42,77,22,380	6,07,69,31,933
Profit for the year	-	-	41,24,10,939	-	-	41,24,10,939
Other comprehensive income for the year	-	-	-	-	56,26,87,527	56,26,87,527
Total comprehensive income for the year	-	37,75,990	6,05,78,44,502	-	99,04,09,907	7,05,20,30,399
Add: Contribution towards share capital				8,20,00,000		8,20,00,000
Issue of Equity Shares	-	-	-	(8,20,00,000)	-	(8,20,00,000)
Utilisation during the year	-	-	-	-	-	-
Balance as at March 31, 2021	-	37,75,990	6,05,78,44,502	-	99,04,09,907	7,05,20,30,399

For and on behalf of the Board of Directors
(CIN : U40100GJ1990SGC013961)

For Anil N Shah & Co.
Chartered Accountants
FRN No.: 114131W

Sd/-
Mehul J. Danayak
Chief Financial Officer

Sd/-
Mamta Verma
Chairman
DIN: 01854315

Sd/-
Jigna H. Shah
Partner
M.No. 141825

Sd/-
Krupa N. Joshi
Company Secretary

Sd/-
Vikalp Bharadwaj
Managing Director
DIN: 09396222

Date : 29/12/2021
Place : Ahmedabad
UDIN: 22141825AAAAAD1089

Date : 29/12/2021
Place : Gandhinagar

GUJARAT POWER CORPORATION LIMITED
Notes to Financial statements for the year ended 31st March 2021

Note 1 Statement of significant Accounting policies and practices

A. General Information

The financial statements comprise financial statements of Gujarat Power Corporation Limited ("the Company"), which is a state government company incorporated under The Companies Act, 2013.

The registered office of the Company is located at 6th Floor, Block No. 6 & 8, Udyog Bhavan, Sector - 11, Gandhinagar - 11.

The Company is engaged in business of generation of power and also been designated as nodal agency by the Government of Gujarat (GoG) for development of solar park.

B. Significant Accounting policies

B.1. Statement of compliance with Ind AS

The standalone financial statements are prepared in accordance with Indian Accounting Standards (Ind AS) notified under Section 133 of the Companies Act, 2013 including the rules notified under the relevant provisions of the Companies Act, 2013.

B.2. Historical cost convention

The financial statements are prepared on accrual basis of accounting under historical cost convention in accordance with generally accepted accounting principles in India and the relevant provisions of the Companies Act, 2013 including Indian Accounting Standards notified thereunder, except for the following where the fair valuation have been carried out in accordance with the requirements of respective Ind AS:

- Certain financial assets and liabilities measured at fair value
- Defined benefit plans - plan assets measured at fair value

Prior Period/Pre-paid items:

Prior Period items as determined by the management are accounted retrospectively by restating the relevant accounting periods.

B.3. Use of estimates and judgements

The preparation and presentation of the financial statements are in conformity with the Ind AS which requires the management to make estimates, judgments and assumptions that affect the reported amounts of assets and liabilities, revenues and expenses and disclosure of contingent liabilities. Such estimates and assumptions are based on management's evaluation of relevant facts and circumstances as on the date of financial statements. The actual outcome may differ from these estimates.

Estimates and underlying assumptions are reviewed on an ongoing basis. Revisions to the accounting estimates are accounted prospectively.

This policy provides an overview of the areas that involved judgement and items which are more likely to be materially adjusted due to estimates and assumptions turning out to be different than those originally assessed. Detailed information about each of these estimates and judgements is included in relevant notes together with information about the basis of calculation for each affected line item in the financial statements. Information about assumptions, estimation and uncertainties that have a significant risk of resulting in a material adjustment within the next financial year are included in the following notes:

- Current / Deferred tax liabilities
- Measurement of employee defined benefit liabilities
- Provisions and contingent liabilities
- Fair valuation of investment

Principles of fair value measurement have been provided in note - L of the significant accounting policies.

B.4. Current versus non-current classification

The Company presents assets and liabilities in the Balance Sheet based on current/non-current classification as per the requirements of Ind AS compliant Schedule III to the Companies Act, 2013.

C. Borrowing costs

Borrowing costs attributable during the acquisition or construction of qualifying assets are capitalized as part of the cost of the assets. A qualifying asset is one that necessarily takes substantial period of time to get ready for intended use. All other borrowing costs are charged to revenue.

D. Property, Plant and Equipment (PPE)

All items of property, plant and equipment are stated at historical cost of acquisition/construction (net of recoverable taxes) less accumulated depreciation and impairment losses, if any.

Historical cost includes expenditure that is directly attributable to the acquisition as well as construction/installation of the items. Subsequent costs are included in the asset's carrying amount or recognized as a separate asset, as appropriate, only when it is probable that future economic benefits associated with the item will flow to the Company and the cost of the item can be measured reliably. All other repairs and maintenance are charged to statement of profit and loss during the reporting period in which they are incurred. Rehabilitation and resettlement expenses incurred after initial acquisition of the assets are expensed to profit or loss in the year in which they are incurred.

Transition to Ind AS:

On transition to Ind AS, the Company has elected to continue with the carrying value of all of its property, plant and equipment including capital work-in-progress recognised as at 1 April 2015 measured as per the previous GAAP and use that carrying value as the deemed cost of the property, plant and equipment.

The present value of the expected cost for the decommissioning of an asset after its use is included in the cost of the respective asset if the recognition criteria for a provision are met.

Capital Work-in-progress includes expenditure that is directly attributable to the acquisition/construction of assets, which are yet to be commissioned.

An item of property, plant or equipment is derecognized upon disposal or when no future economic benefits are expected to arise from the continued use of the asset. Any gain or loss arising on the disposal or retirement of an item of property, plant and equipment is recognized in the statement of profit and loss.

Depreciation on Property, Plant & Equity (PPE) is provided in the manner prescribed in Schedule II to the Companies Act, 2013 read with relevant circulars issued by the Department of Company Affairs. Method of depreciation adopted is Straight Line Method (SLM). Depreciation on assets acquired/disposed off during the year is provided on pro-rata basis.

The estimated useful lives of assets as per SLM are as follows:

Particulars	Useful life
1. Building	3 to 60 Years
2. Plant & machinery	5 to 40 Years
3. Windmill	22 Years
4. Solar park	25 Years
5. Furniture & Fixtures	8 to 10 Years
6. Vehicles	8 Years
7. Computer	3 Years
8. Office Equipment	5 to 35 Years

Mine Development Asset

Mine Development asset generally comprises of initial expenditure for lignite mines and estimated future decommissioning costs.

Decommissioning cost generally includes cost of restoration. Provisions for decommissioning costs are recognized when the Company has a legal or constructive obligation to restore mines, dismantle and remove a facility or an item of property, plant & equipment and to restore the site on which it is located. The full eventual estimated liability towards costs relating to dismantling and restoring mines and allied facilities are recognized in respective mine development asset.

At this stage, estimation of Decommissioning liability is not possible as per the opinion of Mining Expert consulted by the company and so it is concluded that removal of overburden will be part of Mining development asset as and when its reasonable estimation is possible.

Mine development asset is generally amortized either on the basis of quantity of Lignite actually extracted during the year or period based fixed amortization on a yearly basis. However, the Amortization method, once agreed between buyer and seller, is consistently applied over the life of mine.

E. Intangible assets

Intangible assets are measured on initial recognition at cost (net of recoverable taxes, if any). Subsequently, intangible assets are carried at cost less any accumulated amortization and accumulated impairment losses, if any.

F. Government Grants

Grants from the Government are recognized at their fair value where there is a reasonable assurance that the grant will be received and the Company will comply with all attached conditions.

Government grants relating to income are deferred and recognized in the Statement of Profit and Loss over the period necessary to match them with the costs that they are intended to compensate and presented within the other income.

Government grants relating to the purchase or construction of items of property, plant and equipment or investment properties are included in non-financial liabilities as deferred income and credited to Statement of Profit and Loss on a straight line basis over the expected lives of the related assets and presented within the other income.

Financial assistance in the form of revenue subsidy is netted of from related expense. Government grant with condition attached to it are utilized for incurring related expenses and balance in account pending for utilization due to work/part of work being still to be carried out is shown as other current liability.

G. Impairment of non-financial assets

An asset is treated as impaired when carrying cost of asset exceeds its recoverable value. An impairment loss is charged to Statement of Profit and Loss in the year in which an asset is identified as impaired. The impairment loss recognized in prior accounting period is reversed, if there has been a change in estimate of recoverable amount. In case of intangible assets, the same will be tested on periodical basis for impairment.

H. Leases

The determination of whether an arrangement is (or contains) a lease is based on the substance of the arrangement at the inception of the lease. The arrangement is, or contains, a lease if fulfilment of the arrangement is dependent on the use of a specific asset or assets and the arrangement conveys a right to use the asset or assets, even if that right is not explicitly specified in an arrangement.

Lease accounting

Ministry of Corporate Affairs ("MCA") through Companies (Indian Accounting Standards) Amendment Rules, 2019 and Companies (Indian Accounting Standards) Second Amendment Rules, has notified Ind AS 116 Leases which replaces the existing lease standard, Ind AS 17 leases, and other interpretations. Ind AS 116 sets out the principles for the recognition, measurement, presentation and disclosure of leases for both lessees and lessors. It introduces a single, on-balance sheet lease accounting model for lessees.

The adoption of this new Standard has resulted in the Company recognising a right-of-use asset and related lease liability in connection with all former operating leases except for leases having a remaining lease term of less than 12 months from the date of initial application.

The Company has adopted Ind AS 116 using modified retrospective approach from 1 April 2019 and has not restated comparatives for the 2018 reporting period. The Company has measured the lease liability at present

value of remaining lease payments discounted by using the weighted average incremental borrowing rate as at the date of initial application and Right of Use asset is measured at an amount equal to lease liability, adjusted by the amount of any prepaid or accrued lease payments relating to that lease recognized in the balance sheet immediately before the date of initial application.

The Company as a lessee

The Company considers whether a contract is, or contains a lease. A lease is defined as 'a contract, or part of a contract, that conveys the right to use an asset (the underlying asset) for a period in exchange for consideration'. To apply this definition, the Company assesses whether the contract meets three key evaluations which are whether:

- the contract contains an identified asset, which is either explicitly identified in the contract or implicitly specified by being identified at the time the asset is made available to the Company
- the Company has the right to obtain substantially all of the economic benefits from use of the identified asset throughout the period of use, considering its rights within the defined scope of the contract
- the Company has the right to direct the use of the identified asset throughout the period of use. The Company assess whether it has the right to direct 'how and for what purpose' the asset is used throughout the period of use.

Measurement and recognition

At lease commencement date, the Company recognises a right-of-use asset and a lease liability in the statement of assets and liabilities. The right-of-use asset is measured at cost, which includes the initial measurement of the lease liability, any initial direct costs incurred by the Company, an estimate of any costs to dismantle and remove the asset at the end of the lease, and any lease payments made in advance of the lease commencement date (net of any incentives received).

The Company depreciates the right-of-use assets on a straight-line basis from the lease commencement date to the earlier of the end of the useful life of the right-of-use asset or the end of the lease term. The Company also assesses the right-of use asset for impairment when such indicators exist.

At the commencement date, the Company measures the lease liability at the present value of the lease payments unpaid at that date, discounted using the interest rate implicit in the lease if that rate is readily available or the Company's incremental borrowing rate.

Subsequent to initial measurement, the liability will be reduced for payments made and increased for interest. It is remeasured to reflect any reassessment or modification, or if there are changes in in-substance fixed payments.

When the lease liability is re-measured, the corresponding adjustment is reflected in the right-of-use asset, or profit and loss if the right-of-use asset is already reduced to zero.

The Company has elected to account for short-term leases and leases of low-value assets using the practical expedients.

Instead of recognising a right-of-use asset and lease liability, the payments in relation to these are recognised as an expense in profit or loss on a straight-line basis over the lease term.

The Company as a lessor

At the inception of the lease the Group classifies each of its leases as either an operating lease or a finance lease. The Company recognises lease payments received under operating leases as income on a straight-line basis over the lease term. In case of a finance lease, finance income is recognised over the lease term based on a pattern reflecting a constant periodic rate of return on the lessor's net investment in the lease. When the Company is an intermediate lessor it accounts for its interests in the head lease and the sub-lease separately. It assesses the lease classification of a sub-lease with reference to the right-of-use asset arising from the head lease, not with reference to the underlying asset. If a head lease is a short-term lease to which the Group applies the exemption described above, then it classifies the sub-lease as an operating lease.

I. Non-current assets held for sale and discontinued operations

Non-current assets are classified as held for sale if their carrying amount will be recovered principally through a sale transaction rather than through continuing use and a sale is considered highly probable. They are measured

at the lower of their carrying amount and fair value less costs to sell, except for assets such as deferred tax assets, assets arising from employee benefits, financial assets and contractual rights under insurance contracts, which are specifically exempt from this requirement.

Non-current assets are not depreciated or amortized while they are classified as held for sale. Non-current assets classified as held for sale are presented separately from the other assets in the balance sheet.

A discontinued operation is a component of the Company that has been disposed of or is classified as held for sale and that represents a separate major line of business or geographical area of operations, is part of a single coordinated plan to dispose of such a line of business or area of operations, or is a subsidiary acquired exclusively with a view to resale. The results of discontinued operations are presented separately in the statement of profit and loss.

J. Financial instruments

A financial instrument is any contract that gives rise to a financial asset of one entity and a financial liability or equity instrument of another entity.

Financial assets

Initial recognition

A financial asset is recognized in the balance sheet when the Company becomes party to the contractual provisions of the instrument.

Initial measurement

At initial recognition, the Company measures a financial asset (which are not measured at fair value) through profit or loss at its fair value plus or minus transaction costs that are directly attributable to the acquisition or issue of the financial asset.

Subsequent measurement

For purpose of subsequent measurement, financial assets are classified into:

- A. Financial assets measured at amortized cost;
- B. Financial assets measured at Fair Value Through Profit or Loss (FVTPL); and
- C. Financial assets measured at Fair Value Through Other Comprehensive Income (FVOCI).

The Company classifies its financial assets in the above mentioned categories based on:

- A. The Company's business model for managing the financial assets, and
- B. The contractual cash flows characteristics of the financial asset.

A financial asset is measured at amortized cost if both of the following conditions are met:

- A. The financial asset is held within a business model whose objective is to hold financial assets in order to collect contractual cash flows and
- B. The contractual terms of the financial assets give rise on specified dates to cash flows that are solely payments of principal and interest (SPPI) on the principal amount outstanding.

Amortized cost of a financial asset or financial liability means the amount at which the financial asset or financial liability is measured at initial recognition minus the principal repayments, plus or minus the cumulative amortization using the effective interest rate method of any difference between that initial amount and the maturity amount and, for financial assets, adjusted for any loss allowance.

Financial assets are subsequently measured at amortised cost using the effective interest rate (EIR) method. Amortised cost is calculated by taking into account any discount or premium on acquisition and fees or costs that are an integral part of the EIR. The EIR amortisation is included in finance income in the profit or loss. The losses arising from impairment are recognised in the profit or loss.

A financial asset is measured at fair value through other comprehensive income if both of the following conditions are met:

A. The financial asset is held within a business model whose objective is achieved by both collecting the contractual cash flows and selling financial assets and

B. The asset's contractual cash flows represents SPPI.

A financial asset is measured at fair value through profit or loss unless it is measured at amortised cost or at fair value through other comprehensive income. In addition, the Company may elect to designate a financial asset, which otherwise meets amortized cost or FVOCI criteria, as at FVTPL. However, such election is allowed only if doing so reduces or eliminates a measurement or recognition inconsistency (referred to as 'accounting mismatch').

Trade receivables

Trade receivables are recognised initially at fair value and subsequently measured at amortised cost, less provision for impairment.

Equity instruments

All equity investments in scope of Ind AS 109 are measured at fair value. Equity instruments which are held for trading are classified as at FVTPL. For all other equity instruments, the Company may make an irrevocable election to present in other comprehensive income subsequent changes in the fair value. The Company makes such election on an instrument by-instrument basis. The classification is made on initial recognition and is irrevocable.

If the Company decides to classify an equity instrument as at FVOCI, then all fair value changes on the instrument, excluding dividends, are recognized in the Other Comprehensive Income (OCI). On sale of investments, cumulative gain or loss is recognised in OCI and the amount is not reclassified to profit or loss. Equity instruments included within the FVTPL category are measured at fair value with all changes recognised in the Profit and Loss.

The company has elected to measure its equity instrument through FVOCI.

Derecognition

A financial asset (or, where applicable, a part of a financial asset or part of a group of similar financial assets) is primarily derecognised (i.e. removed from the Company's balance sheet) when:

A. The contractual rights to the cash flows from the financial asset have expired, or

B. The Company has transferred its rights to receive cash flows from the asset or has assumed an obligation to pay the received cash flows in full without material delay to a third party under a 'pass-through' arrangement; and either

i) The Company has transferred substantially all the risks and rewards of the asset, or

ii) The Company has neither transferred nor retained substantially all the risks and rewards of the asset, but has transferred control of the asset.

When the Company has transferred its rights to receive cash flows from an asset or has entered into a pass-through arrangement, it evaluates if and to what extent it has retained the risks and rewards of ownership. When it has neither transferred nor retained substantially all of the risks and rewards of the asset, nor transferred control of the asset, the Company continues to recognise the transferred asset to the extent of the Company's continuing involvement. In that case, the Company also recognises an associated liability. The transferred asset and the associated liability are measured on a basis that reflects the rights and obligations that the Company has retained.

Continuing involvement that takes the form of a guarantee over the transferred asset is measured at the lower of the original carrying amount of the asset and the maximum amount of consideration that the Company could be required to repay.

Impairment of financial assets

The Company assesses impairment based on expected credit loss (ECL) model to the following:

A. Financial assets measured at amortised cost

B. Financial assets measured at fair value through other comprehensive income

Expected credit losses are measured through a loss allowance at an amount equal to:

A. The 12-months expected credit losses (expected credit losses that result from those default events on the financial instrument that are possible within 12 months after the reporting date); or

B. Full time expected credit losses (expected credit losses that result from all possible default events over the life of the financial instrument).

The Company follows 'simplified approach' for recognition of impairment loss allowance on trade receivables. It recognises impairment loss allowance based on lifetime ECLs at each reporting date, right from its initial recognition. At every reporting date, the historical observed default rates are updated and changes in the forwardlooking estimates are analysed.

For recognition of impairment loss on other financial assets and risk exposure, the Company determines that whether there has been a significant increase in the credit risk since initial recognition. If credit risk has not increased significantly, 12-months ECL is used to provide for impairment loss. However, if credit risk has increased significantly, lifetime ECL is used. If, in a subsequent period, credit quality of the instrument improves such that there is no longer a significant increase in credit risk since initial recognition, then the Company reverts to recognising impairment loss allowance based on 12-months ECL.

ECL impairment loss allowance (or reversal) recognized during the period is recognized as income/ expense in the statement of profit and loss. The balance sheet presentation for various financial instruments is described below:

A. Financial assets measured as at amortised cost and contractual revenue receivables - ECL is presented as an allowance, i.e., as an integral part of the measurement of those assets in the balance sheet. The allowance reduces the net carrying amount. Until the asset meets write-off criteria, the company does not reduce impairment allowance from the gross carrying amount.

B. Financial assets measured at FVOCI - Since financial assets are already reflected at fair value, impairment allowance is not further reduced from its value. Rather, ECL amount is presented as accumulated impairment amount in the OCI.

For assessing increase in credit risk and impairment loss, the Company combines financial instruments on the basis of shared credit risk characteristics with the objective of facilitating an analysis that is designed to enable significant increases in credit risk to be identified on a timely basis.

Financial Liabilities

Initial recognition and measurement

All financial liabilities are recognised initially at fair value and, in case of loans and borrowings and payables, net of directly attributable transaction costs.

Subsequently, all financial liabilities are measured at amortised cost or at fair value through profit or loss. The Company's financial liabilities include trade and other payables, loan and borrowings including bank overdrafts.

Subsequent measurement

A. Financial liabilities measured at amortised cost

B. Financial liabilities subsequently measured at fair value through profit or loss

Financial liabilities at fair value through profit or loss include financial liabilities held for trading and financial liabilities designated upon initial recognition as at fair value through profit or loss. Financial liabilities are classified as held for trading if they are incurred for the purpose of repurchasing in the near term. Gains or losses on liabilities held for trading are recognised in the profit or loss.

Financial liabilities designated upon initial recognition at fair value through profit or loss are designated as such at the initial date of recognition, and only if the criteria in Ind AS 109 are satisfied. For liabilities designated as FVTPL, fair value gains/ losses attributable to changes in own credit risk are recognized in OCI. These gains/ loss are not subsequently transferred to profit or loss. However, the Company may transfer the cumulative gain or loss within equity. All other changes in fair value of such liability are recognised in the statement of profit or loss. The Company has not designated any financial liability as at fair value through profit or loss.

Trade and other payables

These amounts represent liability for goods and services provided to the Company prior to the end of financial year which are unpaid. Trade and other payables are presented as current liabilities unless payment is not due within 12 months after the reporting period. They are recognised initially at fair value and subsequently measured at amortised cost using the effective interest rate method.

Derecognition

A financial liability is derecognised when the obligation under the liability is discharged or cancelled or expires. When an existing financial liability is replaced by another from the same lender on substantially different terms, or the terms of an existing liability are substantially modified, such an exchange or modification is treated as the derecognition of the original liability and the recognition of a new liability. The difference in the respective carrying amounts is recognised in the statement of profit or loss.

K. Offsetting financial instruments

Financial assets and financial liabilities are offset and the net amount is reported in the balance sheet when, and only when, there is a legally enforceable right to offset the recognised amount and there is intention either to settle on net basis or to realise the assets and to settle the liabilities simultaneously. The legally enforceable right must not be contingent on future events and must be enforceable in the normal course of business and in the event of default, insolvency or bankruptcy of the Company or counterparty.

L. Fair value

The Company measures certain financial instruments at fair value at each balance sheet date. The fair value measurement is based on the presumption that the transaction to sell the asset or transfer the liability takes place either:

- A. In the principal market for the asset or liability, or
- B. In the absence of a principal market, in the most advantageous market for the asset or liability.

The principal or the most advantageous market must be accessible by the Company. The fair value of an asset or a liability is measured using the assumptions that market participants would use when pricing the asset or liability, assuming that market participants act in their best economic interest.

The Company uses valuation techniques that are appropriate in the circumstances and for which sufficient data are available to measure fair value, maximizing the use of relevant observable inputs and minimising the use of unobservable inputs.

All assets and liabilities for which fair value is measured or disclosed in the financial statements are categorised within the fair value hierarchy, described as under, based on the lowest level input that is significant to the fair value measurement as a whole:

- A. Level 1 - Quoted (unadjusted) market prices in active markets for identical assets or liabilities.
- B. Level 2 - Valuation techniques for which the lowest level input that is significant to the fair value measurement is directly or indirectly observable.
- C. Level 3 - Valuation techniques for which the lowest level input that is significant to the fair value measurement is unobservable.

For assets and liabilities that are recognised in the financial statements on a recurring basis, the Company determines whether transfers have occurred between levels in the hierarchy by re-assessing categorisation (based on the lowest level input that is significant to the fair value measurement as a whole) at the end of each reporting period.

This note summarises the accounting policy for fair value. Other fair value related disclosures are given in the relevant notes.

M. Inventories

Inventories comprises of Developed Plots. Developed Plots comprises of cost of land acquisition, construction & development cost, cost of materials, service and other expenditure related to the solar park - 1 project, valued at cost. Developed Plots are valued at lower of cost or net realisable value.

N. Employee benefits

i. Short term employee benefit obligations

Liabilities for wages, salaries, including non-monetary benefits that are expected to be settled wholly within 12 months after the end of the period in which the employees render the related services are recognised in respect of employees' services up to the end of the reporting period and are measured at the amounts expected to be paid when the liabilities are to be settled. The liabilities are presented as current employee benefit obligations in the balance sheet.

ii. Other long term employee benefit obligations

The liabilities for earned leave and sick leave are not expected to be settled wholly within 12 months after the end of the period in which employees render the related service. They are therefore measured as the present value of expected future payments to be made in respect of services provided by employees up to the end of reporting period using the projected unit credit method. The benefits are discounted using the market yield at the end of reporting period that have terms approximating to the terms of related obligation. Remeasurement as a result of experience, adjustments and changes in actuarial assumptions are recognised in the statement of profit and loss.

iii. Post-employment obligations

The Company operates the following post-employment schemes:

- A. Defined benefit plan such as gratuity; and
- B. Defined benefit plan such as Leave encashment
- C. Defined contribution plan such as provident fund

Gratuity obligations

Gratuity obligation is measured on the basis of annual third party actuarial valuation and recognized during the period when employees rendered the services. Company offers its employees, defined benefit plans in the form of gratuity schemes. The company contributes funds to Life Insurance Corporation of India. The premium amount paid every year is charged to profit and loss account.

Leave encashment

Provision for leave encashment is determined and accrued on the basis of actuarial valuation.

Provident fund

Contribution to provident fund, a defined contribution plan, are made in accordance with the rules of the statute and are recognized as expense when employees have rendered service entitling them to the contributions.

O. Foreign currency transactions

Foreign currency transactions are translated into the functional currency using the exchange rates at the date of the transactions. Foreign exchange gains and losses resulting from the settlement of such transactions and from the translation of monetary assets and liabilities denominated in foreign currencies at the year-end exchange rates are generally recognised in profit or loss.

P. Revenue recognition

Revenue is recognized when no significant uncertainty as to the measurability or collectability exists. Revenue is measured at the fair value of the consideration received or receivable. Revenue is reduced for rebates and other similar allowances.

Revenue (i.e. premium and development charged collected) from plot given on lease is recognized when no significant uncertainty as to measurability or collectability exist and when all the significant risk & rewards of ownership have been passed to the buyer as per agreed terms. The amount received from customers which does not qualify for revenue recognition if accounted for as other current liabilities under the head advance from customer. The amount receivable from customers against the revenue recognized is accounted for as current asset under the head trade receivables.

As per Ind AS-115, revenue is recognised upon satisfaction of performance obligation. 700MW Ultra Mega Project- Raghnesda and 5000 MW Solar Project- Dholera had commenced and no performance obligations

(contractual duties) are satisfied in respect of them. Therefore considering the definitions and requirements laid down under IND AS-115, revenue will be recognised at a point of time once the projects are completed.

Revenue from services is recognized as and when services are rendered taking into account contractual terms.

Revenue from power generation is recognized taking into account contractual terms.

Interest income is recognized on time proportion basis taking into account the amount outstanding and the rate applicable

Dividend is accounted when the right to receive payment is established.

Q. Expenses

Operating expenses and cost of construction and development charges are charged to profit and loss account on the basis of proportion of allocation of plots in its solar park area at Charankha.

Expenses incurred on the projects 700MW Ultra Mega Project- Raghnesda and 5000 MW Solar Project- Dholera are transferred to work-in-progress inventory as the projects have just commenced.

R. Taxation

Income tax

The income tax expense or credit for the period is the tax payable on the current period's taxable income based on the applicable income tax rate adjusted by changes in deferred tax assets and liabilities attributable to temporary differences and to unused tax losses.

The current income tax charge is calculated on the basis of the tax laws enacted or substantively enacted at the end of the reporting period. Current income tax assets and liabilities are measured at the amount expected to be recovered from or paid to the taxation authorities, based on the rates and tax laws enacted or substantively enacted, at the reporting date. Current tax items are recognised in correlation to the underlying transaction either in OCI or directly in equity.

Deferred taxes

Deferred tax is provided in full on temporary difference arising between the tax bases of the assets and liabilities and their carrying amounts in standalone financial statements.

Deferred income tax is determined using tax rates (and laws) that have been enacted or substantially enacted by the end of the reporting period and are expected to apply when the related deferred income tax asset is realized or the deferred income tax liability is settled. Deferred tax assets are recognised for all deductible temporary differences and unused tax losses only if it is probable that future taxable amounts will be available to utilize those temporary differences and losses.

Deferred tax assets and liabilities are offset when there is a legally enforceable right to offset current tax assets and liabilities and when the deferred tax balances relate to the same taxation authority. Current tax assets and tax liabilities are offset where the Company has a legally enforceable right to offset and intends either to settle on a net basis, or to realize the asset and settle the liability simultaneously.

Current tax and deferred tax are recognised in the Statement of Profit and Loss, except to the extent that it relates to items recognised in other comprehensive income or directly in equity. In this case, the tax is also recognised in other comprehensive income or directly in equity, respectively. Any tax credit available is recognised as deferred tax to the extent that it is probable that future taxable profit will be available against which the unused tax credits can be utilised.

The said asset is created by way of credit to the statement of profit and loss and shown under the head deferred tax asset.

The carrying amount of deferred tax assets is reviewed at each reporting date and reduced to the extent that it is no longer probable that sufficient taxable profit will be available to allow all or part of the deferred tax asset to be utilised. Unrecognised deferred tax assets are re-assessed at each reporting date and are recognised to the extent that it has become probable that future taxable profits will allow the deferred tax asset to be recovered.

S. Provisions, contingent liabilities and contingent assets

Provisions are recognised at present value when the Company has a present obligation (legal or constructive) as a result of a past event, it is probable that an outflow of resources embodying economic benefits will be required to settle the obligation and a reliable estimate can be made of the amount of the obligation. The expense relating to a provision is presented in the statement of profit and loss net of any reimbursement.

Decommissioning costs are provided at the present value of expected costs to settle the obligation using estimated cash flows and are recognised as part of the cost of PPE. The cash flows are discounted at a current pre-tax rate that reflects the risk specific to the decommissioning liability. The unwinding of discount is expensed as incurred and recognised in the statement of profit and loss as a finance cost. The estimated future costs of decommissioning are reviewed annually and adjusted as appropriate. Changes in the estimated future costs or in the discount rate applied are added to or deducted from the cost of the asset.

Contingent liabilities are not provided for, if material, are disclosed by way of notes to accounts. Contingent assets are not recognised in financial statements. However, the same is disclosed, where an inflow of economic benefit is probable.

T. Cash and Cash Equivalents

Cash and cash equivalents comprise cash and deposits with banks. The Company considers all highly liquid investments with a remaining maturity at the date of purchase of twelve months or less and that are readily convertible to known amounts of cash to be cash equivalents.

For the purpose of presentation in the statement of cash flows, cash and cash equivalents includes cash on hand, other short term, highly liquid investments with original maturities of three months or less that are readily convertible to known amounts of cash and which are subject to an insignificant risk of changes in value, and bank overdrafts. Bank overdrafts are shown within borrowings in current liabilities in the balance sheet.

U. Statement of Cash Flows

Cash flows are reported using the indirect method, whereby profit before tax is adjusted for the effects of transactions of a non-cash nature, any deferrals or accruals of past or future operating cash receipts or payments and item of income or expenses associated with investing or financing cash flows. The cash flows from operating, investing and financing activities of the Company are segregated.

V. Events occurring after the Reporting Date

Adjusting events (that provides evidence of condition that existed at the balance sheet date) occurring after the balance sheet date are recognized in the financial statements. Material non adjusting events (that are inductive of conditions that arose subsequent to the balance sheet date) occurring after the balance sheet date that represents material change and commitments affecting the financial position are disclosed in the financial statements .

W. Exceptional items

Certain occasions, the size, type or incidence of an item of income or expense, pertaining to the ordinary activities of the Company is such that its disclosure improves the understanding of the performance of the Company, such income or expense is classified as an exceptional item and accordingly, disclosed in the notes accompanying to the financial statements.

X. Segment reporting

GPCL during the year was engaged in the business of development of projects related to power and generation of power. Its activities and revenue from activities are associated with Energy sector only and hence, as per Ind AS-108 "Operating Segments" issued by the Institute of Chartered Accountants of India, the company has single reportable segment .Details of which are presented as other note 31(O)

Y. General Note

A cut off date for recording and closing of accounts of F.Y. 2020-21 is 31/05/2021.

Date of approval of financial statements of F.Y.2020-21 is 29/12/2021.

Note : 2 Property, Plant & Equipment
For the year 2020-21

Particulars	Gross Block				
	As at 1st April 2020	Addition during the year	Disposal/ Adjustment	IND AS Measurement	As at 31st March 2021
LAND	67,83,66,992	46,44,266	46,44,266	-	67,83,66,992
BUILDING	66,43,58,827	-	9,73,22,734	-	56,70,36,093
PLANT & MACHINERY	18,75,03,601	35,000	35,76,237	-	18,39,62,364
OFFICE EQUIPMENT	43,77,75,657	10,08,253	2,500	-	43,87,81,410
FURNITURE & FIXTURE	3,16,18,180	15,000	1,75,99,367	-	1,40,33,813
COMPUTERS	1,98,52,024	-	-	-	1,98,52,024
VEHICLE	82,60,026	-	-	-	82,60,026
WIND MILL	1,22,18,03,928	-	-	-	1,22,18,03,928
SOLAR PARK	1,23,08,97,317	-	-	-	1,23,08,97,317
TOTAL	4,48,04,36,552	57,02,519	12,31,45,104	-	4,36,29,93,967

For the year 2019-20

Particulars	Gross Block				
	As at 1st April 2019	Addition during the year	Disposal/ Adjustment	Impact on IND AS Transition	As at 31st March 2020
LAND	67,83,66,992	-	-	-	67,83,66,992
BUILDING	66,43,58,827	-	-	-	66,43,58,827
PLANT & MACHINERY	18,75,03,601	-	-	-	18,75,03,601
OFFICE EQUIPMENT	43,73,14,054	6,30,947	1,69,344	-	43,77,75,657
FURNITURE & FIXTURE	3,16,09,342	8,838	-	-	3,16,18,180
COMPUTERS	1,97,52,189	99,835	-	-	1,98,52,024
VEHICLE	82,60,026	-	-	-	82,60,026
WIND MILL	1,22,18,03,928	-	-	-	1,22,18,03,928
SOLAR PARK	1,23,08,97,317	-	-	-	1,23,08,97,317
TOTAL	4,47,98,66,276	7,39,620	1,69,344	-	4,48,04,36,552

(Amount in ₹)

Depreciation and Amortization					Net Block	
As at 1st April 2020	For the year	Disposal/ Adjustment	IND AS Measurement	As at 31st March 2021	As at 31st March 2021	As at 31st March 2020
-	-	-	-	-	67,83,66,992	67,83,66,992
14,33,90,539	93,89,296	1,25,84,305	-	14,01,95,529	42,68,40,563	52,09,68,288
5,74,66,035	77,30,779	19,51,825	-	6,32,44,989	12,07,17,376	13,00,37,566
13,26,74,449	1,50,01,107	-	-	14,76,75,556	29,11,05,854	30,51,01,208
2,68,25,974	15,93,526	1,56,87,376	-	1,27,32,123	13,01,690	47,92,206
1,87,44,240	1,09,919	-	-	1,88,54,159	9,97,866	11,07,784
74,70,265	3,15,415	-	-	77,85,680	4,74,346	7,89,761
44,95,85,850	5,15,17,980	-	-	50,11,03,830	72,07,00,098	77,22,18,078
32,41,06,435	4,59,57,298	-	-	37,00,63,733	86,08,33,584	90,67,90,882
1,16,02,63,787	13,16,15,319	3,02,23,507	-	1,26,16,55,599	3,10,13,38,367	3,32,01,72,765

(Amount in ₹)

Depreciation and Amortization					Net Block	
As at 1st April 2019	For the year	Disposal/ Adjustment	Impact on IND AS Transition	As at 31st March 2020	As at 31st March 2020	As at 31st March 2019
-	-	-	-	-	67,83,66,992	67,83,66,992
13,31,32,015	1,02,58,524	-	-	14,33,90,539	52,09,68,288	53,12,26,812
4,96,90,385	77,75,650	-	-	5,74,66,035	13,00,37,566	13,78,13,217
11,80,33,443	1,48,01,881	1,60,875	-	13,26,74,449	30,51,01,208	31,92,80,611
2,39,67,978	28,57,996	-	-	2,68,25,974	47,92,206	76,41,364
1,86,44,072	1,00,168	-	-	1,87,44,240	11,07,784	11,08,117
70,68,738	4,01,527	-	-	74,70,265	7,89,761	11,91,288
39,79,34,390	5,16,51,460	-	-	44,95,85,850	77,22,18,078	82,38,69,538
27,80,23,227	4,60,83,209	-	-	32,41,06,435	90,67,90,882	95,28,74,090
1,02,64,94,246	13,39,30,415	1,60,875	-	1,16,02,63,787	3,32,01,72,765	3,45,33,72,029

Note:

- 1) Pursuant to the enactment of Companies Act 2013, the company has applied the estimated useful lives as specified in Schedule II as disclosed in Accounting Policy on Depreciation/Amortisation. Accordingly the unamortised carrying value is being depreciated / amortised over the revised/remaining useful lives.
- 2) There is a first charge over the hypothecated Assets of Rs. 61,14,46,519/- pertaining to 10 MW Solar Project for all the obligation of the Company as per power purchase agreement and VGF Securitisation Act with SECI.

Note 2
LEASES
A. Effect of Leases as lessee

Qualitative information on nature of leasing activities, terms, conditions, asset class taken on lease etc.

The following is the carrying amounts of Company's Right of use assets and the movement in lease liabilities during the year ended March 31, 2021:

a. Right of Use Asset on Land

Particulars	For the year 2020-21 Amount (Rs.)
Gross carrying value	
Opening Balance	-
Additions during the year	11,03,025
Deductions	-
Closing Balance (A)	11,03,025
Accumulated amortisation	
Opening Balance	-
Charge for the year	5,09,422
Deduction/Adjustment during the year	-
Closing Balance (B)	5,09,422
Net balance as at 31st March, 2021 (C=A-B)	5,93,603

b. Lease Liability

Particulars	For the year 2020-21 Amount (Rs.)
Opening Balance	-
Additions during the year	11,03,025
Finance costs incurred	3,37,865
Adjustment of Lease Liabilities	(9,56,800)
Closing balance	4,84,090
Current Portion	64,698
Non-Current Portion	4,19,392

c. Amounts recognised in profit or loss

Particulars	For the year 2020-21 Amount (Rs.)
2020-21 - Leases under Ind AS 116	
Amortization Expenses of Right to Use Asset	5,09,422
Interest Expenses on Lease Liability	3,37,865
Total Amounts recognised in profit or loss	8,47,287

c. Amounts recognised in profit or loss

Particulars	31st March 2021	
	Minimum Lease Payments	Present Value of MLP
Not Later than 1 year	1,48,200	64,698
Later Than 1 year and not later than 5 years	7,41,000	2,55,284
Later Than 5 years	7,05,020	1,64,109
Total Minimum Lease Payments	15,94,220	4,84,090
Less:- Amounts representing finance charges	-	-
Present Value of Minimum lease payments	15,94,220	4,84,090

The interest rate of borrowing i.e., 8.45% is used as the discount rate in calculating the present value of the minimum lease payments

Note 2 Mining Development Assets

Particulars	As at 31st March, 2021	As at 31st March, 2020
Initial Development Expenditure		
Opening Balance	40,47,98,891	41,09,77,160
Add: Recognition during the year	-	-
Less: Amortised during the year	(96,16,954)	(61,78,269)
Closing Balance	39,51,81,937	40,47,98,891
Asset For Decommissioning Liability *		

*The Government of Gujarat vide its various orders have granted mining lease for lignite for 25 years from respective dates covering the area of 1355 hectares. The said lease provides to use all lignite excavated from the above area for use in BLTPS power plants. As per the agreement MDO is bound to excavate about 33.50MMT of lignite, which is covered under the lignite mining fee, as per the terms and conditions of agreement. At this stage, estimation of decommissioning cost cannot be ascertained to estimate the unwinding cost of Ghogha Surka Lignite Mining Project as per the opinion of Technical Mining Expert. In view thereof, as per the principle of IND AS 37 "provisions, contingent liabilities and contingent assets for the future decommissioning of mines at the end of their economic lives can not be made."

Note 3
Investments in Subsidiary, Associate and Joint venture (Unquoted)

Particulars	As at 31st March, 2021	As at 31st March, 2020
Non-Current		
A. Investments in unquoted equity shares of Subsidiary, Associate and Joint Ventures		
Baitarni West Coal Company Limited (BWCCL) (As at 31st March 2021 : 1,00,000; As at 31st March 2020 : 1,00,000 Equity shares of Rs. 1000 each fully paid up)	10,00,00,000	10,00,00,000
Torrent Pipavav Generation Limited (TPGL) (As at 31st March 2021: 25,00,000; As at 31st March 2020 : 25,00,000 Equity shares of Rs. 10 each fully paid up)	2,50,00,000	2,50,00,000
GSPC Pipavav Power Company Limited (GPPCL) As at 31st March 2021 : 2,18,37,627; As at 31st March 2020 : 2,18,37,627 Equity shares of Rs. 10 each fully paid up)	21,83,76,270	21,83,76,270
Total investments in Subsidiary, Associate and Joint venture	34,33,76,270	34,33,76,270
Refer note no. 29 & 30(K)		

Note 4

Investments		
Particulars	As at 31st March, 2021	As at 31st March, 2020
Non-current investments		
A. Investment in quoted equity shares of other companies (measured at Fair Value Through OCI) (FVTOCI)		
Gujarat Industrial Power Company Limited (GIPCL) (As at 31st March 2021 : 49,77,491; As at 31st March 2020 : 49,77,491 Equity shares of Rs. 10 each fully paid up)	37,70,44,944	24,83,76,802
Gujarat Gas Limited (GGL) (As at 31st March 2021 : 1332235 Equity shares of Rs.2 each fully paid up; As at 31st March 2022 : 1332235 Equity shares of Rs.2 each fully paid up)	73,19,96,521	30,75,46,450
B. Investment in unquoted equity shares of other companies (measured at Fair Value Through OCI)(FVTOCI)		
Gujarat State Energy Generation Limited (GSEGL) (As at 31st March,2021: 1,58,15,454 Equity Shares of Rs.10 each fully paid up,As at 31st March,2020: 1,58,15,454 Equity Shares of Rs.10 each fully paid up)	18,04,54,330	17,08,06,903
Kalapur Bank (As at 31st March 2021 : 400 Equity shares of Rs. 25 each fully paid up, As at 31st March 2020 : 400 Equity shares of Rs. 25 each fully paid up)	10,000	10,000
Total non-current investments	1,28,95,05,795	72,67,40,155
Refer Note-29-Fair Value Measurement		
Current investments		
Particulars	As at 31st March, 2021	As at 31st March, 2020
Other Current Investments	-	-
Total Current investments	-	-

Note 5

Other financial assets		
Particulars	As at 31st March, 2021	As at 31st March, 2020
Non-Current		
Security & Other deposit	1,88,28,158	1,88,28,158
Total non-current financial assets	1,88,28,158	1,88,28,158
Current		
Deposits with Corporate Bodies	8,46,05,23,681	6,02,34,62,462
Total current deposits	8,46,05,23,681	6,02,34,62,462

Note 6

Current tax asset		
Particulars	As at 31st March, 2021	As at 31st March, 2020
Advance Income Tax for the year	8,82,00,000	6,08,00,000
TDS Receivable	6,78,35,829	6,91,06,084
TCS Receivable	16,87,359	22,79,241
Provision for Income tax of the year	(10,03,55,453)	(12,88,74,560)
Current Tax asset (net)	5,73,67,734	33,10,765

Note 7

Other assets		
Particulars	As at 31st March, 2021	As at 31st March, 2020
Non-Current		
Capital Advance	17,63,411	3,33,69,775
O&M Income receivable	9,22,12,626	7,10,78,845
Advance Income Tax (Net of Provision of Tax)	25,66,30,403	25,28,87,518
MAT Credit entitlement	11,96,45,928	19,49,46,582
Others	49,48,929	49,48,929
Total other non-current assets	47,52,01,297	55,72,31,649
Current		
Project Development Cost	10,04,10,146	10,04,10,146
Interest accrued but not due on:		
(a) Deposits with banks	71,63,426	1,06,45,990
(b) Bond	3,28,807	5,16,471
(c) Deposits with corporate bodies	23,09,41,500	21,52,49,823
O&M Income receivable	2,33,65,630	2,35,67,526
Current maturity of receivable towards fixed asset	70,00,000	70,00,000
Other		
Advances for Gogha surkha Mine Project	8,53,16,858	19,01,20,487
Amount Recoverable from GWIL	99,64,405	-
Prepaid expenses	74,25,471	56,61,028
Service Tax Receivable	3,28,628	3,28,628
GST Receivable	2,94,56,408	-
Other	4,98,315	35,55,079
Total other current assets	50,21,99,595	55,70,55,178

Note 8

Inventories		
Particulars	As at 31st March, 2021	As at 31st March, 2020
Developed Plots/Work in progress of Solar Park - 1 Charankha	32,35,30,170	32,35,90,170
Development cost towards 700MW Ultra Mega Project- Raghnesda	28,80,36,590	3,18,24,069
Development cost towards 5000 MW Solar Project- Dholera	19,73,265	17,86,530
Total inventories	61,35,40,025	35,72,00,769

Note 9

Trade receivables		
Particulars	As at 31st March, 2021	As at 31st March, 2020
Trade receivables considered good-secured	8,87,20,541	6,86,23,490
Trade receivables considered good-unsecured	66,05,47,844	1,75,77,91,308
Trade receivables which have significant increase in credit risk	-	-
Trade receivables - credit impaired	11,67,100	11,67,100
	75,04,35,485	1,82,75,81,898
Allowance for bad and doubtful debts	(-11,67,100)	(-11,67,100)
Total trade receivables	74,92,68,385	1,82,64,14,798

Note 10

Cash and cash equivalents		
Particulars	As at 31st March, 2021	As at 31st March, 2020
Cash and bank balances		
Balances with banks		
In current accounts	73,34,40,352	63,87,816
Cash on hand	51,101	36,424
Total cash and cash equivalents	73,34,91,453	64,24,240
Other bank balances		
Margin money deposits	71,35,49,870	66,03,69,248
Liquid deposit	5,76,42,434	5,36,82,320
Total other bank balances	77,11,92,304	71,40,51,568

Note 11

Equity share capital		
Particulars	As at 31st March, 2021	As at 31st March, 2020
Authorised share capital 6,00,00,000 equity shares of Rs. 100 each (31st March, 2021 : 6,00,00,000 equity shares of Rs. 100 each)	6,00,00,00,000	6,00,00,00,000
Total	6,00,00,00,000	6,00,00,00,000
Particulars	As at 31st March, 2021	As at 31st March, 2020
Issued, subscribed and paid up capital		
5,13,22,568 equity shares of Rs. 100 each (P.Y. 5,05,02,568 equity shares of Rs. 100 each)	5,13,22,55,300	5,05,02,55,300
Fractional certificates/warrants- 15 shares representing one half of equity share	750	750
Total	5,13,22,56,050	5,05,02,56,050
Reconciliation of the shares outstanding at the beginning and at the end of the reporting period		
Particulars	No of shares	Amount
As at 1st April 2018		
At the beginning of the year	4,40,41,238	4,40,41,23,050
Add : Shares issued during the year	35,00,000	35,00,00,000
As at 1st April 2019	4,75,41,238	4,75,41,23,050
At the beginning of the year	4,75,41,238	4,75,41,23,050
Add : Shares issued during the year	29,61,330	29,61,33,000
As at 1st April 2020	5,05,02,568	5,05,02,56,050
At the beginning of the year	5,05,02,568	5,05,02,56,050
Add : Shares issued during the year	8,20,000	8,20,00,000
As at 31st March 2021	5,13,22,568	5,13,22,56,050
Details of shareholder(s) holding more than 5% Equity Shares		
Particulars	As at 31st March, 2021	As at 31st March, 2020
Number of Equity Shares		
Government of Gujarat	4,93,92,462	4,85,72,462
% Holding in equity shares		
Government of Gujarat	96.24%	96.18%

Notes
Terms /Rights attached to equity shares

- The Company has only one class of equity shares having a par value of Rs. 100 per share. Each Shareholder is eligible for one vote per share, without restrictions and are entitled to dividend, as and when declared. The dividend proposed by Board of Directors, if any, is subject to the approval of shareholders in the ensuing Annual General Meeting, except in case of interim dividend. In the event of liquidation, all the equity shareholders rank equally and are eligible to receive the remaining assets of the Company, after distribution of all preferential amounts.
- The Company has not allotted any share pursuant to Contract(s) without payment being received in cash during the period of 5 years immediately preceding the Balance Sheet date.
- The company has not bought back its shares during the period of 5 years immediately preceding the Balance Sheet date.

Note 12

Other equity		
Particulars	As at 31st March, 2021	As at 31st March, 2020
General Reserve	37,75,990	37,75,990
Retained Earnings	6,05,78,44,503	5,64,54,33,563
Share application money pending allotment	-	-
Reserves representing unrealized gains/losses	99,04,09,907	42,77,22,380
Total other equity	7,05,20,30,399	6,07,69,31,933
Particulars	As at 31st March, 2021	As at 31st March, 2020
General reserve		
Opening Balance	37,75,990	37,75,990
Total general reserve	37,75,990	37,75,990
Particulars	As at 31st March, 2021	As at 31st March, 2020
Retained earnings		
Opening Balance	5,64,54,33,563	4,97,08,53,325
Add:		
Profit during the year	41,24,10,939	67,45,80,238
Total retained earnings	6,05,78,44,503	5,64,54,33,563
Particulars	As at 31st March, 2021	As at 31st March, 2020
Share application money pending allotment		
Opening Balance	-	16,28,00,000
Add: During the year	8,20,00,000	13,33,33,000
(Less): During the year	(8,20,00,000)	(29,61,33,000)
Total Share application money pending allotment	-	-
Particulars	As at 31st March, 2021	As at 31st March, 2020
Reserves representing unrealized gains/losses		
FVOCI - equity investments		
Opening Balance	42,77,22,377	42,58,05,101
Increase/(Decrease) fair value of FVOCI equity instruments	56,27,65,640	22,82,353
Remeasurement of post-employment benefit obligations	(1,10,205)	(5,15,064)
Income tax relating to these items	32,092	1,49,987
Total reserves representing unrealized gains/losses	99,04,09,904	42,77,22,377

Note 13

Provisions		
Particulars	As at 31st March, 2021	As at 31st March, 2020
Non-Current		
Provision for gratuity	9,81,960	1,32,324
Provision for leave encashment	1,33,73,646	1,20,92,871
Asset Retirement Obligation - ARO	12,85,47,793	11,90,25,734
Total non-current provisions	14,29,03,399	13,12,50,929
Current		
Provision for Gratuity	4,44,941	5,92,462
Provision for expenses	58,19,274	5,29,123
Total current provisions	62,64,215	11,21,585

Note 14

Deferred tax Asset/(Liability)		
Particulars	As at 31st March, 2021	As at 31st March, 2020
Deferred tax Asset	4,31,52,284	4,10,76,122
Total	4,31,52,284	4,10,76,122
Deferred tax Liability	46,10,13,850	46,97,44,203
Total	46,10,13,850	46,97,44,203
Net Deferred Tax (Asset)/Liability	41,78,61,566	42,86,68,081

Note 15

Other liabilities		
Particulars	As at 31st March, 2021	As at 31st March, 2020
Non-current		
Trade payables		
(a) Total outstanding dues of creditors other than micro enterprises and small enterprises	2,18,73,871	2,17,25,671
(b) Total outstanding dues of micro enterprises and small enterprises	-	-
Others	50,63,92,750	18,51,14,136
Total non-current liabilities	52,82,66,621	20,68,39,807
Current		
Statutory dues	3,05,23,917	24,03,79,765
Employee benefit payable	1,88,200	27,32,335
Advance from customers	2,09,54,02,723	47,76,94,937
Grant pending utilisation	36,04,70,464	16,62,47,043
Interest on GoG Loan	-	61,88,79,321
Interest payable on Grant	-	1,76,19,846
Interest Payable to GEDA on Grant	11,22,87,072	
Earnest Money Deposit	2,26,06,684	1,91,30,900
CSR Payable	2,72,11,358	
Others	1,25,47,50,119	1,33,14,89,033
Total current liabilities	3,90,34,40,536	2,87,41,73,179

Note 16

Trade payables		
Particulars	As at 31st March, 2021	As at 31st March, 2020
Total outstanding dues of creditors other than micro enterprises and small enterprises	32,85,85,819	8,45,63,230
Total outstanding dues of micro enterprises and small enterprises	-	52,62,874
Total trade payables	32,85,85,819	8,98,26,104

*The company has not received intimation from many suppliers regarding their status under Micro, Small and Medium Enterprise Development Act, 2006. Further, there are no Micro and Small enterprise to whom company owes dues, which are outstanding for more than 45 days as on 31st March, 2021. This information is required to be disclosed under the said Act, has been determined to the extent such parties have been identified on the basis of information available with the company.

Note 17

Revenue from operations		
Particulars	For the year ended 31st March, 2021	For the year ended 31st March, 2020
Sale of Goods		
Revenue from Lignite Projects *	2,26,80,65,092	1,68,98,38,451
Sale of services		
Revenue from plot given on lease	-	8,20,84,051
Revenue from generation of Electricity	24,71,78,818	30,64,18,308
Less: Rebate on Sale of Electricity	(1,18,64,175)	(1,42,82,731)
Less: DSM charges- Windmill projects	(4,59,695)	(9,54,137)
Less: DSM charges- Solar power projects	(1,75,27,789)	(99,38,537)
Less: Green Incentive Expense	(32,64,069)	-
	2,48,21,28,182	2,05,31,65,405
Other operating revenues		
Lease Rent	1,46,34,443	1,46,05,258
Recovered Towards O&M -Charanka Project Expense	19,24,25,010	19,37,18,914
Other Operating Income	80,363	1,50,000
	20,71,39,816	20,84,74,172
Total revenue from operations	2,68,92,67,998	2,26,16,39,577

* Fuel Supply Agreement (FSA) between GPCL and GSECL is under process and will be executed once finalized. As an adhoc interim arrangement, GPCL has requested GSECL to release amount paid by GPCL to the MDO towards mining fees.

Note 18

Other income		
Particulars	For the year ended 31st March, 2021	For the year ended 31st March, 2020
Dividend on Long-Term Investments	1,61,00,018	1,57,66,959
Dividend on Long-Term Investments (Bank)	-	1,500
Insurance claim received	12,900	91,80,864
Tender Fees	2,26,002	2,95,182
Miscellaneous income	2,36,43,976	21,45,555
	3,99,82,896	2,73,90,060
Total other income	3,99,82,896	2,73,90,060

Note 19

Finance income		
Particulars	For the year ended	For the year ended
	31st March, 2021	31st March, 2020
Interest income		
Interest on Inter Corporate Deposit	45,69,27,451	41,52,56,954
Interest on Deposits	3,69,14,655	4,29,83,118
Other Interest	2,250	4,018
Total finance income	49,38,44,356	45,82,44,091

Note 20

Cost of construction and development of plots		
Particulars	For the year ended	For the year ended
	31st March, 2021	31st March, 2020
Solar Park-1		
Opening Balance of cost of construction and development of plots	32,35,90,170	37,29,45,835
Add: Incurred/Transferred during the year	-	13,20,000
Less: Adjusted during the year	(60,000)	(28,79,399)
Closing balance	(32,35,30,170)	(32,35,90,170)
700MW Raghnesda UMSSP		
Opening Balance of cost of construction and development of plots	3,18,24,069	2,76,74,117
Add: Incurred/Transferred during the year	25,70,38,112	21,00,90,605
Less: Adjusted during the year	(8,25,590)	(20,59,40,653)
Closing balance	(28,80,36,590)	(3,18,24,069)
Dhorela Project		
Opening Balance of cost of construction and development of plots	17,86,530	-
Add: Incurred/Transferred during the year	1,86,735	17,86,530
Less: Adjusted during the year	-	-
Closing balance	(19,73,265)	(17,86,530)
Total Cost of construction and development of plots	-	4,77,96,266

Note 21

Mining Development Expense		
Particulars	For the year ended	For the year ended
	31st March, 2021	31st March, 2020
Lignite Mining Development Expense	1,98,01,21,075	1,59,41,32,550
Total Mining Development Expense	1,98,01,21,075	1,59,41,32,550

Note 22

Employee benefit expenses		
Particulars	For the year ended	For the year ended
	31st March, 2021	31st March, 2020
Salary, wages and allowances	2,41,81,485	1,34,97,796
Contribution to provident fund and other funds	30,28,156	28,96,120
Manpower supply Expense	48,51,129	57,56,644
Staff welfare expenses	81,543	42,940
Total employee benefit expenses	3,21,42,313	2,21,93,500

Note 23

Finance costs		
Particulars	For the year ended	For the year ended
	31st March, 2021	31st March, 2020
Bank guarantee charges	18,54,050	17,99,560
Interest on Grant (*)	12,13,91,429	1,82,88,231
Interest on leasehold asset	3,37,865	-
Unwinding of discount on provision of Asset Retirement Obligation	95,22,059	88,16,721
Total finance costs	13,31,05,403	2,89,04,512

(*) GPCL receives financial assistance from Government and the same is parked in ICD with Gujarat State Financial Services Limited (GSFS Ltd.) by GPCL on which interest is received and such interest received by GPCL is to be given to Government. Hence GPCL recorded income and expense thereof and as per IND AS -1 said transaction has been routed through statement of Profit & Loss for better understanding of financial statements and clarity. Since IND AS -1 categorically states that "An entity shall not offset assets and liabilities or income and expenses unless required or permitted by IND AS"

Note 24

Other expenses		
Particulars	For the year ended	For the year ended
	31st March, 2021	31st March, 2020
(A) Repair & Maintenance		
Plant & Machinery	7,34,51,548	7,80,27,172
Insurance	75,77,278	39,03,822
Professional fee	38,21,565	93,07,968
Scheduling & Accounting fee	89,218	75,894
Travelling expense	3,20,478	10,00,492
Water charges	11,67,77,398	75,88,980
Other repair & maintenance	29,05,738	34,04,130
	20,49,43,222	10,33,08,457
(B) Other		
Lease Rent	-	1,48,200
Rent	2,89,616	4,90,288
Loss on transfer of asset	8,82,74,832	467
Rates & Taxes	49,001	22,03,267
Advertisement and Selling Expenses	71,82,991	4,18,334
Electricity Expense	7,36,219	9,03,029
Interest on Tax	16,574	4,07,741
CSR / Donation [(Refer note no. 31(N))]	4,05,64,713	53,00,000
Other expense	1,69,52,293	1,22,80,729
	15,40,66,239	2,21,52,054
(C) As Statutory Auditors	1,14,800	1,13,482
Total other expenses (A+B+C)	35,91,24,260	12,55,73,994

Note 25

Earning per share		
Particulars	For the year ended	For the year ended
	31st March, 2021	31st March, 2020
Profit attributable to equity holders for :		
Basic earnings	41,24,10,939	67,45,80,238
Adjusted for the effect of dilution	-	-
Weighted average number of equity Shares for:		
Basic EPS	5,06,01,417	4,90,56,999
Adjusted for the effect of dilution	-	-
Earnings Per Share (Rs.):		
Basic	8.15	13.75
Diluted	8.15	13.75

22.1 DISCLOSURES FOR GRATUITY & LEAVE SALARY PROVISIONS AS PER INDIAN ACCOUNTING STANDARD - 19

Company has participated in Group Gratuity scheme of Life Insurance Corporation of India. The liability in respect of gratuity benefits & leave salary being defined benefit schemes, payable in future, are determined by actuarial valuation as on balance sheet date.

In arriving at the valuation for gratuity & leave salaries following assumptions were used:

Particulars	2020-21		2019-20	
	Gratuity	Leave Salary	Gratuity	Leave Salary
Mortality	Indian Assured Lives Mortality (2012-14) Ult.		Indian Assured Lives Mortality (2012-14) Ult.	
Withdrawal rate	5% at younger age reducing to 1% at old age		5% at younger age reducing to 1% at old age	
Retirement Age	58 & 60 years		58 & 60 years	
Discount Rate	6.05%	6.05%	6.45%	6.45%
Rate of Return on Plan Assets	6.45%	6.45%	6.45%	6.45%
Salary escalation	7.00%	7.00%	7.00%	7.00%

The following table sets out status of gratuity plan and leave salary as required under Indian Accounting Standard 19 on "Employee Benefit".

Particulars	2020-21		2019-20	
	Gratuity	Leave Salary	Gratuity	Leave Salary
Table showing change in benefit obligation				
Opening defined benefit obligation	1,62,03,255	1,20,92,871	1,59,35,299	1,11,70,325
Interest Cost	10,28,845	7,70,209	10,60,624	7,51,405
Current Service Cost	5,64,268	5,00,819	6,05,160	4,70,376
Benefit Paid	(17,18,445)	(11,23,260)	(19,87,973)	(12,55,490)
Actuarial Loss / (gain) on Obligations	1,69,388	11,33,007	5,90,145	9,56,255
Past service cost	-	-	-	-
Liability at the end of the period	1,62,47,311	1,33,73,646	1,62,03,255	1,20,92,871

Table showing change in Fair Value of Plan Assets

Fair Value of Plan Assets at the beginning	1,54,78,469	-	1,40,30,325	-
Adjustment to Opening fund	-	-	-	-
Expected Return on Plan Assets	59,183	-	75,081	-
Contributions	-	-	24,11,980	-

Actuarial loss/ (gain) due to experience adjustments	-	-	-	-
Interest Income	10,01,203	-	9,49,056	-
Benefit paid	(17,18,445)	-	(19,87,973)	-
Actuarial gain / (loss) on Plan Assets	-	-	-	-
Fair Value of Plan Assets at the end of the period	1,48,20,410	-	1,54,78,469	-
Particulars	2020-21		2019-20	
	Gratuity	Leave Salary	Gratuity	Leave Salary
Actual Gain / loss recognized				
Actuarial (gain) / loss on obligations	7,24,786	11,33,007	19,04,974	9,56,255
Actuarial (gain) / loss on Plan Assets	59,183	-	75,081	-
Net Actuarial (gain) / loss recognized during year	7,83,969	11,33,007	19,80,055	9,56,255
Amount recognized in Balance Sheet				
Liability at the end of the period	1,62,47,311	1,33,73,646	1,62,03,255	1,20,92,871
Fair Value of Plan Asset at the end of the period	1,48,20,410	-	1,54,78,469	-
Net Amount recognized in Balance Sheet	14,26,901	1,33,73,646	7,24,786	1,20,92,871
Expense recognized in the Statement of Profit and Loss				
Current Service cost	5,64,268	5,00,819	6,05,160	4,70,376
Interest cost	27,642	7,70,209	1,11,568	7,51,405
Expected return on Plan Asset	-	-	-	-
Net Actuarial Loss / (gain) to be recognized	-	11,33,007	-	9,56,255
Adjustment to Opening fund/Prior year Charges	-	-	-	-
Net Expense recognized in P&L	5,91,910	24,04,035	7,16,728	21,78,036
Expense recognized in the Statement of Other Comprehensive Income				
Due to change in financial assumption	3,12,162	2,76,598	6,46,852	-
Due to change in demographic assumption	-	-	(9,058)	-
Due to experience adjustment	(1,42,774)	8,56,409	(47,649)	9,56,255
Return on plan assets excluding amounts included in interest income	(59,183)	-	(75,081)	-
Net Expense recognized in OCI	1,10,205	11,33,007	5,15,064	9,56,255
Sensitivity Analysis				
Reasonably possible changes at the reporting date to one of the relevant actuarial assumptions, holding other assumptions constant, would have affected the defined benefit obligation by the amounts shown below:				
Gratuity	2020-21		2019-20	
	Increase	Decrease	Increase	Decrease
Discount rate - 0.5% (PY: 0.5%)	1,58,58,447	1,66,49,938	1,57,68,063	1,66,54,897
Salary growth rate - 0.5% (PY: 0.5%)	1,63,60,393	1,61,73,545	1,63,56,417	1,60,50,494
Leave salary	2020-21		2019-20	
	Increase	Decrease	Increase	Decrease
Discount rate - 0.5% (PY: 0.5%)	1,30,29,203	1,37,31,576	1,17,63,654	1,24,34,969
Salary growth rate - 0.5% (PY: 0.5%)	1,37,26,657	1,30,30,630	1,24,31,563	1,17,63,805

26. Effective tax calculation & Deferred tax asset/ (liabilities) [Net]

A) Tax expense		
Amount recognised in statement of profit and loss		
Particulars	Amount (₹)	
	For the period ended 31st March, 2021	For the period ended 31st March, 2020
Current income tax	17,69,17,971	17,49,50,245
Deferred income tax liability / (asset), net		
Origination and reversal of temporary differences	(1,07,74,422)	(6,52,09,660)
Recognition of previously unrecognised tax losses	-	-
Change in recognised deductible temporary differences	-	-
Deferred tax expense	(1,07,74,422)	(6,52,09,660)
Excess provision of income tax in respect of previous years	(16,93,984)	42,43,398
Total tax expense for the year	16,44,49,565	11,39,83,983
Amount recognised in other comprehensive income		
Particulars	Amount (₹)	
	For the period ended 31st March, 2021	For the period ended 31st March, 2020
Items that will not be reclassified to profit or loss (A)		
Changes in fair value of FVTOCI equity instruments	(1,10,205)	(5,15,064)
Changes in fair value of equity instruments	56,27,65,640	22,82,353
	56,26,55,435	17,67,289
Income tax relating to items that will not be reclassified to profit or loss (B)		
Changes in fair value of FVTOCI equity instruments	32,092	1,49,987
	32,092	1,49,987
Net amount recognised in other comprehensive income (A+B)		
Remeasurements of the defined benefit plans	(78,113)	(3,65,077)
Equity instruments through other comprehensive income	56,27,65,640	22,82,353
	56,26,87,527	19,17,276
Reconciliation of effective income tax rate		
Particulars	Amount (₹)	
	For the period ended 31st March, 2021	For the period ended 31st March, 2020
Profit before tax	57,68,60,504	78,85,64,244
Tax using the Company's domestic tax rate @ 29.12% (Previous Year @ 34.944%)	16,79,81,779	22,96,29,902
Reduction in tax rate		
Tax effect of:		
Non-deductible tax expenses		
Depreciation as per Profit and Loss Account	4,12,75,182	4,07,99,649
CSR Expenses	1,18,12,444	15,43,360
Other Disallowances	2,57,10,450	91,789
Impact on account of Ind AS	(35,02,892)	(43,43,404)
Disallowance U/s 43B		
Any sum payable by way of contribution to any provident fund or superannuation fund or gratuity fund or any other fund for the welfare of employees-Labour Cess, Gratuity & Leave Encashment	5,77,418	(2,42,354)
Deductions		

Depreciation as per Income tax act	(2,58,99,961)	(3,04,38,640)
Deduction allowable - Others		
Dividend Income	-	(45,91,775)
Actuarial Loss recorded in OCI	(32,092)	(1,49,987)
Deduction under Chapter VI-A	(4,10,04,357)	(5,73,48,294)
Recognition of deferred tax	(1,07,74,423)	(6,52,09,660)
Short/(Excess) Provision of tax for earlier years	(16,93,984)	42,43,398
Tax expense recognised in statement of profit and loss	16,44,49,564	11,39,83,983

B) Movement in deferred tax balances					
Particulars	"Net balance April 1, 2020"	31st March, 2021			
		Recognised in profit or loss	Net	Deferred tax asset	Deferred tax liability
Deferred tax asset/ (liabilities)					
On excess of carrying value of PPE over Tax base	(42,41,62,043)	1,45,95,995	(40,95,66,048)	-	(40,95,66,048)
Decommissioning obligations - Provision	3,46,60,294	27,72,823	3,74,33,117	3,74,33,117	-
Asset Retirement Obligation - Windmill	(1,22,04,940)	8,14,731	(1,13,90,210)	-	(1,13,90,210)
Carried forward of loss	-	-	-	-	-
O&M Income Receivable	(2,75,61,024)	(60,95,365)	(3,36,56,390)	-	(3,36,56,390)
Fair Value of Investment	(5,55,923)	(5,53,118)	(11,09,041)	-	(11,09,041)
Other items	(52,60,272)	0	(52,60,271)	-	(52,60,271)
Rates & Taxes, Leave encashment, labour cess & Gratuity	64,15,828	(6,96,661)	57,19,167	57,19,167	-
Effect Due to IND AS 116	-	(31,890)	(31,890)	-	(31,890)
Tax assets/ (liabilities)	(42,86,68,081)	1,08,06,514	(41,78,61,567)	4,31,52,284	(46,10,13,850)
Set off tax					
Net tax assets/ (liabilities)	(42,86,68,081)	1,08,06,514	(41,78,61,567)	4,31,52,284	(46,10,13,850)

Notes

- The company offsets tax assets and liabilities if and only if it has a legally enforceable right to set off current tax assets and current tax liabilities and the deferred tax assets and deferred tax liabilities relate to income taxes levied by the same tax authority.
- Significant management judgement is required in determining provision for income tax, deferred income tax assets and liabilities and recoverability of deferred income tax assets. The recoverability of deferred income tax assets is based on estimates of taxable income by each jurisdiction in which the relevant entity operates and the period over which deferred income tax assets will be recovered.

Note 27 Related Party disclosures

As per IND AS 24 'Related Party Disclosure', and Companies Act, 2013, the disclosure of transactions with the related parties are given below:

A. Related Parties

S.No	Particulars	Relationship
1	Baitarni West Coal Company Limited	Associate Company
2	Gujarat Urja Vikas Nigam Limited	Promoter
3	Sunaina Tomar, IAS	Chairman (Upto 15/06/2021)
4	Mamta Verma, IAS	Chairman (From 09/07/2021)
5	S.B Khayalia	Managing Director (Key Managerial Personnel) (Upto 30/09/2021)
6	Vikalp Bharadwaj, IAS	Managing Director (Key Managerial Personnel) (From 26/10/2021)
7	Shri Praful Hardevrai Rana	Director
8	Shri Ramjibhai Ganeshbhai Desai(upto 07.08.2020)	Nominee Director
9	Ms.Dipal Hadiyal (w.e.f 23/12/2020)	Nominee Director
10	Smt. Anju Sharma, IAS	Woman Director
11	Shri. Mehul J. Danayak	Chief Financial Officer (Key Managerial Personnel)
12	Ms. Krupa Joshi	Company Secretary (Key Managerial Personnel)

B. Related Party Transaction (Amount in ₹)

Sr. No.	Particulars	2020-21 Rs.	2019-20 Rs.
A	Transactions During The Year		
	Sale of Electricity to GUVNL	13,21,94,096	19,76,93,929
	Director sitting fees		
	P H Rana	27,000	51,000
	Prakash S Shah	-	51,000
	Bharatkumar Modi	-	39,000
	Sujit Gulati	-	-
	I P Gautam	-	-
	Sobhanaben Desai	-	-
	P.K Taneja	6,000	-
	Dipal Hadiyal	3,000	-
	Anju Sharma	6,000	-
	R G Desai	6,000	-
	Sunaina Tomar	12,000	-
	Director expenses		
	P. H. Rana	9,000	17,000
	R.G.Desai	1,000	16,000
	Sobhanaben Desai	-	-
	Prakash. S. Shah	-	17,000
	Mahesh Singh	1,000	-
	Bharatkumar Modi	-	13,000
	Pankaj Joshi	-	3,000
	P.K Taneja	2,000	-
	Anju Sharma	4,000	7,000
	Sunaina Tomar	4,000	1,000
	S B Khayalia	9,000	3,000
	Dipal Hadiyal	1,000	-
	Salary and Allowances		
	Mehul Danayak	18,10,932	17,45,656
	S.B Khayalia	90,13,779	17,69,360
	Ms. Krupa Joshi	9,26,360	8,80,200
B	Closing balance		
	Receivable towards sale of electricity from GUVNL	2,05,40,625	2,92,21,530

Note 28

A. Financial instruments by category and their fair value (Amount in ₹)

As at 31st March 2021	Carrying amount				Fair value			
	FVTPL	FVTOCI	Amortised Cost	Total	Level 1 - Quoted price in active markets	Level 2 - Significant observable inputs	Level 3 - Significant unobservable inputs	Total
Financial assets								
Investments								
Quoted		1,10,90,41,465		1,10,90,41,465	1,10,90,41,465			1,10,90,41,465
Unquoted		18,04,64,330		18,04,64,330			18,04,64,330	18,04,64,330
Other financial assets								
Current			8,46,05,23,681	8,46,05,23,681				
Trade Receivables			74,92,68,385	74,92,68,385				
Cash and Cash Equivalents			73,34,91,453	73,34,91,453				
Other Bank Balances			77,11,92,304	77,11,92,304				
Other financial assets								
Non-current			1,88,28,158	1,88,28,158			1,88,28,158	1,88,28,158
Total financial assets		1,28,95,05,795	10,73,33,03,981	12,02,28,09,776	1,10,90,41,465		19,92,92,488	1,30,83,33,953
Financial liabilities								
Borrowings								
Non-current								
Other financial liabilities								
current			52,82,66,621	52,82,66,621				
Non-current			32,85,85,819	32,85,85,819				
Trade Payables								
Total financial liabilities			85,68,52,439	85,68,52,439				

Fair value of financial assets and liabilities measured at amortised cost is not materially different from the amortised cost. Further, impact of time value of money is not significant for the financial instruments classified as current. Accordingly, the fair value has not been disclosed separately.

As at 31st March 2020	Carrying amount				Fair value			
	FVTPL	FVTOCI	Amortised Cost	Total	Level 1 - Quoted price in active markets	Level 2 - Significant observable inputs	Level 3 - Significant unobservable inputs	Total
Financial assets								
Investments								
Quoted		55,59,23,252		55,59,23,252	55,59,23,252			55,59,23,252
Unquoted		17,08,16,903		17,08,16,903			17,08,16,903	17,08,16,903
Other financial assets								
Current			6,02,34,62,462	6,02,34,62,462				
Trade Receivables			1,82,64,14,798	1,82,64,14,798				
Cash and Cash Equivalents			64,24,240	64,24,240				
Other Bank Balances			71,40,51,568	71,40,51,568				
Other financial assets								
Non-current			1,88,28,158	1,88,28,158			1,88,28,158	1,88,28,158
Total financial assets		72,67,40,155	8,58,91,81,226	9,31,59,21,381	55,59,23,252		18,96,45,061	74,55,68,313
Financial liabilities								
Borrowings								
Non-current								
Other financial liabilities								
current			3,90,34,40,536	3,90,34,40,536				
Non-current			20,68,39,807	20,68,39,807				
Trade Payables			8,98,26,104	8,98,26,104				
Total financial liabilities			4,20,01,06,446	4,20,01,06,446				

Fair value of financial assets and liabilities measured at amortised cost is not materially different from the amortised cost. Further, impact of time value of money is not significant for the financial instruments classified as current. Accordingly, the fair value has not been disclosed separately.

Types of inputs are as under:

Input Level I (Directly Observable) which includes quoted prices in active markets for identical assets such as quoted price for an equity security on Security Exchanges.

Input Level II (Indirectly Observable) which includes prices in active markets for similar assets such as quoted price for similar assets in active markets, valuation multiple derived from prices in observed transactions involving similar businesses etc.

Input Level III (Unobservable) which includes management's own assumptions for arriving at a fair value such as projected cash flows used to value a business etc.

B. Measurement of fair values
Valuation techniques and significant unobservable inputs

The following tables show the valuation techniques used in measuring Level 2 and Level 3 fair values, as well as the significant unobservable inputs used.

Financial instruments measured at fair value

FVTOCI in unquoted equity shares	“Investments in Equity Shares of Subsidiaries & Equity Accounted Entities as on the transition date: GSEG - Equity valuation of GSEG at the transition date has been carried out using discounted cash flow (DCF) method. Free cash flows to equity (“FCFE”) have been discounted at 14% cost of equity to arrive at equity valuation.
	Investments in Equity Shares of Other Entities : Kalupur Bank - Investment in the shares of Kalupur Bank was made at the time of taking loan from it, 400 shares at a price of Rs. 25/- were purchased. However the said loan has got repaid in the F.Y. 2016-17 and hence the said shares are expected to be sold off. In view of the aforesaid scenario, and materiality concept due to its meagre value, the said investment has been presented at its carrying cost.”

Transfers between Levels 1 and 2

There have been no transfers between Level 1 and Level 2 during the reporting periods.

Level 3 fair values

Movements in the values of unquoted equity instruments for the period ended 31st March, 2021 is as below:

(Amount in ₹)

Particulars	Amount
As at 1 April 2020	17,08,16,903
Gains/ (losses) recognised in other comprehensive income	96,47,427
As at 31 March 2021	18,04,64,330

Transfer out of Level 3

There were no transfers out of level 3 during the year 2019-20 and 2020-21.

C. Financial risk management

The Company’s principal financial liabilities comprises of loans & borrowings and trade & other payables. The main purpose of these financial liabilities is to finance the Company operations and to provide guarantees to support its operations. The Company’s principal financial assets include trade & other receivables, cash & cash equivalents and investments that are derived directly from its operations. The Company has exposure to the following risks arising from financial instruments:

- i. Credit risk
- ii. Liquidity risk
- iii. Market risk

(i) Credit risk

Credit risk is the risk that a customer or counterparty to a financial instrument will fail to perform or fail to pay amounts due causing financial loss to the company. The potential activities where credit risks may arise include from cash and cash equivalents, derivative financial instruments and deposits with financial institutions and principally from credit exposures to customers relating to outstanding receivables.

Trade receivables

Significant portion of trade receivables at the respective reporting date comprise of PSUs and entities with significant government influence. Further, Management does not expect any credit risk on the same.

Other financial assets

“Other financial assets comprise of cash and cash equivalents, loans provided to employees and investments in equity shares of companies other than subsidiaries, associates and joint ventures.

- Cash and cash equivalents and Bank deposits are placed with banks having good reputation and past track record with adequate credit rating. The Company reviews their credit-worthiness at regular intervals.
- Investments are made in credit worthy companies.”

(ii) Liquidity risk

Liquidity risk is the risk that the Company will encounter difficulty in meeting the obligations associated with its financial liabilities that are proposed to be settled by delivering cash or other financial asset. The Company’s financial planning has ensured, as far as possible, that there is sufficient liquidity to meet the liabilities whenever due, under both normal and stressed conditions, without incurring unacceptable losses or risking damage to the Company’s reputation.

Exposure to liquidity risk

The following are the remaining contractual maturities of financial liabilities at the reporting date. The amounts are gross / undiscounted values and include estimated interest payments and exclude the impact of netting agreements.

(Amount in ₹)

31st March, 2021	Contractual cash flows based on maturity			
	Carrying amount	Total	Less than 12 months	More than 12 months
Non-derivative financial liabilities				
Non current borrowings	-	-	-	-
Current borrowings	-	-	-	-
Non current financial liabilities	52,82,66,621	52,82,66,621	-	52,82,66,621
Current financial liabilities	3,90,34,40,536	3,90,34,40,536	3,90,34,40,536	-
Trade and other payables	32,85,85,819	32,85,85,819	32,85,85,819	-
Total	4,76,02,92,976	4,76,02,92,976	4,23,20,26,355	52,82,66,621

(Amount in ₹)

31st March, 2020	Contractual cash flows based on maturity			
	Carrying amount	Total	Less than 12 months	More than 12 months
Non-derivative financial liabilities				
Non current borrowings	-	-	-	-
Current borrowings	-	-	-	-
Non current financial liabilities	20,68,39,807	20,68,39,807	-	20,68,39,807
Current financial liabilities	2,87,41,73,179	2,87,41,73,179	2,87,41,73,179	-
Trade and other payables	8,98,26,104	8,98,26,104	8,98,26,104	-
Total	3,17,08,39,090	3,17,08,39,090	2,96,39,99,283	20,68,39,807

(iii) Market risk

Market risk is the risk or uncertainty arising from possible market price movements and their impact on the present/ future performance of a business. The market risks include price risk, currency risk and interest rate risk. The primary price risk for the company is commodity price risk i.e. price risk of that could adversely affect the value of the Company’s financial assets, liabilities or expected future cash flows.

Equity price risk

The Company’s exposure to equity securities price risk arises from investments held by the Company which are classified in the balance sheet as fair value through other comprehensive income (FVOCI). The captioned equity investments are publicly traded as they are listed on the NSE Nifty 50 Index.

Sensitivity

The table below summarises the impact of increases/decreases of the index on the Company’s other comprehensive income for the period. The analysis is based on the assumption that the index had increased average of the movements in quoted prices of equity shares held as investments for the respective periods. All other variables held constant.

Particulars	Impact on Other Comprehensive Income		
	As at 31st March, 2021	As at 31st March, 2020	As at 31st March, 2019
NSE NIFTY 50 - increase 30% (31 March 2020 - 20%)	33,27,12,440	11,11,84,650	11,03,80,240
NSE NIFTY 50 - decrease 30% (31 March 2020 - 20%)	(33,27,12,440)	(11,11,84,650)	(11,03,80,240)

Interest rate risk

Interest rate risk can be either fair value interest rate risk or cash flow interest rate risk. Fair value interest rate risk is the risk of changes in fair values of fixed interest bearing investments because of fluctuations in the interest rates. Cash flow interest rate risk is the risk that the future cash flows of floating interest bearing investments will fluctuate because of fluctuations in the interest rates. The Company does not have any undrawn or outstanding borrowings at fluctuating rate of interest and hence does not possess any interest rate risk.

D. Capital management

"The Company's objectives when managing capital are to:

- safeguard their ability to continue as a going concern, so that they can continue to provide returns for shareholders and benefits for other stakeholders, and
- maintain an optimal capital structure to reduce the cost of capital.

The Company monitors capital using a ratio of 'adjusted net debt' to 'adjusted equity'. For this purpose, adjusted net debt is defined as total non-current liabilities, less cash and cash equivalents. Adjusted equity comprises all components of equity."

The Company's adjusted net debt to equity ratio on 31st March, 2021 was as follows.

Particulars	As at 31st March, 2021	As at 31st March, 2020	As at 31st March, 2019
Total non-current liabilities	1,08,90,31,586	76,67,58,817	75,79,65,350
Less : Cash and bank balances	1,50,46,83,757	72,04,75,808	63,91,39,279
Adjusted net debt	(41,56,52,171)	4,62,83,009	11,88,26,071
Total equity	12,18,42,86,448	11,12,71,87,983	10,31,73,57,470
Adjusted net debt to adjusted equity ratio	-0.034:1 times	0.004:1 times	0.01:1 times

Note 29
Details of investments in jointly controlled entities made by the company

Sr. No.	Name of the entity	Country of incorporation	Proportion of ownership interest	Proportion of ownership interest	Name of other partners	Principal Activities
1	Torrent Pipavav Generation Limited	India	5%	95%	Torrent Power Ltd.	Coal Based power plant
2	Baitarni West Coal Company Limited	India	33.33%	33.33%	Kerala State Electricity Board Orissa Hydro Power Corp. Ltd.	The coal block allocated to company has been deallocated. The matter is sub-judice in the Hon'ble High Court of Orissa
3	GSPC Pipavav Power Company Limited	India	2.53%	97.46%	Gujarat State Petroleum Corporation	Generation and Distribution of Power

Note 30

- A) GPCL has taken advance possession of 1407-06-98 Sqr. mtrs of Government land at village Raghanaesna, Taluka Vav on 20/1/2016 for 700 MW Ultra Mega Solar Power Project as per letter dated 20/1/2016 of Collector, Banaskatha, Palanpur. This land is given to GPCL subject to making payment to Government based on provisions and conditions of New Solar Policies. The same has not been accounted for as Government has not fixed the price of land.
- B) GPCL has taken advance possession of 510.31.31 Ha. of Government waste land at village Hadsad, Taluka Suigam, District Banaskatha on 30.09.2011 for Solar Park. The same has not been accounted for as Government has not fixed the price of land.

- C) GPCL has taken advance possession of 81.75.38 Ha. of Government waste land at village Dungda, Taluka Suigam, District Banaskatha on 30.09.2011 for Solar Park. The same has not been accounted for as Government has not fixed the price of land.
- D) Previous year's figures have been regrouped/reclassified/recasted, wherever necessary, to conform to this year's classification.
- E) GPCL had received a total demand of Water charges of Rs.14.63 Cr/- (Inclusive of interest amount Rs.2.95 Cr/-) for the period from 2011-12 to 2015-16 from SSNNL as per their claim for 4.5 MLD water supply for Charanka Solar Park-1 Project. Board members have directed that the said matter may be tried to be settled by offering SSNNL, the principal amount only. Accordingly, provision for water charges has been made in the books and interest amount is shown as contingent liability."
- F) Gujarat Power Corporation Limited (GPCL) has entered into viability Gap Funding Securitization Agreement with Solar Energy Corporation of India (SECI) for getting VGF support of Rs.1,75,00,000/- for its 10 MW Solar Power Project in the year 2014.

As per clause no.2.1 (a) of the VGF securitization agreement dated 27-03-2014, GPCL is eligible to receive VGF support of Rs.1,75,00,000/- subject to the compliance of terms and conditions as detailed in Article 2.2 of the agreement. As per clause 2.1 (b) of the above-mentioned agreement, VGF of Rs.1,75,00,000/- will be released in 6 tranches. The first tranche of 50% of VGF shall be released on successful commissioning of the full project capacity. Balance 50% of the VGF shall be released progressively over next 5 years in five equal installments of 10% each subject to plant meeting generation requirement and other terms & conditions.

This Project was successfully commissioned (COD) in March-2015. Cost of the Asset has to be firmed up on Commercial Operation Date (COD) and total VGF receivable i.e. Rs.1.75 Crores has to be reduced from the cost of the Asset in the Financial year in which COD is achieved i.e. F.Y. 2014-15. Accordingly, in the financial year 2014-15, GPCL passed an entry in its Audited books of account by debiting Viability Gap Funding Receivable a/c by Rs.1,75,00,000/- and crediting 10 MW Solar Power Project a/c by Rs.1,75,00,000/-, as GPCL was eligible to receive Rs.1,75,00,000/- as per the VGF agreement with SECI in F.Y.2014-15 as the Project was successfully commissioned (COD) in March-2015. In the F.Y. 2016-17, SECI released Rs.87,50,000/- to GPCL towards First tranche and Rs. 17,50,000/- lakh towards second tranche. Release of third, fourth, fifth & sixth trench from SECI are awaited. Hence as per the agreement, the amount to be released at the end of the 6th year (March-2020) @ Rs.17.50 lakh per annum is subject to plant meeting generation requirement and other terms and conditions. As per the agreement and in the opinion of the management these amounts are receivable from SECI and accordingly Company has accounted the same as receivable from SECI as on 31st March 2015 and reduced the amount from Property, Plant and Equipments.

- G) GPCL has incurred about Rs.1.27 Crores towards actual consultancy fees for its 1000 MW Pipavav Power Project. GOG has accepted to compensate only cost incurred by the Company for acquisition of land and denied to pay any other expenses incurred on the project including consultancy fees. However it was directed by Board that GPCL may request GOG to compensate total expenses incurred including actual consultancy fees of Rs.1.27 Crores to GPCL, but there is no response from GOG in the matter. In view of the letter dated 21/08/2021 from GIDC, as the company is of the opinion that this claim can be received from GIDC, provision with reference to Rs.1.27 Crores incurred by GPCL towards actual consultancy fees for its 1000 MW Pipavav Power Project, is not created by the company in current year.
- H) The company did not have any long term contract including derivative contract for which there were any material foreseeable losses.
- I) In the opinion of management, the value of realisation of assets other than fixed assets and non current investment in the ordinary course of business will not be less than the value at which they are stated in the balancesheet.
- J) In the absence of balance confirmation the balances of receivable and payable as on 31/03/2021 are subject to adjustment if any on reconciliation/settlement.
- K) GPCL has investment in Torrent Pipavav Generation Limited and Baitarni West Coal Company Limited (Refer note-3 Investments in Subsidiary, Associate and Joint venture). Test of impairment is done on the basis of existence of such conditions which indicate the requirement of impairment. As per letter dated 21/08/2021 from GIDC, all cost incurred for the project will be recovered from GIDC, and hence the management is of the opinion that in view of no concrete indicators as of now towards impairment, there is no requirement of impairment. In the 50th Board meeting of Baitarni West Coal Company Limited, held on 24/03/2021, the BWCC board deliberated in the matter and again in meeting held on 23rd September, 2021 the matter was taken up but no concrete decision could be taken with reference to way forward in this matter. In view of the same, as recoverable value cannot be quantified with certainty, the effect of impairment as per Ind AS-36 is not done in current year."

- L) As draft fuel supply agreement has not been finalised by company, it was decided by the management to raise interim invoice for supply of lignite on ad-hoc basis amounting to Rs.226.81 Cr/- subsequent to the approval of the management. Such amount is included in revenue from operation (note-17) for the current year, keeping in view the fact that finalisation of draft supply agreement may take some more time."
- M) As per Ind AS-115, revenue is recognised upon satisfaction of performance obligation. 700MW Ultra Mega Project- Raghnesda and 5000 MW Solar Project- Dholera had commenced and no performance obligations (contractual duties) are satisfied in respect of them. Therefore considering the definitions and requirements laid down under IND AS-115, revenue will be recognised at a point of time once the projects are completed. Therefore, no revenue is recognised in respect of these two projects in FY 2020-21. The amount received from customers have been shown as 'Advance from Customers' as Current Liabilities in the financial statement. Moreover, as per letter dated , 10/06/2021, approval of the competent authority has been granted for extension of timeline for Raghnesada and Dholera solar park upto 31.12.2021 subject to fulfilment of conditions and therefore recognition of revenue has been delayed."
- N) GPERF was formulated under Public Private Partnership (PPP) mode to set up an institute viz Gujarat power engineering research institute- GPERI - with an idea of creating a technical human resource in power sector for the State of Gujarat. The promoter of GPERF is Gujarat Power Corporation Limited (GPCL) which is a State Govt. Company promoted by the Government Of Gujarat (GoG). In the meeting conducted by GTU on 19th March 2020, it was agreed by GTU to take over the said organisation as constituent college with all assets except staff of GPERI and liabilities.
- GPCL has spent about Rs.11.85 Crores for providing various assets to GPERI. In pursuance to above, GPERF formally handed over GPERI to GTU with effect from 11.09.2020 with all movable and immovable assets. GPCL has been charging depreciation on these assets. In view of the decision taken in the matter as referred above, Company has charged depreciation on these assets for F.Y. 2020-21 till 10.09.2020 and the written down value amount of Rs. 8,82,74,832 as on 31.03.2021 in books has been charged to P&L account as loss on transfer of assets in the F.Y.2020-21."
- O) In view of the Segment reporting policy, entity-wide disclosures are given from the financial statements are as below:

Particulars	Amount (In Rs.)
Information about products and services:	
Revenue from External Customers	2,68,92,67,998
Information about geographical areas:	
Non-Current assets: (In domicile country)	
Property Plant & Equipment	3,10,19,31,970
Mining Development Asset	39,51,81,937
Investment in subsidiary, associate and joint venture	34,33,76,270
Other non-current assets	47,52,01,297

Information about major customers:

Revenues from supply of lignite from one customer of company represents approx. Rs. 226.81 Cr /- (84.34% of the company's total revenue.)

- P) Expense incurred for CSR during the financial year are as follows:
- a) Gross amount required to be spent for CSR by the company during the current year (F.Y. 2020-21) is Rs. 1,35,51,081/- and unspent amount of Rs. 1,40,23,244/- brought forward from previous year (F.Y. 2019-20) thereby aggregating to Rs. 2,75,74,325 /-.
- Out of which total amount spent in the current year (F.Y.2020-21), amount spent from past years fund is Rs. 1,29,85,000/- and from current year fund is Rs. 368,355/- and hence provision for balance unspent amount of Rs. 1,42,20,970/- has been created in the books of account.."
- b) As per the environmental clearance dated 24/12/2014, (clause no. xxvi) ,GPCL being the project proponent will have to carry CSR activities in the mining affected areas in consultation with local authorities and villages @5 Rs. per tonne of lignite mined, subject to annual inflation.

For FY 18-19, GPCL produced 5,09,194.83 MT of lignite and thus is liable to carry out CSR amounting to about Rs. 25,45,974.15/- in the year 2019-20.

Further for FY 19-20,GPCL produced 8,17,062.19 MT of lignite and thus is liable to carry out CSR amounting to about Rs.40,85,310.95/- in the year 2020-21.

Further for FY 20-21,GPCL produced 12,71,820.5 MT of lignite and thus is liable to carry out CSR amounting to about Rs.63,59,102.50/- in the year 2021-22 GPCL has accordingly created provision of CSR for Rs.1,29,90,388/- in FY 20-21."

c) Amount spent during the year on:

(Amount in ₹)

Sr. No	Particulars	Total
1	Construction/acquisition of any asset	-
2	On purposes other than (i) above	1,33,53,355
Total		1,33,53,355

Q) Contingent Liabilities

(Amount in Lakhs)

Particulars	As at 31st March, 2021	As at 31st March, 2020
Bank Guarantee and Margin money	7,431.93	7411.77
Disputed income-tax demand in respect of various Assessment years	11,601.16	11709.91
Disputed Service tax demand as on 12/11/18	2,953.65	2944.99
Estimated amount of contracts to be executed & not provided for	5,471.00	3953.01
SSNNL's Disputed claim towards water charges as assessed	295.37	1914.64
Disputed Claim with SECI	241.08	241.08
Disputed Claim with Customer for cancellation of order	293.35	0.00
Total	28287.53	28175.40

For and on behalf of the Board of Directors
(CIN : U40100GJ1990SGC013961)

For Anil N Shah & Co.
Chartered Accountants
FRN No.: 114131W

Sd/-
Mehul J. Danayak
Chief Financial Officer

Sd/-
Mamta Verma
Chairman
DIN: 01854315

Sd/-
Jigna H. Shah
Partner
M.No. 141825

Sd/-
Krupa N. Joshi
Company Secretary

Sd/-
Vikalp Bharadwaj
Managing Director
DIN: 09396222

Date : 29/12/2021
Place : Ahmedabad
UDIN: 22141825AAAAAD1089

Date : 29/12/2021
Place : Gandhinagar

